

॥ અધ્યાય ૧૨ ॥

શ્રી સંત ધોલપ, રામદર્શન

(શ્રી સાઈબાબાનું શ્રી સંત ધોલપસ્વામી અને પ્રલુબ રામચંદ્રના રૂપે દર્શન આપવા)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સહગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હે સહગુરુ સાઈનાથ ! તારો જ્યે જ્યકાર થાઓ. તારાં ચરણોમાં હું મારું શિશ નમાવીને તને નમસ્કાર કરું છું. તારી અવસ્થા લુર્વિકારી અને સ્વસ્વરૂપમાં એકરૂપ થયેલી છે. હું તારે શરણે આવ્યો છું તેથી મારી ઉપર તું કૃપા કર. તું સત્ય, જ્ઞાન અને આજાંદ્યુકત છે તથા સુખ અને સંતોષનો ભંડાર છે. સંસારથી ભવસાગરમાંથી પસાર થતા દુઃખી લુંગોને સાંત્વના આપનારો છે. તું અદ્વૈતનો ઉપરેશ કરીને મંદ બુદ્ધિના લોકોના દ્રૈત તરફના મોહ નારા કરે છે. જેમ આ આકાશ સર્વ ઢેકાણે પૂર્ણપણે વિસ્તરેલું છે, તેવું જ તારું સર્વવ્યાપી પણું છે. તારું તે સ્વરૂપ મનમાં રેખાંકિત કરીને જેમ મળે તેનો અનુભવ કરો. તેઓ ભાગ્યવાન ગણાય છે. સાધુ સજજનોનું સંરક્ષણ થવું જોઈએ અને દુર્જનોનો જડમૂળથી સંહાર થવો જોઈએ. તે માટે ઈશ્વરી અવતાર પ્રગટ છે. પરંતુ સંતો તેના કરતાં થોડા જુદા છે. તેઓ એક મોરો છે અને બીજો હલકો છે તેવી એની તેમને ખબર નથી હોતી. બંને એમને માટે એક સરખા હોય છે. ઈશ્વર કરતાં પણ સંત જ મોટા કારણ કે દુર્જનોને તો તેઓ પહેલાં સારા માર્ગે લાવતા હોય છે. સંતોની યોગ્યતા વધારે અને દેવોથી પણ આગવી હોય છે. હિરણ્યકશ્યપુ અને રાવણને દેવદ્રોષ મૃત્યુ આવ્યું. તે રીતે એક પણ સંત જન્મયો જેના દ્વારા આવું કામ થયું ॥૭૦॥ દીન, દ્વારા અને દુર્જન માટે તેમનું કાળજું હંમેશા પ્રબળતું રહે છે અને પ્રેમથી હૈયુ ભરાઈ આવે છે. સંસારથી સાગરના તેઓ અગત્ય ઋષિ છે, કે જેમણે ખોભામાં ભરીને એક જ અંજલિમાં આખો સમુદ્ર પીઘો હતો. અજ્ઞાનરૂપી અંધકારના તો તેઓ સૂર્ય સમાન છે. પરમાત્માની હ્યાતી અહીંથાં શ્રી સાઈમાં જ જણાય છે. ખરેખર જે જોવા જઈએ તો તેમનું રૂપ પરમાત્માથી જુદું નથી. એવા સંતો પૈકી ‘એક અમારો સાઈ’, ભક્તો માટે જ અવતર્યો છે. તેઓ લુલાત્મા અને પરમાત્માના એક જ સ્વરૂપે વૈભવથી સુશોભિત મહારાષ્ટ્રના આણંદી ગામના ઠ.સ. ૧૨૭૧ થી ૧૮૨૩માં થયેલા પ્રસિદ્ધ સંત જ્ઞાનદેવ મહારાજ છે. તેમનો સર્વ પ્રાણી માત્ર પર પ્રેમ હતો, અન્ય કોઈ પણ વાતોમાં જરા સરખું આકર્ષણ ન હતું. એક ઢેકાણે આસક્તિ (સત્તા) અને બીજાં ઢેકાણે વિરકિત હોવાં છીતાં તેમનામાં શત્રુભાવ કે પક્ષપાત વગરની શુદ્ધ ભાવના હતી. તેમને માટે ગરીબ અને શ્રીમંત બંને સરખા જ હતા. તેવા આ મહાનુભાવ સાઈનું માહાત્મ્ય હવે તમે સાંભળો. (ઓ. ૧-૧૦)

સંતો પોતાના ભક્તો પ્રત્યે પ્રેમના આકર્ષણને કારણે પોતાના પુણ્યોનો બંડાર ખર્ચી નાંખે છે. તેઓ પર્વત કે ખીણની પરવા ન કરતાં ભક્તો માટે કુદી પડતા હોય છે. ભક્તો પણ સ્વાભાવિક ભાવના એક સમજુને પરમાર્થ શેમાં છે, તે સમજ્યા વીના સ્વી, પુત્ર અને ધનમાં આસક્ત થાય છે. તે બીચારા અજ્ઞાનીઓને ક્ષમા કરી દઈને છોડાવો. આણસમજુ અને સરળ વૃત્તિના લોકોને ઈશ્વર કૃપા કરીને પ્રેમથી પોતાની પાસે લે છે. પરંતુ જે દેવથી દૂર થઈને દેવોથી વિમુખ હોય છે, તેમનું અભિમાન તેમને જ નુકશાનકારક બને છે. અજ્ઞાની માણસની દ્વારા ખાઈને, એકાદ સંત જ તેની ઉપર પ્રેમ કરે છે.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેથી જ તેવા માણસોનો એમની ઉપર બેઘડક વિશ્વાસ બેસે છે. જ્ઞાનને દેખાવ માત્ર વ્યર્થ હોય છે. પોતાને વિદ્ધાન સમજનારા મુર્ખ બુદ્ધિના લોકો શુષ્ક અભિમાનમાં અમસ્તા જ કુલાતા હોય છે. અને ભક્તિ માર્ગનો તિરસ્કાર કરતા હોય છે. અમારે તેવાની સંગત જેઠી નથી. તે પ્રમાણે શરૂ કરેલા જ વર્ણશંકર બંદની પણ જરૂર નથી. જેમને પોતાની વર્ણ ઉપર પર થોડું પણ અભિમાન હોય તેવાની પણ જરૂર નથી. તમે વર્ણ અને આશ્રમોનું કદર નિયમ પાલન કરનારા ગર્વિષ્ટ મનુષ્યો કદી બનતા નહીં. તેવી જ રીતે વેદોમાં ન માનનારા, દોંગી અને પાખંડી પંડિતો પણ થતા નહીં. જેમ વેદ અને વેદાંગનો ઊંડો અભ્યાસ કર્યો છે અને તેમાં પારંગત છે, પરંતુ જ્ઞાનના ગર્વથી જે છલકાયેલા છે તેઓ ભક્તિ માર્ગમાં આડે આવે છે. એમની કોઈ ખેરીયત દેખાતી નથી. અજ્ઞાની માણસ પણ શ્રદ્ધાના જેર પર સંસારના ભય અને સંકટો પાર કરી જય છે. પરંતુ આ શાસ્ત્ર પંડિતોના પેચ કદી પણ કોઈથી ઉકેલી શકાવાના નથી. સંતોના ચરણમાં વિશ્વાસ મૂકે તો જ અજ્ઞાનીનું અજ્ઞાન દૂર થાય છે અને અજ્ઞાનનું અભિમાન રાખનારા માણસોના સંશયોની તકલીફી પણ રહેતી નથી. તેમના હૃદયમાં સદ્બાવ ઉત્પન્ન થશે. (ઓ. ૧૧-૧૬)

એક વખતે સારી દૈવગતિ અનુસાર કેવી વિચિત્ર ઘટના બની તે કહું છું. એક કર્મઠના નસીબે સાઈની અલભ્ય એવી મુલાકાત થઈ. તેનો સંકલ્પ કંઈક જુદ્દો હતો છતાં યોગાનુયોગ નિરાળો જ હતો. જેથી કરીને તેમને શિરડીનો લાભ મળ્યો, અને એમને ગુરુનાં દર્શન થયા. તે ગુરુનો મહિમા દર્શાવનારી, રસાળ અને અગત્યની ગુરુભક્તિના પ્રેમની અનુભૂતિ કરાવી આપનારી કથા હવે સાંભળો. એક વખતે ક્ષેત્ર નાસિકના રહેવાસી ‘મૂળો’ અટક ધરાવનારા કર્મઠ અને મરનાદી અને અભિહોની પોતાના પૂર્વેનાં પૂર્વેનાં બળે શિરડીમાં આવ્યા. આવા પૂર્વેનાં કરેલા પુણ્યબળ સિવાય કોઈ શિરડીમાં એક પળ સુદ્ધાં રોકાઈ શકતું નહીં. કોઈનો શિરડીમાં રોકાવાનો નિશ્ચય કેટલોચ મજ્જમ હોય, છતાં પણ બાબાની સામે તેની દૃશ્યા ચાલતી નહીં. કોઈ કહેતું કે હું જઈને મન ફાવશે ત્યાં સુધી શિરડીમાં રહીશ તો એ તેના હાથની વાત ન હતી. એ સર્વ પ્રકારે પરાધીન રહેતો. હું.... હું એવું કહેનારા અને નિશ્ચય કરનારા કેટલાયે જણ થાકી ગયા. સાઈ પોતાની દૃશ્યા પ્રમાણે જ ચાલનારા સ્વતંત્ર દેવતા હતા. તેમની સામે બીજાઓનો અહંકાર ઓગળી જતો હતો. આપણો વારો આવ્યા સિવાય બાબાને આપણું સ્મરણ થતું નથી. તેમના ગુણોનું વર્ણન પણ કાન પર પડતું નથી. પછી દર્શન કરવાની પ્રેરણા કયાંથી મળવાની? સાઈ સમર્થના દર્શન માટે જવાની કેટલાયની દૃશ્યા હોવાં છતાં તેમને સાઈના દેહત્યાગ સુધી યોગ સાંપડયો જ નહિ. પછી ક્યારેક જઈશું પછી જઈશું એવી ચીકાશ કરનારા શિરડી જતાં જતાં રહી ગયા અને બાબાનું નિધન થઈ ગયુ. આજે નહિ કાલે એમ કરતાં જેમની દર્શનની અભિલાષા ફળી નહીં અને આખરે મળવાનું ચૂકી ગયા. તેઓ ફક્ત પ્રશ્નાતાપને જ પામ્યા. આવી જેમની અભિલાષા બાકી રહી ગઈ છે, તેમણે વિશ્વાસ મૂકીને આદરપૂર્વક આ કથાનું શ્રવણ કરતાં તેમની દૂધની તરસ છાશથી ભાંગશે. ખરેખર, ભાગ્યના બળે જે કોઈ ત્યાં ગયા અને બાબાનાં દર્શન અને ચરણસ્પર્શથી સંતોષ પાખ્યા, તેઓ કંઈ ત્યાં થોડાં જ વસી શક્યા? બાબાએ રાખવા જેઠાએ ને? પોતાની મેળે કોઈ જઈ શકતું ન હતું અને રહેવું છે એવું સમજુને કોઈ રહી શકતું નહીં. આજા મળે એણે જ રહેવું અને જ કહેતાં તેને પાછા ચાલ્યા જવું પડતું. (ઓ. ૨૦-૩૩)

એક વખતે કાકામહાજની એ મુંબઠના શેઠ ધરમશી જેઠાબાઈની પેઢીમાં મુખ્ય કારભારી હતા. તેઓ મુંબઠ થઈને શિરડી ગયા હતા. ત્યાં એક અઠવાડિયું રહીને પાછા ફરીસું એવું તેમના મનમાં હતું. શિરડીમાં ચાવડીને સુંદર રીતે શણગારીને અને બાબાની સામે પારણું ટાંગીને ભક્તજનો કૃષ્ણજન્મનો ઉત્સવ મનાવી રહ્યા હતા. પ્રેમથી નાચતાં હતાં. કાકા ગોકુળઅષ્ટમીનો સમારંભ આનંદથી પોતાની આંખો વડે નિહાળવાનો મળે તે માટે આનંદની પળો સાધીને શિરડી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આવ્યા હતા. પરંતુ શકૃઅાતના પ્રથમ દર્શનમાં જતાવેંત જ બાબાએ તેમને પૂછ્યું, ‘ધરે પાછા કયારે જવાના છો ?’ આથી કાકાના મનમાં ખૂબજ ફૂતુહલ જાયું, મળનારની સાથે આવો કેવો પ્રક્રષ્ટ પૂછ્યો ? તેમના મનાં તો શિરડી અઠવાડિયું રહેવાનું હતું ! પણ જ્યારે બાબાએ પ્રક્રષ્ટ પૂછ્યો ત્યારે કાકાએ તો જવાબ આપ્યો જ છૂટકો. પરંતુ એ પણ જણે કે બાબાએ જ સૂચબ્યું હોય એ પ્રમાણે કાકાએ યોગ્ય એવો જ જવાબ આપ્યો, ‘બાબા ! આપ જ્યારે આજા કરશો ત્યારે મારે ઘેર જઈશ.’ કાકા પાસેથી પ્રત્યુત્તર મળતાં જ બાબા બોલ્યા, ‘કાલે જ જલ.’ કાકાએ શિર નમાવીને નમ્રપણે આજા માન્ય રાખી, અને બાબાને નમસ્કાર કરીને ગોકુળઅષ્ટમી જેવા તહેવારનો દિવસ હોવા છતાં ધર તરફ જવા માટે પ્રયાણ કર્યું. ત્યાં ગામ પહોંચીને પેઢી ઉપર જઈને જેણું તો માલિક કાકા કયારે પાછા આવરો તેની રાહ જેતા જ ઊભા હતા. ગુમાસ્તો એકાએક માંદો પડવાથી કાકાની ખાસ જરૂર પડી હતી, અને એટલા માટે એમણે કાકાને તરતોતરત જ જલદી પાછા ફરવા માટેનો એક પત્ર શિરડી મુકામે લખ્યો હતો. કાકા શિરડીભાંથી નીકળી ગયા બાદ ટપાલીએ ત્યાં તપાસ કરાવી અને કાકા ત્યાં ન હોવાને લીધે તે પત્ર પાછો મોકલ્યો હતો, જે કાકાને ઘેર મળેલ. (ઓ. ૩૪-૪૪)

ઉપરોક્ત વાતથી વિપરીત આ નાની સરખી બીજુ એક વાત સાંભળો. ભક્તોને પોતાનું કલ્યાણ શેમાં છે તેની ખબર હોતી નથી. પરંતુ બાબા તે અંગે નિશ્ચિતપણે જાણતા હતા. એક સમયે નાસિકના ભાઉસાહેબ ધૂમાળ નામના પ્રય્યાત વક્કિલ અને પરમભક્ત બાબાના દર્શન માટે શિરડી આવ્યા. તેમના મનમાં એમ હતું કે બાબાનાં ઊભા ઊભા દર્શન કરવાં તેમજ પગે પડીને ઉદ્દી તથા આશરીવાંદ લઈને પાછા જતા રહેલું. પાછા વળતાં એમને નિફાડ ગામે ઉત્તરવું હતું. એક ખટલા માટે કોઈમા કામે ત્યાં જવું આવશ્યક હતું. તેમણે ભલેને મનમાં આમ વિચાર્યું હોય પરંતુ બાબાના યોગ્ય અને અયોગ્ય શું તેની ચોક્કસ ખબર હતી. ધૂમાળ પાછા જવાની આજા માંગતા હતા પણ બાબા તેમને જવાની આજા આપતા નહીં. આમને આમ બાબાએ તેમને અઠવાડિયા સુધી રોકી રાખ્યા અને જવાની આજા આપવાનું સ્પષ્ટ નકાર્યું. કોઈમાં ખટલાની સુનવણી લંબાવાછ ગઈ. અને પછી ત્રણ પહેલી તારીખો તે પણ એવી જ ગઈ. અઠવાડિયું પૂરું થતાં, વળી થોડા દિવસ ધૂમાળને બાબાએ રોકી રાખ્યા. અહિં નિફાળગામે ખટલાના દિવસે જ ન્યાયાધીશને બેચેની વધી અને કદી ન સમજય તેવો અને સહન ન થઈ શકે તેવો પેટનો દુઃખાવો ઉપડયો. ખટલો આપોઆપ આગળ ઘકેલાઈ ગયો. તે સમયનો સદૃષ્યુપયોગ થાય એ જ હિસાબે ધૂમાળને સાઈબાબાનો સહલવાસ પ્રાપ્ત થયો. પક્ષકારોની ચિંતા ઓછી થઈ ગઈ અને સાઈબાબા ઉપર વિશ્વાસ મૂકવાને કારણે કોઈ પણ પ્રકારના પ્રયાસ કર્યા વગર બધું આપોઆપ ઘડાઈ ગયું. પછી આગળ ઉપર યોગ્ય સમયે બાબાએ ધૂમાળને આજા કરી અને બધાં જ કામો વ્યવસ્થિત રીતે પાર પડ્યાં. ખરેખર બાબાએ જ લીલા કરી તે અપૂર્વ છે. ખટલો ચાર મહિના ચાલ્યો અને ચાર ન્યાયાધીશ બદલાયા. પરંતુ છેવેટે યશ મળ્યો અને આરોપી નિર્દોષ છૂટી ગયો. (ઓ. ૪૫-૫૫)

એક વખત પ્રખર ભક્ત શ્રેષ્ઠ નાનાસાહેબની પત્નીનો પક્ષ બાબાએ કેવી રીતે લીધો તે વાત સાંભળો. નાનાસાહેબ નિમોણ ગામના વતની હતા. સરકારમાં તેમનો ખૂબ મોટો મોટો હતો. અને તેમને ન્યાયાધીશનો કારબાર સૌંપવામાં આવ્યો હતો. માધવરાવના તેઓ મોટા પિતરાઈ ભાઈ હતા. તેઓ વયોવૃદ્ધ હોવાને કારણે સર્વને અતિ પૂજ્ય હતા. તેમનાં પત્ની પણ બાબા પ્રત્યે એકનિષ્ઠ હતાં. આ બંનેને સાઈનું જ ઘેલું લાગેલું હતું. પોતાનું વતન છોડીને બંનેએ શિરડીમાં મુકામ કર્યો હતો. તે બંને શ્રી સાઈનાં ચરણોમાં શ્રદ્ધા રાખીને સુખેથી દિવસો પસાર કરતાં હતાં. બ્રહ્મમુહૂર્તમાં ઉદ્દીને વહેલી સવારે સ્નાન કરીને દેવપૂજન પૂર્ણ કરીને હંમેશા કાકડ આરતી કરવા માટે બંને જણા ચાવડીમાં આવતા. પછી નાનાસાહેબ સ્તોત્ર બોલતા અને મસ્તિષ્ઠમાં રહીને સાંજ સુધી બાબાની સેવામાં તેઓ મન્ત્ર રહેતા હતા. તે બાબાને લેંડીબાગ લઈ જતાં અને મસ્તિષ્ઠમાં પાછા લઈ આવતા તથા જરૂર પ્રેમપૂર્વક બાબાની સેવા કરતા. તેમનાં ધર્મપત્ની પણ દિવસભર ખૂબ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પ્રેમથી બાબાની પોતાનાથી થાય તે બધી જ સેવા ચાકરી કરતાં. ફક્ત નહાવા ઘોવા અને રંધવા તેમજ જમવા માટે અને રાત્રે સુવા માટે જ પોતાના મુકામે જતા. બાકી રહેલ દિવસ દરમ્યાનનો રોષ સમય આ પ્રેમાણ જેડું બાબાની સાથે રહીને જ પસાર કરતું. આ બંનેની સેવાનું જે વિગતવાર વર્ણન કર્યા કરું તો ગ્રંથનો વિસ્તાર વધી જશે, માટે જ ઉપર મુજબ જણાવેલા વિષય પુરતી જ વાત હું તમને સંભળાવું છું. બાબાએ સમાધિ લીધા બાદ નાનાસાહેબનું મૃત્યુ થોડા જ સમયમાં અને ઉત્તમ પ્રકારે થયું. તેમણે બાબાનું અખંડ નામસ્મરણ કરતાં કરતાં અને બાબાનું ધ્યાન ધરતાં જ દેહ છીડ્યો. મૃત્યુના ત્રણ દિવસ પહેલાં તમને સર્વત્ર બાબા જ દેખાતા હતા. પોતાની પત્નીને પણ તેઓ ‘આવો સાઈબાબા’ એમ જ કહેતા હતા. (ઓ. ૫૬-૬૬)

અમહમદનગર લુલાના બેલાપુર મુકામે નાનાસાહેબનો પુત્ર માંદો હોવાને કારણે નાનાસાહેબનાં પત્નીને ત્યાં મળવા જવું હતું. તેમણે પત્નીની સંભતિથી ત્યાં જવાની તૈયારી કરી હતી. હંમેશા પ્રમાણે બાબાને યાદ કરીને તેમનો હુકમ મળતાં તેમણે પત્નીને આ વાત કરી. આ પ્રકારે એમનું બેલાપુર જવાનું નક્કી થયું. પરંતુ ત્યારબાદ નાનાએ તેમનાં પત્નીને તે જ દિવસે શિરડી પાછા ફરવું જેઠાં તેમ જણાવવાથી તેવું નક્કી થયું. નાનાસાહેબે કોઈ કારણવસાત પત્નીને કહ્યું કે ‘જ પાછી તરત આવી જને’ તેવું સાંભળીને પત્નીને મનહુઃખ થયું. બીજે દિવસે અમાસ હતી. તેથી તે દિવસ પણ ત્યાં જ નીકળે એવી બાઈની ઇચ્છા હતી, પરંતુ નાના સાહેબને તે વાત યોગ્ય ન લાગી. એ સિવાય પણ અમાસનો દિવસ બહારગામ જવા માટે અયોગ્ય હોય છે. માટે બાઈને એક મોટો પ્રક્રિયા કે તેમાંથી છુટકારો કેવી રીતે મળશે. તેમને તે અંગેની ચિંતા થવા લાગી. બેલાપુર ગયા વગર તેમના મનને સમાધાન થતું ન હતું. અને સાથે સાથે પત્નીની આજા તોડવી પણ શક્ય ન હતી. છતાં તૈયારી કરીને તેઓ બેલાપુર જવા માટે નીકળ્યાં. બાબાની સવારી લેંડીબાગ તરફ જવા માટે નીકળી હતી. બાઈએ બાબાને નમસ્કાર કર્યા. ગામનું કોઈ પણ જણ બહારગામ જતાં પહેલાં, કાર્યમાં વિદ્ધન ન આવે માટે મંદિરે ઈશ્વરના દર્શન કરીને જય છે, તેવી પ્રથા શિરડીમાં પણ હતી. પરંતુ ત્યાંના દેવ સાઈ હતા. જવાની ગમે તેટલી ઉતાવળ હોય છતાં બહાર જતી વખતે શિરડીના લોકો બાબાના શ્રી ચરણોમાં નમન કરીને જતા. શિરડીની આવી પ્રથા પ્રમાણે સાહેના વાડાની સામે બાબા ક્ષણભર ઉભા હતા. તે વખતે તે બાઈએ બાબા પાસે જઈને ચરણવંદન કર્યા. નાનાસાહેબ નિમોણકર અને બીજી સૌ દર્શને આવેલાઓની ઉત્સુક મંડળી સબલ અને આસ કરીને નાનાસાહેબ સમક્ષ બાબાએ જે કંઈ નાનાસાહેના પત્નીને કહ્યું તે પ્રસંગે એની યોગ્યતા સમજય છે. પગ પર માથું મુકીને બાઈએ જવાની આજા માગી ત્યારે બાબા બોલ્યા, ‘ભલે જલ અને હોવે જલ્દી નીકળો. મન સ્વસ્થ થવા હો અને પહોંચ્યા પછી ચાર દિવસ સુખેથી બેલાપુરમાં રહેણે તથા બધાની પૂછપરછ કરીને શિરડી પાછા આવજો.’ બાબાના આવા વચ્ચનો સાંભળીને બાઈને અનપેક્ષિત સાંત્વન મળ્યું. નિમોણકરને ઈશારો સમજયો અને બંનેને સંતોષ થયો. સારાંશ એટલો કે, આપણે કાર્યક્રમ તો નક્કી કરીએ છીએ, પરંતુ આપણને આગળ પાછળનું જ્ઞાન હોતું નથી. સંતોને આપણનું કલ્યાણ અને અહિતની ખબર હોય છે. સંતોને ખબર ન હોય એવી કોઈ વાત આ જગતમાં નથી. તેમને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણોય કાળનું જ્ઞાન સ્પષ્ટ હોય છે. તેમની આજા પ્રમાણે જે વર્તન કરીએ તો ભક્તો સુખી સંપત્ત થાય છે. (ઓ. ૬૭-૮૪)

હોવે આગળ ઉપર કહ્યા પ્રમાણે મૂળે ઉપર કૃપા કરીને બાબાએ તેમને તેમના ગુરુના ડ્રિપમાં દર્શન કેવી રીતે કરાયાં તે મુખ્ય કથાનું વર્ણન આગળ ચલાવીએ. મૂળેના મનમાં શ્રીમંતુ બાપુસાહેબ બુદ્ધીની મુલાકાત લઈને તાબડતોખ પાછા ફરી જવું એવું હતું. પરંતુ તેમનો હેતુ ભલેને આ પ્રકારનો હોય પણ બાબાનો એમાં બીજે જ કોઈ આશય હતો. તે ચમત્કાર અને રહસ્ય શ્રોતાઓએ ધ્યાન દઈને સાંભળ્યું. શ્રીમંતુ બુદ્ધી સાહેબની મુલાકાત બાદ સર્વ મંડળી મસ્જિદ તરફ જવા નીકળી. મૂળેને પણ ઇચ્છા થઈ અને સમુહની સાથે તે પણ નીકળ્યા. મૂળેએ છ અને છ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો. જ્યોતિષશાસ્ત્રમાં તેઓ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ખૂબ જ પ્રવીણ હતા. તેવી જ રીતે સામુદ્રિક શાસ્ત્રમાં પણ પૂરેપૂરા નિપુણ હતા. બાબાનાં દર્શન થતાં જ એમનું મન ત્યાં વસી ગયું. બાબાના પ્રેમાળ ભક્તો બાબાને નિષ્પાપ અને કરુણા અને ભાવથી પેડા, પતાસા, બરફી, શ્રીકૃષ્ણ અને નારંગી જેવાં ફળફળાહિ બેટ ધરતાં હતા. ત્યાં એક બાઈ જંબુ, જલમફળ, કેળાં, શેરડી વેચવા માટે આવતી હતી. બાબા પોતાના પૈસાથી મનમાં આવે તો તેની પાસેથી પણ તે ખરીદી લેતા હતા. તેઓ પોતાની પાસેના પૈસા ખર્ચને કેરીના ટોપલા વેચાતા લેતા અને કેળાં પણ પુષ્કળ મંગાવતા. તે ફળ બાબા ભક્તોને વહેંચી દેતા. તે એક એક કેરી બે હાથ વડે ઘોળીને ભક્તોને પોતાને હાથે વહેંચી દેતાં. ભક્તો પણ બાબાની તેમના હાથ વડે મળેલી કેરીની પ્રસાદીને હેઠે લગાવતા અને તેનો રસ મોઢામાં ઉત્તરવા માંડતો. જાણો કે રસની જરેલી વાટકી મોઢે લગાડી ન હોય ? કેળાંની તો વાત જ અજલ્ય હતી. ભક્તો અંદરના ગર્ભનું માધુર્ય માણાતા અને બાબા કેળાંની છાલ ચાટતા. આ કીયાઓ કેટલી બધી આ આશ્વર્યકારક કહેવાય ! આ બધાં ફળો બાબા પોતાના હાથે જ ભક્તોમાં વહેંચી આપતા અને કયારેક મનમાં આવે તો એકાદું જલે પણ ચાખતા. આ નિત્યક્રમ અનુસાર ભક્તજનો માટે જ કેળાંની ટોપલી વેચાતી લઇને એ જ વખતે તેઓ એ ભક્તોમાં વહેંચ્યતા હતા. મૂળે શાસ્ત્રીને બાબાનાં ચરણો ઉપરનાં રેખા ચિહ્નો જેઠિને ખૂબજ આશ્વર્ય થયું. તેમને હથેળીમાં ધન, વજ અને અંકુશ જેવાં ચિહ્નો સાથેની રેખાઓનું નિરીક્ષણ કરવાની દીચણા થઈ. આવાં ચિહ્નો ફક્ત દીશરી અવતારની હથેળીઓમાં જ હોય છે. એ સમયે બાબાના ભક્ત કાકાસાહેબ દીક્ષિત ત્યાં બાબા પાસે જ હતા. તેમણે ચાર કેળાં ઉચ્ચક્યાં અને બાબાને હાથમાં આપ્યાં. ત્યારે કોઈએ બાબાને વિનંતી કરી કે આ ક્ષેત્ર નિવાસી મૂળે શાસ્ત્રી મોટા પુણ્યના બળથી તમારા ચરણોમાં આવ્યા છે. એમને ફળોનો પ્રસાદ આપેને ! કોઈ વિનંતી કરે કે ન કરે, બાબાના મનમાં આવ્યા સિવાય તેઓ કોઈને પણ કંઈ આપતા નહિ કે કરવા દેતાં નહીં. મૂળે કેળાં નહીં પણ હુસ્તરેખાઓ જેવા માગતા હતા. તેથી તે પોતાનો હાથ આગળ ધરતા હતા. એ રીતે તે બાબાના હાથની રેખાઓ જેવા માંગતા હતા. પરંતુ બાબા તે તરફ ધ્યાન આપતા જ ન હતા અને બધાને પ્રસાદ વહેંચતા હતા. મૂળે શાસ્ત્રીએ બાબાને વિનંતી કરી કે મને ફળ નથી જેઠિનાં પરંતુ આપનો હાથ જેવા હો. મને સામુદ્રિક શાસ્ત્રે જેવાનું ફાયે છે અને હાથ જેઠિને ભવિષ્ય કહું છું. પરંતુ બાબાએ તેમને હાથ જેવા દીધો નહીં. તેમ છિતાં મૂળે આગળ આગળ જવા લાગ્યા. અને સામુદ્રિક લક્ષણો જેવા માટે પોતાનો હાથ લાંબો કરવા લાગ્યા પણ બાબાએ તો પાછળ વળીને જેયું પણ નહીં. જાણો કે કોઈ ઓળખાણ જ નથી. છેલ્લે મૂળેએ પસરાવેલ હાથ પર બાબાએ ચાર કેળાં મૂકી દીધાં અને કહું કે બેસો. પરંતુ મૂળેના હાથમાં પોતાના હાથ મૂક્યો નહીં. જેણો પોતાનું આખુંય શરીર સમગ્ર આખુંય સંધળુ દીશર માટે ઘરી નાંખ્યુ છે તેને સામુદ્રિક શાસ્ત્ર સાથે શી નિસ્બત ? સાઈમહારાજની સર્વ દીચણાઓ પૂર્ણ થયેલી હતી. અને તેઓ પોતાનાં ભક્તોનાં મા બાપ હતા ! આવી બાબાની નિઃસ્પૃહ સ્થિતિને સામુદ્રિક લક્ષણો તરફની બેપરવાહી અને ઉદાસીન વૃત્તિ જેઠિને શાસ્ત્રી ભુવાએ પોતાનો હાથ પાછો ખેંચી તીધો અને બાબાને હાથ જેવાનો આગળ છોડી દીધો. તેઓ થોડા સમય સ્વસ્થ બેઠા તે પછી સમુહની સાથે વાડામાં પાછા ગયા. (ઓ. ૮૫-૧૦૮)

વાડામાં પહોંચ્યા બાદ મૂળેએ સ્નાન કર્યું ને અબોટીયું પહેર્યું. ત્યારબાદ અન્ધિહોવીના નિયમ અનુસાર નિત્ય વિધિ શરૂ કરી. આ બાજુ દરરોજના નિયમ પ્રમાણે બાબા લેંગીબાગ તરફ જવા માટે નીકળ્યા અને બોલ્યા ‘ગેરુ જેઠે લઈ લેને રે આજે ભગવા વસ્ત્ર પહેરીશું.’ બાબાની આવી વાણી સાંભળીને બધાને આશ્વર્ય થયું. બાબા ગેરુ લઈને શું કરશે ? આજુબાજુ ઉભેલા લોકો વિચાર કરવા લાગ્યા, કે બાબાને આજે ગેરુની ચાદ કેમ આવી ? બાબાના શબ્દો હંમેશા આવા ગૂઢાર્થવાળા જ રહેતા. એનો અર્થ કોણ જાણો ? પરંતુ ધ્યાનપૂર્વક જે તે સાંભળવામાં આવે તો તેના અનેક અર્થ સ્પષ્ટ થઈ જતા. સંતેના બોલ ક્યારે પણ નિર્ધક નથી હોતા. સદાને માટે અર્થપૂર્ણ અને સંદિગ્ય હોય છે. એની કિંમત કોણ આંડી શકે ? સંતો પહેલાં ખૂબ વિચાર કરીને પછી જ બોલતા હોય છે. તે જેવું બોલે છે તેવું જ કરી બતાવે છે. આ સર્વમાન્ય

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સિદ્ધાંત પ્રમાણે સંતોનાં વચનો કયારેય અર્થહીન અને સાર વગરના હોતાં નથી. ધ્યાન દીને જે એને સારી રીતે સમજવામાં આવે તો ઉકેલ જડે છે. આ બાજુ બાબા લેંડીબાળથી પાછા આવ્યા તે સમયે નગારુ અને રણશિંગ વાગવા લાગ્યાં. બાપુસાહેબ જ્ઞે વચ્ચેથી ઉતાવળે મૂળેને સૂચના આપી કે, ‘આરતીનો સમય થયો છે માટે તમે મસ્નિદ્દમાં આવો છો ?’ પણ શાસ્ક્રીબુવા માટે અભોટીયું પહેરીને જવું યોગ્ય ન લાગ્યું તેમણે ઉત્તર આપ્યો કે ત્રીજી પ્રહરે સાંજે ચાર વાગે દર્શન કરવા માટે જઈશ. તે પછી આરતીની તૈયારી કરવા લાગ્યા. અહીંયાં મસ્નિદ્દમાં બાબા પાછા આવ્યા અને પોતાના આસન પર આવીને બેઠા. સૌ પૂજન પતી ગઈ અને આરતી પણ પૂર્ણ થઈ. તે સમયે બાબા બોલ્યા કે ‘લાવો પેલા નવા ખ્રાલણ પાસેથી દક્ષિણા લાવો’ આ સાંભળીને બાપુસાહેબ બુદ્ધી તરત જ ઉઠીને મૂળો પાસે દક્ષિણા મંગવા માટે ગયા. તે સમયે મૂળો સ્નાન કરીને અને અભોટીયું પહેરીને સ્વસ્થ ચિસે પલાંદી વાળીને પજાસનમાં બેઠા હતા. બાબાનો સંદેશો સાંભળીને મૂળેના મનમાં શંકા થઈ કે ‘મારે દક્ષિણા શા માટે આપવાની ? હું એક અન્ધીલોતી પવિત્ર ખ્રાલણ છું. બાબા ભલેને મોટા સંતપુરુષ હોય પરંતુ હું કોઈ એમનો આજાધારક શિષ્ય કે ભક્ત થોડો જ છું ? મારી પાસે વળી શાની દક્ષિણા માંગે છે ?’ આ પ્રકારે એમના મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ અને તેમને થયું કે સાઈ જેવા સિદ્ધ મારી પાસે દક્ષિણા માંગે છે અને બુદ્ધી જેવા શ્રીમંત એમનો સંદેશો લાવે છે. આ કેવું ? મૂળેના મનમાં શંકા તો હતી જ છતાં તેમણે દક્ષિણા સાથે લીધી. મૂળેના મનમાં બીજે પણ એક સંશય હતો કે આરંભ કરેલું નિત્યકર્મ છે તેને અધ્યરૂં રાખીને હું મસ્નિદ્દમાં કેવી રીતે જાઉં ? ના પણ કહી શકાય એવું નથી ! સંશયવાળા જીવાત્મામાં નિશ્ચિતતા હોતી નથી. તેમનું મન સદ્ગ્યાને માટે ડામાડોળ રહે છે. તેમની પ્રગતિ આ લોકમાં થતી નથી. અને પરલોકમાં જાણે થતી નથી. આવા લોકોની ત્રિશંકુ જેવી સ્થિતિ બની જાય છે. છેવટે મૂળેએ મસ્નિદ્દમાં આરતીના સમયે જવાનો નિશ્ચય કર્યો. (ઓ. ૧૦૮-૧૨૬)

મૂળો સભામંડપમાં તો ગયા પણ દૂર ઉભા રહ્યા. પોતે પવિત્ર અભોટીયામાં અને મસ્નિદ્દ તો અપવિત્ર ! બાબાની પાસે જવું કેવી રીતે ? તેઓ દૂર ઉભા રહીને હાથ જેઠી ને કમને વચ્ચે વચ્ચે બાબા ઉપર ફૂલ ચઢાવવા લાગ્યા. એટલામાં એમની દિશા સામે ચમત્કાર થયો. ગાદી ઉપર બેઠેલા બાબા એકદમ અદશ્ય થઈ ગયા. અને તેમના સ્થાને મૂળેશાસ્કીને પોતાના ગુરુશ્રેષ્ઠ શ્રી ઘોલપ સ્વામી બેઠેલા જાણાયા. ઘોલપનાથ મૂળો સાઈનાથની જગ્યાએ દેખાતા હતા. જ્યારે અન્ય ભક્તોને સાઈબાબા દેખાતા હતા. તે ભલેને પહેલાં જ બ્રહ્મીભૂત થયેલા હતા. તેમ છતાં મૂળેને તેનું ખૂબ જ આશ્રય થયું. ખુસું જોતાં તેમના ગુરુ ભલે સમાવિસ્થ થયા હતા છતાં તેઓ મૂળની નજરો સામે હોય એવું હેખાંતું હતું. આ જેઠેને મૂળો આશ્રયમાં ગરકાવ થઈ ગયા. અને મનમાં શંકા થવા લાગી કે જે એને સ્વખન કહું તો હું જગૃત અવસ્થામાં છું, અને જે જગૃત અવસ્થામાં હોઉં તો ગુરુ કેવી રીતે મારી સામે આવીને ઉભા રહ્યા છે ? મનમાં મોટો ગુંચવાડો ઉત્પન્ન થયો. થોડા સમય માટે તેઓ બિલકુલ ચૂપ અને શાંત થઈ ગયા. પોતાની જાતે પોતાના શરીર પર એક ચુંટલી ભરી જેઠ અને મનમાં બોલ્યા, ‘આ કંઈ ખોટું નથી. મનમાં વગર કારણે સંશય કેમ આવ્યો ? હું તો બધાની જેઠે અહીં જ છું !’ મૂળેશાસ્કી ભલે સંત ઘોલપ સ્વામીના ભક્ત હતા તથા બાબાના વિષયમાં શંકારીલ હતા. તેમ છતાં આ પ્રસંગ બનવાથી તેઓ શુદ્ધ ભાવે સાઈબાબાના ભક્ત બની ગયા. પોતે ખ્રાલણ હતા અને વેદાંગ શાસ્ક્રોમાં પ્રવીણ હતા. મસ્નિદ્દમાં ઘોલપ સ્વામીના દર્શન થયા એ જેઠેને તેમના આશ્રયનો પાર ન રહ્યો. પછી તે મસ્નિદ્દમાં ગયા. પોતાના ગુરુના ચરણોમાં નમસ્કાર કર્યા. અને હાથ જેઠીને ઉભા રહ્યા. મોઢામાંથી એક શબ્દ પણ નીકલ્યો નહીં. ભગવાં વચ્ચોમાં સજજ થયેલાં ઘોલપ સ્વામીને જેઠેને દોહતાં દોહતાં તેમના પગ પકડી લીધા. તેમનું ઉચ્ચ વર્ઝનું અભિમાન ઓગળી ગયું. આંખોમાંથી ગેરસમજ ચાલી ગઈ અને પોતાના ગુરુ સાથેની મુલાકાત થતાં તેમને જાણે કે કુબેરનો ખજનો હાથ લાગ્યો. તેમની સંશયાત્મક ભાવના ચૂર ચૂર થઈ ગઈ. બાબા ઉપર અપ્રિતમ પ્રેમ ઉભરાયો અને અઠદી ઓલેલી આંખોથી સાઈનાં ચરણ એકીટશે જેવા લાગ્યા. એવું લાગ્યું કે અનેક જન્મોનાં સારાં કર્મનાં ફળ પ્રાપ્ત થયાં. તેથી સાઈ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મહારાજનાં ચરણોમાં આશ્રય પામ્યા. તેમના ચરણદ્વારા તિર્થમાં સ્નાન કરીને જાણે કે નસીબ ઉધડી ગયું. આરતી માટે ભેગા થયેલા બીજા લોકો આશ્રયમાં ડૂબી ગયા કે, પહેલાં તો મૂળે દૂરથી કૂલ પદ્મરાવતા અને હવે એકાએક બાબાની પાસે જાઈને બાબાના પગમાં મસ્તક મૂકીને શું કરી રહ્યા છે? અન્ય લોકો જ્યારે બાબાની આરતી ગાતા હતા તે વખતે મૂળે ઘોલપ સ્વામીનું નામ જેર જેરથી લઈને તેમની આરતી ગાતા હતા. અને તે આનંદમાં અને તેમના પ્રમાણમાં તલ્લીન થઈ જતા હતા. મૂળેની શોળું અને અબોટિયાની જાણે પ્રતિષ્ઠા ઉઠી ગઈ. તેમજ છુતઅધૃતની અને સામાજિક ઉચ્ચ નીચની યાદ જ રહી નહીં. બાબા સામે સાણંગ દંડવત્પ્ર પ્રણામ કરી તેમણે આનંદથી આંખો બંધ કરી. પછી ઉભા થઈને જુઓ છે, તો ઘોલપ સ્વામી અદ્દ્ય થઈ ગયા હતા અને તેમની જગ્યા એ સાઈસમર્થને દક્ષિણા માંગતા જેથા.. બાબાની આ આનંદ-સ્વરૂપ મૂર્તિ જેઠને તેઓ સ્તરથી થઈ ગયા. અને પોતાની અસલ શંકાશીલ સ્થિતિનું ભાન રહ્યું નહીં. આ પ્રકારે સાઈમહારાજનો ચમત્કાર જેઠને મૂળેની ભૂખ તરસ નહિ જેવી થઈ ગઈ. પોતાનાં ગુરુના દર્શનની તેઓ પાવન થઈ હર્ષધેલા થઈ ગયા. મનનું સમાધાન થયું. ફરી પાથી બાબાને દંડવત્પ્ર પ્રણામ કરીને છલકાતી આંખે બાબાનાં ચરણમાં માથું મૂકીને નમસ્કાર કર્યા. દક્ષિણા જે માંગી તે આપી અને ફરી ચરણમાં મસ્તક મૂક્યું. અશ્રુભીની આંખે તેમનું શરીર રોમાંચિત થઈ ગયું. કંઠ ગદગદીત થઈ ગયો અને મન ભરાઈ આયું. તેથી મનના અષ્ટભાવ ઉત્પન્ન થયા. અને તેઓ બોલ્યા, ‘મનનો સંશય મટ્યો અને તે ઉપરાંત મને મારા ગુરુના દર્શન થયાં.’ બાબાની આ અલૌકિક લીલા જેઠને મૂળે સાથે બધાઓનો કંઠ ઢંઘાઈ ગયો, અને આ અનુભવથી તે સર્વને ગેરુનો અર્થ સમજાયો. આ જ સાઈ અને આ જ મૂળે પણ વચ્ચેથી કેવા બદલાયા. તે બાબતનું તેમને આશ્રય થવા લાગ્યું. બાબાની કળા કૌશલ્યને કોણ સમજી શકશે? તેમની લીલાઓ તો અગાધ છે. (ઓ. ૧૨૭-૧૫૦)

આવા જ એક માભલતદાર સાઈ દર્શનની દૃઢાથી એક ડૉક્ટર મિત્રને સાથે લઈ શિરડી જવા માટે નીકળ્યા. ડૉક્ટર જાતના ખાત્મણ હતા અને ભગવાન શ્રી રામચંદ્રજીના ઉપાસક હતા. પોતે આચરણશીલ હોવાને લીધે સ્નાન સંધ્યા વગેરે શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે તેમને તે પાળવાની ટેવ હતી. તેથી તે એવું માનતા હતા કે શ્રી સાઈબાબા તો મુસલમાન છે જ્યારે પોતાના આરાધ્ય દેવ સીતાપતિ શ્રી રામચંદ્ર ભગવાન છે. તેથી હું સાઈબાબાને નમસ્કાર કરવાનો નથી. તે એમણે પોતાના મિત્રને પહેલેથી જ કહી દીધું હતું. એક મુસલમાનને પગે લાગવું મને ગમતું નથી. આ કારણે પહેલેથી જ શિરડી જવા હું થોડો સંકોચ અનુભવતો હતો. તેવું પણ એમને કહેવામાં આયું હતું. પગે પડવાનો આગ્રહ કોઈ તમને કરશો નહિ, કે કોઈ તે બાબતની જુદ્દ પણ નહીં કરે. છતાંય ધારોકે કોઈ આવો આગ્રહ કરે તો તમે કરતાં નહીં. પણ શિરડી જવાનો કાર્યક્રમ મનમાં પાકો કરો. બાબા પોતે પણ પોતાને નમસ્કાર કરવાનું કોઈને કહેતાં નથી. આ પ્રકારે માભલતદારે આશ્વાસન આયું. તે બાદ ડૉક્ટરને શિરડી જવાની દૃઢા થઈ. પછી મિત્રોના શબ્દો ઉપર વિશ્વાસ રાખીને તથા સંશય દૂર કરીને અને દફ નિશ્ચય પૂર્વક તેઓ દર્શન માટે ગયા. પરંતુ આશ્રયની વાત એ કે, તેઓ જ્યારે શિરડી પહોંચ્યા અને મસ્તિષ્ઠમાં ગયા ત્યારે પ્રથમ ડૉક્ટરે જ બાબાને દંડવત્પ્ર પ્રણામ કર્યા. તેથી માભલતદારને ખૂબજ આશ્રય થયું. તેમણે પ્રશ્ન કર્યો કે આપે કરેલો નિશ્ચય કેમ ભૂતી ગયા? ‘વળી અમારી પહેલાં તમે એક મુસલમાનને દંડવત્પ્ર પ્રણામ કેમ કર્યા?’ ત્યારે તે ડૉક્ટર નવાઈથી કહેવા લાગ્યા કે મેં શ્યામબર્ણ સુંદર કોમળ અને સુશોભિત સન્જેલા શ્રીરામનું દર્શન કર્યું અને તેમનું રૂપ જેઠને શુદ્ધ મનથી તેમને નમસ્કાર કર્યા. ભગવાન શ્રીરામ સાક્ષાત પોતે જ આસન ઉપર બેઠા હતા, અને બધાની સાથે વાતો કરતા હતા, અને તેથી થોડી જ ક્ષાણોમાં સાઈરૂપ પાછું દેખાવા લાગ્યું. માટે હું તો આભો બની ગયો. શું આને સ્વર્ણ કહેવું? તે શાના મુસલમાન? તે તો ચોક્કસ યોગસંપત્ત અવતારી પુરુષ જ હોવા જેઠાએ. પાંડુરંગનો ભક્ત ચોખામેળા જાતનો મહાર હતો. તેજ રીતે રોહીદાસ ચમાર હતો અને સજન કસાઈ (ખાટકી) હિંસા કરનારો હતો. એમની જાતનો વિચાર શા માટે કરવો? કેવળ જગત ઉપર ઉપકાર કરવા માટે જ અને જન્મ મરણનો ફેરો ચુકવવા માટે જ પોતાનું નિર્ગુણ નિરકાર રૂપ છોડીને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આ સંત જગતમાં સાકાર સ્વરૂપે પ્રગટ્યા છે. આપણા સાઈ તો પ્રત્યક્ષ ઈરચીત ફળ આપનાંસું કલ્પવૃક્ષ જ છે. એક ક્ષણમાં સાઈ તો બીજુ ક્ષણમાં શ્રીરામ થાય છે. મારી હુંપણાની ખોટી સમજ તેમણે દંડવત્ પ્રણામ કરાવીને નષ્ટ કરી નાખી. બીજા દિવસે ડૉક્ટરે વ્રત લીધું કે, જ્યાં સુધી શ્રી સાઈનાથ મહારાજ કૃપા કરતા નથી. ત્યાં સુધી મસ્નિદમાં પગ મૂકવો નથી. એમ વિચારી તેઓ શિરડીમાં જ ઉપવાસ પર ઉત્તર્યા. આમ ત્રણ દિવસ વિતી ગયા અને ચોથા દિવસે જે ઘટના ઘટી તે ધ્યાનપૂર્વક સાંભળો. ખાનદેશમાં રહેનારો ડૉક્ટરનો એક મિત્ર અચાનક સાઈબાબાના દર્શન માટે શિરડી આવ્યો. તેની સાથે લગભગ નવ વર્ષના ગાળા પછી મુલાકાત થઈ માટે ડૉક્ટરના મનમાં આનંદ સમાતો ન હતો. ડૉક્ટર તે મિત્રની પાછળ પાછળ મસ્નિદમાં દર્શન કરવા માટે ગયા. ત્યાં જઈને ડૉક્ટરે નમસ્કાર કર્યો તેથી બાબાએ ડૉક્ટરને પૂછ્યું, ‘કેમ, ડૉક્ટર! કોઈ તને બોલાવવા માટે આવ્યું હતું કે? તો પછી તું આવ્યો કેમ? તે મને સમજન્બવ.’ આવો માર્મિક પ્રક્રષ્ટ સાંભળતા જ ડૉક્ટર શરમથી પીગળી ગયા. પોતાના કરેલા નિશ્ચયની વાત તેને યાદ આવી અને મનમાં પશ્ચાતાપ સાથે ઐદ કરવા લાગ્યા. પરંતુ તે દિવસની મધ્ય રાત્રીએ બાબાની તેમની ઉપર કૃપા થઈ. અને ઊંઘમાં પરમાનંદ સ્થિતિનું માધુર્ય તેણે ચાખ્યું. ત્યાર બાદ ડૉક્ટર તેમને ગામ પાછા ગયા, છતાં પેલી સંપૂર્ણ સ્વચ્છાનંદની સ્થિતિનો અનુભવ તેમને સતત પંદર દિવસ સુધી રહ્યો અને સાઈચરણોમાં તેમની લક્ષિતનો ખૂબ વધારો થયો. (ઓ. ૧૫૧-૧૭૩)

આવા સાઈના એક એક એવા નવા અનુભવો કહી શકાય તેમ છે અને ગ્રંથનું ગૌરવ વધારી શકાય તેવું પણ છે. પરંતુ વિસ્તાર વધી જય તેના ભયથી સમેટી લઉં છું. આરંભમાં કહેલી મૂળેની વાર્તા સાંભળીને શ્રોતાઓને મનમાં આશ્રય જરૂર થયું હશે, પરંતુ તેનો બોધ સૌચે સમજ લેવો. જેનો જે ગુરુ હોય, તેમાં દફ વિશ્વાસ રાખવો. બીજુ અન્ય જગ્યાએ નહીં, આ જ ભાવાર્થ મનમાં ઠસાવવો જેઠાએ. આ જીવાય બાબાનો આ લીલામાં કોઈ બીજે હેતુ હોય એવું મને દેખાતું નથી. જેને જેમ ફાયે તેમ વિચારે પણ અર્થ તો આ જ નીકળે શકે. કોઈની કીર્તિ કેટલી મહાન હોય અને તેની સરખામણીમાં આપણા ગુરુની જરા પણ ન હોય તેમ છતાં પોતાના ગુરુમાં દ્રદ વિશ્વાસ હોવો જેઠાએ. આ જ તેનો ઉપદેશ છે. પોથી પુરાણમાં ખોળવા જઈએ તો તેમાં પણ આ જ ઉપદેશ ભરેલો છે. છતાં તેના પુરાવા મળ્યા વીના દ્રદ વિશ્વાસ બેસતા બેસતો નથી. પોતાનો પાક્ઝો વિશ્વાસ ન હોવાં છતાં કેટલાક મનુષ્યો પોતાને આત્મનિષ્ઠ ગણાવીને મહાસે છે. તેમના જન્મોનાં બધાં જ કષ્ટો ઘણીબાર સ્પષ્ટ દેખાઈ આવતાં હોય છે. ‘દીક્ર ચ નાસ્તિ પરં ચ ના’- આ નહીં અને તે પણ નહીં જેવી સ્થિતિમાં એક ક્ષણ પણ મનને શાંતિ નથી હોતી, અને પોતે મુક્ત છે તેવી બડાસો મારે છે. (ઓ. ૧૭૪-૧૮૧)

આગળના અદ્યાયની મીઠાસ આનાં કરતાં પણ ખૂબજ વધશે. વાસ્તવાર સાઈનાં દર્શન કરવાથી અમર્યાદિત આનંદનો લાભ મળે છે. હવે પછીના અદ્યાયમાં ભક્ત ભિમાજ પાટીલનો ક્ષયરોગ કેવી રીતે મટાડયો અને બાબાએ દર્શન દઈને નાનાસાહેબ ચાંદોરકર પરનો ભરોસો કેવી રીતે સમજન્બવો તે જાણવા મળશે. માટે કહ્યું છે કે કંઈ પણ નાના જરૂર કરશે। જે બીજા ના કરી શકે ॥ અ. ૧૩ ઓ. ૪૮ કેવળ દર્શનનો જ આ પ્રતાપ છે. જેના માત્ર દર્શન થવાથી પાપમુક્તી થાય છે. આરતી કરીને બાબા આ લોકના ભોગ પોતાના પાલવમાં સંતાડે તેટલા આપે છે, અને પરલોકના ભોગ પણ પુજ્ઞ આપે છે. જે બાબા યોગીજનોને દાખિપાત અને નાસ્તિકોને પાપથી સંપૂર્ણ મુક્ત કરે છે, તો પછી આસ્તિકોની તે શી વાત કરવી ? તેઓ તો આપોઆપ જ પાપમુક્ત થઈ જય છે. જેમની બુદ્ધિ બ્રહ્મમાં સ્થિર થયેલી છે અને જેઓને અપરોક્ષ રૂપે ઈશ્વરનો સાક્ષાત્કાર થયો તેવા મહાત્માની દાખ જેની ઉપર પડે તો મોટામાં મોટા પાપોથી પણ મુક્ત થઈ જય છે. આવી બાબાની સમજ ન શકાય તેવી કળા છે. બાબાનો તમારી ઉપર પ્રેમ છે માટે તમે સૌ તેને શુદ્ધ મનથી સાંભળો. જ્યાં ભક્તિ પ્રેમનો ઉમંગ છે અને જ્યાં જીવોમાં બાબાને આહવાનો છે, ત્યાં જ ખરી માયાનો ઉમળકો પ્રગટે છે અને ત્યાં જ શ્રવણની મજા આવે છે. અનન્ય ભક્તો માટે જે નિશ્ચિત આશ્રય સ્થાન છે તેવા સાઈ ચરણોને હેમાડપંત નમન કરે છે. એની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કરણીનો કોઈ પાર જ નથી. સંસારના જન્મ મરણના ભય દૂર કરવા માટે બાબા સમર્थ છે. (ઓ. ૧૮૨-૧૮૬)
સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત
શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્ર ‘શ્રી સંત ધોલપનું રામર્દ્ઘન’ આ નામનો બારમો અધ્યાય.
અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



અધ્યાય ૧૨નું અર્થ વિવરણ

‘જેના પણ જે કોઈ ગુરુ હશે તેમાં જ શિષ્યનો દઢ વિશ્વાસ હોવો જેઠાએ, અને બીજા સ્થાનોમાં ન હોવો જેઠાએ.’ આવા આ અધ્યાયના તાત્પર્ય અને શિક્ષણ માટે હેમાડપંતે આગળ ઉપર ઓ. ૧૭૬માં કહ્યું છે. આ સિવાય આ અધ્યાયનો બીજો એક સાર છે. આગળના નવમા અધ્યાયમાં બાબાની આજ્ઞા ન સાંભળનાર ભક્તોના થયેલા હાલનું જે વર્ણન આપણે વાંચ્યુ છે. હવે આ અધ્યાયમાં કાકા મહાજની ભાઉસાહેલ ધૂમાળ અને નાનાસાહેલ નિમોણકરના પત્ની આ બધાઓએ બાબાની આજ્ઞાનું પાલન કર્યું, એટલે તેમને નુકશાન તો ન થયું પરંતુ તેમનાં કાર્યો સિદ્ધ થયાં. નાસિકના મૂળે શાસ્ત્રી પણ બાબાની ઈચ્છાને માન આપીને દક્ષિણા લઈ મસ્નુફમાં બાબાની આરતી સમયે ગયા હતા. માટે જ તેમને પોતાના ખ્રલલીન ધોલપ ગુરુના ફરીથી દર્શનનો મોક્ષ પ્રાપ્ત થયો.

સારાંશ આપણે કરીએ સંકેત । પણ ના જાણીએ આદિઅંત ।

હિત અહિત જાણે સંત । નથી તેમને કંદ અજ્ઞાણ ॥૮૩॥

ભૂત ભવિષ્ય વત્તમાન । સર્વનું પ્રત્યક્ષ જ્ઞાન ।

એમની આજ્ઞાનુસાર વર્તન । કરી ભક્ત થા સુખ સંપત્ત ॥૮૪॥



॥ અધ્યાય ૧૩ ॥

ભીમાજુ ક્ષયનિવારણ

(શ્રી સાઈબાબાએ ભીમાજુ પાટીલનો ક્ષયરોગ મટાડચો)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

શ્રી સાઈબાબાનાં એક વાક્યમાં કહેવાયેલા વચનો આમ તો સંક્ષિપ્ત એટલે કે ઘણાં નાનાં હતાં, પરંતુ અર્થપૂર્ણ
હોવાથી સમજવા માટે અધરાં અને ગહન હતાં. વિશાળ થતાં તે ખૂબ જ સરળ લાગતાં. પણ સુત્રતામાં થતાં તે એટલાં જ
અટપટાં લાગતાં હતાં. શ્રી બાબાના શબ્દો તેનું અર્થધટન કરવા માટે ખૂબ જ ગંભીર અને ઊંડા હતા. પરંતુ તે સાથે
અર્થહીન કે વગરકામના બબડાટ જેવા પણ ન હતા. તે શબ્દો વધારે સૌમ્ય, શાંત અને સમતોલ તથા અત્યંત આણમોલ
હતા. ગીતાજીના ચોથા અધ્યાયનો બાવીસમાં શ્લોક ‘યદૃચ્છા લાભ સંતુષ્ટો’ પહેલેથી છેવટ સુધી એક જ સંગતમાં
જણાવું રહેવું, દૈવી ગતિથી જે કંઈ પ્રાપ્ત થાય તેને અનુસરીને વર્તતા રહેવું, સદાય સંતુષ્ટ અને તૃપ્ત છે તેમ રહેવું. તેમજ
કદાપિ વિંતા ન કરવી. તે સમજવવા માટે બાબા કહેતા ‘અરે હું તો ધરબાર સિવાયનો ફકીર થઈને બેઠો છું. હું બેદિકર
થઈને તથા બધી જ લમણાઈક છોડીને એક જ જગ્યા પર સ્વસ્થ બેઠો છું, છતાં એ ટાળતાં ન ટળનારી અનિવાર્ય માયા
મારા જેવાને પણ સત્તાવે છે. હું તેને ભૂતી જલ્દ છું પણ તે મને છોડતી નથી. મને એ સતત જકડી રાખવા માંગે છે. શ્રી
હરિની એ આદી માયા છે. બ્રહ્મદેવ જેવાને પણ જે હેરાન કરી નાખે તો મારા જેવા એક લાચાર ફકીરની તો શી વિશાત ?
શ્રીહરિ જ્યારે પ્રસન્ન થશે ત્યારે જ એ હારી જશે. શ્રી હરિનું અખંડ ભજન કર્યા સિવાય માયાનું નિવારણ શક્ય નથી.’
બાબા માયાનો મહિમા આ રીતે ભક્તોને કહેતા હતા અને શ્રીહરિની સેવાપૂજનથી અને શાંત અને નિવૃત્ત કરવા માટે જે
સદાય ભજન કરતા રહેવાની સ્થિતિમાં રહે છે તેની પ્રશંસા કરતા હતા. (ઓ. ૧-૮)

‘સંતો જ મારું સચેતન અને સળુવ સ્વર્દ્ધપ છે.’ એવું ભગવાન શ્રીકૃષ્ણે ભાગવતમાં ઉદ્વને જે ચોખ્ખા શબ્દોમાં
કહ્યું છે, એની કોને ખબર નથી ? માટે ભક્તોના કલ્યાણ અર્થે દ્વારાના સાગર એવા સાઈસમર્થ, સત્ય અને અર્થયુક્ત
જે કંઈ બોલ્યા તે અતિ નમ થઈને સાંભળીએ. ‘જેમનાં પાપો ધોવાઈ ચૂક્યાં છે તે જ ખરા પુણ્યાત્માઓ મારા
ભજનમાં જેડાયા છે. અને તેમને જ મારી ભરળ મળી છે. ‘સાઈ સાઈ’ આવું નિત્ય બોલશો તો હું સાત સમુદ્ર પાર
હશો તમે છતાં તમારું કાળજીપૂર્વક રક્ષણ કરીશા. મારા આ શબ્દો પર વિશ્વાસ રાખશો તો આત્મીથી તમારું કલ્યાણ
થશે. મારે પૂજની મોંદીદાટ સામગ્રીઓ જેઠીની નથી. આઠ કે સોણ પ્રકારની પૂજની અને વિધિઓની જરૂરિયાત પણ
નથી. કેવળ જ્યાં પુષ્કળ ભક્તિભાવ હશે તે જ ઠેકાણે મારી હાજરી રહેશે એવું સમજાને. ભક્તોનો પ્રેમ જેઠીને બાબા
આ પ્રમાણે વખતોવખત કહી ગયા છે. પ્રેમથી બરેલા તે શબ્દોને ફક્ત યાદ કરીને મનને રમતું રાખીએ એવો આ
દ્વારા અને શરણો આવેલાઓની પાછળ પીઠબળ સમાન ‘આ સાઈસખા છે.’ ભક્તોનું ઉપરાણું લઈ એમને શું કમાલ
કરી છે તે જુઓ ! મનને એકાગ્ર કરીને આ કથા સાંભળવાથી આપણું કાર્ય સિદ્ધ થશે. સાઈના મુખેથી જે અમૃતવૃષ્ટિ
થઈ છે તે જ અહીંયાં આપણો સંતોષ અને સમાધાન છે તથા તે જ પ્રગતિ છે. જેને પોતાનું હિત સાધવાની મનમાં

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

ઇચ્છા હશે તે શિરડી જવાની દોહધામના કષ્ટથી થોડા કંટાળવાના છે ? (ઓ. ૮-૧૭)

પાછળના અદ્યાયની વાર્તા કંઈક આવી છે. એક અશ્રિહેત્રીને એના પ્રત્યાલીન થયેલા ગુરુના દર્શન આપીને બાબાએ તેને આનંદિત કર્યો. આ અદ્યાય એનાં કરતાં પણ વધારે મધુર છે. એક ક્ષય રોગથી પીડાતા કમજેર ભક્તને સ્વભન્માં સજ્જ આપીને બાબાએ તેને આરોગ્ય બક્ષ્યું. ‘માટે ભાવિક જનો ! સાઈનાથનું પાપોથી મુક્ત કરાવનારું એવું ગૂઢ ચરિત્રનું શ્રવણ કરો. આ ચરિત્ર પોતાની પુણ્યાઠી બીજને પાવન કરનારું છે. તે જાણે કે ગંગાનદીનનું પવિત્ર જળ હોય ! આલોક તેમજ પરલોકનું હિત સાધનારું આ ચરિત્ર સાંભળનારા શ્રોતાઓના કાન પણ ધન્ય છે. આ ચરિત્રને જે અમૃતની ઉપમાં આપીએ તો અમૃત કંઈ આ ચરિત્ર કરતાં વધારે મીઠું થોડું હશે ? અમૃત તો પ્રાણોનું રક્ષણ કરે છે, પણ આ ચરિત્ર તો વારંવાર થતા જન્મોના ચક્કબ્યુહમાંથી મુક્તિ અપાવે છે. (ઓ. ૨૮-૨૨)

જે જીવ પોતાને સંપૂર્ણ સત્તાધિશ માનતો હશે અને જેના મનમાં પોતાની ઇચ્છામાં આવે તે પ્રમાણે પોતે વર્તી શકીએ એવું સમજતો હશે તેવાઓએ તો આ કથા અવશ્ય સાંભળવી. જીવ માત્ર જે ખરેખર સ્વતંત્ર છે, તો પછી સુખ ખાતર રાત અને દિવસ મહેનત કરવા છતાં તેના ભાગે દુઃખ જ શા માટે આવે છે ? આ તો નસીબના ખેલ છે. દુઃખો ટાળવા માટે દેરેક જગ્યાએ સાવધાની વર્તના છતાં તે દુઃખો અતિશય તત્પરતાથી તેની શોધ કરીને તેની પાછળ પડે છે તેને શોધીને જ જંપે છે. તે દુઃખોમાંથી ઘૂંઠકરો મેળવવા જતાં તે ગણે પડે છે, અને ઝાટકી નાખવાથી વધારે ચોટે છે. જીવમાત્રની આ નકામી મથામણ છે. દરરોજનો મનુષ્યનો આ પરિશ્રમ તેને થકવીને ફીણ કરી નાખે છે. જીવ જે સાચે જ સ્વતંત્ર હોત તો પૂર્ણ પણે સુખોને આધિન રહ્યો હોત અને દુઃખોને લેશ માત્ર પણ સ્પર્શ કરત નહીં. સ્વતંત્ર બુદ્ધિ હોવાને કારણે પાપ કરવા જેવું કદી પણ વત્ત્યો જ ન હોત. અને ખૂબજ પુણ્ય ભેગું કરત અને તેણે સુખોની જ સમૃદ્ધિ ભેગી કરી લીધી હોત. પરંતુ જીવ સ્વતંત્ર નથી. તેની પીઠ પાછળ કર્મતંત્ર હોય છે. આ તંત્રનો ખેલ વિચિત્ર છે. બધાં જ કર્મ કરવાનાં સાધન આ તંત્રના હાથમાં હોય છે. પુણ્યકર્મ થાય છે. તે તરફ તેનું ધ્યાન જાય છે, પણ તેના આપોઆપ પાપકર્મ કરવા માટે વળી જાય છે. શરીર સારાં કર્મોનું સ્થાન શોધવા જતાં નરસાં કર્મો સાથે જોડાઈ જાય છે. (ઓ. ૨૩-૩૦)

હવે પૂના જિલ્લાના જુન્નર તાલુકામાં આવેલા નારાયણ ગામના ભીમાજુ પાટીલની કથા સાંભળો. તેમાં જાણે કે અમૃતની મીઠાશ છે. ભીમાજુ ધરનો સુખી સંપત્ત હતો. આવનારા જનારાઓને તે અન્ન વહેંચતો હતો. તેનું મન ક્યારેય બિન્ન થતું નહીં. તે સદ્ધા હસમુખો જ રહેતો. ઈશ્વરનાં કામો અવનવા હોય છે. લાભ કે હાની ન સમજની સમજની છે. કર્મોનું ભોગવાનું સામે ચાતીને આવે છે અને શરીરમાં ન ધારેલા રોગો પ્રવેશે છે. ભીમાજુને ઇ.સ. ૧૯૦૮માં તેના કમનસીબે શારીરિક પીડા ઉત્પત્ત થઈ. તેને ભયંકર ઉધરસવાળો ક્ષય રોગનો તાવ આવવા માંડયો. અને દિવસે દિવસે તે વધતો જ ગયો. તેને સહન ના થાય તેવી ક્ષય રોગની ઉધરસ થવા લાગી. આતી ભીમાજુ લાચાર અને નિરાશ થઈ ગયો. તેને મોઢામાં કાયમ ફીણ આવતું. પાણી જેવી ઉલ્લીાઓ થતી અને તેમાં ધણીવાર લોહી પડવા માંડયું. આથી તે ધણીવાર ગાભરાઈ જતો, પેટમાં સતત દુઃખાઓ થતો અને તેને બેચેની રોકી શકાતી નહીં. આવા ભયંકર રોગથી પીડાતો ભીમાજુ બિછાને પડ્યો. એના હાથ પગ ગળવા માંડયા અને શરીરથી તે સુકાતો જ ચાલ્યો. બધા જ ઉપાયો કરી ઘૂંઠયા પણ સારું ન લાગતાં તે ખૂબ ત્રાસી ગયો. ખાનપાનમાં જરી પણ રૂચિ રહી નહીં. કંણ જેવો પાતળો અને હલકો ખોરાક પણ તેને જરાય પચતો નહીં. આ બધાને કારણે શરીરમાં અસહ્ય તકલીફ થવાથી ભીમાજુ ધણો જ અસ્વસ્થ થઈ ગયો. તેને કંઈ પણ સૂજ પડતી ન હતી. તેણે દેરેક દેવદેવીઓની પૂજન કરી જોઈ અને વૈદ્ય અને ડૉક્ટરોએ પણ હાથ હેઠા મૂક્યા. બિચારા ભીમાજુની જીવવાની આશા પર પાણી ફરી વળ્યું. તે રોગનાં વિચારોના વમળમાં મનથી ઉદાસ થઈ ગયો. તેને સમજની ગયું કે હવે થોડા જ દિવસનો આ ખેલ છે. દિવસે દિવસે તેને વધારે થાક લાગવા માંડયો અને અશક્તિ વધાવ માંડી. તે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જેમ તેમ કરીને દિવસો પસાર કરવા લાગ્યો. તેના કુળ દેવતાની આરાધના પણ તેને આરોગ્ય આપી શકી નહીં. જ્યોતિષીઓને અને ભૂતપ્રેતને ભગાડનારા તાંત્રિકોને પૂર્ણી પૂર્ણીને પાટીલ થાક્યો. કોઈ કહેતું, ‘આ કેવો શરીરનો બાધિ છે !’ કોણ જાણે કેવા બદટર નસીબના યોગ છે ! એમ જ લાગતું હતું કે જાણે હવે ભોગ લાગ્યા. મનુષ્યના પ્રયત્નો નક્કામા હોય છે. તે ડૉક્ટર, વૈધ અને હકીમ તે સૌના ઉપચાર કરતાં કરતાં થાક્યો. કોઈનું કંઈ પણ ઉપજ્યું નહીં. અને બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. પાટીલ પોતે પણ પુર્ઝળ કંટાખ્યો અને બોલ્યો ઓ ભગવાન મેં એવું તો શું કર્યું છે કે કોઈ પણ ઉપાય માફક આવતો જ નથી ? આ તે કેવા પાપ છે ?’ ઈશ્વરનો ન્યાય પણ કેવો વિચિત્ર છે ? જે કોઈ સુખમાં આળોટી રહ્યા છે તેમને ઈશ્વર એક પળ પુરતુંયે તેવું સ્મરણ કરવા દેતો નથી. ખરેખર તેની લીલા અન્યથબી પમાડે તેવી છે. પછી જ્યારે તેના પોતાના મનમાં આવે ત્યારે અનેક પ્રકારનાં સંકટોની પરંપરા ઘડી નાખે છે, અને પોતાનું સ્મરણ કરાવડાવીને ભક્તો પાસેથી ‘હે નારાયણ ! તું દોડીને આવ’ તેમ બોલાવે છે. (ઓ. ૩૧-૪૬)

દુઃખોથી આકુળ વ્યાકુળ થયેલા ભીમાળનો પોકાર સાંભળીને ઈશ્વરનો તેને માટેનો પ્રેમ ઉભરાઈ આવ્યો. અને ભીમાળને બુદ્ધિ સુઝી કે નાનાસાહેબ ચાંદોરકરને પત્ર લખ્યો. નાનાસાહેબ મારે માટે કંઈક તો કરશે જ જે ભીજ કોઈ કરી શકવાના નથી. પાટીલના મનમાં તેમને માટે આ પ્રકારનો વિશ્વાસ જન્મ્યો. આજે શુલ્શુકન થયા. તેણે નાનાસાહેબને વિગતવાર પત્ર લખ્યો. ભીમાળને નાનાસાહેબની યાદ આવી એટલે સાથે સાઈબાબાની પણ એકદમ યાદ આવી, અને રોગ મટાડવાનું સાધન મળ્યું. સંતોનું કોશાલ્ય તર્કની બહારનું હોય છે. કાળચકની રચના ગણો કે ગમે તેમ પણ તે ઈશ્વરની જ યોજના હોય છે. માટે અર્થહીન કલ્પના કરીને ખોટી બડાઈ મારવી નહીં. સારી તેમ જ ખરાબ ડિયાઓનો સૂત્રધાર ઈશ્વર જ છે. તે જ મારે છે અને તારે છે. સર્વ કાર્ય કરનારો તે એકલો જ છે. પાટીલે ચાંદોરકરને લખ્યું કે ‘હું દ્વારા ખાઈએ આસી ગયો છું. જીવનાનો હવે કંટાળો આવી ગયો છે. તેથી જગત ઉદાસ લાગે છે. ડૉક્ટરોએ આશા છોડી દીધી છે, તેમજ આ હર્દ મટે એવું નથી, તેવું નિદાન થયું છે. હકીમ વૈદ્યો પણ થાકી ગયા છે. મારી પોતાની આશા પણ મરી પરવારી છે. છતાં આપને એક વિનંતી છે, કે મને તમારી સાથે એક મુલાકાત ગોઠવી આપો. મારા મનની બસ એજ આકંશા છે.’ ચાંદોરકરે પત્ર વાંચ્યો. તેમનું મન ઉદાસ થઈ ગયું. ભીમાળ એક મોટો અને ભલો સહૃદ્યુહસ્થ હતો તેની જાણ હોવાથી નાનાનું મન દ્વારી ઉઠયું. તેમણે જવાબ મોકલ્યો ‘સાઈબાબાનાં ચરણ પકડવાનો ફક્ત આ એક માત્ર ઈલાજ છે તેજ સારા થવા માટેનો એકમાત્ર ઉપાય છે. તેજ માઈ બાપ છે. તેજ બધાના કાન મરજનારી મા છે. ભૂમ પાડતાની સાથે સાઇ દોડીને આવશે અને આકુળ વ્યાકુળ થઈને કેદમાં ઉઠાવી લેશે. તેને બાળકોની કાળજી લેવાની ખરબ છે. ક્ષયરોગ વળી શું લાગ્યો ? જ્યાં દર્શનથી રક્તપિત્ત જેવો મહારોગ પણ સારો થઈ જય છે ! શંકા મનમાં જરાયે રાખતા નહીં. શિરડી જાંબો અને એમના ચરણો ખરોખર પકડી લો. સૌ બાબા ભક્ત જે કંઈ માંગે તે તમામ વસ્તુઓ તેમને આપવા માટે વચ્ચનબદ્ધ છે. માટે કહી રહ્યો છું કે જલદી કરો અને તેમના દર્શને જવ. ભયમાં મોટામાં મોટો ભય મૂત્યુનો જ બિને વળી કર્યો ? જવ, સાઈનાં ચરણમાં આશ્રય લો. તે જ તમને નિર્ભય કરશે. અને મરણના ભયથી છીડાવશે. (ઓ. ૪૭-૬૧)

અહીં ભીમાળની વ્યથા અસહ્ય વધી ગઈ હતી અને જીવનનો આખરી સમય પાસે આવી પડ્યો હતો. નાનાનો પત્ર વાંચીને પાટીલને એવા વિચારો આવવા લાગ્યા કે સાઈબાબાને કયારે મળવાનું થશે અને કયારે આ કામ પાર પડશે. તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા અને બોલ્યા, ‘સરસામાન બાંધવા માંડો, કાલે જ નીકળવાની તૈયારી કરો અને શિરડીની વાટ પકડો.’ આ પ્રમાણે પાકો નિશ્ચય કરી, બધાના સંદેશાઓ લઈને પાટીલ સાઈમહારાજના દર્શન માટે શિરડી જવા નીકલ્યા. સાથે સગાઓને પણ તેડી લીધા. મનમાં ઉત્સુકતા હતી કે શિરડી મને કેટલું જલદી દેખારો ? મસ્નિદના ચોક પાસે આગળના દરવાજી નજીક ગાડી આવી અને ચાર જણા મળીને ભીમાળને ઉંચકીને મસ્નિદમાં લઈ આવ્યા. નાનાસાહેબ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સાથે જ હતા. માધવરાવ પણ ત્યાં જ હતા. જેમને લીધે સાઈબાબાના ચરણ કમળનો લાભ લેવાનું બધા માટે સહેલું થઈ પડતું તેઓ મસ્ઝિફના પગથિયા ચઢીને પાઠીલ સુધી પહોંચે ત્યાં સુધી પહોંચે ત્યાં જ પાઠીલની સામે જેઠિને બાબા બોલ્યા, ‘શ્યામા, આ ચોરને બાંધી લાવીને તું કેમ મારે માથે મારે છે ? શું તું આ બરાબર કરે છે ?’ ત્યાં જ ભીમાળુએ સાઈના ચરણકમળ પર મસ્તક ટેકવ્યું અને બોલ્યા ‘હે સાઈનાથ ! હે દીનાનાથ !’ આ અનાથ ઉપર ફૂપા કરો, અને મને સંભાળી લો.’ ભીમાળ પાઠીલની વ્યથા જેઠિને સાઈનાથ મહારાજને દ્યા આવી અને તેની સાથે જ પાઠીલને વિશ્વાસ બેઠો કે હવે પોતાની દુઃખબરી પરિસ્થિતિનો અંત આવી જશે. (ઓ. ૬૨-૭૦)

ભીમાળને આમ અસ્વસ્થ જેઠિને ફૂપાના સાગર એવા સાઈ સમર્થનું મન અત્યંત દ્રવી ઉઠું અને હસીને બોલ્યા, ‘અહીંયાં બેસ. બધી ચિંતા છોડી હે. બહુ વિચારશીલ માણસો અમથા જ મનસ્તાપ કરીને દુઃખી થતા હોય છે. શિરડીમાં પગ પડતાની સાથે જ તારા બધા બોગોનો અંત આવ્યો છે. સંકટોના સાગરમાં ભલેને ગળા પર્યત ફૂલેલો હોય કે મહાન દુઃખોના ખાડામાં દટાયેલો હોય છતાં જે કોઈ આ મસ્ઝિફમાઈનો ઓટલો ચઢીને આવ્યો તે સુખી થયો જ સમજો. ‘અહીંનો ફરીદ’ મોટો દ્યાળું છે. એ તારી વ્યથા મૂળમાંથી જ ખેંચી નાખશે. તે જરૂર પડે કાન પકડનારો છે, અને તેજ પ્રેમથી તારી સંભાળ લેશે. તે માટે તું સ્વસ્થ રહેશે. ચિંતા કરીશા નહીં. જ્ઞાનો ભીમાબાઈ ને ઘરે રહેશે. એક બે દિવસમાં તને સારું લાગશે.’ શ્રીબાબાના મુખેથી આ શબ્દો સાંભળીને જણે કે એકાદ મૃત્યુ પામેલા માણસ પર અમૃત વર્ષાનું સિંચન થતાં તેને ફરી પાછું જીવનદાન મળે છે તેવો ભાસ થયો અને તેથી પાઠીલને મનનું સમાધાન થયું. જેવી રીતે મૃત્યુના દ્વારે ગયેલાને અમૃત મળે અને તરસથી પીડાતા જનને પણી મળે તેવી જ રીતે પાઠીલને પોતાને વિષે સમાધાન થયું. આ પહેલાં દર પાંચ મિનિટે તેના મોમાંથી ખાંસી સાથે લોહી આવતું હતું, પરંતુ બાબાની સામે એક કલાક બેઠા બાદ લગભગ તે બંધ થઈ ગયું. ભીમારી શાની છે તે તપાસીને જેણું નહીં અને રોગનું કારણ શું છે તે પણ પૂછું નહીં. ફક્ત ફૂપાદાષ્ટિથી જ રોગ મૂળમાંથી કાઢી નાખ્યો. સંતની ફૂપા દાખિ જ આમ કરવામાં પુરતી છે. સુકાદ ગયેલી ડાળી ઉપર સુંદર અંકુરો ફૂટી નીકળે છે, વસંત ઋતુની ગેરહાજરીમાં પણ ફૂલોનાં જુમખાં ખીલી ઉઠે છે, તે પછી સુકાવા જેવી ડાળી ફળોથી ખીચોખીય ભરાઈ જાય છે. રોગ શું કે આરોગ્ય શું ? તેને ભોગવ્યા સિવાય માણસનો છુટકો નથી. બીજા કોઈ પણ ઉપાય ચાલતા નથી. ફક્ત ભોગવવાથી જ એનો નાશ થાય છે. તે ચોક્કસ પણ ઘડનારી વાત છે. તેને ભોગવ્યા સિવાય કોઈ પણ ઉપાયે તેની નિવૃત્તિ થતી નથી. પણ જે કોઈ સારા નાસિબે કોઈ એકાદ સંતના દર્શાન થઈ જાય તો તે રોગમુક્તિનું ઔષધ બની જાય છે. પછી રોગથી પીડાતો એ માનવ પોતાના રોગ અને તેનાથી ઉત્પત્ત થતાં દુઃખોને યાતના વિના સહન કરી શકે છે. રોગ કઠોર પીડા અને કલેશનો અનુભવ કરાવે છે. પરંતુ સંત કરુણાભરી દાખિથી તે રોગોનું નિવારણ કરે છે અને દુઃખની ખબર પડવા હેતા નથી. બાબાના શબ્દો જ ખાત્રીદાયક હતા. તે શબ્દો ગુણ આપનારા રામબાણ ઔષધ જેવા હતા. એક પરમ ભક્તનો ખરાબ મેલેરિયા તાવ કાળા કુતરાને દર્દી ભાત ખવડાવતા તે સારો થઈ ગયો હતો. એક કથામાં આ બીજી વાર્તા લાગશે પરંતુ તેને સારાંશરૂપે સાંભળો તો તેની ઉચિતતા દેખાઈ આવશે. તેની ચાદ આપનારો પણ સાઈ જ છે. ‘મારી કથા હું જ કરીશ’ એવું સાઈ એ કહ્યું છે માટે તેમણે જ આ સમયે આ કથાની મને યાદ દેવડાવી છે. (ઓ. ૭૧-૮૭)

બાળા ગણપત શિંગી નામનો એક દરળું બાબાનો મોટો ભક્ત હતો. એક દિવસે તે બાબાની સામે અતિશય લાચારી સાથે ગરીબું મોં કરીને વિનંતી કરવા લાગ્યો. ‘બાબા એવું તે મેં શું પાપ કર્યું છે, કે આ મેલેરિયાનો તાવ મને છોડતો નથી ? પુષ્પ ઉપાય કર્યા તેમ છતાં તે આ શરીરમાંથી જતો નથી, તો એને માટે હું શું કરું ? વનસ્પતિના અર્ક અને ઉકાળા વગેરે ઔષધીઓના બધા ઉપચાર કર્યા. હવે તમે જ કંઈ ઉપાય બતાયો જેથી કરીને આ તાવ મારો પીછો છોડો.’ આ સાંભળી, બાબાના મનમાં દ્યા આવી અને જવાબ આપ્યો, ‘દર્દી ભાત મેળવેલા થોડા કોળિયા લક્ષ્મીદેવીના મંહિર પાસે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કાળા કૂતરાને ખવડાવ એટલે તરત જ સારો થઈ જઈશ.' બાળા ગભરાતો ગભરાતો ગયો અને ઘરે જઈને ઢાંકી રાખેલો ભાત અને દહીને તેને મળ્યાં. બાળો મનમાં વિચાર કરવા લાગ્યો કે દહી તો મળ્યું પણ મંદિર પાસે કાળો કૂતરો તો વળી આ સમયે કેવી રીતે મળશે ? પરંતુ બાળાની આ ચિંતા વગર કામની હતી. તેણે બાબાના કહ્યા પ્રમાણે જગ્યા ઉપર જઈને જેથું તો ત્યાં કાળું કૂતરું પૂછ્યી હલાવતું આવતું જેથું. આ યોગાનુયોગ જેઠિને બાળાના મનમાં ખૂબ આનંદ થયો. દહી ભાત કહ્યા પ્રમાણે ખવડાવ્યા અને તેની જાણ બાબાને કરી. કહેવાનો અર્થ એ કે એ જે કંઈ ઘટના ઘટી પરંતુ તે હિવસથી બાળાને ટાઢિયો તાવ મટી ગયો અને તેને આરામ થઈ ગયો. (ઓ. ૮૮-૮૭)

આવી જ રીતે એક વખતે બાપુસાહેબ બુદ્ધીને શરીરમાં ઢાંડી ચાહી અને એકસરખા જુલાબ અને ઉલ્ટીઓ થવા માંડી. દવાદરુથી કબાટ ભરેલું હતું પરંતુ તેમાંથી એકેય દવા માફક ન આવી. બાપુસાહેબ ખૂબ ગભરયા અને ચિંતામાં પડ્યા. સતત થતાં જુલાબ અને ઉલ્ટીઓને કારણે તેઓ ખૂબ અશક્ત થઈ ગયા. તેમનામાં બાબાના નિયમિત દર્શન કરવા જવાની શક્તિ રહી નહીં. આ વાત બાબાના કાને પહોંચી. તેમને બાપુસાહેબને બોલાવ્યા અને પોતાની સામે બેસાડીને કહ્યું, 'અભરદાર ! હવે પછી શૌચ માટે જવું નહીં. ઉલ્ટીઓ પણ અટકી જવી જેઠાંએ.' પછી એમની સામે જેતા હાથના અંગુઠા પાસેની આંગળી હલાવીને બાબાએ પાછા એ જ શબ્દોનો પુનઃ ઉચ્ચાર કર્યો. બાબાના આ શબ્દોની ધાક એટલી બધી હતી કે આ બંને વ્યાધી પોબારા ગણી ગયા. અને બુદ્ધીને આરામ થઈ ગયો. વળી એક વખતે શરીરમાં ઝાડા ઉલ્ટીનો વાવર શડ થયો. બુદ્ધીને પણ એનો ત્રાસ થવા માંડયો. તેમને સતત ઉલ્ટી અને જુલાબ થવાથી અને તરસને લીધે પેટમાં અમળાવા લાગ્યું. ડૉક્ટર પિલ્લે તેમની પાસે જ હતા. તેમણે બધા જરૂરી ઉપાયો કર્યા. પરંતુ આખરે જ્યારે એક પણ ઉપાય ચાલ્યો નહિ ત્યારે તેઓ બાબા પાસે ગયા. જે જે બન્યું હતું તે જ પ્રમાણેનું બધું કહીને પૂછ્યું, 'કોઝી આપવી કે પાણી આપવું ? શું યોગ્ય છે ?' ત્યારે બાબા બોલ્યા, 'તેમને દૂધ પિવડાવો અને અખરોટ, બદામ અને પિસ્તા ખવડાવો. તેને ખીર જેવું પીવા માટે આપો એટલે તેની તરસ મટી જરૂરો અને રોગ પણ સારો થઈ જશે.' આવું વિચિત્ર પીણું પીવડાવ્યા બાદ બુદ્ધીને તકલીફ ઓછી થઈ ગઈ અને સારા થઈ ગયા. 'અખરોટ, બદામ અને પીસ્તા જેવી વસ્તુ ખાવા છતાં તેમને તરત જ આરામ થઈ જવો તે કેવી મોટી આશ્વર્યની વાત છે ! પરંતુ બાબાના શબ્દો એ જ વિશ્વાસ અને શ્રદ્ધાનું મોટું સ્થાન હોવાથી બધું જ સરળ થતું હતું. જેથી મનમાં જરાય શંકા આવતી નથી. (ઓ. ૮૮-૧૦૮)

એક વખતે આંદ્હીના એક સ્વામી તેમની ખુશીથી સાઈના દર્શન કરવા માટે શરીરી આવ્યા અને બાબાના નિવાસસ્થાન માસ્ટિજફમાં જઈ પહોંચ્યા. તેમને કાનની બીમારી હતી. તેથી તેઓ કાયમી અસ્વસ્થ અને અનિદ્રાની અવસ્થામાં રહેતા હતા. તેમણે શક્રહિયા કરાવી હતી છતાં લેષમાત્ર ફર્ક પડ્યો નહીં. શિરડી આવ્યા બાદ ખૂબ સણકા મારવા લાગ્યા અને દુઃખાવો વધ્યો. હવે કોઈ ઉપાય રહ્યો નહીં એમ લાગતાં તેમણે શરીરથી પાછા ફરી જવાનો વિચાર કર્યો અને તે માટે બાબાના આશીર્વાદ લેવા ગયા. સાઈચરણમાં નમસ્કાર કરીને ઉદ્દી પ્રસાદ મેળવ્યા બાદ સ્વામીએ બાબાને કહ્યું કે સાઈ સહાય આપની કૃપા અમારા પર રહે તેવા આશીર્વાદ આપો. માધવરાવ દેશપાંડે તે સમયે ત્યાં જ હતા. તેમણે સ્વામીના કાનના દર્દ અંગે બાબાને વિનંતી કરી અને બાબાએ પણ 'અલ્લા અચ્છા કરેગા' એમ કહીને સ્વામીને આશ્વાસન આપ્યું. આવા આશીર્વાદ મળતાં જ સ્વામી પૂના પાછા ફર્યા. ત્યાંથી આઈ હિવસ બાદ તેમનો પત્ર આવ્યો કે કાનમાં જે સતત સણકા મારતા હતા તે જે ક્ષણે બાબાએ આશીર્વાદ આપ્યો એ જ ક્ષણથી ગાયબ થઈ ગયા. ફક્ત સોજે જ રહ્યો હતો. ફરીથી શક્રહિયા કરાવવી તે વિચારે તે મુંબથ આવ્યા અને પહેલાના ડૉક્ટર પાસે ગયા. પરંતુ બાબાની લીલા કોણ જાણે ? કાન તપાસતાં ડૉક્ટરને સોજે કયાંય દેખાયો જ નહિ આથી ડૉક્ટર બોલ્યા, 'આમાં હવે શક્રહિયાની કોઈ જરૂર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નથી.' આ પ્રકારે બાબાના ફક્ત મૌખિક આશીર્વાદથી સ્વામીની ભયંકર ચિંતા દૂર થઈ ગઈ. બધાને તે ઘટનાની ખૂબ જ નવાઈ લાગી. (ઓ. ૧૧૦-૧૧૮)

આવી જ બીજુ એક કથા આ પ્રસંગના અનુસંધાનમાં ધ્યાનમાં આવી જે શ્રોતાઓને કહીને પછી આ અધ્યાય સમાપ્ત કરીએ. મસ્નિદ્વમાં સભામંડપની ફરસ પર જે હિવસે પથ્થર બેસાડવાની શરૂઆત થઈ તેના આઠ હિવસ પહેલાં કાકા મહાજનીને સહન ન થાય એવું અલ્લાણ થયું હતું. પુષ્કળ જુલાબ થવાથી તેઓ ખૂબ જ ત્રાસી ગયા હતા. પણ મનમાં તે મનમાં બાબા ઉપર અતૂટ વિશ્વાસ રાખીને કોઈ પણ પ્રકારના ઉપચાર કરતા ન હતા. સાઈબાબા પૂર્ણ અંતશાની છે એ મહાજની જાણતા હતા. માટે આ તકલીફની બાબાને જાણ કરી નહીં. જ્યારે મનમાં આવશે ત્યારે તેઓ પોતે જ એને મટાડી દેશે. એવો વિશ્વાસ હોવાને કારણે આ વ્યાધિને ચૂંપચાપ જ સહન કરતા રહ્યા. પોતાના સર્વભોગ આનંદથી ભોગવી લેવા પરંતુ બાબાની પૂજનમાં કોઈ ખલેલ પડે નહિ એવી એક પ્રબળ ઈચ્છા સદ્ગતા કાકાના મનમાં રહેતી. જુલાબ કેટલીયે વખત અને ગમે ત્યારે થવા લાગ્યો ત્યારે પણ આરતીની સેવા ન ચૂકાય માટે કાકાએ શું કર્યું તે જુઓ ! એક પાણી ભરેલો લોટો અંધારામાં પણ હાથ લાગે એવી રીતે મસ્નિદ્વની એક બાજુ મૂકી રાખ્યો. પોતે બાબાની પાસે બેસીને ચરણ સેવા કરતા હતા. તેઓ આરતીમાં દરરોજની માફક હાજર રહેતા અને રોજનો નિયમ પૂરો કરતા. જે પેટમાં ચૂંક આવે તો પાણી ભરેલો લોટો પાસે જ રહેતો. એકાંત સ્થળ પર જઈને શૌચક્રિયા પતાવીને પાછા આવી જતા. તાત્યા કોતે પાટીલે ફરસ બનાવવાની આજ્ઞા માંગતાં બાબાએ એમને શું કહ્યું તે જુઓ, 'હું લેંડી તરફ જઉ છું. ત્યાંથી પાછો આવું એટલે ફરસનું કામ શરૂ કરને.' બાબા પાછા આવ્યા, આસન પર જઈને બેઠા, ત્યાં કાકામહાજની સમયસર આવ્યા અને ચરણ સેવા શરૂ કરી. એટલામાં કોપરગાંવથી ટાંગો આવી પહોંચ્યો. જેમાં મુંબઠિના ભક્તો આવી પહોંચ્યા. પૂજન સાહિત્યના સરસામાન સાથે તેઓએ મસ્નિદ્વમાં ઉપર જઈને બાબાને નમસ્કાર કર્યા. બીજુ મંડળીઓ સાથે અંધેરીના પાટીલ પણ આવ્યા હતા. પૂજન માટે ફૂલ અને અક્ષત લઈને રાહ જોતા બેઠા હતા. એટલામાં નીચેના પટાંગણમાં જ્યાં હાલમાં રથ મૂકવામાં આવે છે. બરોબર ત્યાં જ કોદાળી મારીને ભોયતિયું સરખુ કરવાની શરૂઆત થઈ. કોદાળી મારવાના ધાનો અવાજ કાન પર પડતાં બાબાએ વિચિત્ર ખૂબ પાડી, આંખો મોટી કરી અને નૃસિંહઅવતાર ધારણ કર્યો. 'કોદાળીનો ફટકો કોણે માર્યો ? એને હું કર્મરમાંથી લટકાવી અડગો કરી નાખીશ.' એમ બોલીને સટકો હાથમાં લઈને ઊભા થયા. આથી બધાને મનમાં ધ્રાસકો પડ્યો. મજુર તો કોદાળી ફેંકીને ભાગ્યો. જે તે બધા ઉઠીને ભાગવા માંડ્યા. કાકા સુદ્ધાં ગભરાયા એટલામાં તેમનો હાથ પકડી લીધો અને બોલ્યા, 'તું કયાં જય છે ચલ નીચે બેસ.' પછી તાત્યા કોતે પાટીલ અને લક્ષ્મીભાઈ કે જે મને આગળ ઉપર બાબાએ પોતે પ્રાણ છોડતાં પહેલાં નવ રૂપિયાનું અપૂર્વ દાન આપ્યું હતું. તેવી જ રીતે ખૂબ લાગી છે, એમ કહીને ભાખરી મંગાવી અને તે લાવતાં જ બાબાએ પાસે ઉલેલા ફૂતરાને ખવડાવી અને ખૂબથી વ્યાકુળ થયેલા મુંગા પ્રાણીની પણ ખૂબ સમજવી એનું શિક્ષણ આપ્યું. તેમની ઉપર પણ બાબાએ ગાળોનો વરસાદ વરસાવ્યો. આંગણાની બહાર જે લોકો ઊભા હતા તેમને પણ ગાળો ભાંડી અને ઢોડાહોડ થઈ એવામાં બાબાએ ત્યાં નીચે પહેલી કોઇની શેકેલી મળ્યીની થેલી લીધી. બાબાને ગુસ્સે થયેલા જેઠીને જે ડરના માર્યા ચારે તરફ ભાગી ગયા હતા એમાંના એ મસ્નિદ્વમાં પહેલી થેલી હતી. થેલીમાં દાણા આશરે એક શેર જેટલા હતા. બાબાએ મુડી ભરીને બહાર કાઢીને મસ્નિને ફૂંક મારી સાફ કરવાની શરૂઆત કરી. પછી તે સ્વરચ થયેલા દાણા કાકા મહાજનીને ખાવા માટે આપવા લાગ્યા. એક બાજુ ગાળો અને બીજુ બાજુ દાણા મસળવાનું ચાલુ હતું. મહાજનીને કહેવા લાગ્યા 'ખાઈ....જ' અને એમના હાથ પર સાફ કરેલા દાણા મુક્તા ગયા. થોડા પોતાનાં મોદામાં પણ નાખતા હતા. આ પ્રકારે થેલી ખાલી કરી નાખી. પછી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

દાણા ખલાસ થતાં બોલ્યા ‘મને તરસ લાગી છે પાણી લાવ’ કાકાએ જારી ભરીને પાણી આપ્યું. પોતે પીધું અને કાકાને કહ્યું ‘લે... પી... જા...’ કાકાએ જારીમાંથી પાણી પી રહ્યા બાદ બાબા બોલ્યા, ‘જ તારા જુલાબ બંધ થઈ ગયા. પેલા બ્રાહ્મણો કયાં મર્યાં છે ? જ એમને લઈ આવ.’ ત્યાં બધી મંડળી પાછી આવીને મસ્ઝિદમાં પહેલા હતા તેમ ગોઠવાઈ ગયા. અને ફર્શ બેસાડવાનું કામ પાછું શરૂ થયું. કાકાનું અજીર્ણ મટી ગયું. જુલાબ ઉપર સિંગના દાણાનો આ તે કેવો ઉપચાર ? પરંતુ સંતોના શબ્દો એ જ દવા હોય છે. સંતોના શબ્દોને જે પ્રસાદ સમજે છે, એમને બીજ કોઈ પણ પ્રકારના ઉપચારોની કે ઔષધની જરૂર રહેતી નથી. (ઓ. ૧૧૬-૧૪૭)

મધ્ય પ્રદેશના હરદા શહેરના એક ગૃહસ્થ પેટના વ્યાધિથી ચૌદ વર્ષથી ત્રાસી ગયા હતા. તે બધા જ ઈલાજ કરી ચૂક્યા હતા પણ એનું કારણ મળતું ન હતું. એમનું નામ દત્તોપંત હતું. એમના કાન પર એવી વાત આવી કે શિરડીમાં સાઈબાબા નામના કોઈ મહાન સંત છે. અને જેમના દર્શન માત્રથી લોકોને અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે. આવી શ્રીસાઈની કીર્તિ સાંભળીને દત્તોપંત શિરડી બાબાના ચરણમાં નમસ્કાર કરવા પહોંચ્યો ગયા. બાબાને નમસ્કાર કર્યા અને કરુણ ચહેરે બાબા સામે જેવા લાગ્યા અને બોલ્યા, ‘બાબા ! ચૌદ વર્ષ વિત્યા પણ આ પેટનો દુઃખાવો પીછો છોડતો નથી. બસ થયો આ દુઃખાવો, હવે હું એનાથી કંટાળી ગયો છું. હવે એ દુઃખાપો સહન કરવાની પણ શક્તિ નથી રહી. જંદગીમાં કોઈને માર્યો નથી કે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી કે કોઈ દિવસે માબાપનું અપમાન કર્યું. પાછલા જન્મોનું તો કંઈ યાદ નથી. તો પછી આ અસહ્ય વેદના કેમ કરીને સારી થશે ?’ સંતોની કેવળ પ્રેમભરી આંખોથી જ અને એમના પ્રસાદ્ધપી આશીર્વચનોથી રોગ સારા થઈ જતા હોય છે. બીજા કશાની જરૂર નથી હોતી. એવો જ અનુભવ દત્તોપંતને આવ્યો. બાબાનો હાથ મસ્તક પર પડતાં અને ઉદ્દી, વિભૂતી તેમજ આશીર્વાદ પામતાં આનંદ થયો. પછી મહારાજે એમને શિરડીમાં જ રોકી રાપ્યા અને આસ્તે આસ્તે બાબાની કૃપાથી જ સારો થયો હતો. સારાંશ એટલો કે ગુણ તો બાબાએ કહેલા ઔષધમાં નથી. પણ એમના બોલેલા શબ્દોમાં છે અને એમણે આપેલા આશીર્વાદોમાં છે. (ઓ. ૧૪૮-૧૫૫)

આવા બે મહાનુભાવ ! એમના મનની મોટાઈ અને પ્રભાવનું હું શું વર્ણન કરું ? દેરેક સળવ અને નિર્જવ વસ્તુ ઉપર એમનો જ સદ્ગુરુ રહેતો, અને પરોપકાર કરવો એ એમનો મૂળ સ્વભાવ હતો. આવી શબ્દોની સ્તુતિ ગાતાં જતાં એક કરતા અનેક નવી નવી વાતો યાદ આવે છે. ત્યારે પાછળ કહી ગયા પ્રમાણેનું ભીમાળનું ચરિત્ર આગળ ચલાવીએ. બાબાએ થોડી ઉદ્દી મંગાવી અને ભીમાળને થોડી આપી, તથા થોડી એમના કપાળ ઉપર ઘસી દીધી. તે જ હાથ ભીમાળના માથા ઉપર મૂક્યો અને તેમને તેમના મુકામ પર પાછા ફરવાની આજા મળી. તેથી પાટીલને ચેન પડ્યું અને પોતે જ પોતાની મેળે ચાલીને ગાડી સુધી ગયા. ત્યાંથી બાબાના કહ્યા પ્રમાણે તેઓ ભીમાબાઈના ઘરે ગયા. એ જગ્યા થોડી નાની અને અહચણવાળી અને સાંકડી હતી. પણ એમને બાબાએ સૂચવેલ એ જ એનું મહાત્મ્ય હતું. માટીના તાજ થર થાપીથાપીને ભીની જમીન સપાઈ અને લીસી કરેલી જે થોડી બેજવાળી હતી. તેમ છતાં પાટીલે બાબાની આજા માનીને ત્યાં જ પોતાની સગવડ કરી લીધી. ભીમાળને ગામમાં ખૂબ જ ઓળખાણ હતી. ઘરે તો મોટી અને સૂકી જગ્યા મળી ગઈ હોત. પરંતુ બાબા મુખમાંથી જે સ્થાનનું નામ નીકળ્યું તે છોડીને કોઈ અન્ય સ્થાન માટેનો પાટીલે વિચાર કર્યો નહીં. ભીમાબાઈને ત્યાં અનાજના બે ખાતી કોથળાઓ પાથરીને એની ઉપર ભીમાળ સાંકડે સ્વસ્થ મને સૂછી ગયા. પછી તે રાત્રે એક એવી ઘટના બની કે ભીમાળને સ્વખ આવ્યું. બચપણના નિશાળના માસ્તર આવ્યા અને પાટીલને મારવા લાગ્યા. હાથમાં એક છડી લઈને મારી મારીને એમની પીઠ સુન્નવી દીધી. કવિતાની એક દૂંક મોઢે કરવા માટે પોતાના શિષ્યને ખૂબ ત્રાસ આપ્યો, એ રચના કઈ કવિતાની હતી વળી ? એ જણવાનું મોઢું કુતૂહલ શ્રોતાઓના મનમાં થશે, માટે એના અક્ષરે અક્ષર જે મેં સાંભળ્યા તે હું નીચે રજૂ કરું છું.

કવિતા

જુસ ગમે પદ અન્ય ગૃહી, જર ઠેવિયલેં જણૂ સર્પશિરીં ।
વાક્ય જિયેં અતિ દુર્લભ, જ્યાપરિ દુર્ભિળ તેં ધન લોભિકારી ।
કાંતસમાગમ તેંચ ગમેં સુખપર્વ, નસે જરિ ચિત્ત ધરીં ।
શાંત મને નિજકાંતમંતે, હરિ કૃત્ય ‘સતી’ જનિં તીચ ખરી ॥

(બીજા ઘરે પગ મૂકતાં જ તે સ્થીને એવું લાગ્યું કે જાણે સાપના માથા પર મૂક્યો, જેના મોઢાના શબ્દો સાંભળવા ખરેખર ખૂબ અધરા હોય છે. જાણે કે લોભિયાના હાથમાં પૈસો હોય તો પણ ખબર નથી પડતી. પતિનો સહિતાસ જ જેની સુખની આણમોલ સંધી છે, પછી ધરમાં પૈસો હોય કે ન હોય, પોતાના પતિનું મનગમતું કોઈ પણ કામ તે સંતુષ્ટ મનથી કરે છે. એ જ આ જગતમાં ખરી ‘સતી’ અને પતિત્રતા સ્વી કહેવાય છે.)

પરંતુ એ શિક્ષા શા માટે એ વાત જરાયે સમજતી ન હતી. પેલો નિશાળનો માસ્તર હાથમાંથી લાકડીને છોડતો ન હતો. તે પુષ્કળ જુદે ચઢેલો હતો. ત્યાં પાછું બીજું સ્વભન શકું થયું. તે તો એના કરતાંયે વિચિત્ર હતું. કોઈ એક સહગૃહસ્થ છાતી ઉપર ચઢીને બેસી ગયો હોય એવો ભાસ થયો. એને ચટણી વાટવાનો પથ્થર હાથમાં લીધો, અને ભીમાળની છાતી ઉપર ચટણી કે મસાલો વાટતો હોય તેમ છાતી ઉપર ફેરવવા લાગ્યો. ભીમાળના પ્રાણ આફુળ વ્યાફુળ થઈ કંઠે આવ્યા. જાણે કે સ્વર્ગમાં સિધાવ્યા. પછી સ્વભન પૂરું થયું અને ભીમાળને ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. તેના કારણે તેમના મનને થોડી વિશ્રાંતિ મળી. બીજે દિવસે સૂર્યોદય થતા પાટીલ જગ્યા. તેમના મનમાં અપૂર્વ સ્કૂર્તિ લાગવા માંડી અને રોગનો વિચાર એકદમ નહીં જેવો થઈ ગયો. ચટણી વાટવાનો પથ્થર અને સોટીના સોળ એ જેવાનું થાદ કોને હતું? સ્વભનને લોકો આભાસ કહે છે. પરંતુ કોઈ કોઈવાર તેનો ઉલ્લો અનુભવ પણ થાય છે. પાટીલનો રોગ એ જ ક્ષણે પૂર્ણપણે નાશ થયો અને દુઃખનું નિવારણ થયું. પાટીલ મનથી ખૂબ હરખાયા અને સંતુષ્ટ થયા. એને એવું લાગવા માંડયું કે જાણે પોતાનો પૂર્વજન્મ થયો છે. તે આસ્તે આસ્તે બાબાનાં દર્શાન માટે નીકળ્યા. બાબાનું ચંદ્ર જેવું મુખ જેઠિને પાટીલના મનમાં આનંદની ભરતી આવી, અને એમનો પોતાનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો. આંખોમાં ગ્લાની છવાઈ ગઈ અને તંદ્રા લાગી ગઈ. પ્રેમનાં અશ્રુ વહેવાં લાગ્યાં. બાબાનાં ચરણોમાં મસ્તક મુકીને તે કહેવા લાગ્યા ‘માસ્તર માર અને છાતી ફાડવાનાં પરિણામ અચૂક ગુણકારી નિવઠયાં. આ ઉપચારનો ઝોડ પાડવો મારા જેવા પામર માણસ માટે કંઈ શક્ય નથી. માટે હું બાબાનાં ચરણ પર મારું માથું ટેકવી દઉં છું. આનાથી જ મને સમાધાન થશે. આ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. હે બાબા સાઈ! તમારી અજલયબી કોઈપણ જતની ચિંતા કે તર્ક વગરની છે.’ આવી પરાકરી સ્તુતિ કહેતાં કહેતાં પાટીલ ત્યાં શિરડીમાં લગભગ એક મહિનો રહ્યા. તેમજ ત્યારબાદ નાનાસાહેબના ઉપકાર માની કૃતાર્થ થઈને પાટીલ પોતાના ગામ સુખરૂપ પાછા ફિર્યા. (ઓ. ૧૫૬-૧૭૮)

આવા એ ભક્તિ અને શ્રદ્ધાયુક્ત અને આનંદથી પરિપૂર્ણ ચિત્તે અને સાઈબાબાના ઉપકારની જેને પૂરેપૂરી જાણકારી છે એવા ભીમાળ પાટીલ ઉપરાઉપરી શિરડી આવવા લાગ્યા. સાઈબાબાને તો ફક્ત બે હાથ, મસ્તક અને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ એ જ જેઠાં. ઉપકારની ભક્તોને જાણકારી રહે એટલે બસ. અમુક લોકો સંકટગ્રસ્ત થતા, જેવી રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે અને એમાંથી પરિપૂર્ણ પાર પડતાં જેવી રીતે એનું વ્રત વિધિ સાથે થથા સ્થિતિ કરાવે છે, તેવું જ પાટીલ ત્યારથી સત્ય સાઈનું વ્રત યથા શાસ્ત્ર સ્નાન કરીને ‘બ્રહ્મચર્યનું’ પાલન કરીને દર ગુરુવારે સતત કરવા લાગ્યા. લોકો જ્યારે સત્યનારાયણની કથા વાંચતા ત્યારે ભીમાળ દાસગણુ કૃત લીલામૃત,

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અવર્ગીન ભક્ત સાઈનું ચરિત્ર પ્રેમપૂર્વક વાંચતાં. આ ગ્રંથમાં ૪૫ અધ્યાયોમાં દાસગળું મહારાજે અનેક ભક્તોનાં ચરિત્રનાં વર્ણન કરેલાં છે. એમાંના સાઈનાથ માટે ત્રણ અધ્યાયો એટલે જ સત્ય સાઈની કથા, જે દૂરેક વ્રતોમાં એક ઉત્તમ વ્રત સમજુને પાઠીલ વાંચતા હતા. આથી એમને અતિશાય સુખ મળ્યું અને મનને શાંતિ પ્રાપ્ત થઈ. પાઠીલ હંમેશા સ્નેહીઓ અને સંબંધી સાથે ભેગા કરી આનંદથી અને નિયમિત સત્ય-સાઈ વ્રત કરતા હતા. નૈવેદ્ય બનાવવાની એ જ રીત લોટ, ધી, ઘાંડ વગેરે સત્યનારાયણની કથામાં સવાઈ સામગ્રી લઈને પ્રસાદ બનાવીએ છીએ તેવો. ત્યાં નારાયણ અને અહીંયા સાઈ બંને ડેકાણો કયાં પણ કશામાંથે ઓછાપણું નહીં. પાઠીલે આવી પદ્ધતિ પાડી દીધી, અને એ જ પ્રથા આખા ગામમાં પણ પડી. પછી ત્યાં સત્ય-સાઈ વ્રતનો પાઠ હંમેશાને માટે ચાલ્યો. એવા આ પરમ ફૂપાળું સંત ભક્તોના ભાગ્ય ઉધાડવા આવ્યા કે ફક્ત દર્શનથી જ સંસારની અનેક જંજલ અને ચિંતાઓ દૂર કરતા હોય છે. અને આવેલા કાળને પણ પાછો મોકલતા હોય છે. (ઓ. ૧૭૯-૧૮૬)

હવે પછીની આગળની કથામાં કોઈકને પુત્ર પ્રાપ્તિની ચિંતા અને સંતો વર્ચ્યે રહેલી એકાત્મતાના વર્ણન સાંભળતાંની સાથે ચમત્કાર લાગશે. નાંદિં શહેરના રહેવાસી, એક મોટા શ્રીમંત પારસી સદ્ગુહસ્થે સાઈબાબાના આશીર્વાહ મેળવેલા અને તેમને ત્યાં પુત્ર પ્રાપ્ત થયેલી. ત્યાંના મૌલવીસાહેબ નામના સંતની નિશાની બાબાએ સમજાવેલી અને એ પારસી આનંદ પામની પોતાના ગામે પાછા ગયેલા. આ કથા અતિ પ્રેમાળ છે. શ્રોતાઓએ સ્વસ્થ ચિંતે સાંભળવાથી એમને શ્રીસાઈની વ્યાપકતા અને વાતસલ્યતા સમજશે. હેમાડપંત સાઈબાબાનાં ચરણો આવ્યા છે. સંતોને અને શ્રોતાઓને નમસ્કાર કરે છે. હવે પછીના અધ્યાયનું વર્ણન ધ્યાનપૂર્વક સાંભળશો. (ઓ. ૧૮૦-૧૮૪)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજ્જનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત.
શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રના ‘ભીમાળ ક્ષય નિવરાણ’ નામનો તેરમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણા.



અધ્યાય ૧. ઉનું અર્થ વિવરણ

આ અધ્યાયમાં કહેતી કથા અનુસાર ભક્તોના રોગ ફક્ત પોતાના શબ્દોથી અને આશીર્વાદથી બાબા કેવી રીતે સારા કરતા હતા તે આપણાને સમજાય છે. ક્યારેક ક્યારેક એમના ઉપાયો વિચિત્ર અને અધોર પણ દેખાય છે. છતાં ભક્તોને આરામ થતો હતો. ખરા અર્થમાં કહીએ તો ગુણ ઔષધોમાં કે ઉપાયોમાં ન હતા, પણ બાબાના હાથમાં અને આશીર્વાદમાં હતા.

ભીમાળની કથા હેમાદપંતે અમુક સિદ્ધાંત સ્પષ્ટ કરીને કહ્યાં છે -

(૧) પેહલું એટલે કે આ દુનિયામાં મનુષ્યક્રષ્ણે પ્રાણીને જ ઈશ્વરે બુદ્ધિ આપી હોવા છતાં તેનો ઉપયોગ કરીને મનમાં નક્કી કર્યા પ્રમાણે એ વર્તી શકતો નથી. તેની પાછળ કર્મનું તંત્ર લાગેલું હોય છે. જન્મોજન્મથી કરેલાં કર્મોના સંસ્કાર અને તેને બોગવવાનાં પરિણામ એને ભળતી જ જગ્યાએ ખેંચી જતાં હોય છે.

પુણ્ય તરફ લક્ષ જય છે । પગ પાપ પંથે ખેંચાય છે ।

સત્કર્મ પંથ શોધે છે । કુકર્મને તે શે જડે ? ॥૩૦॥

માટે સત્કર્મ કરીને પરમાર્થ સાધવા માટે માણસે ખૂબ પ્રયત્ન કરવો પડે છે, એટલું જ નહીં પણ સદ્ગુરુની ઇત્ત્રાયામાં જવું પડે છે.

(૨) બીજે સિદ્ધાંત એટલે માણસ સુખ માટે રાત દિવસ પ્રયત્ન કરવા છતાં પણ પૂર્વ કર્મોનાં ફળ અનુસાર દુઃખો પડતાં હોય છે. જાણો કે એને શોધતાં જ ના હોય.

શોધવા જતા ગણે વળગે । ઝાડી નાખતા વધુ ચોટે ।

અંજટ જીવની ખોટીએ । અહો રાત્રના કષ્ટ જે જે ॥૨૬॥

તે ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. આત્મહત્યા કરીને અથવા તો અન્ય બીજી ઉપાયોથી તે ટાળી શકતાં નથી. ફરી જન્મ લઈને તે ભોગવાં જ પડે છે. જીવતા જીવ આત્મજ્ઞાન થઈને મુક્ત થયેલાઓને પણ પ્રારબ્ધના ભોગ છુટતા નથી. આવા સંન્નેગોમાં અસલમાં જે દુઃખ આવે એને સહન કરવાની માણસે તૈયારી રાખવી. આ જન્મે આપણે રીત અને નિયમો અનુસાર વર્તીએ છીએ તેમ છતાં આટલાં દુઃખ શા માટે પડે છે, એનો વિચાર કરી નિરાશ પણ ન થવું જોઈએ. તેમજ વારંવાર એના વિશે બોલવું પણ ન જોઈએ.

શુદ્ધ આચરણ આચરતાં । મને શા કાજે આ દુઃખાવસ્થા ।

દુર્જર્મ માર્ગે ના જતાં । આ પાપ મારે શિરે શાં ॥૩૭. ૩૪/૫૫॥

(૩) ત્રીજે સિદ્ધાંત એટલે કે દુઃખોના નિવારણનો માત્ર એક જ ઉપાય છે. તે એટલે કે સદ્ગુરુના અથવા એકાદ સંતના શરણે જવું. તેમની કૃપાદિથિ થાય તો જ માણસ માટે તે દુઃખો આરામથી યાતના સિવાય ભોગવવા શક્ય બનતા હોય છે. અસલમાં સદ્ગુરુ અને સંતો તે દુઃખો ભોગવવા માટે આપણને ધૈર્ય પ્રદાન કરતાં હોય છે.

તો એ સુભાગ્યે સંતદર્શન । એ જ છે વ્યાધિનું ઉપશમન ।

વ્યાધિગ્રસ્ત તવ વ્યાધિ સહન । વિના દુઃખે સહન કરે ॥૧૮॥

દાખવે વ્યાધિ ભોગ દારુણ । સંત રાખે દાટિ સક્રુણ ।

તેથી ભોક્તૃત્વ દુઃખ વિણ । સંત નિવારણ કરે છે ॥૧૯॥

પણ અમુક પ્રસંગોએ મનમાં આવતા સદ્ગુરુ અથવા સંતો પોતાની દૈવી શક્તિનો ઉપયોગ કરીને ભક્તોનાં દુઃખો સાંભળીને એમને તે એકદમ ભોગવવા દઈને એનો ત્વરિત જ છુટકારો કરાવતા હોય છે. જેમકે ભીમાળનો ક્ષયરોગ.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બાબાએ તેને એક ૪ રાતના સ્વપ્નમાં છી અને મસાલા વાટવાના પથ્થરની ભફે માર મારી તીવ્રપણે ભોગવવાની તરત ૪ સારા કર્યા. તેવી ૪ રીતે અધ્યાય ઉઘમાં ડૉક્ટર પિલ્લાઈના સૂનેલા પગ ઉપર અખૂલનો પગ પાડી તેમને ખૂબ વેદનામાં નાખી બાબાએ તેમનો વાળાનો રોગનો ત્રાસ જડમૂળથી કાઢી અને દશ દિવસમાં સારું કરી દીધું હતું. અથવા તો એ દુઃખો પોતાના ઉપર લઈને એ ભક્તોને મુક્ત કરતા હોય છે. જેમ કે પાછલા અધ્યાય ઇમાં બાબાએ દાદાસાહેબ ખાપડેના નાના છોકરાની ખેગની ગાંઠો પોતાના શરીર ઉપર લઈને તેનો જીવ બચાવ્યો હતો.

અંતમાં, આ અધ્યાયમાં ભક્તોએ સદ્ગુરુ અથવા તો સંતોને પોતાની કૃતજ્ઞતા કેવી રીતે વ્યક્ત કરવી તે આપણને શીખવા મળ્યું. સંતોની તેમના ભક્તો ઉપર કોઈ પણ લાભ વગરની પ્રીતિ હોય છે. અને તેઓ સદ્ગુરુની પૂર્ણ થયેલા હોય છે. માટે એમના ઉપકારો ફેડવા માટે નીચેની ઓવી ધ્યાનમાં રાખો.

બે હાથ ને એક માથું । સર્થેર્થ શક્ષા અનન્યતાનું ।

શ્રીસાઈને ન જોઈએ બીજું । કેવળ કૃતજ્ઞતા વિષ કશું ॥૧૮૦॥



॥ અદ્યાય ૧૪ ॥

રતનજી સાઈ સમાગમ

(નાઈના રતનજી શેઠના સાઈબાબા સાથેના નજીકના સંબંધો)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

આ સંતતેષ શ્રી સાઈનાથ મહારાજ ! તારો જ્યલ્યકોર થાઓ. હે દ્યાસાગર, ગુજારાંભીર, નિવિકાર, પરાતપરા,
અપાર અને નિરવધ સાઈનાથ ! તારો જ્યલ્યકોર થાઓ. પોતાના ભક્તો માટે મનમાં દ્યા હોવાને કારણો એમની દસ્તિની
પેલે પાર વાતો પર ધ્યાન દઈને તેમને અનેક કારણો થકી એમના સાંનિધ્યમાં રહી, તેમને સંકટોમાંથી છોડાવે છે. દીન
દુઃખીઓના ઉદ્ઘાર કરવા માટે, ભક્તોને સંભળવા માટે તથા કઠોર અને વાસનાઙ્ખી દુષ્ટ નિશાચરોનો વધ કરવા માટે
સાઈબાબાનો આ ઈશ્વરીય અવતાર હતો. જે કોઈ ઉત્તમ મનોવૃત્તિ અને સદ્ગુરુબાબીની દર્શની આવ્યા તેમને વિષય
સુખોમાંથી મન બદલીને પરમાત્મા તરફનું ધ્યાન લગાવી અને વલણ ફેરવીને આનંદિત કર્યા. તેમનાં હૃદય ભરાઈ આવ્યા,
અને તેઓ પ્રેમથી સાઈનામે ડોલવા લાગ્યા. એવા આ સર્વગુણ સંપત્ત સાઈસર્વધર્મનાં ચરણોમાં આ અધિમ, ગરીબ અને
અતિનમ્ર એવા મારા પામરના સાઢાંગ નમસ્કાર. (ઓ. ૧-૫)

પહેલાંની કથાના અનુસંધાનમાં કાળા ફૂતરાને દહિભાત ખવડાવવાથી મેલેરિયાનો તાબ ઉત્તરી જવાની કથાનું વર્ણિન
થયું. જલ્દી સારી ન થનારી બાપુસાહેબ બુઝીની મહામારીની બીમારી અંગૂઠા પાસેની આંગળીની ઘાક બતાવીને અને
કાકામહાજનીના પેટની બીમારીમાં શેડેલી સિંગ ખવડાવીને સારી કરી. તેવી જ રીતે કોઈના પેટનો રોગ, તો કોઈનો
કર્ણરોગ અને કોઈનો વળી મહાપ્રભણ એવો ક્ષયરોગ ફક્ત દર્શનથી જ નાચ કર્યા. શ્રીસાઈકૃપાથી બીમાળ પાઠીલનાં દુઃખ
નહિ જેવા થઈ ગયાં, તેમજ સુખ સંપત્ત થઈને સાઈબાબાનાં ચરણોમાં ફૂતશતાપૂર્વક પૂર્ણપણે તેમના શરણે આવ્યા. તે જ
પ્રમાણે આ નવીન પ્રકારના અપૂર્વ ચ્યાત્કારો શ્રોતાઓની સાંભળવાની અત્યંત ઉત્સુકતા જેઠિને રજૂ કરું છું. શ્રોતાગણો
જે ધ્યાન દઈને સાંભળવાના નહિ હોય તો એક વક્તા તરીકે મને સ્કૂર્ટિ કયાંથી આવશે ? આ કથાને ઉત્કૃષ્ટપણું કયાંથી
મળશે ? અને તે રસપૂર્ણ પણ કેવી રીતે થરો ? વક્તા શું કથન કરવાનો ? એ તો હંમેશા શ્રોતાઓને જ આધિન હોય છે.
શ્રોતાઓ જ એનો આધાર હોય છે, અને તેમને લીધે જ તો કથામાં મીઠાશનો વધારો થાય છે. (ઓ. ૬-૧૨)

એક તો આ સંત ચરિત્ર બધી રીતે મધુર અને સંતોના આહાર વિહાર પણ શુદ્ધ અને સારા તથા તેમના સાધારણ રીતે
ઉચ્ચારેલા શબ્દો પણ અત્યંત મધુર જ હોય છે. આ ફક્ત ચરિત્ર નથી, પણ વિષય સુખોથી મન વાળીને પરમાત્મા તરફ
ધ્યાન લગાવનાર આનંદઙ્ખી જીવન પણ છે, જે સાધનાનો વરસાવ અત્યંત દ્યાળું સાઈમહારાજે પોતાના ભક્તોને
પોતાની યાદ રહે માટે સ્મરણ ખાતર પ્રેમથી સાકાર કર્યો છે. સત્પુરુષોની આવી કથાઓ સ્વાર્થ અને પરમાર્થ બંને ઉપર
ધ્યાન હેનારી હોય છે. પ્રવૃત્તિઓની વાત કહેતાં કહેતાં તેમને નિવૃત્તિના માર્ગ પર લાવી દે છે. હેતુ એ કે સંસારમાં સુખેથી
વર્તણું પરંતુ હંમેશા સાવધ રહીને દેહને સાર્થક કરવો. પુષ્કળ પુણ્યોના બળથી જીવને નરહેણ મળે છે. તેમાં પાછો જેનાથી
પરમાર્થ સંધાર્ય છે તેનું તો ભાગ્ય જ કાંઈ જુદું હોય છે. પરંતુ જે દેહ આવા લાભને પણ સાર્થક કરતો નથી, તે વિના કારણ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પૃથ્વી ઉપર ભારત્ય જનમ્યો છે તેવું માની શકાય. તેને એક પશુ કરતા વિરોષ જીવવાનો બિજો કથો આનંદ મળી શકે ? જેને આહાર, નિદ્રા, ભય અને સીસંભોગ સિવાય બીજું કંઈ ખબર જ નથી. એવો માણસ પૂછા અને રિંગડા વગરના પશુ સમાન જ છે, આ મનુષ્ય જન્મનું મહત્વ કેટલું હોઈ શકે એને લીધે તો આ ઈશ્વરભક્તિ સાધ્ય થાય છે, અને ચારેય મુક્તિઓ સાયુજ્ય, સાલોક્ય, સારુપ્ય, સામીએ ચરણોમાં આવીને પેઢે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ એના લીધે જ તો હોય છે. સંસાર એક આકાશમાંના વાદળોના સમૂહમાં ચમકતી વીજળી જેવો લાંબો સમય ન ટકનારો છે. કાળજીપી સર્પ દ્વારા ગળી જવાયેલા લોકોને સુખની પળો ભાગ્યે જ મળે છે. મા-બાપ, બહેન-ભાઈ, પત્ની, પુત્ર અને પુત્રી તથા બીજાં બધાં સંગાંઓ નદીના પ્રવાહમાં જેમ લાકડાં તણાઈને એકત્ર થતાં હોય છે, તેવી રીતે આ સંસારમાં એક ક્ષણ માટે બેગા થયેલા દેખાય છે. પણ એકાદ જેરથી આવેલા મોજની લપેટમાં આવતાં તે વેર વિભેર થઈને એકબીજથી અલગ થઈ જય છે. ત્યારે પહેલાંનો ડિનારો પાછો મળતો નથી. આ જગમાં જેણે પોતાનું હિત સાધ્યું નથી એણે પોતાની મા ને વ્યર્થ પ્રસુતીનો ત્રાસ આપ્યો છે, એમ જ ગણાય. સંતોનાં ચરણોમાં જે તે જય નહીં તો તેના જીવતરમાં મોટું નુકશાન થાય છે. પ્રાણી માત્ર જન્મતાં જ મૃત્યુના માર્ગ પર આગળ વધવા માંડે છે. માટે આજે, આવતી કાલે અથવા તો પરમહિવસે તે ફિસાયો જ સમજવાનું. આ મૃત્યુનું હંમેશા સ્મરણ રાખવું. આ શરીર ફક્ત કાળનો ખોરાક છે. દૂરેક સંસારનું આ એવું અશાશ્વત લક્ષ્ણ છે. માટે મનુષ્યે હંમેશા સાવધ રહેવું. વ્યવહારમાં ચોક્કસપણું રાખી સંપૂર્ણ હોશિયારીથી પગલું ભરવું એટલે મોક્ષ, કષ્ટ વિના હાથ લાગશે. માટે સત્ત કર્મમાં આપસ રાખવી નહીં અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ સાધ્ય કરવાની તથા તેમનો લાભ પ્રાપ્ત કરવા માટે કોઈ દિવસ બેફિકરી કરવી નહીં. (ઓ. ૧૩-૨૭)

સાઈકથા જે પ્રેમથી સાંભળતા હોય છે, તેમને બધામાં ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થાય છે. એમની સાઈ ચરણમાં ભક્તિ વધશે અને સુખ સમૃદ્ધિના બંડાર મળશે. જેમને સાઈબાબા ઉપર સંપૂર્ણ પ્રેમ હશે તેઓને આ કથાનો સંગ્રહ સાઈનાં ચરણકમલોની પગલે પગલે યાદ અપાવરે. જેમનું શબ્દો વડે વર્ણન કરતા ફાવતું નથી, એમનું આ કથામાં શબ્દોથી વર્ણન પાર પડે છે. જે ઇન્દ્રિયોની પેદે પારનું છે એનું આ કથામાંથી ઇન્દ્રિયોથી સેવન કરાય છે. માટે આ કથાઝીપી અમૃતને કેટલુંય સેવન કરવામાં આવે તો પણ મનનું પૂર્ણ સમાધાન થવું અધરું છે. સંતોના કૌશલ્ય તર્ક વગરના હોય છે. એમનો મહિમા પણ અવર્ણનીય હોય છે. એમનું શબ્દોથી સંપૂર્ણપણે વર્ણન કરવા માટે વળી કોણ સમર્થ હશે ? આ કથા એક સરખી કાન પર પડતાં, શ્રી બાબા આંખો સામે એકસરખા દેખાવા માંડે છે, રાત અને દિવસ મનમાં અને ધ્યાનમાં રહે છે, અને સ્મરણમાં અને ચિંતનમાં રહેવા માંડે છે. એટલું જ નહિ પણ જગૃત અવસ્થા કે સ્વભન્માં પણ દેખાય છે, અને ઉઠતાં, બેસતાં, ઊંઘતા અને જગતાં પણ દર્શયમાન થતા રહે છે. ભરચુક વિસ્તારમાં જલ કે એકાંત જંગલમાં જલ ત્યાં પણ હંમેશા તમારી સાથે જ આવતા જતા રહેશે. આવો જ્યારે આપણો એમના તરફનો એક સરખો સ્નેહ લાગે છે આપોઆપ આપણા મનમાં પરમેશ્વર તરફની લગની લાગી ગયાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. અને આવું જ્યારે દરરોજ થવા લાગે ત્યારે ચિત્ત ચૈતન્યમાં એકર્ષય થાય છે. (ઓ. ૨૮-૩૪)

હવે આગલી કથાનો સંબંધ જે પાછલા અધ્યાયના અંતમાં કહ્યો છે તેની શરૂઆત કરીએ. શ્રોતાઓએ આદરપૂર્ણ થવું, ભાવ અને ભક્તિથી શીરાપુરી ગમે તેટલી ખાઈએ છતાં તે સદાને માટે અપૂરતી જ રહે છે. ખૂબ પેટ ભરીને ખાઈએ તેમ છતાં કોઈ દિવસ પરિપૂર્ણ તૃપ્તિ થતી નથી. શ્રોતાજનો ! હવેની આ બીજી કથા જે તમે ધ્યાન દઈને સાંભળશો તો સંતના દર્શનની સાર્થકતાનો મનમાં વિશ્વાસ બેસરો. બાધ્ય સ્વરૂપે સાઈબાબા જાળો કશું જ નહેતા કરતા હતા એવું દેખાતું હતું. પોતાનું સ્થાન છોડીને તે કચાંય જતા નહીં, તેમ છતાં શિરડીમાં બેઠા બેઠા તેઓ બધું જ જાણતા હતા, અને એનો અનુભવ પણ દૂરેક લોકોને તે કરાવતા. (ઓ. ૩૫-૩૮)

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જે વિકાળથી શુદ્ધ અભાવિત અસ્તિત્વઙ્ઘે તત્ત્વ એટલે કે બ્રહ્મ આપણા શરીરમાં હોય છે, એ જ સંપૂર્ણ જગમાં પણ છે. આ વાત આપણા શરીરનું ભાન ભૂલી જઈને સતત ધ્યાનમાં રાખો. આ સત્ત્વને જે શરણે ગયેલો છે એની એકડ્રપતા બધી જ વસ્તુઓ જેઠે છે એમ જણાવું. કારણો જે જુદાં જુદાં ધાર્યા કે જન્મ મરણની પરંપરા પાછળ લાગી જય છે. આપણે અને જગતના બીજા બધાં પ્રાણીઓ અને વસ્તુઓ જુદી જુદી છે. એવું દસાવનારી જે બુદ્ધિ છે તે મૂળમાં અજ્ઞાન કહેવાય છે. ગુરુના મેળાપથી અને શાસ્ત્રોના અભ્યાસથી ચિત્તની શુદ્ધિ થઈને બ્રહ્મભય સાથેની સ્થિતિ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનથી મુક્ત થવું એટલે જ એકત્વની પ્રાપ્તિ સમજવી. મનમાં થોડા પણ જે બેદભાવ રહી જય તો પણી એ અનન્ય સ્થિતિ કેવી રીતે કહેવાય ? બ્રહ્મદેવથી માંડીને તે બધી ન હાલનારી વસ્તુ પર્યન્ત જે જે આપણને સ્વસ્વરૂપ અથવા તો બ્રહ્મથી જુદી દેખાય છે ને જે જે સત્ત્યો હંમેશા એમનો બેદ જણાવા માટે જ્ઞાન વગરનાને બ્રહ્મ નથી એવો ભાસ થાય છે, તે આમ જેઠાં તો બધુંય ચારેબાજુથી ઓતપ્રોત થયેલ બ્રહ્મ જ છે. દેરક પ્રકારનું ઊંડુ જ્ઞાન હોવું જેઠાં એવો જેનો સ્વાભાવિક ગુણ છે. સંસારમાંના કર્તવ્યમાં જ્યાં તક નથી નામ ડામ રૂપ અને ડેકાણાં ભુસી નાંખવામાં આવ્યા છે, એ જ આ અવયવો સિવાયનું બ્રહ્મ છે. આપણું સ્વસ્વરૂપ પોતાને સ્વસ્વરૂપ અથવા તો બ્રહ્મથી જુદું સમજવાના સ્વભાવને લીધે અજ્ઞાન અને મોહની મોટી ભૂલોના હિસાબે જે ચિત્ત જુદાં જુદાં તત્ત્વોના સંબંધમાં સપદાય છે, તેવાને એકત્વનું જ્ઞાન થતાં તે સ્વસ્થ થઈ જય છે. હું જુદો, બીજા લોકો જુદા, એવું જેને કોઈ દિવસ જુદું દેખાતું નથી, જેને આ આખું વિશ્વ અખંડ અને એક જ રસથી ભરેલું છે અને એના સિવાય બીજું કશું જ બાકી નથી. જેમને નામ અને રૂપ સાથે કામ કરવું એ એક ઉપાધિ લાગે છે, જેમણે કામય જુદાપણુંમાં તયાંલું છે, તેમનું બ્રહ્મ થવું તે આ જ. એટલે આ જગમાં આપણે જ ફક્ત છીએ અને આપણા સિવાય બીજી કોઈ જગ્યા ખાતી નથી. આપણે જ દરે દિશામાં પરિપૂર્ણ વ્યાપેલા છીએ, અને પોતાના સિવાય જગતામાં બીજી કોઈ વસ્તુ નથી, એવી જ ભાવના દફયણે રાખવી. ભૂલ ભૂલામણી જેવી માયાને દૂર રાખવી. પોતાના સિવાય બીજી કોઈ પારકી વસ્તુ જ નથી, એ ધ્યાનમાં રાખીને પોતાની દષ્ટિ નિજ સ્વરૂપમાં સમેટી લેવી. શ્રોતાઓને સહેજે શંકા ઉત્પન્ન થશે કે આ બેદભાવ કેવી રીતે ઉત્પન્ન થતો હશે ? બ્રહ્મ એ એક જણાવા જેવી વસ્તુ એટલે ક્રોય અને જીવ જણાવાનો પ્રયત્ન કરનાર જ્ઞાતા એવી ભાવના જણાવા માટેનો ઉપાય કર્યો ? થોડી પણ જે બેદ બુદ્ધિ હશે તો એકત્વનો નાશ થાય છે. તત્કાળ જુદાં જુદાં રૂપો ઉત્પન્ન થઈ જતાં હોય છે. અને જન્મ મરણનું કારણ બનતાં હોય છે. અજ્ઞાનરૂપી દષ્ટિ દૂર થઈ કે સર્વ સૂચિ સૂદ્ધાં દેખાય ન દેખાય એવી થઈ જતી હોય છે, અને દષ્ટિમાં ફક્ત સ્વસ્વરૂપ જ વસીને રહે છે. તેથી જુદાપણું તરત દૂર થઈ જય છે. શુદ્ધ પાણીમાં શુદ્ધ પાણી બેળવવાથી તે એક જ થઈ જય છે. પહેલાંનું અને હવેનું બધું સરખું જ દેખાય છે અને જુદાપણાની ઓળખ બાકી રહેતી નથી. લાકડાના ટુકડાઓના આકાર ભલે જુદાં જુદાં હોય પરંતુ એમને બેગા કરીને સણગાવતાં તે એક જ અનિસ્વરૂપમાં એક થઈ જય છે. એમનો ટુકડાપણાનો ભાવ રહેતો નથી, અને આકાર પણ રહેતો નથી. પોતાના અભિસ્વરૂપમાં જ એ વિલિન થઈ જય છે. તે જ પ્રમાણે આત્મા પણ એક જ છે, આ જ્ઞાનને વધારાનું બીજું એક પ્રમાણ આપીને સિદ્ધ કરવાની જરૂર રહેતી નથી. સર્વ પ્રાણીઓમાં આત્મા પરિપૂર્ણપણે ભરેલો હોય છે. પરંતુ રૂપ વિહિન હોવાને કારણે આંખોથી જેઠ શકાતો નથી. ખોટી કલ્પનાઓના હિસાબે પ્રાણીનું ચિત્ત સહાય ગોટાળામાં પડે છે અને તેને લીધે જ તે જન્મ મરણમાં દુઃખોનો અનુભવ કરીને હુમેશા ક્ષુબ્ધ મન:સ્થિતિમાં રહે છે. નામ અને રૂપ એની ઉપાધિ છોડીને દિશરના સત્ય સ્વરૂપનું જ્ઞાન થયું છે અથવા એવી અવસ્થા સાધ્ય કરી છે, એવા સિદ્ધ પુરુષને માયા બાંધી શકતી નથી. તેમજ એ સહાય આત્માના આનંદમાં મગન રહે છે. આવી સ્થિતિનું મૂર્તિમંત ઉદાહરણ એટલે કે શ્રીસાઈનાં ચરણ છે, અને જે લોકોને તેના દર્શાનનો લાભ મળ્યો, તે લોકો ખરેખર ધન્ય થઈ ગયા. ચંદ્ર જેવી રીતે પાણીમાં દેખાતો હોવાં છતાં ખું જોતા એ એમાંથી બહાર જ હોય છે, એ જ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પ્રમાણે સંત પણ ચોકેર ભક્તજનોથી ઘેરાયેલા હોય તો પણ ખું જેતા તેઓ એમનાથી દૂર જ હોય છે. તેમના મનગમતા ભક્તજનો પાસે બેગા થયેલા હોવા છતાં તેમની કયાં પણ આસક્તિકે લોભ હેતા નથી. તેમના મનની વૃત્તિ આત્મસ્વરૂપમાં વિલિન થયેલી હોય છે. અને તેમની દાષ્ટિ કયારેય બીજી કોઈ જગ્યાએ જેતી નથી. આવા એ મહાન સાધુસંત જેમના બોલ્યા પ્રમાણે કે ઈચ્છા પ્રમાણે સાક્ષાત્ગ ઈશ્વર પણ વર્તતતો હોય છે, એમને માટે આ જગતમાં પ્રાપ્ત ન થાય એવું કંઈ પણ રહેતું નથી. તેમજ ન સમજય એવું પણ કશું જ રહેતું નથી. ઉપરેશ આપનારા અને લેનારા ગુરુશિષ્ય આ જગતમાં અસંખ્ય મળશે. પરંતુ ઉપરેશની જેઠે જેઠે અનુભવ કરાવનારો ગુરુ કવચિત મળતો હોય છે. (ઓ. ૩૮-૬૨)

હવે શરૂઆતનું આ વર્ણન ખૂબ થયું. શ્રોતાઓ મુખ્ય કથા સાંભળવા માટે ઉત્સુક થયા છે. તો એમની ઈચ્છા પણ પૂર્ણ થાઓ. મોગતાઈના જમાનામાં મહારાષ્ટ્રના મરાઠાવાડાના નાઈડ શહેરમાં એક પ્રખ્યાત પારસી વેપારી હતા. તેઓ પોતે અત્યંત ધાર્મિક તેમજ લોકપ્રિય હતા. તેમનું નામ રતનજી શાપુરણ વાહિયા હતું. અને તે મિલમાં કોન્ટ્રાક્ટર હતા. તેમને ત્યાં ધનસંપત્તિ અફાઈ હતી. ગાડીઓ, ઘોડા, જેતી અને ખુલ્લી જમીનો પણ પુર્ખળ હતી. રતનજીના ધરમાં ભારણાં સૌ માટે સદ્ગય ખુલ્લાં જ રહેતાં અને તેમના દરવાજેથી કોઈ પણ યાચક નિરાશ થઈને પાછો જતો નહીં. બહારથી જેતાં રાત અને દિવસ આનંદના સાગરમાં તે દૂબેલા દેખાતા. પણ રતનજી શેઠ અંદરોઅંદર સર્કેળવામાં અધરાં એવા ચિંતારૂપી ભગરોથી સદ્ગય ઘેરાયેલા રહેતા હતા. આ પણ એક ઈશ્વરનો સિદ્ધાંત જ દેખાય છે. કોઈને પણ સંપૂર્ણ સુખ નથી હોતું. કોઈને કંઈ તો વળી કોઈને કંઈ મુંજુંપણ હોય જ. કોઈ કહેશો કે હું મોટો, હું જ ખૂબ ઐશ્વર્યથી મહાન, માટે હું વગર કામનો અક્ષર થઈને ઉંઘો ચાલવા લાગુ એવું માને તેમ છતાં કોઈ પણ કચાશ ન હોવા છતાં તેને નજર ન લાગે માટે બ્રહ્મહેવે પોતાના હાથે જાણી જેઈને થોડી ઉણાપો લગાડી આપે છે, એવું સ્પષ્ટ દેખાય છે. ભરપુર પૈસો અને દરદાળીના જેની પાસે છે, એવા રતનજી શેઠ આવતા જતાને પેટબરીને જમાડતા, ગરીબોનાં દુઃખ દૂર કરતા અને હંમેશા પ્રસંગ ચિત્ત રહેતા. આમ જેવા જઈએ તો દેંક રીતે શેઠ ખૂબ જ સુખી હતા. પરંતુ પુત્રહીન સંપત્તિ સુખ શું કામની? એક પછી એક એવી ભાર છોકરીઓના વસ્તારની આ જંજળને લીધે તેમને સુખનો વાયરો કયાંથી મળે? તેમનું મન પણ સ્વસ્થ કેવી રીતે રહેવાનું! જેમ ભક્તિ વગરનું હરિકીર્તન અને તાલ અને સ્વર વગરનું ગીત તથા જનોઈ વગરનો જે બ્રાહ્મણ હોય તો તેની શું શોભા? દેંક કલામાં (વિદ્યામાં) પાસુંગત હોય પરંતુ સારા નરસાનું ભાન ન હોય, સદાચાર પાળનારો હોય પરંતુ પ્રાણી માત્ર ઉપર હ્યા વગરનો હોય, તો એમાં તેની શી શોભા? કપાળમાં ગોપીચંહનનું દીઠું હોય અને ગળામાં તુલસીની માળા પહેલેલી હોય, પરંતુ જુભનો ઉપયોગ સાધુ સંતોની ફક્ત મશકરી અને ડેકડી ઉડાવવામાં વાપરતો હોય, તો પણ એની શી શોભા? પદ્માંત્ર વગરની તીર્થયાત્રા હોય, ગળામાં માળા વીનાના અન્ય દાળીના હોય, તેવી જ રીતે દીકરા વગરનું જે ધર હોય તો તેની પણ શી શોભા? ‘ઈશ્વર એક સુપુત્ર સંતતિમાં આપશે કે?’ આ વિચારમાં શેઠજી હંમેશા દુઃખી જ દેખાતા હતા. ખાવા પિવાં મન લાગતું નહિ. મન ઉદાસીથી ભરેલું અને ચિંતામાં રહેતું. શેઠજી ઈશ્વરને કાલાવાલ કરતા, ‘ભગવાન! માસું આ એક કલંક ધોઈને મને નિષ્કલંક કર. મારા વંશને એક તો આધાર આપ. હે પ્રભુ! મારી લાજ રાખ.’ (ઓ. ૬૩-૭૮)

શેઠજીને દાસગણુ મહારાજ ઉપર શ્રદ્ધા હતી. એક દિવસે શેઠજીએ પોતાના મનની આ ઈચ્છા તેમને કહી, ત્યારે દાસગણુએ કહ્યું, ‘શિરડી જ્ઞાવ એટલે તમારા મનોરથ સિદ્ધ થશે, સાઈબાબાના દર્શન કરો એમના ચરણોમાં શરણ લો અને પોતાની આ ગુપ્ત ઈચ્છા તેમને કહો, એટલે તેમના તમને આરીવાંદ મળશે કે જી, તારું કલ્યાણ થશે. બાબાનું કૌશાલ્ય તો કલ્પના બહારનું છે. તેમને અનન્યપણે શરણે જ્ઞાવ. તમે સુખી થશે.’ રતનજી શેઠને આ વિચાર ગમ્યો અને શિરડી જવાનો નિશ્ચય કર્યો. થોડાં જ દિવસોમાં તે શિરડી જઈ પહોંચ્યા. મસ્નિફલમાં દર્શન માટે ગયા અને સાઈબાબાને દંડવત્ત પ્રણામ કર્યા. પુણ્ય કર્મનાં ફૂલ્યોનો સાક્ષાત પૂજ્ય એવા સાઈમહારાજને જેઈને શેઠજીનું હદ્દ્ય ભરાઈ આવ્યું. તેમણે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કૂલોનો કરંડિયો ખોલ્યો અને એમાંથી એક સુંદર કૂલોનો હાર કાઢીને પ્રેમપૂર્વક બાબાના ગળામાં પહેરાવ્યો અને ચરણોમાં જુદ્ધાં જુદ્ધાં ફળોનો દગળો સમર્પિત કર્યો. તે પછી ખૂબ નમ્ર આદરભાવથી તેઓ બાબાની પાસે જઈને બેઠા અને પ્રાર્થના કરવા લાગ્યા. ‘મહાન સંકટોથી ઘેરાયેલા લોકો તમારાં ચરણોમાં આવે છે. અને આપ તેમને તરત જ રક્ષણ આપો છો. એ વાત મેં સાંભળી છે, માટે એક મોટી આશા લઈને અપને જ મળવા માટે આવ્યો છું. આપનાં ચરણો અત્યંત આદરભાવથી કંઈક માંગુ છું. મહારાજ ! મને પાછો નહિ મોકલતા.’ એ સાંભળી બાબા બોલ્યા, ‘આવી આવીને દેહ હમણાં આવ્યો ? કંઈ વાંધો નહીં, મને જે જોઈએ તે દક્ષિણા પહેલાં આપ એટલે તું ફૂતાર્થ થશો.’ (ઓ. ૮૦-૮૯)

કોઈ પણ દર્શનાર્થી આવતું અને પગે પડીને દર્શન કરતું કે બાબાએ હિન્દુ હોય કે મુસ્લિમાન અથવા પારસી હોય છીતાં એમની પાસેથી દક્ષિણા માંગતા અને એ પણ કેટલી ? થોડી અમસ્તની નહીં ? પરંતુ એક, બે કે પાંચ ઇપિયાની રકમ માંગતા. સો, હજર, લાખ અથવા તો કરોડ પણ હોઈ શકે એમને યોગ્ય લાગે એટલી રકમ સ્વેચ્છાએ માંગીને લેતા. જોકે બાબાએ ક્યારેય કોઈની પણ પાસેથી હજર, લાખ કે કરોડની દક્ષિણા માંગી જ ન હતી. ક્યારેક ક્યારેક કવિઓ પ્રેમથી રંગમાં આવીને અતિશયોક્તિપૂર્ણ વર્ણન કરતા હોય છે. માટે અહીંથી મનકાવે તેટલી દક્ષિણા એવો જ અર્થ લેવો. જે દક્ષિણા આપતો તોય વધારે આપ એવું કહેતા. અને જે કોઈ એમ કહે કે પૈસા ખૂટી પડયા છે. તો એ કહેતાકે ઉધીના લઈ આવ. જ્યારે ક્યાંયથી ઉધીના ઇપિયા ન મળતા, ત્યારે માંગવાનું થોભાવી દેતા. એ ઉપરાંત ભક્તોને તે શું કહેતા ? ‘તમે જરાય ચિંતા કરતા નહીં, હું તમને પુષ્કળ પૈસા આપીશ. મારી પાસે તમે ફક્ત સ્વસ્થપણો જ બેસો.’ દુનિયામે હર કિસીકા કોઈ હૈ, લેકીન અપના તો યહાં કોઈ નહીં હૈ, અપના અલ્લા હી અલ્લા હૈ’ ‘મારી ઉપર જીવથી પણ વધારે પ્રેમ કરે એવાઓની જ મને કમી છે. જે મને કંઈક આપે છે, તેને હું સૌ ગણું પાછુ આપું છું.’ મોટો લક્ષાધિપતિ હોય તો પણ સાઈબાબા એને ગરીબને ત્યાં દક્ષિણા માંગવા જવા માટે આજ્ઞા કરતા. કોઈ ધનાદ્ય હોય કે બિભારી હોય, ગરીબ દૂષણો અથવા તો નિર્ધન હોય પણ સાઈબાબા માટે એક વધારે મહત્વનો અને બીજો ઓછો એવું ન હતું. શ્રીમંતુ માણસો પણ બાબાની આજ્ઞા શિરોમાન્ય કરીને અભિમાન થોડી ગરીબને ઘેર જઈ બાબા માટે પ્રાર્થનાપૂર્વક દક્ષિણાની માંગણી કરતા. આ વાતનો સારાંશ એટલો જ કે, દક્ષિણાને નિમિત્ત બનાવીને બાબા પોતાના ભક્તોનો અહંકાર તોડતા અને નમ્રતા ધારણ કરવાનું શીખવાડતા. (ઓ. ૮૦-૮૯)

સાધુને ધન શા માટે જોઈએ, એવી શંકા કોઈના પણ મનમાં જરૂર થશે. પરંતુ એનો જે વ્યવસ્થિત વિચાર કરો તો એ મનની શંકા સહેતાઈથી દૂર થઈ જશે. સાઈમહારાજની સર્વ ઇચ્છાઓ પૂર્ણ જ થયેલી હતી. પછી એમને દક્ષિણાની શા જરૂર ? ભક્તો પાસેથી જે પૈસા માંગે છે એને નિષ્કામ કેવી રીતે કહી શકાય ? જેમની નજરમાં વાદળમાંથી પડતા કરા હોય કે હીરા અથવા તાંબાનું નાણું, સોનામહોરો બંને એક જ કિંમતના ગળે તો પછી પોતાના હાથ પૈસા માંગવા માટે શા માટે ફેલાવતા હશે ? પોતે પેટ ભરવા માટે બિક્ષા માગતા હતા, અને વૈરાગ્યની દીક્ષા લીધેલી છે, પછી આવા નિરપેક્ષ વૈરાગીને દક્ષિણાની અપેક્ષા શા માટે હોય ? જેના દ્વારે અષ્ટસિદ્ધ હાથ જોઈને સહાયે ઉલ્લિ હોય છે. જેમની આજ્ઞા પાળવા માટે કુબેરના નવ પ્રકારના ખજના મહાપદ્મ, પદ્મ, શંખ, મકર, કર્યાપ, મુકુંદ, કુંદ, નીલ અને ખર્વ તત્પર હોય છે, એમને દ્વાર્ય માટે લાચારી શા માટે દાખવવી ? સંસારનાં સુખોને લાત મારનારા અને સ્વર્ગ સુખો સામે ભુલેચૂકે પણ ન જેનારા એવા અને પોતાનું હિત શેમાં છે, એ જ્ઞાનવાવાળા વિરક્ત લોકોને ધન શા માટે જોઈએ ? જે સાધુ સંત અને સજજન હોવા છીતાં જેનું લક્ષ પોતાની કીર્તિ સદાયે સારી રહે એ તરફનું હોય અને જેનું જીવન ભક્તોના કલ્યાણ ખાતર જ હોય એવાએ ધનનો સંગ્રહ શા માટે કરવો જોઈએ ? સાધુએ દક્ષિણા શા માટે માંગવી જોઈએ ? તેમનું મન હંમેશાને માટે ઈરણ સિવાયનું હોવું જોઈએ. સાઈબાબા ફકીર હતાં છીતાં તેમને ઇપિયાનો લોભ છૂટતો નથી. હંમેશા પૈસાની પાછળ જ પડી ગયેલા રહેતા.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પ્રથમવાર દર્શન માટે આવેલા પાસેથી પણ દક્ષિણા લેતા અને બીજ દર્શન માટે પણ દક્ષિણા લેતા. સર્દિશો લેવા માટે પણ ‘લાંબો દક્ષિણા’ એમ કહેતા. મિનિટ મિનિટ આ શું ? (પૂજાવિધિમાં અને નૈવેદ્ય ધરસા બાદ) જમવા પહેલા અને પછી આચયમન લેવા માટે પિવાનું પાણી અપાય છે, પછી હાથપગ ઘોવા માટે પાણી અપાય છે. ત્યારબાદ હાથને સુગંધ લગાડવામાં આવે છે. અને ત્યારબાદ પાનનું બીજું આપવામાં આવે છે. સૌથી છેલ્લે દક્ષિણા આપવામાં આવે છે. પરંતુ બાબાનો કમ વિચિત્ર હતો. ચંદ્ન, અત્તર, અષ્ટગંધ કે ચોખા ચઢાવતાં જ તેઓ દક્ષિણાની અપેક્ષા કરતા હતા અને શરૂઆતની પ્રાર્થનાના આરંભમાં જ દક્ષિણા માંગતા હતા. જેને લીધે ‘ઉં તત સત્ત વ્યલાર્પણં અસ્તુ’ આ દક્ષિણા આપવાનો મંત્ર એ જ ક્ષણે બોલવો પડે. (ઓ. ૧૦૦-૧૧૧)

પરંતુ આ શંકાનું નિવારણ કરવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે એમ નથી. ક્ષાળભર જે ધ્યાન આપશો તો સમાધાન પામશો. ધનનો જે સંગ્રહ કરવાનો એમનો ઉદ્દેશ હતો તે આપણે હાથે ધર્મ કાર્ય થાય અથવા દાન કે પરોપકાર થાય એવો જ થાય છે. પરંતુ લોકો એ ધન ક્ષુલ્લક રતીભરના સુખ અને બીજાં સુખો બોગવવા માટે મન ફાલે તેવી રીતે ખર્ચ કરતા હોય છે. ખરું જેતાં જે ગર્ભશ્રીમંત છે, એમને માટે શાસ્ત્રોનો અભ્યાસ, ધર્મકાર્ય અને દાનધર્મ આરામથી કરી શકાય છે, અને તેને લીધે પરમાત્મા વિશેનું જ્ઞાન મેળવી શકાય છે. એવો આ પોતાનો પૈસો પરમેશ્વર તરફ લઈ જઈને આપણને માર્દ પર ચઢાવે છે. ત્યારબાદ મનને સુખ શાંતિ મળે છે. શરૂઆતમાં ઘણા હિંસા સુધી બાબા કંઈ પણ લેતા ન હતા. બળેલી હિંસણીઓ ભેગી કરતા અને એને ખિસ્સામાં ભરતા હતા. ભક્ત હોય કે ના હોય, કોઈની પાસે કાંઈ પણ વસ્તુ માંગતા નહીં. એકાદ કોઈએ જે તાંબાનો પાઈ, પૈસો આપતા તો એનું તમારું અથવા તેલ વેચાતું લઈ આવતા. બાબાને તમારું ઉપર બહુ જ પ્રેમ હતો. બીડી અને ચલમ પીતા હતા. એમાં ચલમ પીવાની તો કોઈ સીમા જ ન હતી. મોટે ભાગે એ સદ્ગ્યાને માટે ચેતતી જ રહેતી પછી આગળ ઉપર કોઈકના મનમાં આચ્યું હશે કે, સંતના દર્શને ખાલી હાથ કેવી રીતે જવાય ? માટે તેઓ દક્ષિણા લઈ જવા લાગ્યા. કોઈ એક પૈસો આપતું તો તે ગજવામાં મૂકી હેતા. અને જે કોઈ દફ્ફુ પૈસો એટલે કે એ પૈસાનો સિક્કો આપે તો એવો ને એવો પાઈ કરતા. આ કમ ખૂબ હિંસ ચાલ્યો. પણ આગળ જતાં સાઈબાબાનું મહાત્મ્ય પુષ્કળ વધ્યું. ભક્તોનાં ટેણેટોળાં આવવા લાગ્યા. અને વિધિપૂર્વક એમનું પૂજન શરૂ થયું. પૂજની પૂર્ણતા સોનું, ફળ, ફૂલ કે દક્ષિણા આપ્યા સિવાય પૂર્ણ થતી નથી. આ નિત્યની પૂજનો વિધિકમ, પૂજન કરવાવાળા શાસ્ત્રોના જ્ઞાનકારોને ખબર હતી. રાજને અભિષેક કરતી વખતે પાણી છાંટવાની અથવા તો ચરણપૂજન કરવા માટે પૂજન કરવાવાળાઓ બેટ સોગાદ લાવતા હોય છે. તેવી જ રીતે ગુરુની પૂજન માટે પણ દક્ષિણા લાવવામાં આવે છે. ‘ઉચ્ચાદિવિ દક્ષિણાવંત’ (દક્ષિણા આપનારો સ્વર્ગલોક પામે છે.) ‘હિરણ્યદા અમૃતવંત’ (સોનું આપનારનું ચિત્ત શુદ્ધ થાય છે.) એવું વેદ ભાગવતમાં કહ્યું છે. (દક્ષિણાસૂક્ત ઋગવેદ મં. ૧૦ સૂત્ક ૧૦૭-૨) (ગંધ) સુગંધી દ્રવ્ય લગાડવાથી શુદ્ધ પવિત્ર માંગલ્ય પ્રાપ્ત થાય છે. પદ્ધરાવાથી આયુષ્ય વધે છે, ફૂલ અને પાનનાં બીડાં અર્પણ કરવાથી સંપત્તિ અને ઔથર્ય પ્રાપ્ત થાય છે. અને દક્ષિણા આપવાથી દ્રવ્ય પ્રાપ્તિમાં વધારો થાય છે. પૂજનાં સાધનોમાં જેવી રીતે ગંધ, અક્ષત, ફૂલ અને પાનનું બીજું એ મહત્વનું હોય છે. તેવી જ રીતે દક્ષિણા અને સોનાનાં ફૂલ પણ મહત્વના હોવાને કારણે પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થાય છે. દેવની પૂજના પ્રસંગે તેની પૂર્ણતા માટે જેવી રીતે દક્ષિણાની જરૂર હોય છે તેવી જ રીતે વ્યવહારમાં પણ વ્રતોના ઉદ્યાપન એટલે કે વ્રતોની સમાપ્તિ પ્રસંગે વ્રતોને અનુસાર બ્રાહ્મણોને ફળો, મીઠાઈઓ અને દક્ષિણામાં રોકડ રકમ આપવાની હોય છે. જગતનો લેણાણનો આ વ્યવહાર ડિપિયામાં કરવો પડે છે. પોતાની આબરૂ ઓછી ન થાય માટે લોકો આવા પ્રસંગે થથા યોગ્ય ધન ખર્ચની તેને કાયમ સાચવતા હોય છે. ‘હિરણ્યગર્ભ-ગર્ભસથ’ વરોરે મંત્ર ઉચ્ચાર કરીને દેવપૂજન માટે જે દક્ષિણા માન્ય હોય તો તે પછી સંતના પૂજન માટે કેમ નહીં ? (ઓ. ૧૧૨-૧૨૮)

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

સંતોનાં દર્શન માટે જતાં પહેલાં, પોતપોતાની બુદ્ધિ અનુસાર દર્શનાર્થીઓને પોતાની આગવી કલ્પના તેમનાં મનામાં હોય છે. બધાનો એકસરખો મત હોયો અધરો છે. કોઈના મનમા ભક્તિનો ભાવ હોય છે, તો કોઈ સંતની પારખ કરવા જતા હોય છે. કોઈ કહે છે કે અમારા મનની વાત જે જાણે એ જ ગતમાં ખરો સંત હોઈ શકે. કોઈ દીર્ઘ આયુષ્ય માંગતા હોય છે, તો વળી કોઈ હાથી, સોનું, સંપત્તિ અને માત્રમત્તા માંગતા હોય છે, કોઈ પુત્ર તો કોઈ પૌત્ર, જ્યારે કોઈ ન ખતમ થનારી અખંડ સત્તા હાસિલ કરવા માંગે છે. શ્રીબાબાની શૈલી ખરેખર અગાધ અને આશ્રયકારક હતી. જે કોઈ એમનાં ચરણ કમળમાં ખોવાઈ જતો હતો. આ પણ જે એના પ્રારબ્ધમાં લખાયેલું ન હોય તો તેમનાં મનમાં પશ્વાતાપ થઈને એનો અહંકાર ઓગળી જઈને તે બાબાનો ખરો અને નિશ્ચિત બોધનો અનુભવ કરતો હોય છે. આવા સર્વસામાન્ય ભક્તો સદાને માટે સંસારમાં આશકત હતા. તેમના મનથી દક્ષિણા આપીને ચોખ્ખા થઈ જવું તે જ બાબાની દ્રચ્છા હતી. ‘ધ્રેન, દાનેન, તપસા’ આ વેદ વાક્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉત્સુક એવા દક્ષિણા આપવા વાળાઓની સાધનાની યુક્તિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ભક્ત સ્વાથી હોય કે પરમાર્થી બંનેને ઇચ્છિત ચીજની પ્રાપ્તિ માટે અને પોતાના કલ્યાણ માટે પોતાના ગુરુને દક્ષિણા આપવી જોઈએ. (ઓ. ૧૨૮-૧૩૬)

બ્રહ્મદેવે પણ દેવ, દાનવ, માનવ આમ એવાં, ત્રણ બાળકોને એમનું બ્રહ્મચર્ચ પૂરુ થતાં, ઉપરેશ માંગતા એક જ વસ્તુ કહી હતી. ‘દ’ આ એક અક્ષરનો ઉપરેશ કર્યો અને એ ઉપરથી તેઓ શું સમજ્યા તે પૂછીને પાકું પણ કરી લીધું. ખરેખર ગુરુ અને શિષ્યનો આ ખેલ અપૂર્વ હોય છે. ‘દાનં થવું’ એટલે સંયમ રાખવો એવું દેવ સમજ્યા. ‘દ્વા કરવી એવું’ દાનવો સમજ્યા. અને ‘દાન કરવું’ એવું મનુષ્ય સમજ્યા. અને બ્રહ્મદેવે (પ્રજનપતિએ) એ સાંભળીને કહ્યું બરાબર છે. તમારું કલ્યાણ થાઓ એવું બોલ્યા. આ દેવ બીજા કોઈ નહીં પણ માનવ જ હોય છે. ફક્ત સ્વભાવથી જ તેઓ જુદા હોય છે. તેઓ ઉત્તમ ગુણ-યુક્ત હોય છે. પરંતુ ઇન્દ્રિયોનો સંયમ હોતો નથી. તેમને દેવ કહેવામાં આવે છે. આસુરો પણ માનવ હોય છે, પણ તે હિંસા કરવાવાળા દુષ્ટ અને ફૂર હોય છે. માનવોને મહાભયંકર લોભ વળેલો હોય છે. આમ માનવોના ત્રણ પ્રકાર છે. લોભથી ખરડાયેલા માણસને લોભક્ષી ખાડામાંથી બહાર કાઢવા માટે કૃપાના સાગર એવા શ્રી સાઈનાથ ભક્તોના કલ્યાણની દ્રચ્છાથી તેમને પોતાનો હાથ આપીને બહાર ખેંચી કાઢે છે. તૈત્તિરીય ઉપનિષદમાંની પહેલી દૂંકમાં અગિયારમાં અનુવાદમાં દાનના અનેક પ્રકાર કહ્યા છે. એમાંના દેરેક પ્રકારને વ્યવસ્થિત સાંભળો. જે કાંઈ આપવું હોતે હંમેશા શ્રદ્ધાપૂર્વક જ આપવું. શ્રદ્ધા સિવાયનું આપેલું દાન ફળ આપતું નથી. રાજની આજાથી, શાસ્ત્રોમાં કહ્યું છે તે માટે અથવા તો ડરથી અને લજનથી, કંઈક પણ આપવું. જગતમાં વિવાહ વગેરના કાર્યપ્રસંગ જગતમાં હોય છે. ત્યાં પણ બેટની વસ્તુઓ અથવા તો રોકડા પૈસાનો વહેવાર કરવો પડતો હોય છે. તે આપીને મિત્રતાનું કર્તવ્ય સંભાળવું એવી લોક વહેવારની શિખામણ છે. (ઓ. ૧૩૭-૧૪૫)

સાઈબાબા પણ ‘દ’ આ અક્ષરથી ભક્તોના કલ્યાણ માટે તેમની પાસેથી માંગતા હતા. તેઓ કહેતા, ‘દ્વા કરો દાન આપો અને દાનાં થાઓ એટલે કે ઇન્દ્રિયોનું દમન કરો એટલે અપાર સુખ પામશો. અદાન્તતા-અન્જિતેન્દ્રિયતા-અદાન્તતા-લોભીપણું, કંજુસપણું અને અદ્યાણુતા-નિર્દ્યાપણું. આ ત્રણ દોષોનો નાશ કરવા માટે આ એક નાના અમર્સ્તા અક્ષરનો ઉપાય પોતાના શિષ્યો માટે ગુરુમહારાજ યોજતા હતા. કામ, કોધ અને લોભ એ આત્મઉન્નતિ માટે અશુભ હોય છે. તેની ઉપર વિજય અથવા કાબુ મેળવવો ખૂબ જ અધરો છે. માટે આ સહેલો ઉપાય બતાવ્યો છે. જેવી રીતે શુંતિમાં બુહદારણ્યક ઉપનિષદ અધ્યાય ૫ પ્રાત્મણ-૨માં કહ્યું છે તેવી જ રીતે ભગવદ ગીતામાં અ. ૧૬ શ્લોક ૨૧માં કહ્યો છે. અને ત્યાં પણ આ જ ઉપરેશ ભાર દઈને કહેવામાં આવ્યો છે. શ્રોતાઓ તેને વ્યવસ્થિત સમજ શકે માટે એનો ઉતારો હું નીચે આપી રહ્યો છું.’

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ ।

કામ:કોધસ્તથા લોભસ્તમાદેતત્ત્રયં ત્યજેત ।

(શ્રીમદ્ ભગવદ્ગીતા અ. ૧૬ શ્લોક ૨૧)

કામ, કોધ, અને લોભ એ નકરનાં ત્રણ દ્વાર જ છે. તે માર્ગે ચાલનારો પોતાનો નાશ વહેરી લે છે. માટે તેમના નિશ્ચિંતપણે છોડી દેવા. શ્રીસાઈસમર્થ અત્યંત દ્યાળું છે. ભક્તોના કલ્યાણ અર્થે તેઓ તેમની પાસેથી દક્ષિણા માંગતા હતા અને ત્યાગનું શિક્ષણ આપતા હતા. દક્ષિણાની શી કિંમત ? ગુરુનાં વચન પાળવા માટે જે પોતાના પ્રાણ ન્યોધાવર નથી કરી શકતા તેમનો પરમાર્થ શા કામનો ? ભક્તોના કલ્યાણ સિવાય દક્ષિણા માંગવાનો બાબાનો અંગત સ્વાર્થ બીજે કયો હોઈ શકે ? તેમનું પોતાનું જીવન કાંઈ દક્ષિણા પર નિર્ભર ન હતું. તેઓ પોતાને માટે તો બિક્ષા માંગતા હતા. દક્ષિણા માગવા પાછળ દક્ષિણાનું દાન આપીને પોતાના ભક્તોનું ચિત્ત શુદ્ધ થાય એટલા પુરતો તેમનો ઉદ્દેશ હતો. સારાંશ એટલો જ કે ઉપર જણાવેલાં વેદ વચનો અનુસાર દક્ષિણાનું દાન કરવા સિવાય ગુરુનું પૂજન સંપૂર્ણ થતું નથી. (ઓ. ૧૪૬-૧૫૫)

હવે આ દક્ષિણા પુરાણ બસ થયું. એ વિષેની ચર્ચાનો અર્થ પણ સ્પષ્ટ થયો. બાબાને કોઈ પણ પ્રકારની આશા ન હતી કે સ્વાર્થ પણ ન હતો. ફક્ત ભક્તોના કલ્યાણ માટે જ તેઓ દક્ષિણા માગતા હતા. હવે આગળની કથામાં સંપૂર્ણપણે તે અંગેનું નિવેદન કરીએ. એમાંનો રતનજીનો દક્ષિણા પ્રસંગ અને સાઈબાબાએ કરેલ સરસ મજાનો વિનોદ સાંભળીએ. શ્રોતાઓએ આ અદ્ભુત કથા સંપૂર્ણ શક્ષાથી સાંભળવી, જેથી કરીને સાઈબાબાનું સ્વરૂપ કેટલું વ્યાપક અને અતૌકિક હતું તે સમજશે. શેઠળ પાસેથી દક્ષિણા માંગતા પહેલાં સાઈબાબાએ અગાઉ બનેલું વૃત્તાંત કહી સંભળાવ્યું છે. પરંતુ શેઠળના મનમાં એની યાદ ન હતી, માટે એમને આશ્રય થયું. ‘તેમને ત્રણ રૂપિયા અને ચૌદ આના આખ્યા હતા તે મને યાદ છે. હવે બાકી રહેવા જે તું લાય્યો છે તે મને દક્ષિણામાં આપી દે.’ રતનજી શેઠ બાબાનું આ પ્રથમવાર જ દર્શન કર્યું હતું. માટે બાબાના આવા બોત સાંભળીને તેમને આશ્રય થયું, અને વિચાર કરવા લાગ્યા કે પોતે તો શિરડીમાં પહેલાં કહી આવ્યા નથી. અને કોઈની સાથે તેમણે કંઈ મોકલ્યું નથી. તેમ છતાં મહારાજ જે કહી રહ્યા છે એ આશ્રયકારક નથી ? આવું કયારેય બન્યું ન હતું. માટે મનમાં ખૂબ મૂંજાવા લાગ્યા. તેમણે બાબાને દક્ષિણા આપી અને નમર્સ્કાર કર્યા. પરંતુ એ કોષણાનો ઉકલ તેમને મળ્યો નહીં. અને છેવટે તે કોષડો ત્યાં એની જ જગ્યા પર રહી ગયો. શેઠ પોતાના આવવાનું કારણ સમજાવ્યું. અને ફરી દેંહવત્ત પ્રણામ કરીને બે હાથ જોડીને પાસે બેઠા. શેઠના મનમાં ખૂબ જ સમાધાન થયું, અને બોલ્યા, ‘બાબા ! ખૂબ સારું થયું. આજે આપના ચરણોનાં દર્શન થયા. મારા પૂર્વજન્મના ભાગ્યનો ઉદ્ય થો. હું દુર્દીવી એક સાધારણ માણસ છું. મને પૂજન, અર્થન, યજા વગેરેની કાંઈ જ સમજ નથી. નસિબથી જ આપના જેવા ત્રિકાળજાની અને સુજા સંતના દર્શન થયા. તમને તો મારા મનની ચિંતાની જાણકારી છે જ, એને કૃપાવંત થઇને દૂર કરો, હે દ્યાળું ! આ તમારા અનન્ય ભક્તને તમારા ચરણથી દૂર કરતા નહીં.’ શ્રીબાબાએ શેઠળની દ્યા આવી અને બોલ્યા, ‘વગર કામની ચિંતા કરતા નહીં. તમારા દુર્ભિયને હવે દૂર થવાનો સમય આવ્યો જ સમજે !’ બાબાએ શેઠળના હાથમાં ઉદ્દીનો પ્રસાદ આપ્યો, અને માથા ઉપર કૃપાનો હાથ મૂક્યો અને ‘મનની મુરાદ અત્યાર પૂર્ણ કરશે’ એવો આશીર્વાદ આપ્યો. પછી રતનજી શેઠ બાબાની આજા લઈને નાંદિં પાછા ફર્યા તથા જે હકીકતમાં બનેલું તેબધું જ સવિસ્તાર ગણુદાસને કહ્યું. ‘યથાયોગ્ય દર્શન થયા, મન ભરપૂર આનંદિત થયું અને પ્રસાદપૂર્વક આશ્વાસન અને આશીર્વાદ પણ મળ્યા. યથાસ્થિત બધું જ થયું પણ એક વસ્તુ મારા સમજવામાં આવી નહીં.’ ‘ત્રણ રૂપિયા અને ચૌદ આના તમે મને આખ્યા હતા તે મને યાદ છે.’ આમ બાબા જે કંઈ બોલ્યા તેનો અર્થ મારા સમજવામાં આવતો નથી. તમે મને એનો અર્થ જરાક સ્પષ્ટ રીતે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કહો. કયા ડિપિયા, અને કયા આના, એ આપવાનું વળી કયારે થયું ? શિરડી તો આ મારું પહેલી જ વાર જવાનું થયું છે. આ બેદ મને કંઈ સમજવામાં આવતો નથી, અને એનો જરા પણ ઉકિલ મળતો નથી. આ બધું મને ખૂબ જ ગૂઢ અને ન સમજય એવું લાગે છે. આપને એમાં કંઈ સમજય છે કે ? (ઓ. ૧૫૬-૧૭૫)

દાસગણુ વિચારમાં પડી ગયા. આ પાછો એક ચમત્કાર થયો. આનો અર્થ વળી શો હોઈ શકે ? તેમના મનમાં કંઈ ભાળ બેસતી ન હતી. પછી પુષ્ટ વિચાર કર્યા પછી તેમના મનમાં એક મુસ્લિમ ઓલિયાની મૂર્તિ યાદ આવી, જેને લોકો મૌલવીસાહેબ કહીને બોલાવતા હતા. જાતે મુસલમાન હતા, પણ તેમની વર્તણું અને હિન્દુચર્ચા સંતો જેવી હતી. હમાલીનો ધંધો કરીને તેઓ ઈશ્વર રાખે એ પ્રમાણે રહેતા હતા. એમનાં વિષે જે સવિસ્તાર કહેવા લાગુ તો ગ્રંથનો વિષય બદલાઈ જશે. આમ જેતાં મૌલવીસાહેબનું આગમન તેમને ત્યાં અચાનક જ થયું. બંનેને એકબીજ ઉપર પુષ્ટ પ્રેમ હતો. શેડળું એમને ઉપચારપૂર્વક ફૂલ ફળ અર્પણ કર્યા, અને ખાવાનું પણ આપ્યું. દાસગણુને તે ક્ષણે એ પ્રસંગ નિભિતે થયેલા ખર્ચાની યાદ આવી. માટે તેમણે ખર્ચાની યાદી મંગાવી. પૈ.... પૈસાનો હિસાબ લગાવ્યો અને ગણતરી કરી. સરવાળો બરાબર ત્રણ ડિપિયા અને ચૌદ આના જ થયો. વધારે નહીં અને ઓછો પણ નહીં. બાબાએ તેની પાવતી કેવી રીતે આપી હશે ? બાબાના આ પ્રકારના અષ્ટસિદ્ધિપણા વિશે જણીને બધાને તેની નવાઈ લાગી. સાઈબાબા જાનનો સાક્ષાત્ ભંડાર હતા. મસ્નિદ્વારમાં બેઠા બેઠા કોઈ પણ દેશમાંના થતા ભૂત ભવિષ્ય અને વર્તમાન જ્ઞાનતા હતા. સાઈસર્થની સર્વ જીવો સાથેની એકાત્મતા વગર શું આ પ્રકારનો અનુભવ આવી શકે કે બીજથી કહી શકાશે ? નાંદિદ શિરડીથી સારું એવું હૂર અને બંને વચ્ચે અંતર પણ ખાસ્સું છે. તેમજ આ બંને સંતો એકબીજને માટે તદ્દન અન્નાયા પછી બાબા પાસે આ વિશેનો તાર/ટપાલ જેવો સંદેશો આવ્યો કયાંથી ? સાઈમહારાજને માટે હું એક મૌલવીબુવા બીજ એવો કોઈ બેદ અથવા વેગળાપણું બંને વચ્ચે ન હતું. મૌલવીબુવાનો આત્મા એ જ સર્વેના હૃદયમાં રહેલો આત્મા હતો. આવી એકાત્મતાના ધાર્મિક રહસ્યને જે સમજ શકે તેને ધન્ય છે. બહારથી બલે તેઓ બંને જુદા દેખાતા હતા પરંતુ આંતરિક રીતે તેઓ હૃદયથી જેડાયેલા હતા. ‘તેઓ બંને’ એ બોલવું પણ યોગ્ય નથી, કારણ કે તેઓ કદી પણ જુદા ન હતા. આ બંનેના એક જ પ્રાણ, એક જ જ્ઞાન અને એક જ ઉદ્દેશ હતા. તથા બંને એક જ સરખા વૃત્તિના પૂર્ણ ચૈતન્યયુક્ત હતા. શિરડી નાંદિદ વચ્ચે અંતર હશે જ પણ તેમની વચ્ચે ન હતું. તેમનો એક જ પ્રાણ અને એક જ દેહ હતો. માટે જ આ બાતમી એકબીજને ત્વરિત મળી હશે. સાધુ સંતોની આ કેવી નવાઈ ? તેમના તારખંત્રમાં તાર હોતા નથી, છતાં પૃથ્વી ઉપર ઘટનારી દેંક ઘટના બાબતે તેઓ માહિતગાર હોય છે. (ઓ. ૧૭૬-૧૮૩)

આગળ ઉપર યોગ્ય સમય પાકયો અને રતનજી ઉપર દેવ પ્રસન્ન થયા. તેમની પત્નીને ગર્ભ રહ્યો અને આશાદ્ધી વૃક્ષને કુંપળો ફૂટી. સમયસર સુવાવડ થઈ અને બાબાના આશીર્વાદનો ખરાં પડ્યા. તેમને ત્યાં પુત્ર રતન જન્મ્યો. તેથી રતનજી આનંદિત થયા. ઘણાં વર્ષોના દુષ્કાળ બાદ જણે અચાનક વરસાદ પડ્યો હોય તે જ પ્રમાણે પુત્ર પ્રાપ્તિથી રતનજીને પૂર્ણ સમાધાન થયું. એ વંશરૂપી વેલ જે એકવાર ઉગ્રી એ યથાક્રમે વધથી જ ગઈ. બાળબચ્યાંઓથી ભરેલા સંસારમાં રતનજી સુખી થયા. ત્યારખાદ વારંવાર તેઓ સાઈદર્શને જતા રહ્યા અને તેમના આશીર્વાદ મેળવતા રહ્યા. રતનજીની મનની બધી જ તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ અને તેઓ મનથી સંતુષ્ટ થયા. વસંત ઋતુમાં આંબા પર બલેને ખૂબ ફળો આવે તો પણ તે બધાં જ ફળો કંઈ પાકતાં નથી, તે જ પ્રમાણે રતનજીનાં બાર બાળકોમાંથી ચાર જ જીવ્યા. અને એ બધાં સુખમાં અને આનંદમાં જીવી રહ્યાં છે. નસિબમાં જે કાંઈ લખેલું છે તે જ બને છે. માટે એમાં જ સુખ માનીને આવા સરળ અને સરસ સ્વભાવવાળા રતનજી સંપૂર્ણ સંતોષથી જરાપણ દ્વારા કર્યા વગર જીવ્યા. (ઓ. ૧૯૪-૨૦૦)

હવે આગળની કથાનો સાર કહું છું. આ બધું સ્વથાવર અને જંગમ વિશ્વ સાઈથી જ વ્યાપેલું છે. આનો સાચો અનુભવ કોઈએ પણ સ્વસ્થ ચિંતા બેસીને લેવો. થાણા શહેરનો એક ગરીબ ચોળકર અટક ઘરાવનારો લાચાર ગૃહસ્થ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હતો. તેની ભાવપૂર્ણ ભક્તિ ઉપર ગુરુ શ્રેષ્ઠ કેવી રીતે પ્રસન્ન થયા અને જેણે સાઈબાબાને પહેલા કદી જેયા ન હતા, છિતાં તેની બાધા કેવી રીતે ફળી અને તેના મનની ઈચ્છા કેવી રીતે પૂર્ણ થઈ તેમનું તેમને કેવો અનુભવ થયો તે સાંભળજો. વગર પ્રેમનું ભજન શા કામનું ? અર્થ સમજ્યા વગરનું ગ્રંથ વાંચન શા કામનું ? અને ભાવભક્તિ સિવાય ઈશ્વર કયાંથી પ્રસન્ન થવાનો ? તે બધી ફોગટની મહેનત ગણાય. કંકુના ચાંલ્લા સિવાયનું કપાળ અને અનુભવ સિવાયનું જ્ઞાન વ્યર્થ હોય છે. આ ફક્ત પુસ્તકિયા જ્ઞાનના શબ્દો નથી. અનુભવ લઈને શ્રોતાઓએ એની કિંમત આંકવી. (ઓ. ૨૦૧-૨૦૫)

આ સાઈની લાતીનો ગ્રંથ શા માટે અને એનો સંબંધ કયો, તે મને ખબર નથી. મારા દ્વારા આ ગ્રંથ સાઈબાબાએ લખાવી લીધો છે. તેમને જ એના હેતુની ખબર છે. ગ્રંથ લખવા માટે જવાબદાર વ્યક્તિ જેઠાંએ. હું તો ફક્ત સાઈબાબાની ચાકરી કરું છું. અને એમની આજ્ઞા અનુસાર આ પેઢી સંભાળું છું. શ્રોતાઓ તરસથી વ્યાકુળ થયેલા ચાતક પદ્ધી જેવા છે, જ્યારે સાઈસમર્થ સ્વઅનંદના મેધ છે. એમની તરસ છીપાવવા તેઓ અનંત કથાડૂંથી પાણીની નીરવ વર્ષા કરી રહ્યા છે. જેમના પ્રભાવથી જ આ મારી વાણી તેમના ચરિત્રનું વર્ણન કરી રહી છે. તેમની ચરણરઙ્ગના કણોમાં મારું આ શરીર હું આળોટવા ઈચ્છું છું. મારી આ વાણીને પ્રેરણા આપનારા તે જ છે. એમનાં ચરણોમાં મારા ચંચળ મનને સ્થિરતા મળો. જેવાં મારી કાયા અને વાણી ભજન તેવી જ રીતે મારાં માનસિક ભજનો પણ મને આનંદ સુખદ્દાયી નીવડો. હું તો સાઈબાબાનો સર્દેશવાહક છું. ચરિત્ર કહેનારા અને બોતાવનારા ભલે સાઈબાબા જતે જ સંપૂર્ણપણે સજજ હોય છિતાં શ્રોતાગણ કાંઈ જુદ્દો થોડો છે ? તેઓ પણ સાઈબાબાથી પારકા નથી. દેખાવમાં આ કેવળ આયુષ્યનો સાહો આચરણ કરું લાગે છે. પરંતુ આ બધી જ સાઈબાબાની લીલા છે. તેમણે પોતે જ એક પ્રેમાળ જેલાડી બનીને આ પ્રબળ લીલા માંડી છે. સાઈબાબાનું ચરિત્ર અગાધ છે. ભક્તોને વિચિત્ર અનુભવો બતાવીને, મને નિમિત્ત બનાવીને પોતાના ભક્ત સમૂહને તેમણે સંતુષ્ટ કર્યા છે. આ ફક્ત ચરિત્ર જ નથી પણ સુખોનો લંડાર છે. અને મોક્ષનું શ્રેષ્ઠ અમૃત છે. જેમનું ખાસ કરીને જુદા જ પ્રકારનું ભાગ્ય હશે તેવા જ લોકોએ આનું ભક્તિભાવથી સેવન કરવું. ગુરુકૃપાનો મહિમા અને નવાઈ ભક્તોને માટે કાયમ યાદગાર નિવડે માટે જ ભક્તોના વિશ્રાબ ખાતર આ ગ્રંથ રચવાનો પરિશ્રમ જેડ્યો છે. આ ચરિત્ર જે મનથી વાંચશો તો ભક્તોને સાંભળવાનો આનંદ થશે. એમાંની કથાઓ ફરી ફરીને વાંચવાથી અને એ પ્રમાણે આચરણ કરવાથી તો ભક્તિ અને પ્રેમ બંને વધશે. આ ચરિત્ર જે રાત ને દિવસ સાંભળવામાં આવે તો મોહ માયાનાં બંધનો તૂટશે, ત્રિપુટીનું (ધ્યાતા, ધ્યાન અને ધ્યેય) ભાન ભૂલાઈ જવાશે અને શ્રોતાગણ સુખસંપત્ત થશે. હેમાઉપંત બાબાનાં ચરણમાં નમીને તેમને અનન્યપણે શરણે ગયા છે. તે એક ક્ષણ પણ રોકાઈ શકતા નથી. કારણ કે વિલંબ પરવડે એવો નથી. તે ચરણોમાં અખંડ દંડવત્ત પ્રણામ કરે છે. (ઓ. ૨૦૬-૨૧૬)

સર્વેનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોથી પ્રેરણા પામેલા ભક્ત હેમાઉપંત રચિત
શ્રીસાઈસમર્થના સત્યચરિત્રનો 'રતનજી સાઈ સમાગમ' નામનો આ ચૌદમો અધ્યાય અહિં સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણા.



અધ્યાય ૧૪નું અર્� વિવરણ.

ઉપર ઉપરથી જોતાં આ અધ્યાયમાં હેમાડપંતે રતનજી પારસીની એક કથા જ કહી છે. પરંતુ તેની સાથે સાથે બીજી અનેક બોધપ્રદ વાતોનું વિવેચન કર્યું છે. શક્તાત્મમાં પાછલા અધ્યાય ૮ પ્રમાણે નરજન્મનો મહિમા ફરી કહીને સંસારની અનિત્યતા સમજાવેલ છે. માટે માણસે આ જન્મમાં પોતાનું હિત સાધી લેવું. આ માટે રોજ પ્રેમથી સાઈકથા સાંભળવાનો ઉપદેશ કરીને તેનું ફળ કહી રહ્યા છે. આ ઉપનિષદમાંનું મહાવાક્ય 'તત્વમસિ' એટલે તે ખ્રિસ્ત પણ તું જ છે એવું કહીને એકત્વ અને વૈવિધ્યનું સુંદર સ્પષ્ટીકરણ સહ વિમોચન કરેલું છે અને પછી ઉપદેશ કર્યો છે.

નાંદિના રતનજીની કથામાં આ જ વાતની ચોખવટ થાય છે. સાઈબાબાના આવા એકત્વને કારણે તેમને રતનજીની આવવાની પહેલેથી જ ખબર હતી. તેથી કહ્યું કે આવતાં આવતાં આજે આવ્યો રતનજી પગે પડતાં 'તણ ઢપિયા ચૌદ આનાં'. જાણું છું તે મને આખ્યાં. બાકી જે મમ કાજ આખ્યાં. આપ દક્ષિણા તે મહને ॥૧૬૦॥' એવું કહીને નાંદિના મૌલીબુઅને શેડે આપેલા નાના સરખા જમણાની પોતાને રજે રજ માહિતી હતી, જે બાબાએ સૂચવેલી તે પણ એક પેલા સંત સાથેની એકાત્મતા હતી.

રતનજીની આ કથા બીજી કથાઓ કરતાં વિશેષ પ્રકારની છે. પ્રથમ એ કે તે એ બીજીકુલ જુદા જ ધર્મના માણસની છે. સાઈબાબાના હિન્દુ અને મુસ્લિમાન ભક્ત પહેલેથી જ ઘણા હતા. હવે પારસી ભક્તની કથા કહીને બાબાનું મહાત્મ્ય બીજી ધર્મના લોકોને પણ સમજાવા લાગ્યું હતું. વાત હેમાડપંતે બતાવી છે. તેમાં પાછા રતનજી એક શ્રીમંત મીલ કોન્દ્રકટર હતા, માટે બાબાની કીર્તિ વધારે પ્રસરી હશે. તે ઉપરાંત રતનજી ઉપર બાબાનો અનુગ્રહ થયો તે પણ એક વિશેષ પ્રકારનો હતો. આ જગતમાં પ્રપંચી લોકો સંતો પાસે મુખ્ય બે વાતો માટે જ દોડી જતા હોય છે. એક તો કોઈ અસાધ્ય રોગ અથવા તો દુઃખના નિવારણ માટે અથવા તો પોતાની કોઈ ઈચ્છા પૂર્ણ કરાવવા માટે. આ ઈચ્છાઓ ખાસ કરીને ત્રણ પ્રકારની હોય છે. પુત્રેષણા, ધનેષણા અને લોકેષણા એટલે કે માન, સન્માનની ઈચ્છા. તેમાં પણ પુત્ર ઈચ્છા વિશેષ કરીને આપણા ભારતના પુરાણકાળીથી જ ખૂબ તીવ્ર રહી છે. સંસારને આગળ ધપાવવા છોકરો વારસદાર તરીકે હોવો અને પોતાનો પુત્ર દ્વારા અન્ધિદાહ આપ્યા સિવાય મૃત વડીલોને સદ્ગતિ મળતી નથી. એ જ કારણે પુત્રપ્રાપ્તિ માટે સંતોની પાછળ લોકોની ભીડ જામેલી જ હોય છે.

આ અધ્યાયમાં બીજું એક ખાસસું મોટું (૬૬ ઓવીનું) પણ સુંદર અને બોધવાયક વિવરણ આવેલું છે. તે એટલે કે દક્ષિણાનું હેમાડપંતે મોટી હોશિયારીથી શાસ્કોનો આધાર લઈને બાબાની દક્ષિણા લેવાની વૃત્તિને સમર્થન આપ્યું છે.

તે કરતાં કરતાં બ્રહ્માની દેવ, દૈત્ય અને માનવ સાથેની કે જે પોતાના ત્રણેય નજીકના છે તેમને કરેલા 'દ' આ એકાક્ષર ઉપદેશની બૃહદારણ્યક ઉપનિષદ્દોમાંની વાત કહીને તેઓ કહે છે. એના સમર્થન ખાતર ગીતાનો ૧૬માં અધ્યાયનો ૨૧મો શ્લોક કહીને તેનો અર્થ પણ સમજાવ્યો છે. પરંતુ એમાં પણ 'માનવાં ગાંજુ લોભ દુર્ધર' કહીને હેમાડપંત દાન કેવી રીતે કરવું ? તે શિખવવા માટે તૈત્તિરીય ઉપનિષદ્દોમાંના અનેક દાનના પ્રકાર જ જ્ઞાવતા કહે છે. આ સાંભળતાં સાંભળતાં આ સચ્ચારિત્રના આગળા અધ્યાય ૪૭માંની ઓવી મને યાદ આવી છે તે કહી રહ્યો છું. અને તેવી જ રીતે આ વિષય પર ગીતાના અધ્યાય ૧૭માંનો આ શ્લોક પણ કહ્યો છે. દાન કરવું તે આપણનું કર્તવ્ય છે, એવું સમજીને દેશ, કાળ અને પાત્રતા જોઈને પોતાના ઉપર ઉપકાર ન કરતાં જે કાંઈ દાન આપવામાં આવે છે, કે કરવામાં આવે છે તેને સાત્ત્વિક દાન શ્રેષ્ઠ કહ્યું છે.



॥ અધ્યાય ૧૫ ॥

ચોળકર શર્કરા આખ્યાન

(ચોળકરની ખડી સાકરની બાધાની કથા)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

જેમનાં અમાર્યાદિત પુણ્યોના લાભો પાકે છે તેમને જ સાઈના દર્શનનો લાભ મળે છે. પછી તેમને ન્રણેય પ્રકારનાં દૃષ્ટિઓ ત્રાસ આપતાં નથી. અને પરમાર્થ પ્રાપ્ત કરવાનું સાધન મળે છે. હે શ્રોતાજનો ! કૃપા કરીને એક ક્ષણ ગુરુનું ધ્યાન કરો, અને કથા તરફ આદરપૂર્વક મન લગાવીને મારી તરફ ધ્યાન આપો. ‘તમે અહીંથાં કથા કહી રહ્યા છો એની મને ખબર છે. વગર કામનો ત્રાસ કેમ વધારો છો’ આવું કહેશો નહિ અને મને ક્ષમા કરજે. શ્રોતાજનો ! તમે સાગર જેવા છો એ પણ છિલોછિલ છલકતો હોવા છતાં જેમ સાગર સરિતાઓને કદી પાછી મોકલતી નથી અને વાદળોએ વર્ષાવેલ વરસાદની સહિત ધારાઓ સમાવી લે છે. તેવા સાગર જેવા તમે સજજન અને સંત શ્રોતાજનો છો. તમારી સાથે જ ભજનનો સહિતાસ જેડવો એવી મેં ઠિચ્છા રાખી છે. તો તમે મારો તિરસ્કાર કરતા નહીં. ગરીબ અને નભળાઓને છોડી દેવા અથવા ભુતી જવા સારું ન કહેવાય. ગંગા નહીનું શુદ્ધ અને પવિત્ર પાણી હોય કે શહેરનો ગટરમાં વહેતો ગંદા પાણીનો પ્રવાહ હોય, સાગર પોતાના પેટાળમાં બંનેના સંગમના સમયે જોરથી ઉછિયા સિવાય અથવા તો મનઃસંતાપથી બિન્ન થયા સિવાય જગ્યા કરી આપે છે. માટે આપ શ્રોતાગણોના મનમાં સંતકથા સાંભળવા બદલની ઉત્સુકતા છે, જેનું સમાધાન મારી તરફ કૃપાથી એકવાર જેતા આપોઆપ થરો. ઉતાવળ ન કરતાં સબુરી અને શ્રદ્ધાથી આ કથાઝુદી અમૃતનું આદરપૂર્વક સેવન કરવામાં આવશે તો શ્રોતાઓને પ્રેમથી ભરેતી ભક્તિ પ્રાપ્ત થરો અને તેઓ કૃતાર્થ થઈ જશે. ભક્તોને અતિશાય પરમ શ્રેષ્ઠ વસ્તુ એટલે કે પરમેશ્વર સહેલાઠી પ્રાપ્ત થરો. ભક્તિ અને મુક્તિ બંને મળરો. ભલાભોળાઓને સુખ-શાંતિ મળરો, અને બધાંને પોતાનું આશ્રયસ્થાન પણ મળરો. ગુરુમહારાજના મોઢે આ મધુર કથા સાંભળીને સંસારમાં રહેલા ભય અને વ્યથા નહિ જેવાં થઈ જશે. શ્રોતાઓના મનને આનંદ થરો અને પોતાના આત્માની સાથે એકડૃપતા પ્રગટ થરો. (ઓ. ૧-૧૦)

આ અધ્યાયમાં એક પ્રેમાળ ભક્તે સાઈબાબાને કેવી પ્રાર્થના કરી અને દર્શન આપીને બાબા એની ઉપર કેવા પ્રસન્ન થયા એ સાંભળો. દૂધ પીવડાવીને બહાર ગયેલી એક બિલાડી પાછી ફરતાં એનાં બચ્ચાં ફરી ફરીને પ્રેમથી ધાવવા પાઇળ પહૃતાં હોય છે. પછી તે બિલાડી કંટાળીને ધૂરકે એટલે થોડા સમય માટે એ બચ્ચાંઓ હબાઠને ચૂપ બેસી જય છે. પરંતુ મા શાંતિથી બેસે કે તરત જ તેની આજુભાજુ ગોળ ગોળ ફરીને પાછા એના આંચળો ચૂસવાની શક્કાત કરે છે. આ પ્રકારે પ્રેમથી તે બચ્ચાંઓ આંચળોથી ગટગટ દૂધ ચૂસવા લાગે એટલે માને માતૃવાત્સલ્યથી દુધનાં ટપકાં ટપકવા માંડે છે અને તે પહેલાંનું ધૂરકવાનું ભૂલી જઈને જમીન ઉપર પ્રેમથી લાંબી થઈને બેસી જય છે. વાત્સલ્યનો ઉદ્ય થતાં જ માનો કંટાળો દૂર થાય છે. તે પોતાનાં બચ્ચાંને ચારે પગથી બરાબર પકડીને તેમને એક સરખી રીતે શરીર પર ફેરેક જગ્યાએ ચાટવા લાગે છે. ખરેખર આ દશ્ય જોવા જેવું જ હોય છે. બચ્ચાંઓના તીક્ષ્ણ નાખ પ્રહારથી જેમ જેમ માને સત્તાવવામાં આવે છે, તેમ તેમ વાત્સલ્યના ઝરા વધીને તેમાંથી દૂધની ધારાઓ વહેવા લાગે છે. જેવી રીતે આ બચ્ચાંઓનો પ્રેમ તેમની માતાના

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

દૂધનો વધારો કરે છે, તેવી જ રીતે તમારામાં પેદા થયેલી સાઈચરણની આ આસક્તિ સાઈબાબાના હદ્યમાં પ્રેમના ઝરા ઉત્પન્ન કરે છે. (ઓ. ૧૧-૧૭)

એક વખતે થાણાના લોકોએ ઈશ્વરની ભક્તિ કરવા માટે આસક્ત એવા દાસગણુને સાંભળવા માટે મધુર એવું કથા કીર્તન કૌપિનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં કરાવ્યું હતું. સભ્ય અને વિવેકપૂર્ણ આગ્રહથી દાસગણુ કથા કરવા તૈયાર થઈ જતા. દાસગણુમાં અકડાઈ આંદબર કે પૈસાનો લોભ ન હતો. કીર્તન માટે એક પણ પૈસાની જરૂર પડતી નહીં. શરીર ઉધાંડું રહેતું અને માથા ઉપર ફેઠો કે પાથડી પણ નહીં. શરીર પર કમ્મરે ફક્ત એક સાંદું ઘોતિયું જ પહેરતા. તેમ છતાં સાંભળનારાઓની ગીર્દી બેસુમાર રહેતી હતી. આ પોષાકની મલક કહું છું, જે શ્રોતાઓને સાંભળીને મજા પડરો. માટે આરામથી સાંભળો. જેથી બાબાનો ચ્યાતકાર સમજનશે. એક વખતે દાસગણુનું કીર્તન શિરડી ગામમાં હતું. આથી તેમણે શરીર ઉપર સરસ અંગરખું પહેર્યું હતું. ખબા ઉપર ખેસ નાંખ્યો હતો. તેમજ માથા ઉપર ફેઠો બાંધ્યો હતો. આવા પોષાકમાં સજીધળુને તેઓ નીકબ્યા. દરરોજના નિયમ પ્રમાણે મસ્નિફલમાં બાબાને આનંદપૂર્વક નમસ્કાર કરવા ગયા, ત્યારે એમને ‘વાહ વાહ ! વરરાજ જેવા સજેલા છો !’ એવું બાબા બોલ્યા, તે એમણે સાંભળ્યું. બાબાએ તેમને ફરી પૂછ્યું, ‘આમ સણું કયાં નીકબ્યો ?’ એ સાંભળી દાસગણુએ બાબાને કહ્યું કે, ‘બાબા ! કીર્તન કરવા માટે હું જરૂર રહ્યો છું.’ ત્યારે બાબાએ કહ્યું, ‘અંગરખું, ઉપવશ, ફેઠો વગેરેની શી જરૂર છે ? આ બધો ત્રાસ શા માટે વેઠો છો ?’ આપણાને આમાંનું કંઈ જ જરૂરનું નથી, માટે મારી સામે બધું જ કાઢી નાખ. આનો ભાર શરીર ઉપર શા માટે રાખે છે ?’ આ આજા સાંભળતા જ દાસગણુએ એ બધાં વસ્ત્રો કાઢી નાખી બાબાનાં ચરણોમાં મૂકી દીઘાં. ત્યારથી તે આ દુનિયામાં રહ્યા ત્યાં સુધી કીર્તના સમયે બિલકુલ જ ઉધાડા શરીરિ હાથમાં કરતાલ લઈને અને ગળામાં માળા પહેરીને બેસતા. આ પદ્ધતિ વિદ્ધાનોમાં ભલે લોકાચાર વિરુદ્ધની હોય છતાં તે અત્યંત શુદ્ધ છે. વિદ્ધાનોમાં વિદ્ધાન જે પ્રસિદ્ધ નારદમુનિનો આ માર્યા છે. આ ગાઢી મૂળ નારદ પાસેથી આવેલી છે. તેમજ ત્યાંથી જ આગળ કીર્તનકરોની હારમાણ શરૂ થઈ. તેમને ઉપર ઉપરનો ઠાઠ કે મોખો દેખાડવાની જરૂર હોતી નથી. અંત: કરણની શુદ્ધિ એ જ તેમનું ધ્યેય હોય છે. શરીરનો નીચલો ભાગ જ વસ્ત્રોથી ઢંકાયેલો એવા કરતાલ અને વીણા વગાડતા અને મોઢેથી શ્રીહરિનું નામ જેરથી ઉચ્ચારતા નારદનું સ્વરૂપ તો બધાના ધ્યાનમાં હશે જ. સાઈબાબાની કૃપાથી દાસગણુ સંતોનાં આખ્યાનો પોતે જ તૈયાર કરતા અને વિનામૂલ્યે તેનું કીર્તન કરતા હતા, આથી તેમને ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થયેલી હતી. લોકોમાં સાઈભક્તિના ઉત્સાહનો દાસગણુએ ખરેખર સારો એવો વધારો કર્યો. તેમજ સાઈ પ્રેમનો અને આમાંનંદનો લાણે કે સર્વ ડેકાણે સાગર જ છલકાયો. ભક્તોના શિરોમણી નાનાસાહેબ ચાંદોરકરનો સાઈભક્તો ઉપર પુષ્કળ ઉપકાર છે. સાઈચરણમાં લોકોની ભક્તિ વધારવા માટે તેઓ જ મૂળ કારણ છે. દાસગણુનું મુંબદીમાં આવવું એ પણ ચાંદોરકરને કારણે જ હતું. તેમને તીવ્યે મુંબદીમાં ડેકેકાણે દાસગણુનાં કીર્તનો અને સાઈબાબાનાં ભજનો ગવાયા. પૂના, અહેમદનગર, સોલાપુર પ્રાંતમાં સાઈમહારાજની ખ્યાતિ પહેલેથી હતી. પરંતુ કોકણાના લોકોને બાબાની ભક્તિનું ઘેલું લગાડનાર ફક્ત આ બે....જ જણા હતા. મુંબદી પ્રાંતમાં જે સાઈબાબા માટેની ભક્તિ વધી તેનું મૂળ કારણ આ બે વ્યક્તિત્વો, આ બે જણાના હથે જ કૃપામૂર્તિ સાઈમહારાજ મુંબદીમાં પ્રગટ થયા. (ઓ. ૧૮-૩૬)

હવે શ્રી કૌપિનેશ્વર મહાદેવના મંદિરમાં દાસગણુના કીર્તનમાંથી સાઈપ્રેમનો ઘોષ, અને એમાંથી હરિનામના જ્યજ્યકારની ચોળકરને એકાએક લહેર ઉઠી. હરિ કીર્તનમાં સાંભળવા માટે ઘણા લોકો આવતા હોય છે. સાંભળવા સાંભળવામાં પણ અનેક પ્રકાર હોય છે. કોઈકને બુવાનું શાસ્ત્રજ્ઞાન ગમે છે તો, કોઈને એમનો અભિનય ગમે છે. અમુકનો શોખ ફક્ત ગાવાની ફબ પૂરતો જ હોય છે અને કહે છે, ‘વાહ વાહ બુવા ! શું સુંદર ગાય છે ? વિષ્ટલના નામધોષમાં અમુક લોકો રંગાઈને પ્રેમથી નાચતા હોય છે. કોઈ લોકોને પૂર્વાંગ પહેલો ભાગ કે જેમાં સંત મહાત્મા

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

વગેરેના વિષયોનું નિરૂપણ હોય છે તે માટે પ્રેમ હોય છે. તો કેટલાકને કથા સાંભળવા પૂર્તી જ આસક્તિ હોય છે. કોઈક કોઈકને કીર્તનકરોને નકલો કરતાં જેવામાં રુચિ હોય છે. તો અમૃક લોકોને દાઢાંતડ્ઝી આજ્યાનો સાંભળવા ગમે છે. કીર્તનકાર અભણ હોય કે વિદ્વાન, શબ્દોના પદે પદે જુદા જુદા અર્થ કાઢનારો હોય કે પછી ઉત્તરાંગ આજ્યાનો કહેવામાં પ્રવીણ હોય પરંતુ સાંભળવાની રીત આવી જ હોય છે. આવા જ શ્રોતાઓ વધારે હોય છે. પરંતુ કીર્તન સાંભળીને જેના મનમાં શ્રદ્ધા અને ભક્તિ ઉત્પન્ન થાય છે. અને ઈશ્વરના અને સંતોના ચરણે પ્રિતી લાગે છે, એવા શ્રોતાઓ કવચિત જ મળતા હોય છે. ઉપરા ઉપરી પુષ્કળવાર સાંભળ્યા બાદ પણ અજ્ઞાનના થરના થર રહી જય તો અને કેવો સાંભળવાનો અનુભવ સમજવો ? જેનાથી ગંઢી ઘોવાઈ જતી નથી, તેને સાબુ કેવી રીતે કહેવો અને જેનાથી અજ્ઞાન નાશ થતું નથી તેને કીર્તન સાંભળ્યું કેવી રીતે કહેવાય ?' (ઓ. ૩૭-૪૪)

ચોળકર પહેલેથી જ શ્રદ્ધાળું હતા. દાસગણું મહિરાજનું કીર્તન સાંભળીને એમને સાઈબાબા પ્રત્યે પ્રેમનો ઉમળકો આવ્યો. ચોળકર મનમાં બોલ્યા, 'હે કૃપાળું સાઈનાથ ! આ ગરીબની સંભાળ રાખ.' ચોળકર બિચારો ગરીબ હતો. એ પોતે કુંભની જવાબદી અને ભરણ પોષણ માટે અસરમર્થ હતો. ઉદ્દર નિવાહ માટે એને સરકારી નોકરી મળે તે માટે તેણે બાબા ઉપર મદાર રાખ્યો. ઈચ્છુક લોકો બાધા રાખતા હોય છે કે, મારું અમૃક કાર્ય પૂર્ણ થશે તો જમણ કરવી બ્રાહ્મણને જમાડીને તૃપ્ત કરીશ. શ્રીમંતોની બાધા એવી હોય છે કે, મનોકામના પૂર્ણ થાય તો હજર લોકોને જમાડીશ અથવા તો સો ગાયોનું દાન કરીશ. પણ ચોળકર, તો પહેલેથી જ નિર્ધન હતો. તેમ છતાં તેને બાધા રાખવાનું મન થયું. શ્રી સાઈના ચરણ વદન ચાદ કરી દ્વારા મોઢે એ બોલ્યો, 'બાબા ! મારો સંસાર ગરીબ છે, ખૂબ મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરી છે, પરંતુ મારો બધો જ મદાર નોકરી મળવા ઉપર છે. કાયમનો પગાર મેળવવા માટે પરીક્ષા તો પાસ કરવી જ પડશે. નહીં તો ગંધની બાખરી અને ઉમેદવારી પણ જતી રહેશે. આપની કૃપાથી જે હું સફળ થઈશ તો તમારાં ચરણોમાં હાજર થઈ તમારા નામથી ખડી સાકર વહેંચીશ. આ મારો પાકો નિશ્ચય છે.' આ પ્રમાણે ચોળકરે બધા રાખી અને મનાં ધાર્યા પ્રમાણે તે પરીક્ષામાં પાસ થયો હોવાથી ખૂબ જ આનંદિત થયો. પરંતુ બાધા પુરી કરવા માટે લાંબો સમય પસાર થઈ જતાં તેણે ખાંડ ખાવાની છોડી દીધી. શિરડી આવવા જવા માટે ખર્ચ પેઠે થોડા પૈસા જોઈએ, ખાલી હાથે જવાય જ નહીં. એમ વિચારીને આજે નહીં કાલે એમ વિચાર ઘડેલાઈ જવાથી ચોળકરને આમ જ દિવસો પસાર કરવા પડ્યા. સહ્યાદ્રીના અત્યંત નાનાં મોટાં અફાટ શિખર ધરાવતો નાણેઘાટ એટલે હુંગર ઉપરનો અચ્યંત વિકટ અને અડચણોથી બેરેલો રસ્તો જયાંથી કોકણના લોકો પૂના જિલ્લામાં આવેલા જુન્નર ગામમાં આવવા જવા માટે આ ઘાટનો ઉપયોગ કરતા હોય છે. તેને ઓળંગતા ફાવશે, પરંતુ સંસારી માણસ માટે આ ઘરનો ઉમરો ઓળંગવો ખૂબ અધરો છે. શિરડીની બાધા પુરી કર્યા સિવાય સાકરવાળો પદાર્થ ખવાય નહિં, માટે ચોળકર ચા સુદ્ધાં વગર ખાંડની ચલાવી લેતા. આવા અમૃક દિવસો નીકળ્યા બાદ યોગ્ય સમય મળતા તે શિરડી ગયા અને માનેલી બાધા પાળીને તેમના મનને સંતોષ થયો. શ્રીબાબાના દર્શન થતાં જ ચોળકર બાબાનાં ચરણોમાં દંડવત્ પ્રણામ કરીને ખૂબ સંતુષ્ટ થયા. શુદ્ધ મનથી ચોળકરે સાકર વહેંચી, શ્રીફળ અર્પણ કર્યું અને મનમાં બોલ્યા કે, આજે મારો મનોરથ સફળ થયો. સાઈબાબાનાં દર્શનથી પણ એમને વિશિષ્ટ આનંદ થયો તેમજ બાબા સાથેની વાતચીતથી તેમને ખૂબ જ સુખ લાગ્યું. ચોળકર બાપુસાહેબ જેગના મહેમાન હતા. અને જેગને ત્યાં તેમનું આવવું જવું રહેતું, માટે જેગ ઉઠતાંની સાથે ચોળકર પણ જવા માટે ઊભા થયા. ત્યાં જ બાબાએ જેગને કહ્યું, 'તેમને ભરપુર ખાંડ નાખીને ચા પીવડાવજે.' આવા માર્મિક અને અર્થપૂર્ણ શબ્દો કાને પડતાં ચોળકર મનમાં આશ્રયચકિત થયા અને એની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યા. તેમણે બાબાનાં ચરણો ઉપર માથું મુકી દીધું. જેગને પણ આશ્રય થયું, પણ એ કરતાં વધારે ચોળકર આનંદિત થયા. કારણ કે બાબાના શબ્દોનો અર્થ ફક્ત તેમને જ સમજાયો, અને તેમના મનની વાત પણ તેમને જ સમજાઈ. બાબાને કદી ચાની વાતની

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

ખબર ન હતી. તો પછી આમ એકાએક કેવી રીતે યાદ આવી ? ચોળકરને વિશ્વાસ બેસાડવા તેમની ભક્તિ દઢ કરવા માટે જ બાબા કદાચ આમ બોલ્યા હશે. એટલામાં જ બાબાએ પૂરે પૂરો અણસાર આપ્યો, ‘ચોળકર બોલ્યા પ્રમાણેની આપેલી ખડીસાકર મને પહોંચી ગઈ છે. તારી ખાંડ છોડી દેવાની બાધા પુરી થઈ. બાધા રાખતી વખતે તારા મનની વાત તેમજ તેવી રીતે બાધા પાળવા માટે મોદું થતાં સાકર ખાવાનું ત્યલુને કરેલું પ્રાયશ્ક્રિત ભલે તે ગુપ્ત રાખ્યું હોય છતાંતે બધું જ મને ખબર છે, ખરું ? તમે કોઈ પણ કોઈ પણ સ્થાને હો પરંતુ મારે માટે ભક્તિ ભાવથી શ્રદ્ધા રાખ્યાને વિનંતી કરી એટલે હું તમારી પાછળ એક ભાઈની જ માફ્ક રાત અને દિવસ ઊભો રહીશ. મારો દેહ ભલે અહિ હોય અને તમે સાત સમુદ્ર પાર હો તથા ત્યાં પણ તમે કંઈ પણ કરો તેની જાણકારી મને અહીંથાં તરત જ થાય છે. દુનિયામાં તમે ગમે ત્યાં જલ, હું તમારી સાથે જ આવતો હોઉં છું. તમારા હદ્યમાં જ મારો વાસ છે. હું જ તમારો અંતર્યામી આત્મા છું.’

‘તમારા હદ્યમાં બેસેલો જે હું છું તેને તમે હંમેશા નમસ્કાર કરો. પ્રાણીમાત્રમાં જે અંતર્યામી વસી રહ્યો છે તે હું જ છું. માટે તમને ઘર કે બહાર રસ્તા ઉપર ના વેઠેમાર્ગું મળે તો તે હું જ છું, ને તેમનામાં મારો જ વાસ છે. નાની કીડીથી માંડીને કીડા સુધી અને જળચર અને સ્થળચરના પ્રાણીમાત્ર, ઝૂતરા, ભૂંડ દેરેક જળાએ હું ઠસોઠસ ભરેલો છું. માટે તમે મારાથી જુદા છો એવું માનતા નહીં. તમારામાં અને મારી વચ્ચે જરાય અંતર નથી કે લેદ નથી. જે મને એ રીતે ઓળખરો અને જાણશે તેનું જ ભાગ્ય બળવાન થશે.’ આ વાત ભલે દેખાવમાં સર્વ સાધારણ લાગે છે. ઇતાં ગુણોથી ખૂબ ઉત્તમ છે. એ ચોળકર ઉપર બાબાને કેટલો પ્રેમ હતો ! ચોળકરને બાબાશ્રીએ ભક્તિ અને શ્રદ્ધાથી જોડ બેસાડી આપી. તેના મનમાં જે જે વાતો હતી, તે બધી બાબાએ અનુભવ કરાવીને મનનું ધારેલું સિદ્ધ કરી આપ્યું. સંતોનું ચાતુર્ય આશ્રયજનક હોય છે ! બાબાના શર્ષ્ટો અણભોલ હતા. ભક્તોના હદ્યમાં તેમનાં વચ્ચે ખૂબ ઉંડા ઉતરી જતાં. ભક્તિઝીપી બાગની જમીન ઉપર ભીનાશ સિંચતા અને ભક્તિના માર્ગનો રસ્તો કરી આપતા. ચાતક પક્ષીની તરસ છુપાવવા માટે જેમ મેઘ દ્વારા થઈને વરસાદની ધારાઓ વરસાવે છે, પરંતુ પરિણામ રૂપે તો આખી ધરાને શાંત અને હંડી કરતા હોય છે. તે જ પ્રકાર અહીંથાં જેવા મળે છે. ચોળકર બિચારો કોણ ! દાસગણું કીર્તન માત્ર નિમિત્ત થયું અને બાધા રાખવાનું મન થયું, અને સાથે સાથે બાબા પણ પ્રસન્ન થયા. માટે જ આ ચમત્કાર થયો અને સંતનું અંતરમન સમજયું. બાબા પોતાના ઉપદેશ ખાતર આવા અવસરો મેળવી આપતા. ચોળકર તો ફક્ત નિમિત્ત બન્યા. તમામ ભક્તોનાં કલ્યાણ માટે બાબાનું વર્તન હંમેશા ન સમજય તેવું રહેણું. આપણે તો તેમની સામે બસ એક ચિત્ત અનયબીથી જેયા જ કરવું. (ઓ. ૪૫-૮૦)

આવી જ બાબાની બીજી એક ચતુરાઈનું વર્ણન કરીને આ અધ્યાય પૂર્ણ કરીએ. એક ભક્તે કેવો પ્રક્રિયા અને એનું બાબાએ કેવી રીતે સમાધાન કરાવ્યું તે સાંભળીએ. એક વખતે બાબા મસ્નિજદમાં પોતાના આસન ઉપર બેઢા હતા, તે વખતે સામે બેઠેલા એક ભક્તે પાછલી ભીત ઉપર એક ગરોળી ચૂક ચૂક અવાજ કરતી સાંભળી. ગરોળી શરીર ઉપર પડવી, અથવા તો ગરોળીનો આમ ચૂકચૂક અવાજ કરવો એ ધારીવાર ભવિષ્યમાં ઘડનારી વસ્તુઓની આગાહી સુયવે છે, માટે કુતૂહલથી તેણે પ્રક્રિયા, ‘બાબા ! આ પાછળની ભીત ઉપર ગરોળી કેમ ચૂક ચૂક કરી રહી છે ? તેના મનમાં શું હશે ? એ કોઈ અમંગલકારી કે અશુભ થવાની આગાહી તો નથી કરતી ને ?’ આ સાંભળી બાબા બોલ્યા, ‘ઔરંગાબાદથી તેની બહેન તેને મળવા માટે આવી રહી છે તેથી તેનો આનંદ સમાતો નથી.’ આમ ગરોળી આવું અમસ્તુ પ્રાણી ! તેને વળી કેવાં મા-બાપ અને ભાઈ-બહેન ? તેને વળી સંસારમાંના વ્યવહાર સંબંધો કયાંથી ? માટે બાબાએ ગમે તેમ મજનુક કરવા માટે જવાબ આપ્યો હશે એવું સમજુને પેલો ભક્ત ક્ષણભર સ્વસ્થ બેસી રહ્યો. એવામાં ઔરંગાબાદથી એક ગૃહસ્થ બાબાના દર્શને ઘોડોસવારી કરીને આવ્યો. તે વખતે બાબા સ્નાન કરી રહ્યા હતા. આ ઘોડેસવાર મુસાફરને આગળ પણ જવાનું હતું. માટે ઘોડાને ખવડાલવાની ચંદી ખરીદવા માટે એ બજાર તરફ ગયો. આ નવા સોદાગર તરફ પેલો પ્રક્રિયાવાળો ભક્ત નવાઈથી જેવા

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

લાગ્યો. એટલામાં સોદાગરે બગલમાં દ્વાવેલો તોબરો કચરો સાફ કરવા માટે જાટક્યો. જમીન પર એનું મોહું નીચે કરી ખંખેરતા એમાંથી એક ગરોળી બહાર નીકળી અને ગભરામણમાં બધાની સામે જ સરસર.... કરતી દોડી ગઈ. પ્રશ્ન પૂછનારા તરફ બાબા જેઠને બોત્યા, ‘હવે એની ઉપર ધ્યાન રાખ તે જેઠ તે ગરોળીની બહેન તે આ. હવે તેની અદ્ભૂત કરામત જે.’ તે જેવી ત્યાંથી નીકળી કે તરત જ પોતાની મોટી બહેન ચૂક ચૂક કરતી હતી તે આવાજને ધ્યાનમાં રાખી દૂમકા ખાતી અને ડોલતી ચાલવા લાગી. બંને બેનોનું મીલન અને તેમાંથી પુષ્ટ દિવસો પછી મુલાકાત થયેતી હોવાથી પરસ્પર ગાઢ આલિંગન આપીને બંને રમવા લાગી. ખેરખર તેમના પ્રેમનો આ ખેલ અતૌંડિક હતો. તે એકબીજાની આજુબાજુ ગોળ ગોળ ફરવા લાગી અને એકબીજા ઉપર ઊભી, આડી, નાસી એવી છલાંગો મારવા માંડી. કયાં ઔરંગાબાદ શહેર અને કયાં શિરડી ગામ. આ કયો પ્રકાર ? આ ઘોડેસવારનું અચાનક આવવું અને તેની જેઠે આ ગરોળીનું આવવું કેવી રીતે થયું ? ગરોળી હશે ઔરંગાબાહની અને તોબરામાં ધૂસી ગઈ હશે, પરંતુ આ પ્રશ્નોત્તરીની અનુકૂળ સંધી એ જ વખતે કેવી રીતે થઈ ? ગરોળીનું ચૂક.... ચૂક શું સૂચક હતું ? પેલા ભક્તનો પ્રશ્ન શું પૂછવો ? તેમજ તેનો ગર્ભિત અર્થ બાબા દ્વારા સમજલીને કહેવો, અને આ અનુભવનો કેટલો જલ્દી ઉકિલ આપવો ? એવો આ અપ્રતિમ લહાવો અને યોગ ઘઢાયો. બાબા સદ્ગ્ય વિનોદવૃત્તિના ચાહક હતા. સંતજનો આવી અનૂપમ સાધના યોજને ભક્તોનું સમાધાન કરી કલ્યાણ કરતા. આ જ્ઞાસુ જે ગૃહસ્થ ન હોત તો ગરોળીનો ચૂક... ચૂક કરવાનો અર્થ કોણે ખબર પડત ? તેમજ સાઈબાબાનો મહિમા કેવી રીતે સમજાત ? અનેક લોકો ગરોળીઓના ચૂકચૂક અવાજથી પરિચિત હોય છે. પણ આ ચૂક ચૂક શબ્દોનો અર્થ કે ગરોળીના સંબંધની માહિતી કોઈએ કહી વિચારી હતી ? સારાંશ કે, આ જગતમાં પહેલેથી નક્કી કરેલ ખેલોની યોજનાઓનાં સુત્ર ગુપ્ત હોવાને લીધે કોઈને પણ સમજતાં નથી. તે બાબતમાં કોઈપણ પહેલેથી તર્ક કરી શકતો નથી. માટે જ એ વસ્તુ અનર્થનો સર્કેત છે એવું સૂચવવામાં આવે છે. પણ જે એ વખતે મોઢેથી ‘કૃષણ કૃષણ કે રામ રામ’ એવું વારંવાર બોલાય તો તે આવનાર અનર્થ ઈજી જતો હોય છે એવું લોકો કહે છે. જે હશે તે ગરોળીના અવાજનો કોઈ પણ અર્થ નીકળતો હોય પણ આ એક આશ્રયકારક ઘટના ના કહેવાય ? પોતાના ભક્તોની તેમનામાં શ્રદ્ધા દઢ કરવા માટે બાબા પાસે આવી ઉત્તમ યુક્તિઓ હતી. (ઓ. ૮૧-૧૦૪)

આ અધ્યાય જે આદરથી વાંચવામાં આવે અને તેનું નિયમિત પારાયણ કરવામાં આવે તો ગુરુ મહારાજ ભક્તોનાં સંકટ દૂર કરશે. આ મનમાં પાડો નિર્ધાર કરશે. એમનાં ચરણોમાં જે કોઈ પણ જાતના સંશય વગર માથું ટેકવી દે છે, એના સાઈ એ જ ‘ત્રાતા’ અને ‘પાતા’ અને અભયદાતા તથા કર્તાહીર્તા હોય છે. અહીંચાં મારા કહેવામાં કંઈક ભૂલ છે એવું માનતા નહીં. સાઈનાથ આવા જ હતા, અને આવા જ છે. મારો પોતાનો અનુભવનો ગુપ્ત સારાંશ હું ભક્તોના કલ્યાણ માટે કહી રહ્યો છું. આ વિશ્વ સંપૂર્ણ હું માત્ર છું. તેમજ મારા સિવાય બીજું કશું જ નથી, કેવળ આ જ લોક નહીં પણ ત્રણે લોક તે હું જ છું, આવું અદ્વિતીયત્વનું સ્કુરણ જ્યાં થાય છે ત્યાં ડર જેવી કોઈ વસ્તુ જ રહેતી નથી. તેને અભિમાન અને અહંકાર સિવાયનું સર્વ ચૈતન્ય ઠસોઠસ બેરેલું છે એવું ચોખ્યું દેખાવા માંડે છે. (ઓ. ૧૦૫-૧૦૮)

ભક્ત હેમાઠપંત સાઈને શરણે આવેલા છે. એક ક્ષણ માટે પણ સાઈચરણ છોડવા તેઓ તૈયાર નથી, કારણ કે સંસાર સાગર પાર કરવા માટે આ એક જ સાધન છે. હવે મારું એક મધુર નિર્ઝપણ સાંભળો. આગલના અધ્યાયમાં ગુરુવર્ય શ્રીસાઈનાથ મહારાજ એક બીજા સુંદર પ્રસંગનું નિર્માણ કરશે. લોકોને બ્રહ્મજ્ઞાન ચપી વગાડતા સાથે જ જેઠતું હોય છે, જ્ઞાણે કે એ રસ્તામાં ન પડયું હોય. કોઈ એક લોભી ગૃહસ્થ સાઈબાબાને બ્રહ્મજ્ઞાન માટે પૂછશે, એ વખતે સાઈમહારાજ તેમના બિસ્સામાંથી એ કાઢી આપશે. આ કથા શ્રોતાઓને સાંભળ્યા બાદ તેમને બાબાની અદ્ભૂત કરણીનાં દર્શન થશે. સર્વસ્વપણે પૂર્ણ લોભ છોડ્યા વગર બ્રહ્મજ્ઞાન કયારેય મળયું શક્ય નથી. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પાત્રતા કોને હોય છે. તેનો વિચાર કોઈ કરતું નથી. સાઈમહારાજ જ કોણે અને કેવી રીતે પ્રાપ્ત થાય એનું સવિસ્તર વિવેચન કરશે. હું શ્રોતાઓની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સામે જોળી ફેલાવીને વિનંતી કરું છું કે, આ સાઈના પ્રેમનો વિતાસ અત્યંત ઉત્સાહથી સાંભળવો. જેથી કરીને તમારું ચિત્ત પ્રસન્ન થાય વિષયગ્રહણ શક્તિનું સમાધાન લાગે અને સંતોનો મહિમા સમજય. માટે શ્રોતાએ અહીં થોડું ધ્યાન વધારે આપજો. (ઓ. ૧૨૦-૧૧૬)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત ને સજ્જનની પ્રેરણા પામેલા ભક્ત હેમાદ્પંત રચિત
શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રનો ‘ચોળકર શર્કરા આખ્યાન’ નામનો આ પંદરમો અધ્યાય સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



અધ્યાય ૧ પનું અર્થ વિવરણ

અગિયારમાં અધ્યાય પ્રમાણે આ અધ્યાયનું પણ આધરપૂર્વક વાંચન અથવા નિમયથી પારાયણ કરવાથી સંકટનું નિવારણ થાય છે. અને તેમાં પણ આ એકદમ નાનો અને સમજવામાં ખૂબ સહેલો હોવાના કારણો આ અધ્યાય ફક્ત ભક્તો દ્વારા જ નહિ પણ બાળકો દ્વારા પણ વાંચવા યોગ્ય છે-

આ અધ્યાય આદરે વાંચે । વા નિયમે આવર્તન તેનું કરે ।

સંકટ ગુરુરાયા તેનાં હારે । અંતરે વાત આ આંકજે ॥૧૦૫॥

માથું અનન્યભાવે ચરણે । જે જે મૂકે વાસ્તવ તેને ।

દે અભય રક્ષે પાણે । કર્તા તે એક છે ॥૧૦૬॥

આ અધ્યાય ઉપરની ફળશ્રુતિનો મને સારો એવો અનુભવ થયો છે.

આ અધ્યાયમાં ચોળકરનું આખ્યાન એટેલે કે ભક્તની જ્યાં અનન્ય ભક્તિ હોય છે ત્યાં પરમેશ્વર અથવા તો સદ્ગુરુનું અંતઃકરણ કરણ કેવી રીતે દ્રવી ઉઠ છે અને તે ભક્તને પોતાના બાળકની માફક છાતીએ ચાંપીને એના લાડ કોડ કેવી રીતે પુરા કરે છે તેનું સાક્ષાત ઉદ્ઘાસણ છે. જેનું વર્ણન કરવા માટે હેમાદ્પંતે બિલાડી અને તેનાં બરચાંઓની કેટલી સુંદર અને અનુરૂપ ઉપમા આપી છે.

આ અધ્યાયના સંદર્ભમાં આગળ દાસગણુના કીર્તન કરતી વખતે ધારણ કરવામાં આવેલ પોષકની મોળલી કથા આપી છે. બાબાએ તેમને ‘વાહ... વાહ.... વરરાજ જેવો સાજ સજ્જ્યો છે’ કહી, ઠંડા મશકરી કરીને અંગરખું, ઉપરણું અને ફેંટો ત્યાં જ કઢાવી નાખેલાં અને અત્યંત શુદ્ધ નારહીય કીર્તન પદ્ધતિનો પાઠ ભણાવ્યો છે. તેથી તે શાણગાર અને સાંપ્રદાયિક પોષાક કરતાં ખરા અંતઃકરણની ભક્તિનું મહત્વ સમજાવ્યું છે.

પછી ચોળકરને ‘પ્રતિજ્ઞા સમયનું તારું ચિત્ત । દીલ થયાનું ગ્રાયશીલ । જો કે તેનો રાખ્યું ગુપ્ત । તે સર્વે હું જાણી ગયો છું ॥૬૬॥’ આમ કહીને બાબાએ તેમને જ નહિ પણ પોતાના સર્વ ભક્તોને આશ્વાસન આપ્યું છે.

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

તમે કોઈ ગમે ત્યાં હો । ભાવ હાથ મુજ સામે ઘરો ।
 તો હું તમારા ભાવ જેવો । બની ઊભો રહું રાત દિન ॥૬૭॥
 મારો દેહ જે કે અહીં છે । સાત સમુક્ર પાર હો તમો ભલે ।
 ત્યાં તમો કાંઈ કરો જે । છે તેની જાણ મને તત્કાળ ॥૬૮॥
 દુનિયામાં ગમે ત્યાં જવ । હું તો છું તમારી સાથ ।
 હદ્યે તમારા મારું ઘર । હું અંતર્યામી તમારો ॥૬૯॥

બાબા આગળ ઉપર ઉપદેશ કરે છે-

હદ્યસ્થ એવો છું હું જે । નમો તમો તેને નિત્યે ।
 ભૂતમાત્રનો અંતર્યામી એ । તેને જ રૂપે હું રહ્યો ॥૭૦॥
 માટે તમને જે કોઈ મળો । ઘરે, બહાર કે રસ્તો ।
 પ્રવર્તું હું તે સ્થાને । હું જ તેનામાં ઊભો ॥૭૧॥
 કીડા કીડી જળચર ખેચર । પ્રાણીમાત્ર થાન દુક્કર ।
 સર્વત્ર ત્યાં હું છું નિરંતર । ભર્યો સાચાર સર્વત્ર ॥૭૨॥
 મારાથી ન રાખો અંતર । તમો હું તો નિરંતર ।
 એવું જાણો જે નર । તેનું મોદું ભાગ્ય છે ॥૭૩॥

આ સિદ્ધાંતના પ્રમાણ ખાતર જાહેર કે આગળની ગરોળીની બે બહેનોની વાત બાબાએ ઘઢી હોય એવું લાગે છે. ગરોળી જેવાં જંતુઓ સાથે પણ એકાત્મ્ય વીના કેમ બાબાને એમનું ‘એક એકની ગોળ ગોળ ફરે’ આનંદ આંખ મીચકારે. આડાં ઊભાં બાજુએ ફરે ॥૮૫॥ સ્વચ્છાદે ચક્કર લગાવે ॥૮૬॥ કારણ સમજયું હશે? તેવી જ રીતે ‘જગતનો આ એલ સૂત્ર, ગુપ્ત અને ન સમજય તેવો’ ચલાવનારો જાતે બાબા પોતે ન હોત તો, ગરોળીનું ચૂકચૂક કરવું, તે અંગેનો કોઈએ પ્રશ્ન પૂછ્યો અને ઔરંગાબાદથી ઘોડા ઉપર સવાર થઈને આવનાર ગૃહસ્થના તોબરાંમાંથી બીજી ગરોળીનું નીકળવું તે ઘટના ઘટવી તે કાંઈ શક્ય છે?

આ અધ્યાયની ‘તેના સંકટો ગુરુરાથા નિવારે’ તેવી ફળશ્રુતિ કહી હોત તો પણ જેમને અહીંથાં કહેવામાં આવેલ તત્ત્વોનો ભાવાર્થ સારી રીતે સમજયો હશે, અને તે ભક્તોએ જે તેને આચરણમાં મૂક્યો હશે તેવાઓને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી.

જગે સંપૂર્ણ હું છું એક । મારા વિષ અન્ય ન કોઈક ।
 નથી એકલો આ જ લોક । અભિલ તૈલોક્ય હું જ હું છું ॥૧૦૮॥
 જયાં અદ્વિતીય એવું સ્કૃતે । ભય વાર્તા ત્યાં કયાંથી ઊરે ।
 નિર અભિમાને નિરહંકરે । ચિન્માત્ર જયાં સર્વ ભર્યું ॥૧૦૯॥

કાંઈ પણ હોય ‘ઉપદેશ અર્થે બાબા તત્પર’ હોવાને લિધે તેઓ ‘આવા અવસરો આજાતાં’ અને ચોળકરનું કે દાસગાણુનું અથવા તો ગરોળીનું નિમિત્ત કરીને દરેકને ઉપદેશ આપતા.

ચાતક તૃષ્ણા છિપાવવા । મૈઘ વર્ષે જળધારા ।
 શાંતિ પામે અભિલ ધરા । તે જ પ્રકાર અહીં બન્યો ॥૭૭॥



॥ અદ્યાય ૧૬ ॥

બ્રહ્મજ્ઞાન કથનમ - ૧

(જગતની ઉત્પત્તિનું કારણ તે મૂળ ઘટક છે એવું અહું અને તેની પ્રાપ્તિનું નિદ્રપણ)

શ્રી ગણોશળુને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રલુને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

(શરૂઆતની ઓ. ૧-૮ વચ્ચે હેમાઠપંતે શ્રી સદગુરુ સાઈમહારાજને ‘શાંતિ’ સિંહાસન પર બેઠેલા ‘સ્વાનંદ સાભ્રાજ્યના સમાટ’ કલ્પીને તેમના આધ્યાત્મિક વૈભવવાળા સુંદર ડ્રપનું વર્ણન કર્યું છે.)

‘શાંતિદ્વારા’ સિંહાસન ઉપર બેઠેલા સ્વ આનંદ દ્વારા સાભ્રાજ્યના માલિક તથા રાજુઓના રાજ, ચક્રવર્તી અને આપણા એક માત્ર આધાર એવા ગુરુ મહારાજને નમસ્કાર કરીએ. એમની બંને બાજુએ ‘અનન્ય ભક્તિ’ અને કોઈપણ જાતના બંધન વગરની ‘મુક્ત સ્થિતિ’ ચમ્ભર ઢોળી રહી છે અને ‘સ્વાનુભૂતિ’ અને ‘સંધ્ય: પ્રતીતિ’ એટલે તરત જ થતો તાત્કાલિક નિશ્ચિત અનુભવ તેમને અત્યંત આદરથી પંખા વડે પવન નાખી રહ્યાં છે. ‘સ્વાત્મસ્થિતિ’ છત્ર હાથમાં લઈ અને ‘શાંતિસંવિતિ’ એટલે શાંતિની સાચી વૃત્તિ હાથમાં છડી ધારણ કરેલી છે. ષડ્રિષ્પુ અને માયા મોહની વૃત્તિ ત્યાં ક્ષાળભર પણ ટકી શકતી નથી. આ સભાના ઠાઠનું કેવી રીતે વર્ણન કરવું ? ચાર વેદો, છ દર્શનો અને અદાર પુરાણો તો સ્તુતિ સ્તોત્રો ગાનારા ભાટચારણ જેવાં છે. શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ ઝળહળી રહ્યો છે અને ‘સ્વાનંદ’ અતિશય ફેલાયેલો છે. વૈરાગ્ય, ભક્તિ, શુદ્ધજ્ઞાન, મનન, અખંડ ચિંતન, આત્માનું સતત ધ્યાન અને પરમેશ્વરનું પ્રત્યક્ષ દર્શન એવા આઠ પ્રધાનો સેવામાં મનુષ થઈને ઊભા છે. ‘શાંતિ’ અને ‘દ્વાન્તિ’ એટલે કે મનોવિકાર ઉપરનો સંયમ અથવા તો તાબે થવું તેવા દ્વિત્ય મહિણી તેમના ગળામાં શોભી રહ્યાં છે. તેમજ વેદાંતદ્વારા સાગરમાંથી અમૃત વહેતું હોય તેવા તેમના મધુર બોલ છે. જેની ધાર તેજથી ઝળકી રહી છે તેવા જ્ઞાનદ્વારા તલવારના વાર કરવા માટે ઉદાહેરા હોય તેવા તેમના હાથ જોઈને સંસારદ્વારા વૃક્ષ થરથર કાંપે છે. હે નિરંજના, અવ્યયા અને ગુણાતિત યોગીરાજ ! તમારો જ્યલ્યકાર થાઓ. દીન દુઃખીઓના ઉદ્ધાર અને ભક્તો ઉપર ઉપકાર કરવા માટે જ તમે આ દેહ ધારણ કર્યો છે. (ઓ. ૧-૮)

દાસગણુ મહારાજે પણ પોતાના ભક્તિસારામૃતના અદ્યાય બાવનમાં સાઈબાબાને આવા જ સાર્વભૌમરાજ’ કહીને સુંદર વર્ણન કરેલું છે-

ધૈર્ય હોય જેનો પિતા । ક્ષમા એ જ જેની માતા ।

શાંતિ જેની વધૂ તત્ત્વતા । દ્વા ભગ્નિની જેવી શોભે છે ॥૮૬॥

સુવિચાર જેનો ભાઈ છે । આસન પથારી હંમેશા ।

સ્વાનંદસાભ્રાજ્ય બોગવતો । કેવો જોઈએ આ બુદ્ધિજ્ઞાણી યોગી ॥૮૭॥

આવો સાર્વભૌમ રાજનો ઉપરી । હા યોગયોગેશ્વર નિર્ધારિતા ।

માટે દંબ રહ્યો છેટે । આ બાદશાહના ભયથી ॥૧૦૧॥

અગાઉના અદ્યાયમાં શ્રી સાઈબાબાએ ભક્ત ચોળકરની દુર્ઘટા પૂર્ણ કરીને એણે રાખેલી બાધા પુરવાર કરી તથા

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેના મનની વાત એને કેવી રીતે સમજલી તેનું વર્ણન થયું છે. સહદ્ગુરુની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થયેલી હોય છે. શિષ્યો તેમની કઈ ઈચ્છા પૂર્ણ કરવાના છે ? શિષ્યની જ સેવા કરવાની ઈચ્છા પૂર્ણ કરી તેને તેઓ નિરીચ્છ ઈચ્છા રહિત બનાવે છે. ભક્તિથી ફૂલ, પાન ગમે તે અર્પણ કરો તેનો તેઓ પ્રેમથી સ્વીકાર કરે છે. જે કોઈ મને પાન ફૂલ ફળ અથવા તો પાણી પણ ભક્તિથી અર્પણ કરે છે, તેવા શુદ્ધચિત્ત મનુષ્યની ભક્તિના ઉપહારનો હું પ્રેમથી સ્વીકાર કરું છું. પરંતુ તે જ મોટા ગર્વથી કે અભિમાનથી ધરાવવામાં આવે કે આપવામાં આવે તો તેનો તરત જ અસ્વીકાર થાય છે. સત્ય, જ્ઞાન અને સુખના તેઓ સાગર હોવાને કારણે, તેમને ઉપર ઉપરનો દેખાવ કરનાર ઉપચારોનું મહત્વ સમજાતું નથી. પરંતુ તે જ જે શ્રદ્ધા અને ભાવનાથી અર્પણ કરવામાં આવે તો તેનો બાબા અત્યંત આનંદથી સ્વીકાર કરે છે. પોતાને કશી જ ખબર નથી એવું બતાવે છે. પરંતુ અજ્ઞાન લઈને જ્ઞાન પ્રદાન કરે છે, અને શાશ્વતસિદ્ધ અને ઢિઢાઓની મર્યાદા ન ઓળંગતા શિષ્યોને ઉચ્ચિત શિક્ષણ આપે છે. તેમની પ્રેમથી સેવા કરતા બ્રહ્મ કે પરમેશ્વરની સાથે એકતા પ્રાપ્ત કરે છે. બીજાં બધાં સાધનો છોડિને ગુરુસેવામાં લીન રહેવું. આ સેવામાં જરા પણ શારીરિક કસર ન છોડતાં એમાં પોતાની ચતુરાઈ કરવાથી તો સાધક સંકટમાં આવી પડે છે. સાઈબાબા એનો અર્થ હોઠ ઉહાપણ એમ કરતા. ગુરુનાં ચરણોમાં વિશ્વાસ જેઠાએ. પોતાનો શિષ્ય શું કરે છે તેનો સહદ્ગુરુ મેળ બેસાડી આપે છે. શિષ્યને આવનારી સંકટની કલ્પના પણ નથી હોતી. ગુરુ જ આપોઆપ એનો ઉપાય કરતા હોય છે. ગુરુ કરતાં મોટો ઉદાર દાતા ત્રિભુવનમાં કોઈ નથી. એવા આશ્રયદાતા સહદ્ગુરુના શરણે જઈએ. સહદ્ગુરુને ચિંતામણીની ઉપમા આપીએ તો ચિંતામણિ ફક્ત ચિંતામુક્તિ આપે છે, પરંતુ ગુરુ ન કલ્પી શકાય તેવી વસ્તુ આપીને ભક્તને આશ્રય પમાડે છે. કલ્પતરું જેઠે એની તુલના કરીએ તો વૃક્ષ ભક્તના મનમાં જે આવે તે પૂરું પાડે છે. પરંતુ ગુરુ નિર્વિકલ્પ સ્થિતિ આપે છે. કામધેનું ઈચ્છિત વસ્તુ આપે છે. પણ ગુરુદ્વારી ધેનુની શ્રેષ્ઠતા તેનાં કરતાં મોટી છે. ગુરુદ્વારી ધેનુ સિવાય ‘અચિત્યદાની’ એટલે કદીપણ ન ઈચ્છેલું આપનારી પદ્ધતી ભલા કોણ મેળવી આપે ? (ઓ. ૮-૨૦)

હવે શ્રોતાઓને એક જ વિનંતી કે, પાછળના અધ્યાયના અંતમાં મેં બ્રહ્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું તે વાત કહી હતી, એ કથા પર ધ્યાન આપીએ. બ્રહ્મજ્ઞાન બોગવનારાની ઈચ્છા વાળા માણસને બાબા કેવી રીતે તૃપ્ત કરતા હતા અને પોતાના ભક્તોને કઈ રીતે ઉપેક્ષા કરતા હતા તે વાત તમે પરમાર્થ સાધવા મટે સાંભળો. સંતો હુંમેશા નિર્જામ હોય છે. તેમની ઈચ્છાઓ સંપૂર્ણપણે પૂર્ણ થયેલી હોય છે. પરંતુ ભક્તોની ઈચ્છાઓની સીમા નથી હોતી. તેમની ઈચ્છાઓ હુંમેશા અપૂર્ણ જ રહેતી હોય છે. કોઈ સંતતી માંગતા હોય છે તો કોઈ રજ્ય સંપત્તિ માંગે છે. કોઈ વળી ભાવભક્તિ માંગે છે. તો વળી એકાદ ભક્ત સંસારમાંથી મુક્તિ માંગતો હોય છે. આવો જ એક ભાવાર્થી પણ પૈસો પેદા કરવામાં એક્ઝો એવા ભક્તે બાબાની મહાન કીર્તિ સાંભળી. તેથી તેને બાબાના દર્શનની ઈચ્છા થઈ. આ વ્યક્તિ ધરખાર વાળો તથા સંતતી અને સંપત્તિવાળો ખૂબ સુખી માણસ હતો. તેને નોકર ચાકરનું સુખ સારું હતું. તેમનાં મનમાં આવ્યું કે ઉદારમૂર્તિ બાબાનાં દર્શન કરવાં. બાબા તો મોટા બ્રહ્મજ્ઞાની છે. સાધુ સંતોના. પગ તેઓ શિરોમણિ છે. તેમના કાર્યો અગ્નાધ છે. તેમનાં ચરણમાં અવશ્ય શીશા નમાવવું જેઠાએ. એ સિવાય બીજી કોઈ વાતની ઉણપ નથી. માટે બ્રહ્મજ્ઞાન માંગી લઈએ. તે જે સહેજમાં મળી જય તો હું ધન્ય થઈ જઈશ. આ વાત પર એના ભિત્રો બોલ્યા, ‘બ્રહ્મ જણવું સહેલું નથી. તારા જેવા લોભીને માટે તે મેળવવું અધરું છે. ધન, સ્વા અને છૈયાં..... છોકરાં છોડિને જેને બીજી બાજુનું સુખનું સાધન ખબર નથી, જેને બ્રહ્મ કેવળ એક સ્વભન્જ જ છે તેને શાંતિ કેવી રીતે મળશે ? ઈન્દ્રિયો દુર્બળ અને ક્ષીણ થઈ જય અને જગમાં જયારે કોઈ માન આપે એવું ન રહે, ત્યારે અમુક લોકો વગર કારણના અને કામદંધા વીનાના બેઠા બેઠા બ્રહ્મજ્ઞાન મેળવવાનાં હવાતીયા મારતા હોય છે. તેવી આ તારી બ્રહ્મ જણવાની ઈચ્છા છે. તારા આ લોભી હાથમાંથી પૈસા છૂટ્યા સિવાય તારી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આ ઈચ્છા પુરી કરનારો કોઈ મળવાનો નથી.' (ઓ. ૨૧-૨૨)

આવી શ્રદ્ધા સાથે તે બ્રહ્માર્થી પાછો ઘોડાજાડી કરી શિરડી જવા માટે ભાડાના પૈસા ખર્ચાને નીકખ્યો. ત્યાં પહોંચીને તેણે સાઈનાં દર્શન કર્યા અને પગમાં પડ્યો. તે વખતે સાઈ મહારાજ જે મીઠા શબ્દો બોલ્યા તે હવે શ્રોતાઓએ સાંભળવા. આ સાઈ કથાર્પી કલ્પવૃક્ષ દ્યાનદ્ર્પી પાણી પીવડાવવાથી પાંકું રોપાશે અને શ્રોતાઓનો આદર જેમ જેમ વધશે તેમ તેમ તેની ઉપર ફૂલો અને ફળોની બહાર આવશે. તે સર્વાંગી રસભાવથી ભરાઈ જશે. સુગંધિત ફૂલોથી તે મધમધશે અને મીઠાં મીઠાં ફળોના ભારથી લચી પડશે. તેથી ભોક્તાની ઈચ્છા પૂર્ણ થશે. બ્રહ્માર્થી બોલ્યો, 'બાબા મને બ્રહ્મ બતાવો. આ જ વિચારમાં જીવ પરોવીને હું અહીંયાં આવ્યો છું. લોકો કહે છે કે શિરડીલાણા બાબા બ્રહ્મ તો, આમ એક જાટકામાં જ બતાવી હેલે છે, માટે આટલે દૂર સુધી આવ્યો છું. હું લાંબા માર્ગના પ્રવાસમાં ખૂબ જ થાકી ગયો છું. છતાંપણ જે બ્રહ્મજ્ઞાન મળી જય તો ફૂતાર્થ થયો એમ સમજુશ.' બાબા બોલ્યા ચિંતા કરતો નહીં. બ્રહ્મ હવે તને રોકડું દેખાડું છું. અહીંયાં ઉધારીની વાત જ નહીં. તારા જેવા પ્રક્રિયાવાળા મળવા ખૂબ અધરા છે. મોટા ભાગના લોકો ઘનસંપત્તિ માંગતા હોય છે. તથા રોગ અને સંકટોનું નિવારણ કરવાનું કહેતા હોય છે. અથવા તો સહાને માટે લૌકિક માન, રાજ્યપદ કે સરકારી નોકરી અને સુખ માંગતા હોય છે. કેવળ આ જગતમાંના સુખો માટે લોકો શિરડી દોડીને આવતા હોય છે. અને મારા જેવા ફૂકાળે રવાડે ચઢતા હોય છે. બ્રહ્મ તો કોઈ માંગતું જ નથી. આ પ્રકારના લોકો અહીં વિપુલ છે અને તારા જેવાઓનો ફૂકાળ છે. હું તો બ્રહ્મ જીજાસુઅઓનો જ ભૂખ્યો છું. આ એક સારી વાત છે. જે બ્રહ્મના હુકમથી સૂર્ય, ચંદ્ર નિયમિત ફરે છે, ઊગે છે અને આથમે છે, પ્રકાશ અને અંધકાર મર્યાદિત રહે છે. ઉનાણો, વસંત વગેરે ઋતુઓ આવે છે તથા ઈન્દ્રદેવ અને આઠ દિશાઓમાં લોકોનાં હિત, રક્ષણ કરવા માટે પરમેશ્વરે નીમેલા અધિકારી ઈન્દ્ર, અનિન્ય, યમ, નૈત્રત્ય, વરુણ, કુબેર, વાયુ અને ઈશ જેવા લોકપાલ નિયમથી પ્રણાનું પાલન કરે છે. આ જે બધું થાય છે તેનું મૂળ કારણ એટલે જ બ્રહ્મ. માટે આ શરીર પડતાં પહેલાં વિચારશીલ માણસો બ્રહ્મ પ્રાપ્તિનો પુરુષાર્થ સાધી લેતા હોય છે. નહિ તો પૂનર્જન્મના ફેરા સતત ફરવાના હોય છે. બ્રહ્મ જાણ્યા સિવાય જે શરીર પડી જય તો સંસારનાં બંધનો પીછો છોડતાં નથી. અને પૂનર્જન્મ નક્કી જ થાય છે. કઠોપનિષદ અ.૨, વલ્તી ઉ, મંત્ર ૩-૪માં આ અંશો જાણાયું છે કે ભયાદસ્યાભિસ્તપતિ ભયાત્ત તપતિ સૂર્યઃ । ભયાદિન્દ્રથ વાયુથ મૃત્યુર્ધર્વાતિ પચ્યમઃ ॥ જેની બીકથી અગ્નિ તપે છે, સૂર્ય પ્રકારો છે, જેના ભયથી ઈન્દ્ર વાયુ અને પાંચમુ મૃત્યુ પોતપોતાના કામ માટે તત્પર રહે છે, ઈંદ્ર ચેકશકદ બોલ્દું પ્રાક શરીરસ્મ વિસ્સસ: । તત: સર્વોષુ લોકોષુ શરીરત્વાય કલ્પતે ॥ શરીરનું પતન થતાં પહેલાં જ આ દેહમાં રહી એ પરબ્રહ્મને જે જાણે નહીં તો અનેક યુગો સુધી અને અનેક લોકમાં અને યોનીમાં શરીર ધારણ કરવું પડતું હોય છે. તમને બ્રહ્મ જ નહીં, પણ આપું બ્રહ્માં બતાવું છું જે તને નખથી માંડીને વાળની ચોટલી સુધી વિંટાળાઈને વ્યાપેલું છે. તેને હું તમને ઉક્લીને ધૂદું કરી આપું છું.' કેટલી સુંદર અમૃત જેવી એ મધુર વાણી ! જાણો કે કોઈ અનુપમ સર્વશ્રેષ્ઠ સુખોની ખાણ. જે મનુષ્ય સંશયર્પી ઝૂલા ઉપર બેઠેલા છે તેવાઓનો પણ ઉદ્વાર કરવા માટે શ્રી સાઈ જ સમર્થ છે. ક્ષણીક આનંદ આપનાર સુખના મોહમાં જે દિવસ અને રાત ખોવાયેલો રહે છે, તેને પણ આ બાબાની વચનદ્ર્પી જ્યોતિને શાસ્ત્રોએ યોગ્ય કહ્યાં છે, તે આચરણ તરફ દોરી જય છે. ચિંતામણિ જે પ્રસન્ન થશે તો લૌકિક સુખ હાથ લાગશે, અને 'મહેન્દ્ર' પ્રસન્ન થયો તો સ્વર્ગની સંપત્તિ પામશે પરંતુ ગુરુની વિશિષ્ટતા એના કરતાં વધારે હોય છે. ગુરુ જેવો મોટો દાતા અન્ય કોઈ નથી. એ જે પ્રસન્ન થઈ ગયો તો પ્રાપ્ત થવામાં અધરામાં અધરું એવું બ્રહ્મ પણ ભક્તને બતાવી હેલે છે. આ કથાના શ્રવણથી સંસારનાં દુઃખો ભુલાઈ જય છે. બ્રહ્માર્થીઓને કેવી રીતે શરીરખંડું એ બાબા બરાબર જ જાણતા હતા. (ઓ. ૩૩-૪૨)

બાબાએ પછી પેલા બ્રહ્માર્થીને બેસાડીને ક્ષણભર માટે પોતે બીજી કોઈ વ્યવસાયમાં રોકાઈ ગયા અને જાણો કે તેણે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કરેલો પ્રશ્ન જ તેઓ ભૂલી ગયા છે એવો દેખાવ કર્યો. પછી બાબાએ શું કર્યું ? એક નાના છોકરાને પાસે બોલાવી ને બાબાએ કહ્યું, ‘જલ્દી જ અને નંદુ મારવાડીને સંદેશો આપ કે બાબાને બહુ જ જરૂર છે. થોડી વારમાં ફટક્ફટ ઉછીના પાંચ રૂપિયા મોકલો.’ છોકરો નંદુના ઘરે ગયો અને જુથે તો તાળું. જેવો ગયો હતો તેવો જ પાછો આવ્યો. અને બાબાને બાતમી આપી. બાબા બોલ્યા, ‘પાછો જ, બાળા વાણિયો ઘરે હશે, અને એજ સંદેશો આપ અને રૂપિયા લઈ આવ.’ પેલા છોકરાનો આ ફેરો પણ અસરુણ રહ્યો. કેમ કે બાળા પણ ઘરે ન હતો. છોકરાએ આવીને બનેલી હુકીકત બાબાને કહી. બાબાએ એને ત્યારબાદ બીજુ એક બે જગ્યાએ દોડાવ્યો. દોડાવ્યો તો ખરો પણ ઓટી દોડાઓડી થઈ, ઘક્કા ખાઈને તે થાકી ગયો, પણ કૂટી કોડી પણ મળી નહિ. નંદુ મારવાડી અને બાળા વાણિયો બંને ઘરે ન હતા તે વાત તો બાબા સંપૂર્ણપણે જાણતા હતા. સાઈમહારાજ તો અંતર્ક્ષાની અને બોલતા ચાલતા બ્રહ્મ જ હતા. તેમને કયાં પાંચ રૂપિયાથી અટકી પડ્યું હતું ? પરંતુ પેલા બ્રહ્માથીને આની બહુ જ નવાઈ લાગી. ઘરે મહેમાન હોય અને મહેમાનગીરી માટે જે મિષ્ટાન્ન કે શીરો વગેરે બનાવવામાં આવે છે, તે ઘરના બધાને ખાવા મળતો હોય છે. તેવી જ રીતે આ બ્રહ્મ ભૂઘ્યાને નિમિત્ત બનાવીને તેને આગળ ધરીને મહારાજે બધાના કલ્યાણ માટે ભક્તોને ઉપદેશ કર્યો. આ બ્રહ્માથીના ગજવામાં તે વખતે રૂપિયા બસો ને પચાસનું પડીકું રાખેલું હતું. જેની સાઈનાથ મહારાજને બબર હતી. બ્રહ્માથીને શું એ સમજાતું ન હતું. શું એને આંખો ન હતી કે ? ગજવામાં નોટોનું બંદલ હોવા છતાં પૈસા પાછા મળશે કે નહીં ? રૂપિયા આપવા કે ન આપવા ? આવા ગોટાળામાં પડીને તે અદ્યાણામાં ફસાયો. સાઈબાબાને વળી પાંચ રૂપિયા ઉધાર આપવા અને તે પણ થોડા સમયની ધીરજ ધર્યા વીના રૂપિયા ધૂટતા નથી અને બ્રહ્મ સાક્ષાત્કાર નીકળ્યો છે ! સાઈમહારાજ સત્ય વચની છે અને ઉછીની માગેલ રકમ પણ નાની અમસ્તી જ છે. તે આપવી જોઈએ તેવો એના મનમાં વિચાર આવતાં તેનો સંશાયાત્મક જીવ ગભરાયો. પાંચ રૂપિયાની શી વાત ? પણ એ આપવાનો પણ એનો જીવ ચાલતો નથી. એ તો મૂર્તિમંત લોભી જ કહેવાય ને ? બીજે કોઈ લોલોભલો કે જેને બાબા પ્રત્યે ખરી લાગણી છે તેણે બાબાએ ઉછીના રૂપિયા માણ્યા તે પ્રસંગ આમ આંખો ફાડીને જેયા ન કરતા. બ્રહ્મની જેને આટલી બધી ભૂખ હોય તેને આ પ્રશ્ન સમજાયો નહિ એવું મને નથી લાગતું. પરંતુ એ તો ઘનના મોહમાં લપટાયેલો હતો. સ્વસ્થ બેસવું તેના માટે શક્ય ન હતું. પાછા વળવાની પણ એને ઉતાવળ હતી. તે બાબાને કહેવા લાગ્યો કે બ્રહ્મનું ઢેકાણું પાડો ને ? (ઓ. પૃ. ૫૩-૭૧)

બાબા ફરી બોલ્યા, ‘બેઠા બેઠા બ્રહ્મ દેખાઉવા માટે જે અત્યાર સુધી પ્રચાસો કર્યો એ તમને સમજાયું કે નહિ ? બ્રહ્મ માટે પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મન્દ્રિયો, અહંકાર, બુદ્ધિ અને મન બધાનું સમર્પણ કરવું પડે છે. કઠોપનિષદ્ધ અધ્યાય ૨ વલ્લી ૩.માં જણાવ્યું છે તે યદી પદ્ધતિનિષ્ઠને, જ્ઞાનાનિ મનસા સહ બુદ્ધિક્ષ ન વિચેષિતિ, તામાદુઃ પરમાં ગતિમ् ॥૧૦॥’ યોગ અભ્યાસ કરતી વખતે મન સહિત પાંચે ઠન્દ્રિયો સારી રીતે સ્થિર થાય છે. અને બુદ્ધિ પણ કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરતી નથી. એજ સ્થિતિને યોગીજનો પરમગતિ કહે છે, જે યોગીઓની સર્વ શ્રેષ્ઠ સ્થિતિ છે. બ્રહ્મજ્ઞાનનો માર્ગ અધરો છે. તે બધા માટે સહેલો નથી. એનો ઉદ્દ્ય થતાં ભાગ્યશાળીઓને બ્રહ્મજ્ઞાન એકાએક પ્રગટ થઈને પ્રાપ્ત થતું હોય છે. બ્રહ્મહેઠના અધિકાર લગીના અને ઉત્કર્ષના વિષયમાં પણ જે વિરક્ત હોય છે, અને જેની બીજી કોઈ જગાએ આશક્તિ નથી હોતી તે જ ખરો બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવાવાળો અધિકારી છે. તે અંગે કઠોપનિષદ્ધમાં નચિકેતા નામનો બાળક યમ પાસે જઈને જન્મ અને મૃત્યુના વિજયનું રહસ્ય પૂછે છે. ત્યારે યમરાજ તેને હાથી, ધોડા, રથ, સુવાર્ણ, નાયવા ગાવાવાળી અપ્સરાઓ અને અનંત કાળ સુધી ચાલે તેટલું સામ્રાજ્ય આપવાની લાલચ બતાવીને તેને આ પ્રશ્ન પૂછવાના વિચારથી પરીવર્તિત કરવા માટેના પ્રયત્ન કરે છે. તેને પેલા નાના બાળકને શું ઉત્તર આપવો ? થોભાવા મર્યાસ્ય ચંદ્રન્કેતત, સર્વેન્દ્રિયાણાં જર્યાન્તિ તેજઃ । અપિ સર્વ જીવિતમહયેવ, તવૈવ વાલ્યસ્તત્વ નૃત્યાજીતે ॥ કઠો ૧-૧-૨૬॥ ‘હે યમરાજ ! તમે વર્ણન કર્યા અનુસાર બધા બોગ ક્ષણબંગુર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હોય છે. અને માણસોની ઈન્ડિગ્યોની શક્તિ નષ્ટ કરતા હોય છે. તેમજ માણસનું આખું આયુષ્ય પછી કેટલુંય મોટું હોય તો પણ થોડું અમસ્તુ જ રહે છે. તો પછી તમારા આ રથ, હાથી, ઘોડા, સુવાર્ણ અને અપ્સરાઓને તમારી પાસે જ રહેવા હો.' બીજું ઉદાહરણ બૃહદ્દારણ્યક ઉપનિષદમાં છે. યાજાવલ્કય ઋષિને બે સ્વીઓ હતી. એક કાત્યાયની અને બીજી મૈત્રેયી. કાત્યાયની સંસારી સ્વી હતી. જ્યારે મૈત્રેયી વિદ્ધાન હતી. જ્યારે યાજાવલ્કય ઋષિએ સંન્યાસ ધારણ કરવાનું નક્કી કર્યું ત્યારે પોતાની બંને સ્વીઓને બોલાવીને કહ્યું કે, મારી આ સંપત્તિ તમારા બંનેમાં વહેંચી દઉં છું. આ સાંભળી કાત્યાયની કંઈ જ પણ બોલી નહીં. પરંતુ મૈત્રેયીએ પૂછ્યું થન્તુ મ ઠિં અંગો: સર્વા પૂછિવી વિતેન પૂર્ણાસ્થાકથં તેનામૃતા સ્યામ. એનાંહ નામૃતા સ્યામ કિમણ તેન કુર્ચા. યદેવ ભગવાન્યેદ તદેવ મેં વ્યૂહિ ॥ બૃહદ્દારણ્યક ઉપ. અ. બા. ૪ મંત્ર ૨-૩ ॥ 'ભગવાન ! ધારે કે આ સર્વ સંપત્તિ સહ પૂછ્યી પણ મારી થઈ જય તેમ છિતાં હું કંઈ અમર થઈ જવાની છું, કે મોક્ષ પામવાની છું ? જેને લઈને હું અમર થઈ શકતી નથી તે લઈને હું શું કરું ? એના કરતા તો આપ જે કંઈ મોક્ષની સાધના વિષે જાણતો હો તે મને કહો.' અર્થાત્ આ બંને ઉત્તમ અધિકારીઓને એટલે કે નચિકેતા અને મૈત્રેયી તેમને અનુક્રમે યમ અને યાજાવલ્કય ઋષિએ પ્રસંગ થઈને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેથી જેમને સહેજ પણ વૈરાગ્યની ભાવના નથી. તેમને કોઈ ગમે તેટલો બ્રહ્મતત્ત્વનો ઉપદેશ કરે, તેમ છિતાં એને કયું ફળ મળશે ? ઉત્તમ પાત્રતા ધરાવનારાઓને બ્રહ્મજ્ઞાન વિના અડયણે, સહેતાઈથી પ્રાપ્ત થતું હોય છે. જ્યારે માધ્યમ પાત્રતા ધરાવનાઓને હંમેશાન નક્કી કરેલ પદ્ધતિ પ્રમાણે ધરી ધરી પરંપરાએ સૂચવેલા માર્ગે જવું પડે છે. એક આકાશ માર્ગે જય છે, જ્યારે બીજે શાસ્ત્રની સંમતિથી કંઈ કંઈ પગથિયાં ચઢીને જય છે. પણ પાત્રતા વગરના લોકો માત્ર બહસની જાગ્રકારી માટે વ્યર્થ પરિશ્રમ કરતા હોય છે. આત્મ સંયમ વીના બ્રહ્મ પ્રાપ્તિ માટેનું કોઈ સાધન નથી. જે કે આ વેદાંતનું વચન સાચું હોવા છિતાં આત્મવિવેક પ્રાપ્ત કરવો એ કંઈ બધાના વશની વાત નથી. પુર્ણ અભ્યાસ અને શ્રમ કરીને હાહકાં ઘસી નાંખવા પડે છે. એને માટે શરીરને ટેવાંથી પડતું હોય છે. ત્યારે ગુરુકૃપા પ્રગટ થઈને બ્રહ્મજ્ઞાન ધીમે ધીમે હાથ લાગું હોય છે. (ઓ. ૭૨-૮૦)

'હું જ ઈશ્વર છું, મારી જ સત્તા બધે ચાલે છે,' એવો જ્યારે બ્રહ્મદેવને અહંકાર થાય છે, અને પોતાનું મૂળ સ્વરૂપ ભૂતાંતું જય છે, ત્યારે જ વિશ્વની ઉત્પત્તિ થતી હોય છે. 'હું જ બ્રહ્મ છું,' એવું જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે એવું સમજનારો જ્ઞાની સ્વરૂપમાં લીન થઈ જતો હોય છે, અને ત્યારે જ એની વિશ્વની વાસ્તવિકતા ઉપરથી અથવા અસલ વસ્તુ ઉપરની કલ્પના નહીં જેવી થઈ જય છે. એવું શ્રુતિ ગર્ભના કરીને કહે છે. આત્મ જગૃતિ થાય અને સર્વવ્યાપી બ્રહ્મ સાથે એકરૂપ થવાની મનોવૃત્તિ થાય કે બ્રહ્મદ્વારી અભિમાં વિશ્વની આહુતી આપાય છે અને સૂચિ બસ્મીભૂત થઈ જય છે. જીવની પણ આ જ દરશા થાય છે. જ્યારે ખોટી સમજની નિવૃત્તિ થાય છે. તે વખતે દોરંગું, સૂર્ય કિરણ અને છીપલું એનો ખોટો બ્રહ્મ દૂર થઈ જય છે. છીપલાનું ખરું જ્ઞાન ન હોવાને કારણે કોઈક વખતે તે ચાંદી રૂપે ભાસવા માંડે છે. પરંતુ એ જ રૂપનું ખરું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે એ છીપલું જ છે એ સમજન્ય છે. ખોટી કલ્પનાઓનું અને બ્રમજાઓનું નિવારણ થાય છે અને ખરું રૂપ દશ્યમાન થાય છે. તેથી છીપલાનું સ્પષ્ટ અને નિશ્ચિત જ્ઞાન થવા લાગે છે. એક બીજના અજ્ઞાનનું (મોહનું) આ લક્ષ્ણ છે. જ્ઞાનદ્વારી દીવાને ઘસીને સ્વર્ણ કરીને અજ્ઞાનદ્વારી મેશા ધોઈ કાઢતાં, ખોટી કલ્પનાઓ અને બ્રમજાઓનો નાશ થતો હોય છે. (ઓ. ૮૧-૮૬)

જન્મ મૃત્યુનું જે બંધન જ ન હોય તો મોક્ષ માટે આત્મ સંયમની શરીર જરૂર ? વેદાંત જેઠે અમારો શો સંબંધ ? શા માટે એનો અભ્યાસ પણ કરવો ? અને પછી બ્રહ્મજ્ઞાનનું વિવેચન શા માટે ? હું સંસારમાં બંધાયેલો છું અને મારે એમાંથી સંપૂર્ણપણે ધૂટવું છે એવા દઢ નિશ્ચય વાળો છે ફક્ત તેજ બ્રહ્મનો અધિકારી છે. અત્યંત અજ્ઞાની અથવા તો પૂર્ણ જ્ઞાની આ બંને અધિકારને પાત્ર નથી. કોઈ બાધ કે રોકટોક જ નથી, તો મુક્તિ કેવી ? આ વાત સાચી છે. માટે જ કહેવાય છે કે આ જીવ બ્રહ્મ છે 'જીવો બ્રહ્મૈય ન પર : ' સ્વભાવથી તો એ નિત્ય શુદ્ધ બુદ્ધ અને મુક્ત જ હોય છે. 'બાધ નથી ત્યાં કેવી

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

મુક્તિ । એ તો છે. વસ્તુસ્થિતિ ॥’ બંધન અથવા તો મુક્તિ તેંબને ગુણોની સોભતમાં રહેવા પર અવતંભિત હોય છે. આનો અનુભવ બધાને છે. બ્રહ્મ જ્યારે માયાની સાથે અથવા તો નિગુણાત્મક પ્રકૃતિથી સંબંધ જોડે છે, ત્યારે તે પોતાને બંધાયેતો જ સમજે છે. માટે ગીતા અ. ઇમાં કહ્યું છે કે, દૈવી-ઇધેષા ગુણમયી ભમ માયા હુરત્યા ગુણ સંયોગ એટલે બંધન, અને ગુણ વિયોગ એટલે મોક્ષ. જ્યાં જુદાપણાનું અસ્તિત્વ જ નથી, ત્યાં કોણ કોને બાંધશે અને છોડશે ? ભયં દ્વિનીયાભિનિદેશશાસ્ત્ર: સ્થાત્ જુદાપણાનું અસ્તિત્વ દેખાડવું એ જ ભયનું કારણ હોય છે. જીવાત્માનો પરમાત્માથી દૈત ભાવ મટી જતાં અદ્વૈતના માર્ગ તરફ નીકળી જતાં કોઈ બંધન નથી કે કોઈ મુક્તિ નથી. દિવસ અને રાત તે કંઈ સૂર્ય ઉત્પન્ન કરે છે ? આ તો દાટિ દોષનો વહેવાર છે. સૂર્ય આ ભાંજગડમાં પડતો નથી, અલિપ્ત રહે છે. હું એક કર્તા, અને હું એક ભોક્તા છું એવું ચિત્તમાં રહેવું અભિમાન સેવીને સ્વર્ગ અને નર્કનાં સુખ દુઃખોનો અનુભવ લેવાની વાસના અને આસક્તિનો વધારો થાય છે. (ઓ. ૮૭-૮૨)

આત્મા આ સદ્દા રહેનારો, પ્રાચીન અને કયારે પણ નાશ ન પામનારો શાશ્વત છે. જન્મ અને મૃત્યુ વિકાર એને બાધારૂપ નથી. કઠોપનિષદ ૨-૨-૧૮ અને ગીતા એ. ૨-૨૦ શ્લોક અને નિત્યઃ શાશ્વતોર્યં પુરાણો ન હન્યતે હન્માને શરીરિ ॥ આ વાત દોહરાવી છે. ઊંકાર એ એનું સાકારસ્વરૂપ છે. તેને આરંભ કે અંત જ નથી. તે સ્વતંત્ર છે. મનુષ્યનો શરીર એ જ આત્મા છે, એવી જેની દાષ્ટિ છે અને ને પોતાને જુદો અને સૂચિને જુદી સમજે છે, તેને અથાગ પરિશ્રમ કરીને પણ આત્માનું અનુભવજન્ય જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વાણી સહિત સર્વ ઈન્દ્રિયોનો લય કરો અને મનમાં નિશ્ચય પાક્ષો કરો. પછી તે મનનો પણ લય કરો અને બુદ્ધિને માનો. પ્રકાશ સ્વરૂપ જે જ્ઞાન આપનારી બુદ્ધિ છે, ત્યાં મનને એકાગ્ર કરો. મનની સાથે બધી ઈન્દ્રિયોનો સમૂહ એક બુદ્ધિને જ સ્વાધીન હોય છે. માટીના ઘડાનું જેમ મૂળ કારણ મારી છે તેવી રીતે ઈન્દ્રિયોને બુદ્ધિ હોય છે. તે એવી જ રીતે એને સદ્દા ફેલાઈને વળણી રહે છે. મન અને સર્વ ઈન્દ્રિયોમાં વ્યાપી રહેતી બુદ્ધિને મહાત્ત્વમાં બેળવી દેવી અને મહાત્વને આત્મામાં સમર્પિત કરવું આમ કરવાથી આત્માનું ખરું સ્વરૂપ ચોક્કસપણે સમજય છે. કઠોપનિષદ અ. ૧ વલ્લી ઉ મંત્ર ૧૩માં યચ્છેત્ વાઽમનસી પ્રાજ્ઞઃ, તત્ યચ્છેત્ જ્ઞાન આત્મનિ । જ્ઞાનમાત્મનિ મહુતિ નિયચ્છેત્, તત્ યચ્છેત્ શાન્ત આત્મનિ ॥૧૩॥ એમ જણાવ્યું છે. બુદ્ધિમાન મનુષ્યે પ્રથમ વાણી અને ઈન્દ્રિયોને પોતાના વિષયથી દૂર કરીને મનમાં વિતીન કરવી. પછી મનને બુદ્ધિમાં વિતીન કરવું. અહીંથા સુધીનો દ્રદ અભ્યાસ થતાં આ જ્ઞાન સ્વરૂપ બુદ્ધિને ‘મહુતિ આત્મનિ’ એટલે જીવાત્માના શુદ્ધ સ્વરૂપમાં વિતીન કરવી. આ પ્રકારે પોતાનાથી જુદી કોઈ પણ વસ્તુની સત્તાનું ભાન રહે નહીં, એટલે પોતાની જાતને શાંત આત્મારૂપ પરથ્રબ્રહ્મ પુરુષોત્તમમાં વિતીન કરી નાંખો, એટલે પછી રૂપું મૃગજળ અને સાપનો આકાર એ કેવળ દાષ્ટિનો દોષ બની જય છે. જે સંપૂર્ણ નથી. અને તેનામાં વિશેષતા નથી તથા જેને જન્મ અને મૃત્યુનું બંધન નથી, એવા આત્માના દર્શન સિવાય આપણું કટ્યાશ થતું નથી એવું સાધુ મહાત્માઓ વારંવાર કહેતા આવ્યા છે. સર્વ કાર્ય માત્રને કારણે હોય છે, નિમિત્ત હોય છે. પરંતુ આ આત્મા જાતે જ ઉત્પન્ન થયેલો હોવાને લીધે એને કારણ નથી હોતું. આત્મા ઝૂબ પ્રાચીન છે. તે પહેલેથી હોવાં છતાં ત્રિકાળ, અભાવિત, તાજે અને નિત્ય નૂતન છે. સ્વાભાવથી તે બુદ્ધિથી પર છે. તે અવકાશની માફક તોડી શકાય નહીં તેવો હોવાને કારણે જન્મ અને મૃત્યુથી પર છે. તે જાતે એકલો અને અવયવો વગરનો છે. તેનો ‘ઉં પ્રાણવ’ એ જ આધાર છે. (ઓ. ૮૩-૧૦૨)

નિર્ગુણ નિરકાર બ્રહ્મને ઓળખતા આવડે એટલે સગુણ સાકાર બ્રહ્મ પ્રાપ્ત કરી શકાય છે. તેનું પ્રતિક ઉં છે. જેનું સદાયે ધ્યાન અને ઉપાસના કરી શકાય છે. સર્વ વેદોનો જે સાર જ પ્રાણવ સ્વરૂપ ઊંકાર છે અને તેના અર્થ સાથેની જે સ્પષ્ટ જણકારી છે તે જ મહાવાક્યો વેદોમાં જીવ અને બ્રહ્મ એ બનેનું ઝૈક્ય બતાવનારા ‘તત્ત્વમસ્ય’ આદિ વાક્યો, એને ચાર વેદોનો પ્રારંભ છે. તે મહાવાક્યો આ છે. પ્રશ્નાનું બ્રહ્મ, અહં પ્રત્યાત્મિ, તત્ ત્વમસ્ય અને અયમાત્મા બ્રહ્મ જેનું

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

અભ્યાસપૂર્વક ચિંતન કરો. વેદ તેની સચ્ચાઈની ખાત્રી આપે છે. લોકો ખૂબ પ્રયત્નોથી અને બ્રહ્મચર્ય પાળીને મેળવે છે, તેને જી ‘ઉં’ પદ કહેવાય છે. કઠોપનિષદ્ધ અ. ૨૧ વલ્તી ૨ મંત્ર ૧૫માં તે આ રીતે સમજાવ્યું છે. સર્વ વેદા થત્ત પદમામનન્તિ, તર્પાડસિ સર્વાણિ ચ વદ વદન્તિ । યદિચ્છન્તો બ્રહ્મચર્ય ચરન્તિ, તત્તે પદં સંગ્રહેણા ઘ્રવીઘ્રોમિત્યેતત્ ॥ સર્વ વેદ જુદી જુદી રીતે જેનું પ્રતિપાદન કરે છે, સર્વ તપ વગેરે સાધનાઓનું જે એક પરમ એટલે કે અંતિમ લક્ષ્ય છે, અને જેને પ્રાપ્ત કરવાની હિચાથી સાધકો નિષાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરતા હોય છે. તેવા એ પુરુષોત્તમ ભગવાનના પરમ તત્ત્વ વિષે હું તમને સંક્ષિપ્તમાં કહું છું. ઉં આ એક અક્ષર છે. એ પદ માટેની મુસાફરી ભલે થોડી વિકટ હોય છીતાં તે મહેનતથી અભ્યાસ કરનારાઓ ઉપર ઉત્તમ ગુરુકૃપા થતાં તે મેળવી લેવાનું ખૂબ સહેલું થઈ જય છે. અત્યંત સ્થૂળ એવી દિન્દ્રિયોથી અનુકૂળ ધારીને સૂક્ષ્મ સારામાઠાના વિવેક સુધી પહોંચ્યા બાદ પ્રયત્નશીલ સાધકોને તેની પ્રાપ્તિ થાય છે. તે જી આ ઉં શાખથી બોલાતો અક્ષર સર્વ તપોમાં શ્રેષ્ઠ છે. બધા તપોનો સાર છે. જેનો માત્ર ઉચ્ચાર કરવાથી તેના ગર્ભિત અર્થનો સાર મનમાં સ્કૂરે છે, અને તેનું વારંવાર પુનરાવર્તન કરવાથી તો તેનો પ્રત્યક્ષ અનુભવ સાક્ષાત્કાર થતો હોય છે. (ઓ. ૧૦૩-૧૦૮)

સર્વ વ્યાપી તથા વૃદ્ધિ અને ક્ષયના વિકાર વીનાના આત્માને જે જાણે તે સહદ્દગુરુનો ભક્ત ધન્ય થશે. આધ્યાત્મિક જેવાં કે તાવ આવવો, હાડકુ ભાંગવુ, કોધ, ચિંતા જેવા માનસિક દુઃખો વગેરે આવિભૂત જેમ કે ચોર, સાપ, ચુદ્ધથી ઉત્પન્ન થનારા દુઃખો અને આધિદૈવ જેવાં કે અતિવૃદ્ધિ, દુકાળ જેવાં દૈવક દુઃખો. આ ત્રણ પ્રકારનાં દુઃખોથી ત્રણી ગયેતા લોકો આ ભાગ્ય કેવી રીતે લોગવી શકશે? આ વૈભવ તો ફક્ત સંતોનો જ હોય છે. અજ્ઞાનતામાંથી બ્રહ્મ અને આત્મા જુદા છે, એવી ભૂલભરેલી સમજને કારણે સંસારની અથવા તો જીન્મ-મરણ વગેરેની પરંપરા ઉત્પન્ન થાય છે. તેનાથી છુટકારો મેળવવાનું સાધન એટલે બ્રહ્મ અને આત્મા એ એક જ છે એવી મનની ભાવના જેની પ્રાપ્તિ સંતો પાસે થાય છે. જ્યારે વિષય સુખોના વિચાર સિવાયાચની મનની સ્થિતિ થાય છે. ત્યારે ‘અહં બ્રહ્માસ્મિ ઈતિ’ હું બ્રહ્મ છું એવું વેદના મહાવાક્યનું વારંવાર ઉચ્ચાર કરવાની આદત પડશે. જ્યારે ગુરુનાં વચ્ચનોની અને શાસ્ત્રોનાં કથનોના ખરાપણાની ખાત્રી થઈને મનથી અને શરીરથી કર્મ કરવાની પ્રવૃત્તિ શાંત થઈ જય છે, ત્યારે જ આત્માની પરિપૂર્ણ ઓળખ થાય છે. ત્યારે જ સંપૂર્ણ અને સ્પષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, વિષય સુખોનાં સાધનો, સંપત્તિ વગેરે શોક પ્રદ જડ વસ્તુઓથી નિવૃત્તિ થાય છે, અંતઃકરણમાં અજ્ઞાન વગેરેની ગૂંચ ઉક્તિ જય છે, અને સાધક અવ્યક્ત પરબ્રહ્મમાં વિતીન થઈ જતો હોય છે. (ઓ. ૧૦૯-૧૧૪)

ઝીણાં છીદ્રોમાંથી આવતા સૂર્ય પ્રકાશનાં કિરણોમાં ખૂબ જ સૂક્ષ્મ કણો દેખાતા હોય છે. તેના કરતાં પણ આણૂ નાનો કહેવાય છે. અને આણૂ કરતાં પણ નાનો અતિશાય સૂક્ષ્મ આત્મા હોય છે. એવી એની નિશ્ચિત કલ્પના કરવામાં આવે છે. મોટમાં મોટું એટલે બ્રહ્માંડ જે ચૌદ ભુવનો સપ્તલોક, સપ્ત પાતાળનું બનેલું જગત છે. પણ આત્મા એના કરતાં પણ મોટો છે. આવી પણ કલ્પના કરવામાં આવી છે. એ સૂક્ષ્મત્વમાં સૂક્ષ્મ કરતાં પણ અતિ સૂક્ષ્મ અને મોટાઈમાં મોટામાં મોટા આકારનો છે. કઠોપનિષદ્ધ અ. ૧ વલ્તી ૨ મંત્ર ૨માં તેને વિષે આમ કહેવાયું છે. અણોરણીયાન્ મહાતો મહીયાન્, આત્મા અરથ જનોર્નિહિતો શુદ્ધયામ્ ॥ આ જીવાત્માની હદ્યદૃપી ગુજ્જામાં રહેનારો આત્મા સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ અને મહાન કરતાં પણ અતિમહાન છે. નામ અને રૂપ આ ઉપાધીમાં જ હોય છે. આત્મા સદ્ગ્યે પરિપૂર્ણ અને ઉપાધી રહિત જ હોય છે. તેને જીન્મ નથી, અને મરણ નથી. અને તે મૂળ કારણ નથી. જે જીન્મ રહિત અથવા તો સ્વયંભૂ સતત ટકવાવાળો અને કદી નાશ નહીં પામનારો શાશ્વત અને પુરાતન છે. તેને સ્પષ્ટપણે સહેલાઈથી જાણવો અધરો છે. ઉંકાર પ્રતિકવાળો જે બ્રહ્મ એ જ અનું મૂળ પરમ સ્વરૂપ છે. વેદ અને બીજન શાસ્ત્ર પુરાણોને પણ સમજવા માટે અધરો એવો એ કોઈ સાધારણ માણસને સહેલાઈથી થોડો પ્રાપ્ત થાય છે? જેને નિશ્ચયપૂર્વક જાણવા અને સમજવા માટે વેદ પણ થાક્યા, તપસ્વીઓ વનવાસીઓ થયા, ઉપનિષદ્ધોએ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પણ હાથ હેઠા મૂક્યા પણ અમુક જ્ઞાન કોઈને થયું નહીં. તેવા આ આત્માના સ્વરૂપની શોધ કરવા કરતાં આત્મા અને પરમાત્મા એક જ છે. આ વાતને જાણવાવાઓ આચાર્ય અથવા તો ગુરુ જ હોવો જોઈએ. તર્ક કરવાવાળાઓ માટે ત્યાં પ્રવેશ નથી હોયો. તો બીજાઓનું તો શું મહત્વ ? કેવળ વાદવિવાદ કરનારાઓ માટે ત્યાં કોઈ જગ્યા નથી. તેઓ મનમાં મૂઝવણોક્ષી વમળોમાં ચક્કર ચક્કર ગોળ ફર્યા જ કરતા હોય છે. વેદશાસ્ત્ર અને ગુરુ સિવાય બીજાઓની સ્વરૂપ જાણવાની બુદ્ધિ ત્યાં સ્થિર થતી નથી. પોતાની બુદ્ધિના કલ્પનાક્ષી તારાઓ ચોર્યાશી લાખ પૂનર્જન્મના ફેરાઓ ચૂકાણી શકતા નથી. પણ શાસ્ત્ર અથવા તો ગુરુક્ષી એક જ ચંદ્ર માત્ર તેને માટે પૂરતો છે. ત્યારબાદ અંધકાર લેશમાત્ર પણ રહેતો નથી. જે બીજાઓ કષ્ટ વેઠીને સાધી શકતો નથી. ગુરુકૃપાથી સહેલાઈથી પ્રાપ્ત થાય છે. જેઓ સહગુરુને છેઠો મક્કમ રીતે ધરી રાખતા હોય છે. તેમને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યાં અજ્ઞાન કાંઈ પણ ન કરતાં ભાજુ પર સરકી જય છે, જ્યાં સચ્ચિદાનંદસ્વરૂપ સ્થિર થાય છે અને સ્વરૂપમાં મન થયેલી સ્થિતિ ઉત્પન્ન થાય છે. તેનું જ બીજું નામ મોક્ષ કહેવાય છે. આ જ દેરેક જીવમાત્રનું અપેક્ષિત ધ્યેય હોય છે. જેને માટે બ્રહ્મ એટલે પરમાત્મા જેડે એકરૂપ થવાની આસક્તિવાળા બ્રહ્મયોગીઓ અને આત્મ ચિંતનમાં મન રહેવાની ઈચ્છા રાખનારા સાધકો ખૂબ કષ્ટ સહન કરતા હોય છે. સ્વરૂપથી મન ચંચળ થાય કે ઈન્દ્રિયોની બોગવળાના વિષયોની અકળામણ વધી જય છે. સ્વરૂપને મન સ્થિર થતાં તે ક્ષીણ થઈ જય છે. જે કોઈ સ્વરૂપથી મોઢું ફેરવી લે છે, તેની સામે વિષયો સહાને માટે સામે આવીને ઉભા રહે છે. પણ જે સ્વરૂપ તરફ ધ્યાન આપે છે તેનાથી વિષયો મોઢું ફેરવી દ્વારા ભાગતા થઈ જય છે. જે મોક્ષ સિવાય બીજા કશાનો વિચાર કરતો નથી કે ઈચ્છા પણ રાખતો નથી, અને પૃથ્વીલોક કે પરલોકનો જેને જરાપણ લોભ નથી, તે જ મોક્ષનો અધિકારી થાય છે. એમાં એકાદ લક્ષણાની જે ખામી રહી જય તો તે મુમુક્ષ નથી એ ચોક્કસ જાણને. એક આંખથી આંધળો માણસ જેવી રીતે દેખાતું હોય એવો ઢોંગ કરે છે, તેવો તે મુમુક્ષત્વનો ઢોંગ કરતો હોય છે. અહંકાર ઓગળ્યા વીના લોભનો નાશ થયા વીના અને મન આસક્તિ રહિત થયા બિના બ્રહ્મજ્ઞાન મનમાં પૂરેપૂરું છસ્તું નથી. દેહ એ જ આત્મા છે, એવી જે બુદ્ધિ છે તે માણસને ભ્રમમાં નાખતી હોય છે. કોઈ પણ વસ્તુ વિષય ઉપર આસક્તિ હોવી એ જ બંધનનું કારણ થાય છે. વિષય બોગ વિષેની કલ્પના કરવી અને એની યાદ કરવી પણ છોડી દેવાથી બ્રહ્મ હાથ લાગે છે. નિર્ગુણ પરબ્રહ્મનો સાક્ષાત્કાર મેળવવો અધ્યરૂપ કામ છે, માટે સગુણ અપરબ્રહ્મના વર્ણનનો ભેદ સમજુને, બુદ્ધિશાળી લોકો તેને જ ઈશ્વર ઉપાસનાનો અને ઈશ્વર પરની શ્રદ્ધાનો માર્ગ સમજીતા હોય છે. (ઓ. ૧૧૫-૧૩૩)

પરમાત્મા સર્વ ભૂતોમાં ગુપ્ત રીતે વાસ કરતો હોય છે. આ તત્વ વેદાંતીઓ જાણતા હોય છે. પણ આનો બધાને જ અનુભવ થાય છે એવો પુરાવો કયાં છે ? સૌ પ્રથમ તો શુદ્ધ ચિત્ત જોઈએ અને બુદ્ધિ દર્ભની આણી જેવી તીક્ષ્ણ અને કુશાશ થાય છે ત્યારે જઈને આ અત્યંત પવિત્ર આત્મા કૃપાવંત થઈને પોતાની મેળે જ પ્રગટ થતો હોય છે. આત્મા સદાય વિકારો સિવાયનો હોય છે. જેને ખરેખરમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું હોય છે, તે કયારેય શોક કે દુઃખ કરતો નથી. ગીતા અ. ૨ લોક ૧૧માં કહ્યું છે. ગતાસ્ત્રનગતાસ્ત્રંશ્ચ નાનુશોચનિત્ય પણિતાઃ । ખરા જ્ઞાનીઓ મૃત્યુનો કે જીતનો શોક કરતા નથી અને તે જ ખરો વૈર્યવાન અને બુદ્ધિવાન હોવાને કારણે સંસારમાંથી સંપૂર્ણ પણ મુક્ત થયેલો હોય છે. અહીંથા પ્રવચન કરવાનું કૌશલ્ય અથવા તો ગ્રંથનો અર્થ સમજનવાની શક્તિ ચાલતી નથી. વેદ અને શ્રુતિ યાથર્થ જ્ઞાન પણ આનો ઉકલ લાવી શકતા નથી. કઠોપનિષદ અ. ૧ વલ્લી ૨ મંત્ર ૨૭માં આ બાબતે ઉત્સેખ આપ્યો છે. નાયમાત્મા પ્રવચેન લભ્યો, ન મેધયા ન બાહુના શુતેન | યમેવૈષ વૃષ્ણુતે તેન લભ્ય: તર્સૈષ આત્મા વિવૃષુતે તનું સ્વામ્ || આ આત્માને એટલે પરબ્રહ્મ પરમાત્મા, પ્રવચનોથી બુદ્ધિ અથવા તો ઘણાં શાસ્ત્રો સાંભળવાથી પ્રાપ્ત કરવો શક્ય નથી. એ જેનો સ્વીકાર કરે છે, તેને જ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેને માટે એ આત્મા પોતાનું ખરું સ્વરૂપ પ્રગટ કરે છે. આત્મા નિત્ય વિકાર રહિતનો છે, અને શરીર અનિત્ય અને સહાને માટે બદલનારું છે, એવું જાણીને જે પણ પોતાનું હિત સાધી લેતો હોય છે, તે જ યોગ્ય અથવા

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

તો અયોગ્ય કાર્ય વિષે જગૃત હોય છે. આત્માજાનીને કિયારેય કોઈ પણ પ્રકારનો ભય કે જરૂર નથી હોતો. એ પોતાને એકલો જ અને આ જગતમાં પોતાના સિવાય કોઈ બીજો નથી તેવું જ સમજતો હોય છે. આમ અનન્યપણાનો ભાવ ભૂસી કાઢતાં બધાં જ દુઃખોનો નાશ નિશ્ચિત ફળ આપતો હોય છે. આત્મા ભલે જાણવા માટે અધરો હોય છે, પ્રવચન અથવા તો કીર્તન સાંભળીને એનું ડેકાણું મળતું નથી, અને ફક્ત બુદ્ધિનો પણ જ્યાં કોઈ ઉપયોગ થતો નથી. તેમ છતાં તે આત્માને યોગ્ય ઉપાયે સહેલાઈથી જાણી શકાય છે. જેને પોતાને બીજુ કોઈ કામના નથી અને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું બસ એ એક જ ઈચ્છા છે એવો જે આત્મા પુષ્કળ પ્રાર્થના કરે છે તેને જ આ શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થતો હોય છે. પોથી કીર્તન વગેરે સાંભળતા ‘એ હું જ છું’ આવી અભેદ દિશિથી જે જેતો હોય છે, અને તેનું જ ધ્યાન રહેતું હોય છે, તેની પર આત્મા ફૂપા કરતો જ હોય છે. જે કાયમ દુષ્ટ ફૂત્યો અથવા તો પાપનું આચરણ કરવામાં તત્પર રહેતો હોય છે. જે સહાને માટે અશાંત અને અસ્થિર હોય છે, અને જેનું ચિત્ત એકાગ્ર નથી હોતું એવો જ્ઞાની માણસ પણ તેને પામી શકતો નથી. કઠોપનિષદ અધ્યાય ૧ વલ્લી ૨ મંત્ર ૨૪ કહે છે કે નાવિસ્તો દુશ્ચરિતાન્નાશાન્તો ના સમાહિતઃ । નશાન્તમાનસોવાપિ પ્રશાનેનૈમાનુયાત् ॥ જે મનુષ્ય દુષ્ટ ફૂત્યોથી અથવા તો પાપાચરણથી વિરક્ત થઈને તેનો ત્યાગ કરતો નથી, જેનું મન ઈશ્વરને ભૂલી જઈને રાત અને દ્વિવસ સંસારના ભોગોમાં ભટકતું રહેતું હોય છે, ઈશ્વર ઉપર શ્રદ્ધા ન હોવાને કારણો જે અશાંત રહેતો હોય છે, અને જેની મન બુદ્ધિ અને ઈન્ડ્રિયો સ્વાધિન નથી, આવો મનુષ્ય સૂક્ષ્મ બુદ્ધિથી પણ આત્મ ચિત્તન કરતો હોવા છતાં આત્માને પ્રાપ્ત કરી શકતો નથી. શુંતિ અને સ્મૃતિમાં કહ્યા પ્રમાણેનાં યોગ્ય કર્મો જે કરે છે અને અયોગ્ય કર્મો છોડી હે છે, જેનું ચિત્ત સહાય એકાગ્ર હોય છે, એનો આત્મા આધિન હોય છે. પાપાચરણથી જે વિરક્ત હોય છે, આચાર્ય અને ગુરુના ચરણમાં જે વિનાસ અને ફળની ઈચ્છાથી વિમુક્ત હોય છે. તેને જ આ આત્મા પ્રાપ્ત થતો હોય છે. વિષય ભોગથી નિજકામ થયા સિવાય કેવળ આત્મવિષયથી કામના કાર્ય સિવાય અને મનની વૃત્તિ શાંત થયા સિવાય આત્મારામને પામવો ખૂબ જ અધરો હોય છે. બ્રહ્મજ્ઞાનની ઈચ્છા ધરાવનારા જ્ઞાનસુને તેનું તપ જેઠિને જ્યારે આત્મા ફૂપા કરે છે, ત્યારે જ એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. ગુરુની મહદ સિવાય તેને પામવું સહેલું નથી. છતાં સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સાધકોને શ્રવણ મનન વગેરે કરવું. અભેદભાવ વગર વ્યવસ્થિત ધ્યાન આપવું, અને તો જ આત્મલાભ સુખથી થાય છે. સંસાર આ સર્વ માયા મોહથી ભરેલો હોય છે. અને એના વિસ્તારનું મૂળ કારણ પણ અજ્ઞાન જ હોય છે. જ્ઞાન સિવાય મોક્ષને આધાર નથી તે સમજ લ્યો. શાસ્ત્રોના અનુભવ માટે તર્ક અને શોધક બુદ્ધિ જરૂરી છે. જ્ઞાન તો માત્ર સંસારને ભુલ્યા બાદ જ ઉત્પન્ન થતું હોય છે, અને બીજી કશાથી શક્ય નથી. તે અસંભવ છે. મોટો સાધુ હોય કે નીચે પાપી હોય, પ્રત્યેક જીવાત્મા તે પરમાત્મા છે, એવું સમજને જે વર્તે છે એ જ ખરો મહાત્મા છે. તેનો આત્મા અભેદ આત્મા કહેવાય છે. બ્રહ્મ અને આત્મા એક જ છે. એવું જે અનુભવપૂર્વકનું જ્ઞાન લે તે જ જ્ઞાનનો કળશ છે. એક વખત આત્મજ્ઞાન થયું કે બીજું બધું જાણવા જેવું કાંઈપણ રહેતું નથી. સાક્ષાત્કારના હિસાબે એનાથી પાસે હાથમાં રહેલ વસ્તુની માફક બધું જ સમજલય છે. તેને આત્મજ્ઞાનનું ફળ એટલે સંસારમાંથી અખંડ નિવૃત્તિ, પરમાનંદની તત્કાળ પ્રાપ્તિ અને મોક્ષ માટેનો સારો સમય પ્રાપ્ત થતો હોય છે. (ઓ. ૧૩૪-૧૫૪)

‘આત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને મહાન કરતાં પણ મહાન છે.’ આવું બોલવું એ પણ ફક્ત એની સર્વવ્યાપકતા બુદ્ધિને સમજલય માટે જ છે. આત્મા સૂક્ષ્મ પણ નથી અને મહાન પણ નથી. એમાની ન્યૂનતા કે અધિકતા, શ્રેષ્ઠતા કે અધમતા ઠેરવેલા ભાવ ફક્ત કલ્પનાના ખેલ છે. પેલો આત્મા તો બ્રહ્મદેવથી માંડીને નાના જાંખરા સુધી સર્વ ચર અને અચર સૃષ્ટિમાં ફેલાયેલો છે. એવા આ વાર્ણિન કરવામાં અશક્ય આત્માનું અસ્તિત્વ સદ્બુદ્ધિમાં સમાવી લેવા માટે વેદાંતીઓ અમર્યાદિત પણ વાચાથી મર્યાદિત કરતા હોય છે. કેવળ બુદ્ધિયુક્ત વાણી વૈભવના યોગોથી આત્માનો ખરો મર્મ હાથ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

લાગતો નથી. સાધુ સંતો અને સદ્ગુરુઓની સંગતથી અને એમની સેવાથી મળનારી કૃપાથી એની પ્રાપ્તિ થતી હોય છે. બ્રહ્મનું સવિસ્તાર વર્ણન પોથી અને પુસ્તકોમાં થોડું જ તૈયાર હાથ લાગે છે ? પરંતુ જ્યાં સુધી સદ્ગુરુની કૃપા જેની ઉપર થતી નથી એની ઉપર આ જગતના અંત સુધી આ આત્મા હાથ લાગતો નથી. રોજની સંધ્યાપૂજા વગેરે નિયમિત રીતે અને શ્રાદ્ધ વગેરે પ્રસંગો નિભિતે કરવામાં આવતાં ફૂત્યો કરીને જ્યાં લગી મન શુદ્ધ સંસ્કારયુક્ત થતું નથી, ત્યાં સુધી બ્રહ્મનો અનુભવ સહેલે પણ મળતો નથી. બ્રહ્મ જ માત્ર નિત્ય છે. અને બાકીનું અનિત્ય છે. જે કાંઈ તમામ નજરે પડે છે, તે સતત કાયમ ટકવાવાળું નથી. એ નગ્ન સત્ય છે, બ્રહ્મનો વકતા પણ દુર્લભ અને તેવી જ રીતે શ્રોતા પણ દુર્લભ અને પ્રેમાળ તેમજ અનુભવશીલ સદ્ગુરુ તો ભાગ્ય જ મળતા હોય છે. બ્રહ્મ શું રસ્તામાં પડેલું છે ? જે યોગીઓ પોતાને પર્વતોમાંની ગુફામાં ગોંધી રાખતા હોય છે. ઇન્દ્રિયનિગ્રહ અને મનોનિગ્રહમાં બાંધી દેતા હોય છે, અને ધ્યાનસ્થ અવસ્થામાં પોતાની જતને પરોવી રાખે છે, તેવાઓને પણ ગુરુકૃપા થયા વગર બ્રહ્મ દેખાતું નથી. તો તે તારા જેવા મૂર્તિમંત લોભિયાને કેવી રીતે મળશે ? જેમને પૈસાનો અતિશય લોભ હોય છે, તેમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ કલ્પનામાં પણ કોઈ દિવસ થતી નથી. એ બરાબર ધ્યાનમાં રાખને. પરમાર્થની વાતો સાંભળતા વિષય બોગોનું ચિંતન અને સંસારના સતત વિચાર કરતા રહેવાથી સાક્ષાત્કાર પણ એવા જ થતા હોય છે. અંતઃકરણના મેલ વિક્ષેપ અને આવરણ આવા ત્રણ દોષ હોય છે. નિષ્ઠામ કર્મ કરવાથી મેલનો નાશ થાય છે અને ઉપાસનાથી વિક્ષેપ ધોવાઈને નીકળી જતા હોય છે. આવી રીતે સ્વકર્મ અને ઉપાસના કરીને કર્તાના ચિત્તને પરિપક્વતા આવે છે અને મેલ અને વિક્ષેપ બંનેનો નાશ થઈને ફક્ત આવરણ જ બાકી રહેતું હોય છે. આ બધા અનર્થોનું બીજ તેનું આવરણજ્ઞાન પ્રગટ થતાં જેવી રીતે સૂર્ય ઉગતાં જ અંધકારનો નાશ થતો હોય છે. તેવી જ રીતે જ્ઞાન પ્રગટ થતાં અજ્ઞાન નાશ પામે છે. સત્ય, જ્ઞાન, અનંત વગેરે લક્ષણોથી જ જેમનું વેદાંતમાં નિષણાત એવા લોકોએ વર્ણન કર્યું છે, આ બ્રહ્મ, જ્ઞાની સ્વર્વરૂપમાં લીન થતાં પ્રકાશવા માર્દે છે. થોડું અંધારુ અને થોડી ચાંદની હોય છે ત્યારે એકલો વટેમાર્ગું જંગલમાં ચાલતી વખતે થઈના હુંદાને અને તુટેલી ડાળીઓને દૂરથી ચોર સમજુને ડરનો માર્ગો ત્યાં સંતાઠ જતો હોય છે. તેને એવું લાગતું હોય છે કે, ‘હું એકલો જ છું અને સાથે પૈસા છે. એ ચોર ટાંપાને જ બેઠો છે હવે વિચાર શાનો કરવાનો ? જીવનો શો ભરોસો ?’ તે જ વસ્તુ દૂર ના દેખાતા દિવાના પ્રકાશમાં આવે છે, અને થડનું ખુંસું સ્વરૂપ જે છે તેવું પ્રગટ થઈ જય છે. વટેમાર્ગુનો ડર જતો રહે છે. અને પોતાને થયેલા ખોટા ચોરનો ભાસ તેને સમજલવા માર્દે છે. (ઓ. ૧૫૫-૧૭૩)

આ બ્રહ્મના જ્ઞાનના માર્ગમાં આવતી અને પ્રાપ્તિ માટેની અદ્યાષો શ્રોતાઓને જણાવી. આગલા અધ્યાયમાં કલ્યાણની દૃઢા કરવાવાળાઓને ‘શ્રેય’ જતે જ પોતાનું રૂપ પ્રગટ કરશે. હેમાડપંત સાઈચરણમાં આળોટે છે. અને મોઢામાં આવે તે બબડે છે. સાઈકૃપા જે.... જે બોલાવે છે, તે બોળા ભાવિકો સાંભળે છે. (ઓ. ૧૭૪-૧૭૫)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા, હેમાડપંત રચિત શ્રી સાઈસમર્થના

સત્ય ચરિત્રના ‘બ્રહ્મજ્ઞાન કથન - ૧’ નામનો સોળમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



॥ અધ્યાય ૧૭ ॥

બ્રહ્મજ્ઞાન કથનમ - ૨

(જગતની ઉત્પત્તિનું કારણ અને મૂળ તત્વ હોય તેવું વ્રલ અને તેની પ્રાપ્તિનું વર્ણન ભાગ-૨)

શ્રી ગણોશળુને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રલુને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

પાછલા અધ્યાયમાં વચન આખ્યું હતું કે આ અધ્યાયમાં શ્રેય એટલે કે શૈક્ષ કલ્યાણનો માર્ગ અને પ્રેય એટલે આ લોકનું સુખો ભોગવવાનો માર્ગ જે સામાન્ય મનુષ્યને પ્રિય હોય છે. તેનાં લક્ષણોનું નિરાકરણ થશે એને કાળજીપૂર્વક સાંભળો. પ્રકાશ અને અંધકારના ગુણધર્મનું ઘડતર ભલે જોવામાં એકસરખું હોય અને એકબીજા સાથે સંકળાયેલા હોય તેમ છતાં તે એકબીજાથી બિન્ન છે. તેવી જ રીતે શ્રેય અને પ્રેમ તેમના ગુણોનું ઘડતર એકબીજાથી પરસ્પરનું હોય તેવું દેખાતું હોવા છતાં તે બંને જુદા જ છે. પ્રેમ તરફ જેનું મન દોડે છે તે સ્વાર્થથી પાયમાલ થાય છે. શ્રેય એ વિવેક રૂપ છે અને પ્રેય અવિવેક રૂપ અર્થાત્ મૂર્ખતા પૂર્ણ છે. શ્રેયનો વિષય કેવળ વિદ્યા અને જ્ઞાન છે, જ્યારે પ્રેમ સહંતર જ અજ્ઞાન છે. જ્યાં સુધી કંચન અને કામિનીનું ખેંચાણ છે, ઇન્દ્રિયોના વિષયની ઇચ્છા છે અને વિવેક તથા વૈરાગ્ય મેળવ્યા નથી ત્યાં સુધી પ્રેમ જ મધુર લાગે છે. જેવી રીતે પાણી અને દૂધ એકત્ર ભેળવેલાં હોય છે તેવી જ રીતે શ્રેય અને પ્રેય એકબીજાનું ભળી ગયેલાં હોય છે. જેવી રીતે માનસરોવરના હંસ પાણી દૂધથી છૂટું પાડીને પીતા હોય છે. તેવી જ રીતે દફનિશ્વયી, બુદ્ધિમાન, વિવેકી અને ભાગ્યવાન માણસો શ્રેય તરફ આસકત હોય છે. તેઓ પ્રેયથી હંમેશા મોં ફેરવી લેતા હોય છે. પરંતુ એ જ મંદબુદ્ધિના લોકોને જુઓ ! શરીર, પશુ, પુત્ર, ધન, મોટાઈ, માન ઈત્યાદી જે છે તેને સુરક્ષિત રાખવા માટે અને જે નથી તેને વધારે મેળવવા માટે તેની પાછળ પડીને એકલું પ્રેય જ સાધતા હોય છે. કઠોપનિષદ અ. ૧ વલ્લી ૨ મંત્ર રમાં આ અંગે કહ્યું છે કે શ્રેયશ્વર પ્રેયશ્વર મનુષ્યમેતસ્તૌ સમ્પરીત્ય વિવિનાક્તિ ધીરઃ । શ્રેયો હિ ધીરોડબિ પ્રેયસો વૃણીતે, પ્રેયો મન્દો યોગક્ષેમાદ વૃણીતે ॥ શ્રેય અને પ્રેય બંને મનુષ્યની સામે આવે છે. બુદ્ધિમાન મનુષ્ય એ બંનેના ગુણ દોષોનો વિચાર કરીને બંનેને એકબીજાથી અલગ સમજુને, શૈક્ષ બુદ્ધિમાન મનુષ્ય પ્રેમ કરતાં શ્રેયને જ શૈક્ષ સમજુને તેનો સ્વીકાર કરે છે. પરંતુ ઓછી બુદ્ધિવાળા માણસ લૌકિક યોગક્ષેમની ઈચ્છાથી પ્રેયને જ પાસે રાખતા હોય છે. શ્રેય શું અને પ્રેય શું, એ બંનેને જાણી લઈએ, તો પણ મનુષ્ય પ્રાણીબુદ્ધિથી સ્વતંત્ર હોવાને કારણે, તે બંને માંથી કોને પસંદ કરવા એ નક્કી કરવાનું હોય છે. બંને સામે જ હોવાને કરાણે તેની પસંદગી કરવી અધરી થઈ જય છે, કારણ આણે પોતાની ઓછી બુદ્ધિ ઉપર વિજય મેળવીને, પ્રેયને જ વળગાડી રાખ્યો છે. દૂધ અને પાણી જેગાં થયાં હોવા છતાં હંસ જેવી રીતે દૂધ જ છૂટું પાડીને પાંચે છે, તેવી જ રીતે પ્રેય ભાજુ પર કાઢી શ્રેયનો જ ફક્ત સ્વીકાર કરવો એ જ ખરો પુરુષાર્થ છે. શ્રેય અને પ્રેય એ બંને જે પુરુષને સ્વાધીન હોય, તો વિવેકહીન મંદભૂતી પુરુષ તેનો યોગ્ય અયોગ્યનો વિચાર કરવામાં સમર્થ નથી હોતો. શ્રેય શેમાં છે એ પ્રથમ ચોક્કસ સમજવું જોઈએ. પછી તેના માર્ગમાં જ કાંઈ પ્રતિબંધો કે ઝકાવટો આવે. એનું સંપૂર્ણપણે નિવારણ કરવા માટે ઉપાય શોધવો જોઈએ. અહીંયાં જ પુરુષાર્થ પોતાની દષ્ટિ સામે દત્તની માફક અહગ ઉભો રહે છે. માટે બુદ્ધિનો પાકો નિશ્ચય કરીને શ્રેય પ્રાપ્ત કરવા માટે જ પ્રયત્ન કરવો. (ઓ. ૧-૧૪)

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સંસારચકનું ભ્રમણ તર્ક વગરનું હોય છે. તે અખંડ રાત દિવસ ફરતું જ રહે છે. એમાં આધ્યાત્મિક ઈશ્વરીય દુઃખો જેવાં કે મનથી થનારાં દુઃખો તાવ, કોધ, ચિંતા, હાડકુ તૂટવું વગેરે. આધિભૌતિક જેવાં કે ચોર, સાપ પંચમહાભૂત વગેરે અને આધિકારીક એટલે કે અતિવૃષ્ટિ અને દુષ્કાળ વગેરે. આવાં ત્રણ પ્રકારનાં ભયંકર અને નિવારણમાં અઘરાં દુઃખો મનુષ્ય સહન કરતો આવ્યો છે. પછી અત્યંત દુઃખોનો માર્યો, અતિરેક સહન કરીને થાકેલો એવો એ નિવારણ કરવાનાં સહેલાં અને સુખદ સાધનો શોધવા લાગે છે. સંસારચકનું આ ભ્રમણ સહન કરવું અધૂરું છે. આ કેવી રીતે રોકી શકશો ? એને માટે કોઈ ઉપાય છે ખરો ? એની શોધ તે કરવા માંડે છે. મહાભાગ્યથી આવી બુદ્ધિ ઉપજી કે ત્યાં પુરુષાર્થનો ઉદ્ય થાય છે. પછી જ તે પુરુષ પોતાના હિત ખાતર યોગ્ય ઉપાય સાધનારો થઈ જય છે. જેનો આરંભ નથી એવું અજ્ઞાન અથવા તો માચા છીપતા ઉપરની ચાંદી જેવી અને મૃગજળના પાણી જેવી નક્કામી ભામક હોય છે. એના ખોટા આભાસ ઢૂપી ખોટા પ્રતિબંધોનો નાશ કરવો જોઈએ. સ્વભન્માં સોનાના કરાનો વરસાદ થાય છે, વખત પડતાં કામે લાગશે તેવું સમજુને ખૂબ કાળજીપૂર્વક બેગા કરીને સંધરી રાખવા છતાં જગૃત થતાં જ તે અદશ્ય થઈ ગયેલા ભાસે છે. અનુભવેલા અને બિનઅનુભવેલા વિષય બોગની વાસના હોવી કે આશા, ઉત્કંધા, કે ઈચ્છા હોવી આ બધા પ્રતિબંધો જ છે. એવું બરાબર સમજુને તેમને પહેલેથી જ જડ મૂળથી ઉખાડી નાઓ. જે સૂર્ય પ્રકારશમાં જેવાનું અશક્ય છે, જ્યાં બુદ્ધિ કામ ન લાગે અને જ્યાં વેદોનું અને શ્રુતિનું એક પગલું પણ વિચારી શકતું નથી, વેદો પણ ‘નેતિ નેતિ’ – આમ નહિ, આમ નહિનું વર્ણન કરવાનું છોડી હે છે. ગુરુ પોતે જ તેમ કરીને બતાવતા હોય છે. કામ અને કોધ આ બે વૃત્તિઓ જ્ઞાનની પ્રાપ્તિ કરવા દેતી નથી. શ્રવણ, મનન અને સમાધિને તે તોડાને છિન્નબિન્ન કરે છે. દીવાની જ્યોત અને કપૂર એનો સમાગમ થતાં એકમેકનું અલગ વ્યક્તિત્વ રહે છે ખરું ? ઊભી જ્યોત જેઠે મેળ થવાની જ વાર કે, કપૂર બળીને જ્યોત થઈ જય છે. એ જ પ્રમાણે કામ કોધ વૃત્તિઢૂપી જ્યોત સાથે, શ્રવણ, મનન અને સમાધિઢૂપી કપૂરનો સમાગમ થતાં એ જ્યોતિમાં કપૂરની માફક તે એકમદ સળગી જય છે. શ્રુતિ અને સ્મૃતિને મનાદી ફરમાવેલા દુષ્કર્મમાં જે સદ્ગ મસ્ત રહેતો હોય છે, અને જેને પોતાનું યોગ્ય અને અયોગ્ય કર્મ સૂજતું નથી, તે જ્ઞાની હોવા છતાં પોતાનું કયું હિત સાચવી શકવાનો છે ? તેવી જ રીતે હંમેશાં અશાંત રહેનારો, જેનું અંત : કરણ અસ્વસ્થ છે અને ઇન્દ્રિયોના ચંચળપણાથી જેનું ચિત્ત બગડચું છે તેવો જીવ જ્ઞાનથી પરિપૂર્ણ થઈ શકતો નથી. જેના ચિત્તને સમાધાન છે, જે ગુરુનો શિષ્ય થઈને પણ સદ્ગારી છે, જેનું આત્મા ઉપરનું ધ્યાન નિશ્ચલ છે, તે જ ફક્ત જ્ઞાન સંપ્રાણ થઈ શકે છે. (ઓ. ૧૫-૨૭)

સંસારમાં રહો કે મોક્ષ મેળવવાની ફીકરમાં રહો, છેલ્લે તો ઈશ્વર પાસે નિજધામ જ જવાનું છે. શરીર ઢૂપી રથનો તું સ્વામી છે. ફાલતું બડબડ કરનારો શું કરી શકે ? ત્યાં ફક્ત મોકું ચલાવનારા માટે જગ્યા નથી. અભ્યાસ અને મહેનત એ જ ખરો સાર છે. શરીરને રથની જગ્યાએ માન અને તેમાં સ્વસ્થપણો બેસો. પોતાના શરીરઢૂપી રથને પોતાની બુદ્ધિઢૂપી સારથી બની હંકારી અને પોતે માલિક બનીને શાંત ચિત્ત રથમાં બેસો. પછી વિષય બોગોના અનેક માર્ગોની વિકટ પરંપરા ઓળંગવાની સુચના સારથીને આપો. અને મનઢૂપી લગામથી દશ ઈન્દ્રિયોસી સંયમ વગરના આવિચારી ધોડાઓને કાબૂમાં કરો. ધોડાઓ જે મનજીવે તેમ ભાગવા પ્રયત્ન કરશે તો લગામ તેમને જકડી રાખશે. એ લગામ સારથીના હાથમાં સોંપીને આનંદથી અને સ્વસ્થ ચિત્ત બેસો. સારથી જે કુશળ અને નિપુણ હશે તો જ ધોડાઓ બરાબર વ્યવસ્થિત ચાલશે. પરંતુ એ જ જે મનઢૂપી લગભાને આધીન હશે તો તે ધોડા બળ વગરના થઈને ચાલવા માટે અસમર્થ થશે. જ્યાં વિવેક ચુક્ત બુદ્ધિ જ સારથી છે, જેને મન પર કાબૂ છે અને જેનું ચિત્ત એકાગ્ર થયેલું છે, અને જ પરમ પદની પ્રાપ્તિ થાય છે. બાકીના લોડો રસ્તામાં જ થાકીને અટવાઈ જય છે. જેમનાં મન કાબૂમાં નથી હીતાં તેવા તો એ પદ લગી પહેંચી પણ શકતા નથી અને એવાઓનો સંસારનો ફેરો ચાલુ રહે છે. કઠોપનિષદ અ. ૧ વલ્લી ઉ મંત્ર ૩, ૪ અધ્યાય દમાં કહ્યું છે કે આત્માનં રથિનં

શ્રી સાઈનું સત્ય ચાટિત્ર

વિદ્ધિ શરીરં રથમેવ તુ । બુદ્ધિં તુ સારથિ વિદ્ધિ મન: પ્રગહમેવ ચ ॥ હે નચિકેતા ! તું પોતાના જીવાત્માના રથનો સ્વામી સમજુને અને શરીરને રથ સમજુને અને બુદ્ધિને સારથી સમજ તથા મનને ઘોડાની લગામ સમજ. ઈન્દ્રિયાણિ લ્યાનહુ: વિષયાંસ્તેષુ ગોચરાન્ । આત્મેન્દ્રિયમનોયુક્તં લોકતેત્યાહુર્મનીષિઃ ॥ જ્ઞાનીઓ ઈન્દ્રિયોને આ રથના ઘોડા સમજે છે, વિષયોને એ ઘોડાઓને ભટકવાના વિવિધ માર્ગો સમજે છે, અને શરીર ઈન્દ્રિય અને મન સાથે રહેનારો જીવાત્મા જ સર્વ વિષયોનો બોક્તા છે એવું કહે છે. વિજ્ઞાન સારથિર્થસ્તુ મન: પ્રગહવાત્ર નર: । સાડધ્વન: પારમાનોતિ તદ્વિજ્ઞાઃ: પરમ પદમ્ ॥ જે મનુષ્યની વિવેકશીલ બુદ્ધિ સારથી હશે અને મનઙ્ગપી લગામને તાબામાં રાખનારો હશે એ સંસાર માર્ગને પાર કરીને સર્વ વ્યાપી પરખલ પુરુષોત્તમનું સુપ્રસિદ્ધ પરમપદ પ્રાપ્ત કરે છે. આ જીવાત્મા અને શરીરના સંબંધોનું ઇપક આધ્યાત્મમાં ખૂબ પ્રસિદ્ધ તો છે જ. (ઓ. ૨૮-૩૫)

આવું એ મહાન પરમપદ પોતાની મેળે જેવું છે તેવું જ પ્રગત થાય છે, અને તે ક્યાં છે તેની શંકા મટી જાય છે. અહીં તર્કવાદ અનુવાદ, પ્રવાદ એટલે અફવાની વાતો અને સંવાદ ચાલતો નથી. અહીં ઈશ્વર કૃપા જ દાદ માગે છે. વાદવિવાદનો કોઈ ઉપયોગ થતો નથી. ત્યાં તર્કની ચતુરાઈ ચાલતી નથી. અનુમાન અર્થહીન થઈ જતાં હોય છે. તર્કવાદીની બુદ્ધિ રૂંધાઈ જાય છે. ભોગો ભાવ જ સિદ્ધિએ પહોંચે છે. એ જ અહીંયાની નવાઈ છે. ઉત્તમ પ્રકારના જ્ઞાનને કારણે તે માર્ગ જુદ્દો હોય છે. અને બુદ્ધિ પણ જુદ્દી જ હોય છે. તથા એ ઉત્તમ જ્ઞાન આપનાર શાસ્ત્રશો પણ જુદા જ હોય છે. તેનું ધ્યાન રાખવું. અમૂલ્ય એવું આ શરીર અર્થ વીનાનું જઈ રહ્યું છે. ધનની લાલસા પણ બપોરના સૂર્યના છાંયડા જેવી છે. જે લાંબો સમય ટકીની નથી. તે હરિની માયા પાર કરનાર માટે ખૂબ જ અધરી છે. આ બધું જાણીને સંતોને પગે લાગવું અને તેમના શરણે જવું. સંતો તો આં સસારઙ્ગી સાગર પાર કરાવનારી નૌકા જેવા તારણહાર હોય છે. તેમાંનો ‘તું’ એક ઉતારું છે. તેમના સિવાય સામે કઠિ ઉત્તરવા માટેનું સાર્મથ્ય કોની પાસે છે ? વિવેક અને વૈરાગ્ય જે સાથે બાંધીને રાખે છે, એ ભલે મોટો મૂર્ખ પથ્થર જેવો જડ હોય છીતાં સંસાર રૂપી સાગર પાર કરવાનું કામ તેને ભારે પડતું નથી. સારાંશ એ કે વિવેક વૈરાગ્ય આ બે જ મહત્વના છે. એકનાથી ભાગવત અ. ૨૩ ઓ. ૪૪૮માં જણાવ્યું છે કે વૈરાગ્ય વિવેક વગર આંધળો । વિવેક વૈરાગ્ય વગર પાંગળો । તે મારા હૃદયે જેડે ફોંણે । એકી સાથે ઉપને ॥૩૮॥ ભગવંતનું ઐશ્વર્ય છ ગુણોવાળું હોય છે. એમાં પણ ‘વૈરાગ્ય’ એ જ ખરેખર મુખ્ય ઐશ્વર્ય છે. જે મહાભાગ્યવાનને ભાગે આવતું હોય છે અને એમને જ પ્રાપ્ત થાય છે, બીજાઓને નહીં. શાસ્ત્રોને યોગ્ય ડેરવેલાં કર્મ કર્યા વગર ચિત્ત શુદ્ધ થતું નથી ત્યાં લગી જ્ઞાન સંપાદન થતું નથી. માટે જ્ઞાન પ્રાપ્તિનું મૂળ કારણ કર્મ છે એ જ જણાવું. નિત્ય દેવપૂજા-ઉપાસના અને પંચકર્મ તેમજ નૈમિત્તિક એટલે નક્કી કરેલા સમયે અથવા પ્રસંગે કરવાનાં વર્ષ શ્રાદ્ધ વગેરે કર્મો કરવાથી ચિત્તનો મેલ ઘોવાઈ જાય છે. આ પ્રકારે શુદ્ધ થયેલા ચિત્તમાં વિવેક અને વૈરાગ્ય ઉત્પત્ત થતાં, શમ, દમ ઉપરાંત તિતીક્ષા, શ્રદ્ધા અને સમાધાન વગેરે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો દ્વારા લાભ થાય છે. અને આ જ દેહથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ફળની ઈચ્છાનો અને સંકલ્પનો ત્યાગ કરીને અને મનને એકાગ્ર કરીને જ કોઈ સહગુરુના અનન્ય શરણો જાય છે. તેને સહગુરુ પોતાની છત્રછાયામાં લે છે. જેને ઈન્દ્રિયોની બહારની પ્રવૃત્તિઓ છોડી દીધી છે તેમજ જે ખરો ભાવિક ભક્ત છે તેને જ આત્મજ્ઞાનનો લાભ થવાથી ખરું ઉહાપણ આવે છે. બીજ કોઈ ઉપાય ચાલતા નથી. માત્ર આત્મજ્ઞાન પ્રાપ્ત થયા બાદ પણ જે તે અધર્મના માર્ગનું આચરણ કરે તો નીચે પૂઢવી પર અથવા તો સ્વર્ગમાં ન રહેતાં ત્રિશંકુ જેવો વર્ચ્યે જ લટકતો રહે છે. જીવની અજ્ઞાનની વૃત્તિ એ જ એને સંસાર તરફ પ્રવૃત્ત કરે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં જ એ જીવ સંસારમાંથી નિવૃત્ત થાય છે. આત્માને જાણેલા આત્મજ્ઞાનનો અહુમ કયારેય નથી હોતો, પુણ્ય અથવા પાપનો બેદ નથી હોતો તેવી રીતે શુભ અને અશુભ પણ નથી હોતું. તેને આ સંસારના લાભ અને નુકશાનનો શું હેતુ છે ? આ દેહની અહંકાર વૃત્તિ શાંત થવાથી જગતની બધી ઉપાધિમાંથી નિવૃત્તિ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પ્રાપ્ત થતાં આ વાતથી નિશ્ચિત લુધની પરમાત્મા જેઠેની એકરૂપ સ્થિતિ પેદા થાય છે. આ સંકેત મનમાં રાખજો. પ્રવૃત્તિને સ્થાને જ શત્રુ અને મિત્ર હોય છે. નિવૃત્તિમાં નવાઈ તો એ છે કે, હું જ સર્વત્ર છું એવું સમજનારાને શત્રુતા કે ભિત્તા વળી શું ? આવા મહાન સુખ સામે દેહનું મહાન હુઃખ તે કેવું બાપડું બને છે ? એની કોણ પરવા કરે છે ? જ્યારે મહાન સુખ ગમવા માટે છે ત્યારે એક પણ પ્રપંચના સંસારી સુખ માટે કોણ, શા માટે રહે ? એક મોટો દુઃખનો દુંગર પણ જે એની ઉપર ધસી આવે તેમ છતાં ધૈર્યનો તે પર્વતરાજ તસુભર પણ હાલતો નથી. ભગવાન જેની ઉપર પ્રસન્ન થાય છે તેને જ તે વૈરાગ્ય આપે છે, અને વિવેકની સાથે સંબંધ જેઠી આપે છે. તથા તેને ભવસાગર પાર કરાવે છે. અરીસામાં દેખાતા ચહેરાના પ્રતિબિંબની માફક આત્માના સ્પષ્ટ દર્શનની જે ઈચ્છા કરે છે એને આ ભૂલોક અથવા તો ઉપરનો બ્રહ્મલોક એ સિવાય ત્રીજી કોઈ જગ્યા જ નથી. યજ્ઞ કરવાથી દેવાતાઓની તૃપ્તિ થતાં પિતૃલોકની પણ પ્રાપ્તિ થશે. કર્મ ફળના ઉપભોગનો લાભ થશે, પરંતુ આત્મજ્ઞાન મળશે નહિ. ગંધર્વલોક, મહર્લોક, જનર્લોક, તપર્લોક અને સત્યર્લોક આમાં આત્મદર્શન અતિશય અસ્પષ્ટ હોય છે, માટે જેમને આત્મદર્શનની લગની છે, એવા લોકો આ પૃથ્વી ઉપરનું આયુષ્ય ખૂબજ માંગતા હોય છે. કારણ કે અહીંયાં ચિત્તની શુદ્ધિ થાય છે, અને આરસી જેવી નિર્મણ બુદ્ધિ મળે છે. એમાં શુદ્ધ અને પવિત્ર આત્મસ્વરૂપ પ્રતિબિંબિત દેખાય છે. બીજું સ્થાન જે બ્રહ્મલોક, ત્યાં પણ આત્મદર્શન અથવા તો આત્મ અવલોકન થતું હોય છે, પરંતુ તેને માટે ત્યાં અનેક પ્રકારના પ્રયત્નો કરવા પડતા હોય છે. એ બ્રહ્મલોક અતિશય કષ્ટદાયક હોય છે. ત્યાં સપ્રમાણે માયા વિંટળાય છે. અંદરથી આંતરદાં પૂર્ણ પ્રમાણે પીલાય છે અને બહારથી પણ આખા શરીરને આલિંગન આપે છે. તેને ટાળવા માટે કોણ સમર્થ છે ? (ઓ. ૩૬-૬૨)

‘ભિસ્સામાં પચાસગણા ઇપિયાનું નાણું હોવાં છતાં તમે બધું બેઢાં બેઢાં જેઠી રહ્યા છો ? કાઢો જેઉ બધા બહાર. બ્રહ્મ તો તારા ભિસ્સામાં જ છે.’ એવું બાબા પેલા બ્રહ્મ લજાસુને કહેતાં જ તેણો ભિસ્સામાં હાથ નાખી પડીંદું બહાર કાઢયું અને ગણતાં દશ દશની પચ્ચીસ નોટો નીકળી. એ જેઠને પેલો ગૃહસ્થ મનમાં ને મનમાં ઓશિયાઓ થઈ ગયો અને, ‘મહારાજ કેટલા અંતર્જ્ઞાની છે’ એવા આશ્ર્ય સાથે એણે બાબાના ચરણ પર માણું મૂક્યું અને આશીર્વચ્છનોની ઉત્કર્ષાથી રાહ જેવા લાગ્યો. પછી બાબાએ એને કહ્યું, ‘પડીંદું વાળ તારા બ્રહ્મજ્ઞાનનું, લોભનો સંદૂર નાશ થયા વગર તને બ્રહ્મજ્ઞાન કયારેય પ્રાપ્ત થવાનું નથી. પુત્ર, પશુ અને ધન કમાવવામાં જ જેનું મન આસક્ત છે તેને દ્રવ્યરૂપી વિઘ્ન દૂર થયા વીના બ્રહ્મજ્ઞાન કયાંથી પ્રાપ્ત થવાનું છે ? દ્રવ્યનો મોહ છૂટવો ખૂબ અધરો છે. જાણો કે તૃષ્ણારૂપી ભંવરના ઊંડા કાઢવના ખાડામાં એટલે કે નહીં અથવા તો તળાવમાં જે જગ્યામાં ઊંડા પાણી છે, એમાં મદ અને મત્સર રૂપી મગરોના અસ્તિત્વને કારણે સહન કરવાનું ખૂબ જ કઢીન છે. એક નિઃસ્પૂહી જ એને પાર કરી શકે છે. લોભ જેઠે બ્રહ્મને અખંડ વેર હોય છે. ત્યાં મનની એકાગ્રતા ને આધાર નથી હોતો. પછી કેવી મુક્તિ અને કેવી સંપૂર્ણ વિરક્ષિત ? ખરેખર લોભિયો માણસ આચારભ્રષ્ટ હોય છે. લોભીને શાંતિ નથી હોતી, સમાધાન નથી હોતું અને નિશ્ચિન્તતા પણ નથી હોતી. ચિત્તમાં જરા પણ લોભ બાકી રહી જાય તો પરમાર્થની સર્વ સાધના માટીમાં મળી જાય છે. શ્રુતિ ને સ્મૃતિએ જેને અયોગ્ય ડેરવ્યો છે અને જે મનાઈ કરેલા પાપાચરણમાં સદૈવ આસક્ત રહે છે. તેનું ચિત્ત કયારેય સ્વસ્થ હોતું નથી. તેને જ વિક્ષિપિત્ત કહેવામાં આવે છે. તે સહાય ફુર્જકર્મમાં જ અટવાયેલો રહે છે. તથા વિષયરૂપી કાઢવમાં આયોટ્ટો રહે છે અને પોતાનું કલ્યાણ કે.... અહિત જેઠી શક્તો નથી. બ્રહ્મવિજ્ઞાન પ્રાપ્ત થઈને પણ તેને કર્મ ફળ વિરક્ષિત અથવા તો, અનાસક્તિ વગર તો એનું બ્રહ્મવિજ્ઞાન નકામું છે. તેને ખરો આત્મલાભ તો થયો જ નથી. કોઈ કાંઈ પણ માંગવા આવે પણ, સંત એના ઉદ્ધાર માટેના અધિકારની ધોર્યતા જેતા હોય છે, અને ત્યારબાદ જેવી જેની યોર્યતા અથવા અયોર્યતા હોય એ પ્રમાણે જ આપતા હોય છે. રાત અને હિવસ જે દેહાભિમાન અને વિષય ચિંતનમાં રોકાયેલો રહે છે, તેને માટે ગુરુનો ઉપદેશ અને પ્રયત્ન વ્યર્થ રહે છે.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેમજ તેના પ્રપંચ અને પરમાર્થ આ બનેને નુકશાન પહોંચાડે છે. ચિત્તની શુદ્ધિ વગર જે પરમાર્થમાં પ્રવેશાવા માંગે છે તે ફક્ત જ્ઞાનનો અને દિભાગનો દેખાડો હોય છે. એમાંથી કંઈ પણ પ્રાપ્ત થતું નથી. માટે યોગ્ય રીતે સમજાય તેટલું જ બોલવું અથવા ઉપદેશ કરવો અને પચે તેટલું જ ખાવું નહિ તો અમસ્તુ જ અપચો થશે, તે બધાને ખબર છે. મારો તો ભંડાર ભરપૂર છે, અખૂટ છે, જેને જેને જે જે જેઠાં અથવા ઠચ્છે તે બધું હું તેને આપીશ. પરંતુ મેળવવાની શક્તિ હોવી જેઠાં. હું તો લેવાવાળો જેટલું લઈ શકે તેટલું જ તેને આપું છું. આ જે ધ્યાન દઈને મારી વાત સાંભળશો તો તમારું કલ્યાણ થશે. આ મસ્તિદમાં બેસીને હું કદાપિ ખોદું બોલતો નથી.' (ઓ. ૬૩-૭૮)

આ સંતના શાખદોડીપી અમૃતની જાણે કે નદી જ છે ! એમાં શ્રદ્ધાથી ભાવિકો છલાંગ મારે કે તેમનો પાપડીપી મેલ ધોવાઈને અંતઃકરણની અને આચરણની પવિત્રતા પ્રાપ્ત થતી જય છે. સાઈબાબાના આવા મહિમાનું વર્ણન કરતાં જઈએ તો એનો અંત જ નથી. જેની જેઠે નથી, એને ઉપમા શાની આપી શકાય ? બાબા ઢોંગ સિવાયના શુદ્ધ પ્રેમને આધીન હતા. તે બધાની 'માઉલી' એટલે કે 'મા' છે. દુઃખથી પીડાતા અને કષ્ટથી થકેલાઓનું એ વિશ્રાંતીધામ છે. આશ્રય માટે આવેલાઓને માટે કલ્પવૃક્ષ છે. અને દિનદ્યાળુંઓ માટે સુખ આપનારો છાંયડો છે. સંસાર પર પાણી મૂડી પર્વતોની ગુફામાં એકાંતવાસ કરી, અને મૌન ધારણ કરીને, ફક્ત પોતાના જ કલ્યાણ માટે તત્પર રહેનારા સંતો પુષ્ટ છે. તેઓ ફક્ત પોતાનો જ સ્વાર્થ સાધે છે. તેમને બીજાઓની શી પરવા ? પણ સાઈબાબા એમાંના સંત ન હતા. તેઓ સ્નેહી અને સોભત વીનાના, સગાવહાલાં વીનાના અને ઘરબાર અને સ્વી સંતાન વીનાના હોવા છતાં સંસારમાં રહેતાં હતા. પાંચ ઘરે મૂડી મૂડી બિક્ષા માંગીને ચોવીસ કલાક જાડ નીચે બેસીને, તત્પુતો સંસારનો પસારો માંડી લોકોને વ્યવહાર શિખવતા હતા. જાતે પ્રહ્ર સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પણ જનતાના કલ્યાણ માટે ઘસાનારા મહાક્ષાની સંત આ જગતમાં ખૂબ જ થોડા છે. ધન્ય છે એ દેશ, ધન્ય છે એ કુળ ધન્ય છે એ નિઝાપ માખાપ અને ધન્ય છે તેમનો પવિત્ર ઊજજવળ ગર્ભ કે જેના પેટે આવાં શુદ્ધ નિર્મણ રતનો જન્મયાં. કોઈ પણ જાતનો પ્રયત્ન કર્યા વગર અનાયાસે પારસમણિ મળવા છતાં એને પથ્થર સમજીને મોટા ભાગના લોકો દૂર ફેંકી દે છે. તેવી રીતે આ શ્રેષ્ઠ ભગવતને આ શિરડીમાં લાંબા સમય સુધી કોઈ ઓળખી શક્યું નહીં. ઉકરડા ઉપર પડેલું રતન નાનાં ભાળકોના હાથમાં આવતાં મન ફાલે ત્યાં એને ફેંકી દે છે, અને મસ્તીમાં પથ્થરની માફક પણ નીચે રગડતાં હોય છે, એવી જ રીતે સાઈબાબાની બાબતમાં શરૂઆતમાં પણ આવું જ થયું હતું. (ઓ. ૮૦-૮૦)

આ પ્રમાણે પેલો બ્રહ્મજ્ઞાનનો શોખ ધરાવનારો ગૃહસ્થ ફક્ત આશિવર્યનોથી જ ટૂપ્ત થઈ ગયો. તમારી અને અમારી આવી જ પદ્ધતિ હોય છે. માર્ગ કષ્ટદાયક હોય એટલે તેને છોડી દેવો. જ્યાં તગી શાખદો સાંભળવા, સ્પર્શવા સંવેદનો લેવાં, સુગંધ લેવી, ખુલ્લા બ્રાહ્ય શરીરનાં દર્શન કરવાં વગેરે બાહ્ય વિષયોનો જ્યાં સુધી ઉપભોગ થતો હોય ત્યાં સુધી વિષયોનો વિરોધ કરવો અશક્ય છે. ઇન્દ્રિય નિગ્રહ વગર સહેલાઈથી મળનારી, વિષય સુખોથી વિરક્ષિત, અંતર આત્માનું પ્રત્યક્ષ દર્શન અથવા તો તેને લગતું યથાર્થજ્ઞાન અશક્ય છે. પહેલાં બધી ઈરછાઓનો ત્યાગ કરી અને ત્યાબાદ સહગુરુના અનન્યપણે શરણે જય છે. આવા જે દઢ શ્રદ્ધાયુક્ત સાધક હોય છે, તે જ આત્મ સાક્ષાત્કારને પાત્ર થાય છે. વિદ્ધાન શ્રોતાઓની પણ પાંચ ઇન્દ્રિયો જ્યારે પોતપોતાના વિષયોને છોડશે, મન જ્યારે સંકલ્પ અને વિકલ્પ પોતાની જત છોડી દેશો અને બધી વાતોથી નિવૃત્ત થયેલા અંતઃકરણમાં બુદ્ધિ પણ જ્યારે નિશ્ચય કરવાનું બંધ કરશે ત્યારે જ તે ખરી અત્યંત ઉત્કૃષ્ટ પરમ ગતિની અવસ્થા એટલે કે મોક્ષ, અને કદી ન બહલનાર નિર્વિકાર બહુની પ્રાપ્તિ થશે। કઠોપનિષદ્ધ અધ્યાય-૨, વલ્તી ૩, મંત્ર ૧૦માં જણાવાયું છે કે યદી ધર્માવાત્શને, જ્ઞાનાનિ મનસા સહ જુદ્ધિશ્વ વ વિયેષ્ટતિ, તામાહુ: પરમાં ગતિમ્ભ. ॥૧૦॥ યોગ અભ્યાસ કરતાં જ્યારે મન સહિત પાંચે ઇન્દ્રિયો સારી રીતે સ્થિર થઈ જય છે, અને બુદ્ધિ જ્યારે કોઈ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પણ પ્રકારની ચેષ્ટા કરતી નથી, તે સ્થિતિને યોગીજનો પરમગતિ એટલે કે યોગની સર્વશ્રેષ્ઠ સ્થિતિ કહે છે. જેની બુદ્ધિએ કોઈ પણ પ્રકારની વાતનો નિર્ધાર કરવાનો રોકી રાખ્યો હો, જેના ચિત્તમાં હું જે છું તે એકલો છું, મારા સિવાય જગતમાં બીજો કોઈ નથી, એવું ચૈતન્ય પ્રગટેલું હો, એ જ ભાગ્યવાન આત્માને ઓળખશે. વિષયોથી મુખ ફેરબ્યું કે ઇન્ડિયો આત્મા તરફ વળે છે, અને ત્યારે જ આત્મ સુખ પ્રગટ થાય છે. બીજાં કોઈ સુખ જ હોતાં નથી. જે વિષયોની મનોવૃત્તિ નીચે સંતાયેલાં છે, તેમને અતિસ્ફૂક્ષમ અને અસ્પષ્ટ એવું જે પરમાનંદ પ્રાપ્તિનું સાધન એટલે આત્મજ્ઞાન તેને સમજવા માટે ખૂબ જ અધુરું અને અતિ ગહન હોય છે. આલોકની અને પરલોકની વાતોમાં બ્રહ્મદેવના અધિકાર પદ પર્યન્તની બધી વાતો માટે જેને આસક્તિ નથી હોતી, તે જ એક બ્રહ્મનિષ્ઠ પદ પર વિધિપૂર્વક બેઠેલો તથા મુક્ત જણાવો. ચિત્તને વિષયોથી ધીર ધીર પાછળ ઘકેતી સ્વસ્વરૂપે સ્થિત કરીને આત્મજ્ઞાનથી જોડવું. આલોકનાં અને પરલોકમાં, કર્મનાં ફળોની વિરક્તિ અને હર્ષ અને શોક જેવાં દ્વારાનો ત્યાગ જેનો બુદ્ધિમાન લોકો જ અનુભવ કરતા હોય છે, અને તે જ ખરો આત્મજ્ઞાનનો માર્ગ છે. (ઓ. ૮૧-૧૦૨)

આધિક્રિયા, આધ્યાત્મિક અને આધિકૌતિક દુઃખ-રૂપી દાવાનળની સંપૂર્ણ ઉકળી ઉઠલી જવાળાઓથી અતિશય તપેલો સંસાર-રૂપી સાગરના પાણીમાં કોણ સુખી હો? એમાંથી આપણો સંપૂર્ણ છુટકારો કરાવવા માટે શ્રી સાઈબાબાની કૃપા મેળવી કરી લેવી અને તેમના ચરિત્રનું આદરપૂર્વક વાંચન, અવલોકન, શ્રવણ અને મનન કરવું. શ્રીસાઈનાથનું ચરિત્ર શ્રોતાઓએ પોતાના પુત્ર, પત્ની અને ભિત્ર સહ સાંભળવાથી તો આલોકનું અને પરલોકનું પણ ઈષ સાધ્ય થશે. તેઓનું કલ્યાણ થશે. શ્રીબાબાની લીલાઓ અનેક પ્રકારની અને અવનવી છે. ભાગ્યવાન શ્રદ્ધાળું શ્રોતાઓ જ આ કથાને સાંભળી શકે છે. આ કથાના નિયમિત શ્રવણથી મનની શાંતિમાં વધારો થાય છે. આ કથારૂપી જરાના પ્રવાહમાં સાંદું નરસું એમ બંને કર્મરૂપી મીઠું ઓગળી જય છે અને કર્ણ દ્વારા સાઈબાબાનું સુંદર રૂપ દાખિમાન થાય છે. આ ચરિત્રના શ્રવણથી પાપોનો નાશ થાય છે. કાળની સાથે પણ લડીને વિજય મેળવવાની તૈયારી થાય છે, તેમજ શ્રોતાઓને પણ પરમ આનંદ અનાયાસે પ્રાપ્ત થાય છે. શ્રવણથી અંત: કરણ શુદ્ધ થાય છે અને જન્મ ભરણના ફેરામાંથી મુક્તિ મળે છે. શ્રોતાઓ જે તે શ્રવણના ફળની ઈચ્છા ન કરતાં તે શ્રવણને ઈશ્વરને અર્પણ કરે તો તેમને બ્રહ્મ પણ પ્રાપ્ત થાય છે. એવા આ સાઈબાબાની સેવાનું કર્મ સેવકોને સદાને માટે નિર્જામ મોકો આપે છે, શ્રીસાઈરામ પોતાના ભક્તોને સ્વસ્થ અને દુઃખોથી મુક્તિ અપાવે છે. શ્રોતાઓ! આ ગ્રંથના એકેએક અધ્યાય લઈને દરરોજ મનથી એનો અભ્યાસ કરી સતત એનું ચિંતન કરો. ‘આનંદો બ્રહ્મેતિ બ્યજનાત્’ આનંદ એ જ બ્રહ્મ છે, એ એમને નિશ્ચિંતપણે જાણવું એમ જે તૈત્તિરીય ઉપનિષદ વલ્લી ત અનુવાદ દમાં પ્રસિદ્ધ છે, તેમાં શ્રુતિ સિદ્ધાંતનો અર્થ બાબા પોતાના ભક્તોને જાણે કે બીજાં શાખામાં કહેતા હતા. તેમનો કાયમી ઉપદેશ રહેતો, ‘જરા પણ ફિકર કરતા નહિ, સદા આનંદિત રહો અને ભરતા સુધી ચિંતા કરતાં નહીં.’ (ઓ. ૧૦૩-૧૧૩)

આ અધ્યાયનું ચોપખું ધોરણ બ્રહ્મત્વને જાણવા માટેનું છે કે જેને કારણે સાઈબાબાના શરણે જનારને તે સંસારરૂપી સાગર પાર કરવા માટેની નૌકા બની શકે. બીજાઓને તે વારંવાર એમના હિતોની વાતો કહેતા. એમની ઉપર સદાએ ઉપકાર કરવા માટે શાસ્ત્રો અને વચનોનું અનુકરણ કરીને બાબા જાતે એ પ્રમાણે વર્તતા હતા. આ સાંદું કે આ ખરાબ આ પ્રકારનો મતભેદ કેવળ વ્યક્તિગત છે. જેને લીધે સર્વ સામાન્ય જનતાને આનંદ વર્તે એ તરફ જ આ ગ્રંથનો ચોખ્ખો હેતુ અને પ્રયોજન છે. બાબા દરેક કાર્યનું કારણ જાણતા. જેવી જેની મનની ઈચ્છા હોય છે તેવું જ થાય છે. ગુરુના મુખેથી નીકળેલી વાતો સાંભળવી, તેમની કલ્પના ન કરી શકાય એવી લીલાઓનો અનુભવ કરવો અને યાદ રહે એવી વસ્તુઓ ભેગી કરીને બીજાઓને સંભળવવી. શ્રીસાઈબાબાનું આ સુંદર ચરિત્ર અત્યંત આદરથી ગ્રહણ કરવાથી વક્તા અને શ્રોતા એ બંનેના દુઃખ દૂર થાય છે અને બાકી બધાના ખરાબ દ્વિવસોનો પણ અંત આવે છે. બાબાની અલૌકિક લીલાઓ જેઠિને જે ચક્રિત

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

થયો નથી, કેવળ દર્શનોથી મન શાંત થયું નથી અને જે તેમના ચરણ કમળમાં નમ્ર થઈને નમ્યો નથી, તે મોટો અભાગી છે, સાઈબાબાનો ઉપહેશ નિર્મળ છે. કંટાળો ન લાવતાં તેને સાંભળવો જોઈએ. આવી મળેલ સુખની તક કોણ ભલા જતી કરશે ? (ઓ. ૧૧૪-૧૨૧)

સ્ત્રી, પુરુષ અને મિત્રઙીપી આ વમળમાં કામ કોધ જેવા મગરો ભરેલા છે. અનેક રોગરુપી મોટાં વિશાળકાય માઇલાંઓ પણ ભરાયેલાં છે અને આશારુપી મોટાં મોંજાંઓથી ખળખળેલો છે. કેટલાયે વખત ઉદ્ઘેગોના જટકા આવી જતા હોય છે, હર્ષ શોક જેવી લાગણીઓ મનમાં ઘટકો ઉત્પન્ન કરે છે. પરંતુ થોડીવારમાં સ્ત્રી અને પુત્રનો સંબંધ કાંઈ એકાએક તોડી શકાતો નથી. આપણા પોતાના જીવને સમજલવીને જાગૃત કરી તેને સમજલવો કે, તું જ સત્યબ્રત્ત છે. બેસવા આપેલી લાકડીને પગથી મજબુત પકડીને પોતાની જતને ઉધા લટકતા પોપટની માફિત તું દેહના સહિવાસથી પોતે જ બંધન યુક્ત થયેલો છે. કેવળ મોહ માયાના કારણે અને પ્રેમ અને ભમતાના અતિરેકથી તું તારી બુદ્ધિ ગુમાવી બેઠો છે અને પોતાનું હિત ભૂલ્યો છે માટે સ્વસ્વરૂપ તરફ જલ્દીથી પાછો ફર અને પોતાના સાચા સ્વરૂપને તું જાણી લે. ખોટી સમજથી ભ્રમોના હિસાબે મનના ગોટાળાઓમાં વધારો થાય છે અને હું દેહ છું તથા હું જ કર્તા છું વરોરેથી અહંકાર વધારે છે. હું અને મારું આમ મૃગજળની જેમ છે. બંધનવાળો માણસ મુક્ત પણ થઈ શકે છે. બંને દશાઓથી જુદો થઈને તું શુદ્ધ સ્વરૂપમાં જ રહે. આ જ્ઞાન ભક્ત તુલના માટે જ હોય છે. સુખ અને હુઃખ જેવા અજ્ઞાનને છોડીને વિશેષ શાનનો અનુભવ કર, એટલે બ્રહ્મજ્ઞાન તેની ખૂબ જ પાસે હશે. દેહમાં જ્યાં સુધી હું અને તું પણ છે, ત્યાં લગી તું પોતાનું એ હિત જેનારો થવાનો નથી. એને છોડ. પોતાના દેહને પકડનારી ચીકાશને તું દૂર કરીને નાખી હે અને પોતાના સ્વસ્વરૂપ સામે જો. કુબેર જેવો શ્રીમંત જે બીજ માંગતો ફરે લાગે તો તે ફક્ત અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું દુર્દેવ છે. નહિ કે ? જીવત્મા પોતે સર્વવ્યાપી અને સર્વજ્ઞ પરમેશ્વર હોવાં છતાં તે પોતાને માત્ર દેહ જ માને તો આવી ખોટી માન્યતાથી અને અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું દુર્દેવ નહીં તો બીજું શું ? (ઓ. ૧૨૨-૧૩૧)

હુંમેશા ઉત્તમ શાસ્ત્રોનું અને ગ્રંથોનું સાહિત્ય સાંભળવું, વિશ્વાસપૂર્વક સદ્ગુરુનાં વચન પાળવા અને સદાય સાવધ રહીને પોતાના લક્ષ ઉપર ધ્યાન આપવું. શાસ્ત્રોએ અને ગુરુએ કહ્યા ગ્રમાણેની અચાર પદ્ધતિ ધ્યાનમાં રાખીને પોતાના ઉદ્ઘારનો માર્ગ ચોખ્યો કરતા હોય છે. તેમના ઉપહેશથી અસંખ્ય લોકોનો ઉદ્ઘાર થાય છે. અને મોક્ષનો માર્ગ સરળ થઈ જય છે. સંસારનાં બંધનોમાંથી એક ક્ષણે છુટકો થરો. તે ક્ષણ કથારે આવરો એવી જેના મનમાં સતત રાત દિવસ ચિંતા થાય છે એવો જીવ સ્ત્રી અને પુત્રના બંધન પળવારમાં છોડી હે છે. મળે એવું એકાંત મેળવીને અને સંસારમાં કોઈ અર્થ નથી એવી મનમાં ગાંઠ વાળીને અધ્યયન અને આત્મચિંતનમાં સદાયે મન્ત્ર રહેવું. ભક્તિ અને શ્રદ્ધાયુક્ત મનથી નમ્રતાથી સાષાંગ પ્રણામ કરીને ગુરુના શરણમાં ગયા વીના શિષ્યને તે જ્ઞાનનો મૂલ્યવાન જથ્થો મળતો નથી. ગુરુને સર્વસ્વ અર્પણ કરી એમની સેવા કરવી. બંધન અને મોક્ષને લગતી વાતો સ્પષ્ટ કરી લેવી અને વિદ્યા અવિદ્યા અંગે એમની સાથે વાર્તાલાપ કરવાથી ગુરુમહારાજ પાસેથી ઉત્તમ ફળ મળે છે. આત્મા કોણ અને પરમાત્મા કોણ એ ગુરુ સિવાય બીજું કોઈ સમજલવી શકતું નથી. ગુરુ પણ શિષ્યની સંપૂર્ણ શરણાગતિ સિવાય જ્ઞાનનો એક કણ પણ આપતા નથી. ગુરુ વીના બીજ પાસેથી મેળવેલું જ્ઞાન કોઈ દિવસ સંસારમાંથી પૂર્ણ છૂટકારો મેળવી આપતું નથી અને મોક્ષગામી ફળ મળતું નથી. કદાચ તે મનમાં છસતું પણ નથી. માટે જ ‘ગુરુ વિના જ્ઞાન નહિ’ તે સર્વ વિદ્ધાનો જાણો છે. બ્રહ્મ અને આત્મા એક જ છે. એના અનુભવની વ્યવસ્થા કરવા માટે ગુરુનાં જ ચરણ સર્મર્થ છે. ત્યાં કોઈ પણ જ્ઞાન જતની આનાકાની વગર માન અપમાન તથા અભિમાન છોડીને જમીન પર ગુરુના ચરણમાં દંડવત્ત પ્રણામ કરવાં જોઈએ. ગુરુ ચરણોમાં ડોક નમાવીને અને તેમના પગ પકડીને દદ મનથી કહેવું પડે છે ‘હું તમારા દાસોનો પણ દાસ છું અને મને તમારા ચરણોમાં સંપૂર્ણ ભરોસો છે.’ પછી જુઓ એ ગુરુના

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ચમત્કાર !! એ ગુરુરૂપી દ્વારાનો સાગર ડોલવા લાગશે. અને પોતાનાં મોળંઓના તરંગોની શાખા પર તમને ઉપર જીલી રાખશે. તે સુરક્ષાની ખાત્રી માટેનો તેમનો અભય હથ તમારા માથા ઉપર મૂકીને અલા બલાનો ધ્વંસ કરે છે, તેમજ માથે ઉદ્દી લગાડીને પાપની સર્વ રાશીના ઢગલાને બાળીને ખાખ કરી નાખે છે. (ઓ. ૧૩૨-૧૪૪)

આ પ્રકારે બ્રહ્માથીને બ્રહ્મનું સ્વરૂપ બતાવીને કેવળ નિમિત્ત થઈ બાબાએ જીવાત્મા અને પરમાત્માની એકતાની જણકારી ભક્તોને સંપૂર્ણપણે આપી છે. મનમાં સહેલે શંકા આવશે, કે સાઈ મહારાજની આટલી પ્રાખર બુદ્ધિમતા અને ગાઢ વિદ્વત્તા હોવાં છતાં મજલ મશકરીને તે આટલું મહત્વ શા માટે આપતા અને બાબાને વિનોદવૃત્તિનો શોખ શા માટે હશે? જેમ કે બ્રહ્માથીને બ્રહ્મજ્ઞાન લેવા ગણન વિષય પર સમજાવીને કહેતી વખતે બાબાએ તેના દ્રવ્ય લોભની બધાની હાજરીમાં મજલ શા માટે ઉડાડી? પરંતુ વિચાર કરીને જેઠાં તો એક જ કારણ દ્યાનમાં આવે છે, તે હવે સાંભળો. નાનાં બાળકો જેઠે બોલતી વખતે તેમની બોખડી અને કાલી કાલી ભાષામાં બોલે છે. ઉભરલાયક માણસો અલંકારીક અથવા તો ઉચ્ચ શબ્દ રચનાઓની કથાવાર્તા થોડાં કરે છે? જેની મશકરી કરવામાં આવે છે એની પર પ્રેમ નથી એવું કંઈ થોડું જ છે? પરંતુ ઉપદેશ કરવામાં વિનોદ, મજલને એક વિશેષ સ્થાન છે. પોતાના પેટમાં કચો રોગ છે એને નાના બાળકને કેવી રીતે સમજાય? ઓષ્ઠધની ઘૂંઠી જે તે જીવી રમતિયાળ બાળક પીતું ન હોય તો મા કદી તેને પટાવીને તો વળી કોઈક વખત આંખો કાઢીને અથવા કોઈવાર માર મારીને તો વળી પ્રેમથી છાતીએ લગાડીને તે પીવડાવે છે. પરંતુ તે જ બાળક મોટું થવા માટે ત્યારે તેના લાડ કોડ કરતા પહેલાં તેની તીવ્ર કે પરીપક્વ બુદ્ધિનો વિચાર કરવો પડે છે. જ્ઞાનનું પણ એવું જ છે. તીક્ષ્ણ બુદ્ધિનું તીવ્ર ગ્રહણ હોય છે. ઉપદેશ ગ્રહણ કરતાં ક્ષણભરનો પણ વિલંબ થતો નથી. પણ જરૂર બુદ્ધિનું તો કામ જ વિચિત્ર હોય છે. તેને મગજમાં ઠસાવવા માટે ઝૂબ જ મુશ્કેલી થાય છે. શ્રીસાઈસમર્થ તો જ્ઞાનના ભંડાર છે. જેવો ભક્ત, જેવી બુદ્ધિ, તેવી જ તેની પાત્રશુદ્ધી નક્કી કરીને જ્ઞાનરૂપી દ્રવ્ય વહેંચે છે, તેઓ તો પૂર્ણ અંતરક્ષાની છે. દરેકને લગતી માહિતી પહેલેથી તેમની પાસે હોય છે. જેને જેવું યોગ્ય સાધન તેને તેવું જ નિયમથી સહજવતા. જેવો જેને અધિકાર એવો જ એનો વિચાર કરીને તેની યોગ્યતા કે અયોગ્યતા પ્રમાણે ભક્તોની જવાબદારી બાબા લેતા. દેખાવમાં અને ઉભરમાં ભલેને અમે મોટા હોવા છતાં સર્વ સિદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થયેતા એવા સિદ્ધ શ્રીસાઈની સામે આપણે એક નાના બાળકની માફક છીએ. માટે મજલ તથા વિનોદ ખાતર સહાય આતુર જ રહેવું. બાબા તો વિનોદનો ભંડાર હતા. જેને જે ગમતું અને જેમાં જેની પસંદગી હોય તેવા તેને માટે યથા ઈચ્છા પૂર્ણ કરી ભક્તોને હંમેશાં સંતોષ વૃત્તિમાં રાખતા. જેથી પોતાનો ઉપદેશ તેમને વ્યવસ્થિત સમજાય અને તેમના મનમાં સહેલાઠી ઉત્તરી જથ્ય અને પછી એ બુદ્ધિવાન હોય કે, બુદ્ધિહિન હોય. ભક્તો આથી સંતોષ જ પામતા. આ અદ્યાય વાંચતા પરમાનંદ પ્રગટશે, સાંભળવાથી નાદ વધશે અને મનનથી સ્વાઅનંદનું સમાધાન થશે. એનું પુનરાવર્તન કરવાથી પરમાર્થનું જ્ઞાન મળશે તેમજ નિરંતર ચિંતનથી અખંડ આનંદ અને સુખ પ્રાપ્ત થશે. આવી આ શ્રી બાબાની લીલા મર્યાદારહિત છે. એમાંનો થોડો પણ અનુભવ જેના નસીબે થયો હશે તે કાચા વાચા અને મનથી ખીલ્યો જ સમજલે. ખરેખર સાઈબાબાની લીલા કલ્પના ન કરી શકાય એવી અગમ જ છે. અને આશ્રય પમાઠે તેવી છે. (ઓ. ૧૪૫-૧૬૧)

હેમાડપંત સાઈબાબાનાં ચરણોમાં શરણો આવ્યા છે. મજલ, મશકરી કરી, જ્ઞાન પ્રદાન કરી ભક્તોનું કલ્યાણ કરવું આ એક જ બાબાનો હેતુ હતો. બ્રહ્માથીને તો કેવળ એક નિમિત્ત જ સમજવો. આગળનો અદ્યાય આ કરતાં પણ સારો હશે જે સાંભળનારાઓના લાડકોડ પૂર્ણ કરાવશે. મારા મનની છાની ઈચ્છાઓએ સ્પષ્ટપણે ઉધાડી કરીને એનો ફોડ પાડીશ. હું માધવરાવ દેશપાંડે પાસે જઈશ. તેમને બાબાનો સહેશો આપીશ. અને પછી બાબાની કૃપા હું કેવી રીતે પામીશ એ શ્રોતાઓએ સંપૂર્ણ પણે સાંભળવું. (ઓ. ૧૬૨-૧૬૪)

શ્રી સાઈનું સત્ય ચિત્ર

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંતો અને સજજનોથી પ્રેરણા પામેલા હેમાડપંત રચિત શ્રી સાઈસર્વના સત્ય ચિત્રનો ‘બ્રહ્મજ્ઞાન કથનમ- ૨’ આ નામનો સતરમો અધ્યાય અહીંથાં સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણ.



અધ્યાય સોણ અને સતરનું અર્થ વિવરણ.

આ બંને અધ્યાયમાં ‘બ્રહ્મજ્ઞાન કથનમ’ પરનો અતિગાહન વિષય કહ્યો છે. કોઈ એક લોભી શ્રીમંત ગૃહસ્થ બાબાની કીર્તિ સાંભળીને પાછા ફરવાના ભાડાના નક્કી કરેલ ટાંગામાં આવીને બાબા પાસે બ્રહ્મજ્ઞાન માંગતા જ બાબાએ મશકરીમંજી તેના ખીસ્સામાંથી તે કાઢી બતાવી તેને ત્યાં ભેગી થયેતી ભક્ત મંડળીને ‘લોભ છૂટયા વગર તફન’। બ્રહ્મ નિઃશંકા અપ્રાચ્યા’ આ કેવું ઠસાવી દીધું, એની એક સરળ સુંદર કથા જે કહી નાખી હોય પણ ત્યાર બાદ કરેલા બ્રહ્મજ્ઞાનના વિવેચન લેવા ગાહન વિષયોને કારણે અને વેદાંતના અને સંસ્કૃત ભાષાના તાંત્રીક શબ્દોને કારણે વાચકોને તે સમજવામાં આધું પડે છે. માટે એનો થોડામાં સાર સાદી ભાષામાં નીચે પ્રમાણે રજૂ કરું છું.

બ્રહ્મ એટલે શું ?

બ્રહ્મ એટલે પરમાત્મા જે જગતની ઉત્પત્તિનું કારણ છે તે સર્વ જગમાં વ્યાપેલું છે. અને સર્વેના હૃદયમાં વાસ કરીને આ જગતનો વ્યવહાર ચલાવી રહેલ છે. એના હુકમથી સૂર્ય અને ચંદ્ર નિયમ પ્રમાણે ઊરે છે અને આથમે છે. ગરમી, વસંત વગેરે ઋતુઓનું નિયમથી આવે છે અને ઈન્દ્ર આદિ દેવ અને લોકપાત નિયમથી પ્રજાનું પાલન કરે છે.

બ્રહ્મજ્ઞાન શાને કહેવાય ?

આ બ્રહ્મને યથાર્થ જાણવું તે. બ્રહ્મ અને આપણો આત્મા એ એક જ છે તે જુદા નથી. એવો વિશ્વાસ હોયો એટલું જ નહિ તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો તેને ‘બ્રહ્મજ્ઞાન’ કહેવાય છે. ઘડામાં અંદરનું આકાશ અને એની બહાર જગતમાં વ્યાપી રહેલું અવકાશ તે જેમ જુદાં નથી તેવી રીતે આપણા શરીરમાં રહેલો આત્મા અને સર્વ જગમાં વ્યાપી રહેલો પરમાત્મા એ પણ જુદા નથી. માટે બ્રહ્મજ્ઞાનને આત્મજ્ઞાન પણ કહેવામાં આવે છે. આત્માને યથાર્થ જાણવો, એટલે બ્રહ્મને જાણ્યાનો અનુભવ ગ્રાપ્ત થાય છે.

માણસે બ્રહ્મજ્ઞાન શા માટે પ્રાપ્ત કરવું ?

‘બ્રહ્મજ્ઞાન’ થયું એટલે માણસને આ વિશ્વમાં સર્વ કંઇ પોતે જ છે પોતાના સિવાય જગમાં અન્ય કોઈ વસ્તુ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નથી એવી ભાવના જગૃત થાય છે. જેને કારણે તેને કોઈ પ્રકારનો ઉર રહેતો નથી. પછી નથી રહેતો તેને કોઈ શત્રુ કે મિત્ર. એકવાર બ્રહ્મને જાણ્યા બાદ કર્ષું જાણવાનું રહેતું નથી. સાક્ષાત્કાર થવાને કારણે તેને બધું સ્પષ્ટ હેખા છે. આ બ્રહ્મજ્ઞાનનું ફળ એટલે સંસારિક દુઃખો અને ચિંતાઓથી નિવૃત્તિ. સતત કાયમી પરમાનંદની પ્રાપ્તિ અને મોક્ષ મળે છે. જે આ બ્રહ્મજ્ઞાન જાણ્યા સિવાય દેહ પડી જય તો સાંસારિક બંધનો પીછો છોડતાં નથી અને પુનર્જન્મના ફેરામાંથી છૂટી શકતું નથી. તે માટે જ વિચારશીલ પુરુષો દેહ પડતાં પહેલાં બ્રહ્મના પુરુષાર્થ સાધી લે છે.

બ્રહ્મજ્ઞાનનો અધિકારી કોણ ?

બ્રહ્મજ્ઞાનનો માર્ગ ખૂબ અધરો છે અને તે બધાને માટે સહેલો નથી. બ્રહ્મ માટે પાંચ પ્રાણા, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ ક્રમન્દ્રિયો, અહંકાર, બુદ્ધિ અને મન એ બધું જ સમર્પણ કરવું પડે છે. જે યોગીઓ પર્વતોમાં જઈને યમ અને નિયમોમાં અટવાઈને ધ્યાન ધરીને સંતાઈને બેઠા છે તેમને પણ ગુરુની કૃપા વગર બ્રહ્મ હેખાતું નથી.

બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિની જે ઈચ્છા કરે છે અને બીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખતો નથી અને આ લોક કે પરલોકનો જેને લેશ માત્ર લોભ નથી એ જ બ્રહ્મજ્ઞાનનો ખરો અધિકારી છે. અહંકાર ઓગજ્યા સિવાય, લોભનો નાશ થયા સિવાય અને મન ઈચ્છા રહિત કર્યા સિવાય બ્રહ્મજ્ઞાન થતું નથી. શરીર એ જ આત્મા છે એવી બુદ્ધિ માણસને ભ્રમમાં રાખે છે. કોઈ પણ વસ્તુવિષયની આસક્તિ હોવી એજ બંધનનું કારણ છે. વિષયો વિષેની કલ્પના અને ઈચ્છા છોડો એટલે બ્રહ્મ હાથ લાગ્યું જ છે એ જાણવું.

જ્યાં સુધી લુભથી બાહ્ય વિષયોનો સ્વાદ લેવાય છે. કાનથી શબ્દો સંભળાય છે ત્વચાથી સ્પર્શ સુખ ભોગવાય છે અને નાકથી સુગંધ અને આંખોથી સુંદર અવયવોનાં દર્શનનો આનંદ લેવાય છે, ત્યાં સુધી ઈન્દ્રિયોનો સંયમ અશક્ય છે. બધી ઈચ્છા આસક્તિ છોડીને સહગુરુના શરણે ગયેલો એવો દદ શ્રદ્ધાવાન સાધક જ આત્મજ્ઞાનને પાત્ર હોય છે. આંખ કાન વગેરે પાંચ ઈન્દ્રિયો પોતપોતાના વિષયોને છોડશે તથા મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરવાનું છોડી દેશે અને બુદ્ધિ પણ જ્યારે પોતાના નિશ્ચલ થયેલા અંતઃકરણમાં પોતાનો નિશ્ચય કરવાનું બંધ કરશે, ત્યારે ઉત્પન્ન થતી સ્થિતિ એ જ પરમગતિ છે અને તેજ નિર્વિકાર બ્રહ્મ છે. બુદ્ધિ નિશ્ચય ન કરનારી થશે અને ચિત્તમાં હું એકલો જ છું, મારા સિવાય જગતમાં અન્ય કોઈ જ નથી, એવું ચૈતન્ય પ્રગટે તેને જ ભાગ્યવાન આત્મા કહેવાશે. ચિત્તને ધીમે ધીમે ફેરવાને એને આત્મસ્વરૂપમાં સ્થિર કરવાથી આત્મજ્ઞાન થાય છે. આલોકમાં કે પરલોકમાં કર્મ ફળની વિરક્તિ અને હર્ષ શોક જેવાં કંદોનો ત્યાગ બુદ્ધિમાન લોકો જ કરી જાણે છે.

બ્રહ્મજ્ઞાનનો અધિકાર કોને નથી ?

બાળબચ્ચાં, ધનદાંખર અને પૈસા કમાવા માટે જેનું મન આસક્ત છે, તેવાને દ્રવ્યકૃપી વિદ્ધન દૂર કર્યા સિવાય બ્રહ્મજ્ઞાન વળી કેવું ? દ્રવ્યનો મોહ છોડવો બહુ જ અધરો છે. તૃપ્તાઙ્ગુણી વમળમાં થયેલાં દુઃખોનું જણે એ ઉંડું વહેણ છે. મહ મત્સર અથવા તો ભયંકર ભગરોના અસ્તિત્વના કારણે એક નિઃસ્પૂર્ણ જ એને પાર કરી શકે છે. લોભની સાથે બ્રહ્મને અખંડ વેર છે, ત્યાં ધ્યાનને માટે જગ્યા નથી રહેતી, પછી કઇ ભક્તિ, કઇ મુક્તિ અને વિરક્તિ ? લોભી માણસનો આચારભ્રષ્ટ હોય છે. લોભીને શાંતિ નથી હોતી. ચિત્તમાં જે આવો એક લોભ ધર કરીને બેસે તો સર્વ સાધનો માટીમાં મળી જય છે.

જ્ઞાન પ્રાપ્ત થયા બાદ પણ જે અધર્મના માર્ગનું આચરણ કરે છે, તે નીચે આ પૃથ્વી ઉપર નહિ અને સ્વર્ગમાં પણ રહેતાં, વિશંકુ જેવી દ્રશ્યમાં વર્ચે જ ભટકતો રહે છે. જીવની આ અજ્ઞાન વૃત્તિ એ જ તેને સંસાર તરફ પ્રવૃત્ત કરતી હોય છે, જે સદાને માટે અશાંત અને અસ્થિર છે અને જેનું ચિત્ત એકાગ્ર નથી હોતું એવો જ્ઞાની પણ આત્માને પામતો નથી.

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

જે કોઈ મનુષ્ય ખરાબ ફૃત્યોથી અને પાપના આચરણથી વિરક્ત થઈને તેને ત્યાગતો નથી અને જેનું મન ઈશ્વરને ભૂતી ને રાત અને દિવસ સંસારમાં ભટકતું રહે છે તથા ઈશ્વર ઉપરની શ્રદ્ધા વીના જે સહાય દૂર અને અશાંત રહેતો હોય છે તથા જેનું મન બુદ્ધિ અને ઈન્દ્રિય, તેને પોતાને આધીન નથી, એવો મનુષ્ય સૂક્ષ્મ બુદ્ધિથી અને આત્મ ચિંતનથી પણ બ્રહ્મ પ્રાપ્ત કરી શકતો નથી.

જેને જાણવાથી બ્રહ્મ સમજાય છે, એ આત્મા કેવો હોય છે ?

ખરું જોતાં તો આત્માનું વર્ણન કરતાં કરતાં વેદો થાકી ગયા, તપસ્વીઓ પણ વનવાસી થયા. ઉપનિષદોએ હાથ લેઠા મૂક્યા અને કોઈને પણ એનો ખરો ઉકેલ મળ્યો નહિ. ઇતાં જે સમજલવી ન શકાય તેમ હોવા છતાં તેને શબ્દોમાં ગુંધીને વેદાંતીઓએ એનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે જે આ પ્રમાણે છે.

આ આત્મા સહાય રહેનારો, પ્રાચીન અને કદી પણ નાશ ન પામનારો છે. જન્મ મૃત્યુ તેને બંધન કર્તા નથી. અને આરંભ કે અંત ન હોવાને કારણે તે સ્વતંત્ર છે.

પ્રતિબિંબમાં એટલે કે એક નાના કાણામાંથી પસાર થતાં સૂર્ય પ્રકાશનાં કિરણોમાંનો અતિ સૂક્ષ્મ કણ અને એનાથી પણ સૂક્ષ્મ અણુ, અને એ આણુ કરતાં પણ અતિ સૂક્ષ્મ એવો આત્મા છે એવી કલ્પના કરવમાં આવે છે. મોટામાં મોટું એટલે બ્રહ્માંડ, પણ આત્મા એના કરતાં પણ મોટો (મહાન) હોય છે, એવી ધારણા છે. પરંતુ આ બધી સાપેક્ષ તુલના માટેની કલ્પનાઓ જ છે. ખરું જોતાં આત્માને માપવો એ એક તદ્દન અશક્ય બાબત છે. એ સૂક્ષ્મતામાં સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ અને મોટાઈમાં મોટા કરતાં પણ અતિ મોટો છે. એની બાબતમાં નામ અને ઇપને ઉપાધીઓ જ માનવાં. તે સહાય પરિપૂર્ણ અને ઉપાધી સિવાયનો છે. તે સહેલાઈથી પ્રાપ્ત થતો નથી. ઊંકાર પ્રતિક ધરાવનારું બ્રહ્મ એ જ એનું મૂળ સ્વરૂપ છે.

બ્રહ્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરાય ?

બ્રહ્મજ્ઞાનનો માર્ગ કપરો છે. તે બધાને માટે સહેલો નથી. તેને માટે અભ્યાસ અને શ્રમ કરીને લોહીનું પાણી કરવું પડે છે. ઉત્તમ અધિકાર પ્રાપ્ત કરેલાને બ્રહ્મજ્ઞાન અહૃયણ સિવાય સહેલાઈથી પ્રાપ્ત થાય છે, જ્યારે મધ્યમ અધિકાર પામેલા માટે દ્રાવેલી પદ્ધતિ પ્રમાણે ધીમે ધીમે તેમાં આગળ વધવું પડે છે. કોઈ ગગન માર્ગે જતા હોય છે, જ્યારે બીજી કમે કે પગથિયાં ચઢીને જતા હોય છે. પરંતુ અધિકાર સિવાયના લોક માત્ર બ્રહ્મને જાણવા આત્મ અથાગ વ્યર્થ પરિશ્રમ કરીને કંઈ જ પામતા નથી. એમનો શ્રમ સંદર્ભ નિર્શર્ક હોય છે.

બ્રહ્મપ્રાપ્તિ માટે આ બે અધ્યાયોમાં નીચે જણાવેલા ઉપાયો બતાવવામાં આવ્યા છે -

(૧) અજ્ઞાનમાંથી આ સંસારની ઉત્પત્તિ થાય છે. અને એમાંથી ધ્રૂટકારો મેળવવા માટેનું સાધન એટલે બ્રહ્મ. બ્રહ્મ અને આત્મા એ એક જ છે. આવી વૃત્તિ કેળવવી પડે છે. જ્યારે વિષય અને સંકલ્પથી શૂન્ય એવી સ્થિતિ ઉત્પત્ત થાય છે. જ્યારે 'અહં બ્રહ્માસ્મિ' હું જ બ્રહ્મ છું આ વેદના મહાવાક્ય આવૃત્તિની માફક બુદ્ધિનું તે તરફ વલણ થાય છે. જ્યારે ગુરુનાં વચ્ચેનો અને શાસ્ત્રમાં કહ્યા મુજબના સત્યની ખાત્રી થવા માંડે છે, અને શરીરની કર્મ કરવાની પ્રવૃત્તિ થોભી જય છે, ત્યારે આત્માની પરિપૂર્ણ ઓળખ થાય છે.

(૨) વાણી સહિત દરેક ઈન્દ્રિયો પર કાબૂ મેળવી મનનો મક્કમ નિર્ધાર કરો. ત્યાર બાદ મનને છોડીને બુદ્ધિને પકડી રાખો. પ્રકાશ સ્વરૂપ જે જ્ઞાન આપનારી બુદ્ધિ છે ત્યાં મનને સ્થિર કરો. મનથી માંડીને સર્વે ઈન્દ્રિયોનો સમૂહ એક બુદ્ધિને જ સ્વાધીન હોય છે. માટીનાં વાસણ માટે જેવી રીતે માટી આદિ કારણ છે. તેવી જ રીતે ઈન્દ્રિયોને માટે બુદ્ધિ હોય છે. તે તેમાં એવી જ રીતે ફેલાયેલી હોય છે. મન અને સર્વ ઈન્દ્રિયોમાં વ્યાપી રહેલ બુદ્ધિને મહાતત્વમાં એટલે સમસ્ત

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સર્વવ્યાપી ઈશ્વરમાં વિલીન કરીને તે મહાતત્વને આત્મામાં સમર્પણું. આવી રીતે સરવાળે આત્માનું સ્વરૂપ સ્વરચ્છ સમજન્ય છે. પછી ઇપ, મૃગજળ, અને સાપનો આકાર ફૂકત દર્શિનો ભ્રમ જ બની જય છે.

(૩) પરબ્રહ્મનું પ્રતિક ‘પ્રણાવ સ્વરૂપ ઉંકાર’નું સદાયે ધ્યાન કરવું. તે બધા વેદોનો સાર છે. એનો ઉચ્ચાર માત્ર કરવાથી તેના અર્થનું તત્ત્વ મનમાં સ્ફૂર્ત છે, અને વારંવાર પઠન કરતાં બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.

(૪) અંત: કરણનો મેલ એટલે કે રાગ, દ્રેષ, વિકાર, વિક્ષેપ અર્થાત્ ભ્રમ અથવા તો મનનું મંથન અને આવરણ અર્થાત્ બ્રહ્મસ્વરૂપને અજ્ઞાનથી ઢાંકી દેવું આવા પ્રકારના ત્રણ દોષ હોય છે. નિજ્ઞામ કર્મ કરીને સ્વકર્મ અને ઉપાસના કરીને ચિત્તના પરિપક્વતા થાય છે. મળ અને મનોવ્યથાનો નાશ થઈને ફૂકત ‘આવરણ’ જ બચે છે. આ બધા અનથનાં જ બીજ જે આ ‘આવરણ’ અને જે જ્ઞાન પ્રાપ્ત થતાં જ જેમ સૂર્યનો ઉદ્ઘય થતાં અંધકાર નાશ પામે છે, તેમ તે પણ નાશ થઈ જય છે. આ પ્રકારે જ્ઞાની માણસ સ્વરૂપમાં લીન થતાં જ સત્ય જ્ઞાન અને આનંદ (સચ્ચિદાનંદ) વગેરે લક્ષ્ણાથી જેનું વેદાંતોમાં વિદ્ધાનોએ વર્ણન કર્યું છે, તે આ બ્રહ્મ પોતે જ પોતાને ડેકાણે પ્રકાશે છે. અંધારું અને થોડી ચાંદનીમાં એકાદ વટેમાર્ગું જંગલમાંથી પસાર થતાં, તુટેલા જાડના બાકી રહેલા થડને ચોર સમજુને ડરનો માર્યો લપાઈ જય છે. તેને એમ જ લાગે છે કે ‘હું એકલો જ છું અને મારી પાસે આટલું બધું દ્રવ્ય છે. પેલો લુટાંનું વાટ જેઠિને જ બેઠો છે. હવે જીવનો કોઈ ભરોસો નથી.’ પરંતુ દિવાના પ્રકાશમાં જાડના થડિયાનું ખરું સ્વરૂપ પ્રગટ થતાં વટેમાર્ગનો ભય દૂર થઈ જય છે અને પોતાને થયેલા ચોરના અને લુટાંના ભાસને એ જતે જ સમજવા માંડે છે.

(૫) ‘શ્રેય’ એટલે સર્વ દુઃખોથી સંપૂર્ણપણે મુક્ત થઈને નિત્ય આનંદ સ્વરૂપ પરબ્રહ્મ પુરુષોત્તમને પ્રાપ્ત કરવાના ઉપાય અને ‘પ્રેય’ એટલે સ્ત્રી, પુત્ર, ધન, ધરભાર, માન-સન્માન, યશ વગેરે આલોક તેમજ પરલોકનાં સુખ બોગવવા અને પ્રાપ્ત કરવા માટેના ઉપાય. શ્રેય જ વિવેકદ્વારા હોય છે. જ્યારે પ્રેય અવિવેકદ્વારા હોય છે. શ્રેયનો વિષય ફૂકત વિદ્યા છે. જ્યારે પ્રેય એટલે સંદર્ભ અજ્ઞાન, શ્રેય અજ્ઞાની માણસોને ગમતું નથી. અને પ્રેય ડાહ્યાઓથી ભૂલતું નથી. જ્યાં સુધી કનક અને કામિનીની લાલસા હોય છે, ઇન્દ્રિયોના વિષયની પસંદગી હોય છે અને વિવેક તથા વૈરાગ્ય પ્રગટયા નથી. હોતા ત્યાં સુધી પ્રેય જ ગમે છે. પાણી અને દૂધ જેવી રીતે એકત્ર થઈને એકબીજિમાં બજેલાં હોય છે, તેવી જ રીતે પ્રેય અને શ્રેય એક બીજમાં ગુંથાયેલાં હોય છે. માન સરોવરના હંસો જેવી રીતે દૂધ એકલું જ છૂંદું પાડીને પીતા હોય છે, તેવી રીતે દદનિશ્વયી, બુદ્ધિમાન, વિવેકી, અને ભાગ્યવાન માણસો શ્રેય તરફ આસક્ત હોય છે અને પ્રેય તરફ પૂંઠ ફેરવતા હોય છે. પરંતુ હવે પેલા મંદ બુદ્ધિના લોકોને જુઓ ! શરીર, પુત્ર, ધન, માન વગેરે યોગક્ષેમના નાહે ચઢીને ફૂકત પ્રેય જ સાધતા હોય છે. શ્રેય અને પ્રેય ગમે તે હોય, આ બંનેને બરાબર સમજ્યા પછી પણ મનુષ્યપ્રાણી બુદ્ધિથી સ્વતંત્ર હોવાને કારણે બેમાંથી કોની પસંદગી કરવી તે એળો જ નક્કી કરવાનું હોય છે. બંને સામે હોવાને કારણે તેમની પસંદગી મુશ્કેલ બની જય છે. કારણ કે માણસની મંદ બુદ્ધિ ઉપર વિજય મેળવીને પ્રેય જ તેને ચોટે છે. પ્રેયને બાજુ પર હૃદાવી શ્રેયનો જ આદર કરવો. તે જ પુરુષાર્થ કહેવાય છે.

(૬) પુરુષાર્થનો ઉદ્ઘય થયો કે પછી તે પુરુષ સંસાર ચક્કના ભમણામાંથી છુટવા માટે પોતાના હિતનો યોગ્ય ઉપાય સાધવા માટે યોગ્ય થઈ જય છે. અનાદિ એવું જે અજ્ઞાન અથવા તો માયા. છીપલાં ઉપરના ચળકાટની જેમ મગૃજળના પાણી જેવી નકામી હોય છે. એના ખોટા આભાસદ્વીપી અહિયણોનો નાશ કરવો જેઠાંએ. સ્વર્ણમાં ધણી વખત સોનાના કરાનો વરસાદ થતો દેખાય છે. તે ખરા સમયે કામ આવશે એવું સમજુને ખૂબ પ્રયત્નોથી બેગો કરેલો એ સોનાદ્વીપી બરફ સવારે જગૃત થતાં ઓગળી ગયેલો અને અદશ્ય થઈ જય છે. અનુભવેલા કે ન અનુભવેલા ભોગોની વાસના હોવી અથવા તો એવી આશા ઉત્કંઠા અને ઈચ્છા હોવી એ સદાય વિદ્ધાને જ નોતરે છે. માટે તેમને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જે મૂળથી જ બેચી કાઢો. કામ અને કોધ આ બંને વૃત્તિઓ જ્ઞાનની પ્રાપ્તિ થવા હેતી નથી. એ ત્રણેય શ્રવણ, મનન અને સમાધીનો ભંગ કરે છે. શ્રુતિ અને સ્મૃતિમાં જેને ત્યજવા યોગ્ય કહ્યા છે એવાં દુષ્કર્મોમાં જે સદ્ગ્યે આગોટે છે અને જેને યોગ્ય અયોગ્ય કર્મ સમજતું નથી. તે જ્ઞાની હોવા છતાં પોતાનું કોઈ પણ હિત સાધી શકતો નથી. તેવી જ રીતે કાયમ અશાંત થયેલો જેનું મન એકાગ્ર નથી અને ઈન્ડ્રિયોના લાહથી જેનું ચિત્ત બગડેલું છે એવો જીવ જ્ઞાનથી પરિપૂર્ણ થઈ શકતો નથી.

(૭) સંસારી રહો કે મોક્ષ પામવાના પ્રયત્નમાં રહો, છેવેટે પોતપોતાના કોઈ પણ ધ્યેય તરફ જવું જ પડે છે. માટે તારા શરીરક્રીદા રહોનું તું માલિક થા અને પોતાની બુદ્ધિને એ રથનો સારથી બનાવી તું સ્વસ્થ ચિત્ત બેસ. પછી વિષયોના અનેક વિકટ માર્ગની પરંપરા ઓળંગવાનું સારથીને કહે. અને મનક્રીપી લગામથી દરો ઈન્ડ્રિઓક્રીપી તોફાની ઘોડાઓને કાખ્યુમાં કર. ઘોડા જે આધાપાછા દોડવા માંડે તેમ છતાં તું લગામ વડે તેમને બરાબર જકડી રાખજે. સારથી જે નિપૂણ અને કુશળ હો તો જ ઘોડાઓ વ્યવસ્થિત દોડે છે. પણ મનક્રીપી લગમાને જે તે આધિન થયા તો તે શક્તિહિન થઈ જય છે. જ્યાં બુદ્ધિનું વિવેકક્રીપી સામર્થ્ય છે, જેના મન પર કાબૂ છે, અને જેનું ચિત્ત એકાગ્ર થયેલ છે તેને જ પરમપદની પ્રાપ્તિ થાય છે. બીજા સૌ રસ્તામાં જ થાકી જય છે.

(૮) વિવેક અને વૈરાગ્યને ભેગા કરવા માટે જે મથે છે તે જે, મુર્ખ અથવા તો પદ્ધથર જેવો હોવા છતાં તેને માટે સંસારક્રીપી સાગર અધરો નથી. ભગવાનનું આશ્રય છ ગુણોનું હોય છે. તેમાં ‘વૈરાગ્ય’ એ પહેલું અને ખરું ઐશ્રય છે. જે ખરો ભાગ્યવાન છે એના જ ભાગ્યમાં એ આવે છે. અને બાકીનાને નહીં. શાસ્ત્રોએ જેને યોગ્ય ડેરવ્યું છે એવું કર્મ કર્યા વીના ચિત્ત શુદ્ધ થતું નથી. જ્યાં સુધી ચિત્ત શુદ્ધ થતું નથી ત્યાં સુધી જ્ઞાન સંપાદન થતું નથી. માટે કર્મ જ જ્ઞાન પ્રાપ્તિનું મૂળ કારણ છે. નિત્ય કર્મ કરવાથી ચિત્તનો મેળ ઘોવાઈ જય છે. આ પ્રકારે શુદ્ધ થયેલા ચિત્તમાં શામ, દમ, ઉપરતી, તિતીક્ષા, શ્રદ્ધા અને સમાધાન, આ સાધન સંપત્તિ ઉત્પન્ન થાય છે. તેનાથી આ હેહમાં જ મુક્તિ પ્રાપ્ત થાય છે.

(૯) જીવ માત્રની અજ્ઞાનને કારણે થતી આ પ્રકારની વૃત્તિ તેને સંસાર તરફ પ્રવૃત્ત કરે છે. આત્મજ્ઞાન મદ્યા પછી તે જ જીવ સંસારમાંથી નિવૃત્ત થાય છે. આત્માને ઓળખનારને અહ્મ્ભાવ કયારેય નથી હોતો અથવા ધર્મ કે અધર્મ પણ નથી. હોતો અને શુભ કે અશુભ પણ નથી. હોતું. તેને સંસારના હિતો અથવા તો અહિતોની શી પરવા ? પ્રવૃત્તિ જ્યાં છે ત્યાં જ શત્રુ અને મિત્ર હોય છે. નિવૃત્તિની નવાઈ એ છે કે હું ને હું ને હું જ બદે છે. એ જેતાં શત્રુન્વ કે મિત્રત્વ કેવું ? આવાં મહાસુખો સામે શરીરનું મહાદુઃખ પણ કયાંથી રહે ? જ્યારે મહાસુખ ગમવા માંડે છે ત્યારે આતોકનાં સુખો માટે કોણ રહે ? આ લોકનાં દુઃખોના હુંગર પણ જે એની ઉપર ઘસી પડે તો પણ ધીરજનો પર્વતરાજ એવો આ જીવ જરા પણ લેશમાત્ર હગતો નથી.

(૧૦) અરિસામાં હેખાતા ચહેરાના સ્પષ્ટ પ્રતિબિંબની માફક આત્માનો સ્પષ્ટ દર્શનનો હેતુ જ જેનું ધ્યેય છે તેને જ આ પૃથ્વી એટલે ભૂલોક અથવા તો ઉપરનો બ્રહ્મલોક, આ બે સિવાય અન્ય કોઈ ત્રીજી જગ્યા રહેતી નથી. યજ કરવાથી દેવતાઓની તૃપ્તિ થઈ કે પિતૃલોકની પ્રાપ્તિ થાય છે અને કર્મ ફળોના ઉપભોગોનો લાભ મળે છે. પણ આત્મજ્ઞાન થતું નથી. ગંધર્વ, મહા, જન, તપ અને સત્ય વગેરે લોકમાં આત્મદર્શન અતિશય અસ્પષ્ટ હોય છે, માટે જેમને આત્મદર્શનની આસક્તિ હોય છે તેઓ પૃથ્વી ઉપર લાંબુ આયુષ્ય માંગે છે. કારણ કે અહીં જ ચિત્ત શુદ્ધ થાય છે આયના જેવી નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેમાં શુદ્ધ અને પવિત્ર આત્મસ્વરૂપ પ્રતિબિંબિત થાય છે.

(૧૧) આંખો કાન વગેરે પાંચે ઈન્ડ્રિયો પોતપોતાના વિષયોને જ્યારે છોડી હે છે, મન પણ જ્યારે સંકલ્પ વિકલ્પ કરવાનું બંધ કરે છે અને બુદ્ધિ પણ જ્યારે આ પ્રમાણે નિશ્ચલ થયેલા અંત:કરણમાં પોતાનો નિશ્ચય કરવાનો ઉધોગ બંધ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કરે છે ત્યારે પેદા થનાર સ્થિતિ તે જ પરમગતિ છે. અને તેને જ નિવિકાર બ્રહ્મ કહેવામાં આવે છે. જેની બુદ્ધિ નિશ્ચય ન કરનારી થાય અને ચિત્તમાં હું એક જ છું, મારા સિવાય જગતમાં બીજું કોઈ નથી એવું ચૈતન્ય પ્રગટે એ જ ભાગ્યવાન આત્માને ઓળખી શકે છે. બ્રહ્મદેવના પદ સુધી આલોકના અને પરલોકના વિષયોમાં જેને આસક્તિ નથી તેને જ બ્રહ્મપદનો અભિષેક થયેલો જાણવો. તેથી તે મુક્ત થયેલો જાણવો. ચિત્તને વિષયોથી ધીરે ધીરે દૂર કરીને આત્મસ્વરૂપે સ્થિર કરીને આત્મજ્ઞાનમાં જેડવું. આલોકમાં કે પરલોકમાં કર્મ ફળોની વિરક્તિ અને હર્ષ શોક વગેરે દ્વંદ્વોનો ત્યાગ તો બુદ્ધિમાન લોકો જ કરી જાણે છે. એ જ અધ્યાત્મનો ખરો માર્ગ છે.

(૧૨) સ્ત્રી, પુરુષ અને મિત્રદ્વારી આ વમળ કામ, કોધ વગેરે મગરમય્યોથી ભરેલું છે. અનેક રોગડ્વપી ‘તિમિલિંગ’ નામના મોટા માછલાંથી વિસ્તાર પામેલો અને આશાડ્વપી મોટાં મોન્ઝાંથી ખળભળતો તથા ઉછળતો છે. તેના અનેક વાર નાના મોટા ઉદ્ઘેગોના ઝટકા આવી જતા હોય છે. સુખ દુઃખ શોક મોહ વગેરે દ્વંદ્વોની મનમાં શંકા ઉત્પન્ન થાય છે. સ્ત્રી અને પુત્રનો મોહ ઝટકી શકાતો નથી. તેણે પોતાના જીવને ઉપદેશ કરવો કે તું જ શુદ્ધ બ્રહ્મ છે, દેહની સંગતથી દાંડી સાથે બંધાઈ ગયેલ ઉંઘો લટકેલ પાંજરામાંના પોપટની જેમ તું પોતાને માટે બદ્ધ થયેલો છે. તું ફક્ત મોહમાયાના બ્રહ્મમાં પડેલો છે. માટે પોતાનું હિત ભુલ્યો છે. તું સાવધ થા અને સ્વરૂપ તરફ ઝડપથી વળી જા. તને બ્રહ્મને કારણે સંશય છે કે હું શરીર છું એવો તારો ખોટો બ્રહ્મ વધ્યો છે. ‘હું, મારો’ આ મૃગજીજ જેવું જ ફસામણું સૂત્ર છે. એ જાણીને ‘મારાપણું’ છોડી હે. હે પોપટ ! હું અને તું પણાના ગોટાળામાં શા માટે ગુંચવાય છે ? તે વાળેલા પગ છોડ અને ઊંચે ઊડી જઈને ચેનથી વિહાર કર.

(૧૩) દુર્ગભ એવો આ આત્મા બધાને માટે થોડો સુગમ થશે તેનું વર્ણિન કરતાં વેદ પણ થાક્યા. તપસ્વીઓ જંગલમાં જઈને વસ્યા અને ઉપનિષદ્ધોએ હાથ હેઠા મૂક્યા તેમ છતાંકોઈને ખરું નિહાન લાધું નહિ. આત્મસ્વરૂપના માર્ગ પહોંચવા માટે અભેદનું દર્શન કરવાનારો આચાર્ય અથવા ગુરુ જ જેઠાએ. ત્યાં બીજાનોનો શોહિસાખ ? ફક્ત તર્ક કરવાવાળાઓને ત્યાં સ્થાન જ નથી. તે ભ્રમદ્વપી વમળમાં ગોળ ગોળ ફરતો રહે છે. પોતાની બુદ્ધિના કલ્પનાદ્વપી તારાઓ ચોરાસી લાખ પૂનર્જન્મના ફેરાઓમાંથી બચી શકતા નથી. આચાર્યદ્વપી ચંદ્ર માત્ર જ પુરતો છે. જે કષ્ટથી સધાતું નથી તે સદગુરુને મજબુત રીતે પકડી રાખવાથી જરા અમસ્તા પ્રયત્નોથી સધાય છે. સવિદ્યા તેને પ્રકાશિત કરે છે અને અવિદ્યા કાર્ય સહિત બાજુએ સરકી જાય છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સ્થિર થાય છે અને સ્વરૂપ સ્થિતિ અવતાર લે છે. તેનું જ મોક્ષ એવું બીજું નામ છે. આ જીવ માત્રનું અપેક્ષિત ધ્યેય છે.

(૧૪) અહીંયાં વાદવિવાદનો કોઈ અર્થ નથી. અહીં તર્કની કોઈ જ ચતુરાઈ ચાલતી નથી. તર્ક જાણવાવાળાની ભતી કુંદિત થાય છે. બોળો ભાવ જ સિદ્ધિએ પહોંચે છે. એ જ અહીંયાંની નવાઈ છે. ઉત્તમજ્ઞાનનો મૂળ માર્ગ વેગળો હોય છે, અને એ બુદ્ધિ પણ જુદી હોય છે. તે ઉત્તમ જ્ઞાન આપનારો શાસ્ત્રજ્ઞ પણ જુદો જ હોય છે તે સારી રીતે જાણજે. અમૂલ્ય એવું આ શરીર વહી જઈ રહ્યું છે, ધનની તૃષ્ણા એ બપોરના છાંખડા જેવી વધારે ટકનાર નથી અને હરિની માયા પાર કરવી અધરી છે. માટે આ બધું સમજુને સંતોના શરણે જવું. સંતો એ સંસારદ્વપી સાગરની નાવ છે. તું તો તેમાં માત્ર એક ઉતારું છે. તેમના વગર સામે કિનારે લઈ જવા માટે કોણ સમર્થ છે ?

(૧૫) સંસારનાં બંધનોથી કયારે ધૂટકારો થાય, એ ક્ષણ કયારે આવશો એવી જેના મનમાં રાત અને દિવસ ચિંતા થાય છે, તેવો જીવ સ્ત્રી અને સંતાનોનો મોહ એક ઝાટકે છોડી હે. જે મળે તે એકાંત સાધીને સંસારમાં કોઈ અર્થ નથી એવી મનમાં ગાંઠ વાળે છે. અધ્યયન અને આત્મચિંતનમાં નિરંતર મશ્ન રહે છે. શ્રદ્ધાયુક્ત મનથી ભક્તિ અને પૂર્ણ નભ્રતાથી સાધાંગ પ્રણામ કરીને ગુરુના શરણે ગયા સિવાય એ શિષ્યને જ્ઞાનનો અધિકાર આપતો નથી. ગુરુને સર્વસ્વ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અર્પણ કરીને એમની સેવા કરવી. બંધન અને મોક્ષ જેવી વૃત્તિઓની એમની સાથે ચર્ચા કરવી, જ્ઞાનના અજ્ઞાન ને કારણે તેમને પ્રશ્ન કરવો એટલે ગુરુમહારાજ પાસેથી આત્મજ્ઞાની પ્રાપ્તિ થરે. આત્મા કોણ અને પરમાત્મા કોણ તે ગુરુ સિવાય કોઈ જ સમજવી શકશે નહીં. ગુરુ પણ પૂર્ણપણે શરણે આવ્યા વગર કોઈને જ્ઞાનનો કણ પણ આપતા નથી. ગુરુ સિવાય બીજા કોઈ પાસે મેળવેલા જ્ઞાનથી સંસરામાંથી પૂર્ણપણે છૂટકારો મળતો પણ નથી. માટે જ ‘ગુરુ વગર જ્ઞાન નહીં’ આ કહેવત બધાં જ જાણતા હોય છે. બ્રહ્મ અને આત્માની એકતા માટે વ્યવસ્થા કરવા માટે ગુરુનાં જ ચરણો સમર્થ છે. ત્યાં આનાકાની વગર અભિમાન છોડીને જમીન ઉપર દુંહવત્ત પ્રણામ કરીને ગુરુનાં ચરણામાં ભસ્તક નમાવીને તથા મનમાં હિંમત ભેગી કરીને ગુરુના ચરણો પકડીને મુખેથી બોલો ‘હું તમારા ગુલામનો ગુલામ છું અને મને ફક્ત તમારાં જ ચરણોમાં ભરોસો છે.’ પછી જુઓ ગુરુનો ચમત્કાર ! એ ગુરુરૂપી દ્યાનો સાગર ઉછળવા લાગશે અને એનાં મોન્ઝાઓની શાચ્યા પર તે તમને જીતી લેશે. અલાબલાનો નાશ કરીને અભય-દાન કરનારનો હાથ તમારા માથા ઉપર મૂકીને બધા જ પાપ-રાશાને બાયે ઉદ્ધી ચોપડશે.

(૧૬) આ સંસાર આધ્યાત્મિક, આધ્યાત્મિક અને આધિબૌતિક આવા ત્રણ સંતાપોના દાવાનળની આગમાં સણગેલો છે. તેમાં કોણ સુખી હોઈ શકે ? તેમાંથી ઉદ્ઘાર કરવા માટે શ્રી સાઈબાબાની કૃપા સંપાદન કરવી. તેમના ચરિત્રનું આદરપૂર્વક વાંચન, શ્રવણ અને મનન કરવું. આ કથા રોજ શ્રવણ કરવાથી શ્રોતાને પરમ શાંતિ મળશે. આ કથારૂપી જરામાં કર્મ અને અકર્મરૂપી મીઠું ઓગળી જય છે અને કાનના દ્વારેથી શ્રીબાબાનું ડ્રેપ આંખોમાં દશ્યમાન થાય છે. ચરિત્રના શ્રવણથી પાપોનો નાશ થાય છે. કાળ પર પણ જગ્ઝભીને વિજયી થવાની તૈયારી થાય છે અને અતિશય સ્ફૂર્તિ આવીને શ્રોતાઓને સંતોષ પ્રાપ્ત થાય છે. શ્રવણથી અંતઃકરણ શુદ્ધ થાય છે. શ્રવણથી જન્મ મરણનો ફેરો પૂર્ણ થાય છે. શ્રવણથી કર્મ ફળની છિચણા ન કરવાથી બ્રહ્મ પણ પ્રાપ્ત થાય છે. માટે શ્રોતાઓએ આ ગ્રંથનો એક એક અધ્યાય લઈને દરરોજ એનું વાંચન કરવું અથવા શ્રવણ કરવું તથા મનથી એનો અભ્યાસ અને સતત મનન અને ચિંતન કરવું.

સારાંશ

દૂંકાણમાં કહેવાનું કે બ્રહ્મજ્ઞાન એટલે પાછલી ઉમરમાં ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થતાં દુનિયામાં કોઈ તેમને પૂછતું નથી. તેમ સમજુને કામ ધંધા સિવાયના વગરકામના સૂતર કાંતતા બેસી રહેવા જેવી વાત નથી. તેવી જ રીતે પાછા વળવાના ભાડા સાથેનો ટાંગો નક્કી કરીને જલ્દી ઉતાવળે આવીને અને તે પણ પાસે ૨૫૦ ડ્રેપિયા ગજવામાં રોકડા હોવા છતાં ફક્ત પાંચ ડ્રેપિયા જેટલી નાની રકમનો લોભ કરવાથી પ્રાપ્ત થતું નથી. બ્રહ્મ પ્રાપ્તિ માટે સાધકને સર્વ સુખ ઉપભોગનો ત્યાગ કરીને, બધી આશા આકાંક્ષાઓ છોડીને પુષ્કળ પરિશ્રમ કરવો પડે છે. શ્રીસાઈબાબા જેવા સદગુરુનો હાથ મજબુત પકડવો પડે છે ત્યારે જ બ્રહ્મ એટલે આત્મા પ્રસન્ન થઈને તે પોતે જ સાધકને માટે પોતાનું યથાર્થ સ્વરૂપ બતાવી દેતો હોય છે.

આવો આ અતિ શ્રેષ્ઠ અને અતિ દુર્લભ એવો બ્રહ્મજ્ઞાન કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય આ બે અધ્યાયમાં વિસ્તારપૂર્વક સમજાવ્યો છે. મુમુક્ષુઓએ તેનું વારંવાર વાંચન કરી એના શબ્દાર્થ અને ભાવાર્થ વ્યવસ્થિત સમજ લઈ ને તેનું મનન તથા ચિંતન કરીને તેના ઉપાય કૃતિમાં લાવવા. જેથી શ્રી સાઈબાબાની કૃપાથી તેમને ખાત્રીપૂર્વક બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થરે.



॥ અદ્યાય ૧૮ ॥

મહુ અનુગ્રહ - ૧

(મારા પોતાની ઉપર એટલે ખુદ હેમાડપંત ઉપર થયેલ બાબાના કૃપા પ્રસાદનું વર્ણન ભાગ - ૧)

શ્રી ગણોશળુને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રલુને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હે સર્વ શ્રેષ્ઠ અને પરમ એવા સદ્ગુરુ ! તારો જ્યલ્યકાર થાઓ. હે સાક્ષાત્ પરબ્રહ્મ જેવા સદ્ગુરુ ! તારો જ્યલ્યકાર થાઓ. ઈશ્વરના મોહમાં પાડનારી શક્તિ માયાને તાબામાં રાખનારા તારો જ્ય થાઓ. તું તારા ભક્તોને પરચો બતાવીને કે આ જગત મિથ્યા છે તેનું ભાન કરાવે છે. હે આરંભ અને અંત વગરના સુખ, દુઃખ, શોક, હર્ષ વગેરે દંદ્રોને પેલે પાર વસતા અને કોઈ પણ પ્રકારના મનોવિકારથી અલિપ્ત એવા સદ્ગુરુ તારો વિજય થાઓ. આત્મસ્વરૂપની ઓળખ કરી આપનારો તું જ એકલો છે. સિંઘવ મિઠાની એક પૂતળી સમુદ્રમાં દૂબકી મારતાં પાછી બહાર આવી શકે એવી ? એવું કઢી જન્મનું શક્ય નથી. તારી બાબતમાં પણ એવું છે. વેદ અને શ્રુતિ જેને માટે રાત અને દિવસ વાદવિવાહ કર્યા કરે છે અને જે વિષે કોઈ તર્ક પણ કરી શકતો નથી. એવા પરબ્રહ્મને તું પોતાની આંગળીઓ ચિંધીને ભક્તોને આસાનીથી બતાવે છે. દૈવ યોગ આવ્યો અને એકવાર પણ તારું ઘેલું લાગ્યું એટલે આ પોતાનો અથવા તો પેલો પારકો, એવા હલકા વિચારોને માટે જગ્યા જ રહેતી નથી. (ઓ. ૧-૫)

પાછલા અધ્યાયમાં બ્રહ્મની મથામણને ઉક્લિને બને ત્યાં સુધી સ્પષ્ટ કરવામાં આવી છે. બ્રહ્મ જ્ઞાનું ઉપર લોભનું આબદ્રણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેવું પ્રતિબંધકારક હોય છે તેનું વર્ણન થયું હવે મારી ઉપર થયેલી કૃપાની કથા આદરથી સાંભળવી જેથી કરીને સાંભળનારાઓના મનમાં બબાના માર્ગદર્શન આપવાના સ્વભાવની ખાતરી થશે. આ પણ એક સુંદર કથા છે. એ જેવી છે તેવી જ હું આપને કહી રહ્યો છું. શ્રોતાઓએ પોતાના કલ્યાણ માટે આ કથા સ્વસ્થ ચિત્તે સાંભળવી. કથા સાંભળવા માટે શ્રોતાઓમાં રહેતી તત્પરતા વકતાને પ્રોત્સાહન ને ઉત્સુકતા આપે છે અને બંનેના હૃદયમાં પ્રેમના ઝરણ ફૂટીને શ્રોતા અને વકતા બંને આનંદયુક્ત થાય છે. (ઓ. ૬-૮)

શ્રી બાબા થોડો પણ ગુસ્સો, લોભ કે બુદ્ધિભેદ ન કરતા. જેવો જેનો અધિકાર હોય એવો જ તેને સાચા સુખના માર્ગનો ઉપદેશ કરતા. કેટલાક લોકોનો એવો મત છે કે, ગુરુએ કહેલો મંત્ર અથવા અર્થ વગરની માન્યતા છે. પ્રત્યક્ષ તો શું પણ સ્વખનમાં કહેલો પણ સારો બોધ અથવા તો સારો ઉપદેશ દરેકને કહેવો જેઠાએ. આ વાતને કોઈ આધાર કે પુરાવા નથી, એવું કહેશો તો કથનને બુદ્ધ કૌશિક ઋષીનો આધાર છે. તેમને સ્વખનમાં દિક્ષા ડ્રેપે પ્રાપ્ત થયેલું ‘શાંતિ સ્તોત્ર’ પણ સર્વેને કહેલું છે. સદ્ગુરુ એ તો વર્ષા ઋતુનાં વાદળો જેવા છે. કૃપાપૂર્વક તેઓ સ્વચ્છાનંદ ડ્રેપી પાણીનો વર્ષાવ કરે છે. તે કંઈ સંધરી રાખવા માટે થોડા હોય છે ? જાતે મન મૂકીને પીવો અને બધાને પીવડાવો. નાના બાળકનો ચહેરો પ્રેમથી પકડીને તેના આરોગ્ય માટે મા જેવી રીતે તેને પ્રેમથી ઔષધની ગુટી પાય છે તેવી જ રીતે બાબાને માટે ઉપદેશ કરવો તેમના હૃથનું કૌશલ્ય હતું. ઉપદેશ કરવાનો તેમનો માર્ગ ગુપ્ત ન હતો. પોતાના ભક્તનો મનસુખો કઈ રીતે અચાનક તેઓ પૂરો કરતા તે હવે ધ્યાન દઈને સાંભળો. (ઓ. ૧૦-૧૬)

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

સદ્ગુરુનો સહવાસ ધન્ય હોય છે, એના મહત્વનું કોણ વર્ણન કરી શકે ? સદ્ગુરુના એક બોલ યાદ આવતાં આપણામાં એનું વર્ણન કરવાની શક્તિ આપોઆપ ખીલી ઉઠે છે. ભક્તિભાવથી ઈશ્વરની સ્તુતિ પૂજન કરવાથી અને ગુરુની પૂજન સેવા કરવાથી ગુરુ પાસેથી પ્રાપ્ત થનારા જ્ઞાનનો લાભ અવશ્ય થાય છે. બીજા બધાં સાધનો નકામાં બને છે. મનના ગોટાળા અને મોહનાં આવરણોને લીધે સંસારનો માર્ગ ધૂંઘળો થયેલો દેખાય છે. ગુરુના ઉપદેશકૃપી દીવાના કિરણો કયાંય પણ અથડાયા વીના નિર્વિદ્ધને માર્ગ બતાવતાં હોય છે. ગુરુ જાતે જ ઈશ્વર છે. બ્રહ્મા, વિષણુ અને મહેશ છે. ગુરુ જ વાસ્તવિક રૂપે પરમેશ્વર અને બધામાં શ્રેષ્ઠ બ્રહ્મ છે. ગુરુગીતા સમજલે છે કે ગુરુઓના ગુરુવિજ્ઞાન: ગુરુદેવો મહેશ્વર: । ગુરુ:સાક્ષાત્પરથાલ તસ્મૈ શ્રી ગુરુયે નમઃ ॥૩૨॥ ગુરુ માતા પણ છે અને પિતા પણ છે. જે દેવ કોપયમાન થાય તો ગુરુ બચાવે છે. પરંતુ ગુરુના ગુસ્સાથી કોઈ બચાવી શકતું નથી તે હંમેશા યાદ રાખજો. ગુરુ સંસારિક વહેવારનો માર્ગ બતાવનાર હોય છે. પુણ્યક્ષેત્રો અને વ્રતોની માહિતી આપનારો તેમજ સંસારિક ઉપાધિઓથી મુક્ત કરનારો ધર્મ અને અધર્મ અંગે તથા વૈરાગ્ય અને વેદ શ્રુતિ અંગે વ્યાખ્યાન કરનારો પ્રવક્તા છે. (ઓ. ૧૭-૨૨)

બુદ્ધિને સાવધ કરીને તથા આંખો ઉધાઈને સંત, સ્વસ્વરૂપના દર્શન કરાવે છે. અને અતિશય કોમળ અંત:કરણથી અને દ્વાળુ એવા તે ગુરુ ભક્તિ સંબંધે ઉચ્ચકોટીની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેને કારણો ભક્તોની વિષયો તથા વાસના ઓછી થાય છે. અને ઉંઘમાં પણ સ્મરણ રહે છે તથા સંતની કૃપા થતાં વિવેક અને વૈરાગ્ય વધતાં વ્યક્તિનાં ફળો મળે છે. સંતનો સહવાસ થાય, તેમની સેવા કરવાનો મોક્ષ મળે, અને તેમની ઉપર પ્રેમ ઉભરાય, એટલે સંત જાતે જ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે કલ્પવૃક્ષ બની તેમના સર્વ દુ:ખોનું નિવારણ કરે છે. માટે સહાય સંતની સાથે રહેવું. તેમની કથાનું પારાયણ કરવું અને તેમનાં ચરણ વંદન કરવા જેથી સર્વ પાપ ધોવાઈ જય છે. (ઓ. ૨૩-૨૬)

અંગ્રેજેના જમાનામાં લોર્ડ રે મુંબઈ રાજ્યના ગવર્નર હતા. તેમના સમય દરમ્યાન ત્યાંના કોફર્ડ નામના મુંબઈ શહેર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરના કારભાર અંગેની તપાસ ચાલતી હતી. પ્રસિદ્ધ પામેલા એક ગૃહસ્થ સાઈબાબાની ભક્તિમાં રંગાયા. તેમને ત્રણ પ્રકારનાં દુ:ખોથી ભરેલો આ સંસાર ઓટો છે તેવું સમજયું. તે દરમ્યાન વ્યાપાર ધંધામાં ઝોટ જવાથી તેમને મનમાં તિરસ્કાર પેદા થયો. તેથી જેઠીતા સરસામાન સાથે તેમણે ઘર છોડી દીધુ. ચિત્ત ડગમગતું હોવાથી તે દૂરના કોઈ પ્રવાસે જતા રહેવું અને ત્યાં સુખેથી એકાંતવાસનો વિચાર કરવો. જીવ જ્યારે કોઈ મોટા સંકટમાં ફસાય છે ત્યારે કષ્ટદાયક સ્થિતિમાં તેને ઈશ્વરની યાદ આવે છે. પછી તે ઈશ્વરને યાદ કરીને તેમાં રચ્યોપચ્યો રહે છે. પણ જ્યાં લગી પાપ કર્મો કરવાનું ઓછું થતું નથી, ત્યાં સુધી ઈશ્વરનું નામ હોઠો ઉપર આવતું નથી. તેમ છિતાંય જે ઈશ્વરનું નામ એકવાર હોઠ પર આવે એટલે તે જીવની ભક્તિ જેઠીને દેવ તેની સંતો સાથે મુલાકાત કરાવે છે. તેવું જ આ ભક્તની સાથે પણ થયું. સંસાર પ્રત્યે તેઓને ખૂબ જ અગણભો આવેલો જેઠીને તેમના સ્નેહીએ તેમના હિતમાં એક સારી સલાહ આપી એ સાંભળો 'કેમ ભાઈ ! તમે સાઈસમર્થના દર્શને શિરડી કેમ નથી જઈ આવતા !' તે અત્યંત દ્વાળું સંતને વિનવો ! તેમનો એક ક્ષણ પૂરતો પણ સહવાસ પામવાથી તમારું ચંચળ મન તરત જ શાંત થઈ જશે અને તત્કાલ હરિનાં ચરણોમાં માર્ગ જડશે. તે પછી ત્યાંથી મનને પાછા વળવાનું ગમશે નહીં. દેશ દેશના અને ભાતભાતના લોકો ત્યાં ભેગા થાય છે, સાઈમહારાજનાં ચરણોમાં દંડવત્ પ્રણામ કરે છે, એમની આજ્ઞા પ્રમાણે વર્તતા અને એમની સેવાથી પોતાના ઘરેલા મનોરથો પ્રાપ્ત કરી લે છે, એવી સાઈબાબાની કીર્તિ પ્રસિદ્ધ છે. અભાલ વૃદ્ધ બધા જ તેમને ઓળખે છે. તેમને જે તમારી દીશ ઉપર દ્વારા આવશે તો તમારાં બધાં જ દુ:ખોનું નિવારણ થઈ જશે. આજકાલ તો શિરડી એ મોટું અને જાહેર પવિત્ર સ્થાન બની ગયું છે. રાત અને દિવસ ત્યાં ભક્તોની અવરજન્ય ચાલુ જ રહે છે. તમે પણ દર્શન તો કરી જુઓ. સંતોનાં દર્શન હંમેશા કલ્યાણકારી હોય છે. જેમ સૂક્ષ્મ દુકાળમાં વરસાદ ન પડવાના કારણે ઉદાસ અને દ્રવ્યહિન માણસો માટે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અચાનક પડનારો વરસાદ અથવા તો ભૂખથી બ્યાકુળ કોઈ જીવાત્માની થાળીમાં પાંચ પકવાન પીરસાય, તે જ પ્રમાણે પેલા સ્નેહીની સત્તાહની અસર થઈ. પેલા ભક્તની સત્તાહ તેના મનમાં ઉત્તરી ગઈ અને અનુભવ મેળવવા જેવા માટે તેમણે શિરડીની વાટ પકડી. શિરડી પહોંચીને બાબાનાં દર્શન કર્યા અને ચરણોમાં દંડવત્ પ્રણામ કર્યા. તેની સાથે જ તેમની આંખો દર્શનથી તૃપ્ત થઈ, અને મનમાં સંતોષ થયો. સનાતન સ્વયંબ્રહોત્ર નિરંજન, પૂર્ણ બ્રહ્મ સાઈનું રૂપ જેઠને ધ્યાનમાં તેનું મન પ્રસન્ન થઈ ગયું. તેમને એવું લાગ્યું, પૂર્વના કે, પુર્ણના બણે આ ચરણ પ્રાપ્ત થયાં છે. અને દર્શનથી મનમાં શાંતિ અને ચિંતા રહિત એવી સ્થિતિ અનુભવી. (ઓ. ૨૭-૪૨)

તેમની અટક સાઠે હતી. તેઓ પોતે મક્કમ નિશ્ચયવાળા હતા. તેમને ગુરુચરિત્ર પુરાણા, તેના પારાયણનો પ્રારંભ નિયમ પૂર્વક ઘણી ગંભીરતાથી કર્યો. સપ્તાહની પૂર્ણાહૃતિ થવાની હતી તેની આગલી રાતે જ બાબાએ ઊંઘમાં દર્શન આપ્યું. પોતાના હાથમાં પોથી લઈને બાબા જતે જ તેમને અર્થ સમજલીને કહેવા લાગ્યા. આસન પર જતે બેસીને સાઠેને સામે બેસાડ્યા, ગુરુચરિત્રની માફક તેઓ કથા કહેતા હતા અને સાઠે સ્વસ્થ ચિત્તે શ્રોતા બનીને આદરપૂર્વક એ ગુરુકથા સાંભળતા હતા. સાઠે વિચારમાં પડ્યા કે આવું ઉલદું કેમ? તેમને ખૂબ જ આશ્રય થયું અને કંઠ ગદગદીત થઈ ગયો. મનમાં બોલ્યા, ‘હે દ્યાળું સાઈનાથ! અજાનદૂપી અંદકારના ઓશિકાને ગરદન પાસે મૂકીને વાસના રૂપી ગાઢી પર જે ધોરતો પડ્યો હોય તેને પણ તું જાગૃત કરે છે. આવો જ આ પ્રસંગ છે. જુઓ? મને ટપલી મારીને ગુરુચરિત્ર રૂપી અમૃત હે કૃપાળું! તે મને પાયું છે.’ આવું મનમાં સ્વભદર્શન જોયા બાદ સાઠે સફાળા જાગી ગયા, અને જે બનેલી વાત તે બધી જ એમને કાકાસાહેબ દીક્ષિતને કહી. એમાણે કહ્યું, ‘કાકાસાહેબ આ દાદાંતનો અર્થ કાંઈ સમજતો નથી. બાબા જ એ જણાવવા માટે સમર્થ છે. બાબાના મનમાં શું છે એ સમજતું નથી. તમે જ એમને પૂછો ને? ગુરુચરિત્ર ગ્રંથનું હું પારાયણ ફરી શરું કરું કે જેટલું થયું છે, તેને પૂરું સમજું? બાબાનો હેતુ શો છે? એ એમને જ પૂર્ણી જુઓ એટલે મનમાં શાંતિ થશે. પછી કાકાસાહેબે યોગ્ય સમય જોઈને બાબાને સાઠેને આવેલા સ્વખન અંગે વાત કરી. અને કહ્યું કે, ‘હે દેવ! આ દાદાંતથી આપ સાઠેને શું સમજવવા માંગો છો? શું સપ્તાહ ચાલુ રાખવી કે અહિં રોકાઈ જાયું? આપ જતે જ સાઠેને આનો અર્થ સમજલીને તેમનો માર્ગ મોકલો કરી આપો. સાઠે મોટા ભાવિક ભક્ત છે. તેની ઉપર કૃપા કરીને એમની આ ઈરછા પૂરી કરો. એટલી જ મારી આપનાં ચરણોમાં વિનંતી છે.’ પછી બાબાએ આજા કરી, ‘એક પારાયણ વધારે થવા દો. આ ગુરુની પોથી વાંચવાથી ભક્ત પાપ રહિત થાય છે. આ પોથીનું પારાયણ કરનારાનું કલ્યાણ થાય છે. પરમેશ્વર પ્રસન્ન થશે અને સંસારિક મોહપાસમાંથી છુટકારો અપાવશે. (ઓ. ૪૩-૪૭)

બાબાએ સાઠેને સ્વખનમાં આપેલા દાદાંતનો માતા મતે આવો પણ એક અર્થ નીકળી શકે છે. ‘પોતાના હાથમાં પોથી લઈને આસન પર બેસીને સામે સાઠેને બેસાડી એક પુરાણિકની માફક અર્થ સમજલીને કથા સંભળાવી રહ્યા હતા. મને એવું લાગે છે ત્યાં સુધી, ભક્તે પોથીનું પારાયણ કેવી રીતે કરવું અને તેને દરરોજ કેવી રીતે વાંચવી તેનું પ્રત્યક્ષ ઉદાહરણ બાબા બતાવવા માગતા હતા. કોઈ પણ શ્રોતાને સામે બેસાડીને બાબાનું ચિત્ર કે મૂર્તિ સામે મૂકીને પોથીનું નિર્ઝપણ વચ્ચે વચ્ચે અર્થ સમજલી કરવામાં આવે તો તે પોથીનું વાંચન ખરેખર સાર્થક થાય છે. સાઠે પાસેથી ફરી એકવાર પારાયણ કરાવવું. સાઠેને આપેલી આ શિખામણથી પોથી ફરી આ રીતે વાંચવી, એવો બાબાનો હેતુ તો નહિ હોય ને? આગળના અદ્યાય ૪૧માં બાબાએ દહાણુના દેવ મામલતદારને પણ સ્વખનમાં આવીને જ્ઞાનેશ્વરી વાંચવાનો આવો જ આદેશ કર્યો હતો. ‘સમજય છે કે પોથી? મને પૂછ્યાં ॥૧૬૭॥ બાબા બોલ્યા પોથી વાંચતા। વાંચો છો બહુ ઉતાવળ કરી। વાંચો જોઉ મહારા દેખતા પોથી। મહારી પાસે બેસીને ॥૧૬૮॥’

બાબા એ જયારે એમ કહ્યું ત્યારે હું ત્યાં જ બાબાના પગ દ્વારા વતો હતો. મને આશ્રય થયું અને મનમાં વિચાર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આવ્યો, ‘બાબા આ આમ કેમ ? સાઠેને આ આટલા થોડા જ શ્રમમાં ફળ મળી ગયું અને મને આ પોશીના પારાયણમાં વર્ષોનાં વર્ષ વીતી ગયા. તેમને તો સાત દિવસમાં જ તેનું ફળ મળ્યું. સાઠેએ ગુરુચરિત્ર એકવાર વાંચ્યુ જ્યારે હું છેલ્લા ચાલીસ વર્ષથી વાંચી રહ્યો છું. એનો કોઈ મતલબ ખરો કે નહીં ? એકને સાત દિવસમાં જ ફળ અને બીજને સાત વર્ષમાં પણ નહીં ? શું આ આપો ગાળો વ્યર્થ ગયો ? મને તો બાબાના પ્રથમ દર્શનનો લાભ મળ્યો. તેના સાત વર્ષ વીતી ગયા. આ દ્વારાંપી મેધ કયારે વર્ષાવ કરશો. એમ સમજુને આ ચાતક રાહ જોઈ રહેલ છે. એવો એક દિવસ જરૂર આવશે કે આ સંત ચૂડામણિ પ્રસન્ન થઈને ઉપદેશ આપીને મારા મનની હોંશ પુરી કરશે.’ શ્રી ગુરુસાઈની નવાઈ તો જુઓ. મારા મનમાં જે કંઈ વિચારો આવ્યા તે તેમણે તરત જ જણી લીધા. અજાનતાને કારણે આવી હજરો ખરાબ વાસનાઓ અને ઈચ્છાઓ માણસના મનમાં એક પછી એક આવતી રહે છે. તેની જણ બાબાને હોય છે. ‘મન ચિંતી તે વૈરી ન ચિંતી’ વેરીના મનમાં પણ ન આવે તેવા દુષ્ટ વિચારો એકાદ કોઈ વિષય પર આપણા મનમાં આવી જય છે. આ કહેવત બધાને ખબર છે. બીજન કોઈને આપણા મનના દુષ્ટ વિચાર ન સમજતા હોય તો સાઈભારાજ તે તાત્કાલિક જણતા, પરંતુ અતિશય દૃપાળું એવી એ ‘મા’ માલિલી બધા દુષ્ટ વિચારોને પોતાના પેટમાં સમજાવી લે છે અને પરોપકાર માટેના સારા વિચારોને યોગ્ય સમય જોઈને પ્રોત્સાહન આપે છે. માટે મારા મનમાં એ વિચારો સમજુને બાબાએ મને કહ્યું, ‘ઉઠ પેલા શ્યામા પાસે જ અને પંદર ડ્રિપિયા દક્ષિણા લઈ આવ. તેની સાથે થોડીવાર બેસ. એકબિજી જેઠે થોડાં ગપ્પા મારો અને દક્ષિણા આપે તે લઈને તરત જ પાછો આવ’ સાઈનાથને મારી ઉપર કૃપા કરવાનું મન થયું માટે દક્ષિણાનું નિમિત્ત બજાવીને મને બોલ્યા, ‘હમણાંને હમણાં જ શ્યામા પાસે જ અને મારે માટે ડ્રિપિયા માગી લાવ.’ આવી આજા થતાં ત્યાં બેસવાની કોની હિંમત થાય ? હું બેસી રહું તો આજાબંગ ગણાય. માટે બાબાની આજા મળતાં તરત જ ઉઠ્યો અને શ્યામરાવ પાસે ગયો. શ્યામરાવ પણ બસ તે જ વખતે સ્નાન કરીને ઘોતિયું પહેરીને બહાર ઉભા હતા. હાલમાં સ્નાન પતાવી ચોળ્યાં ઘોયેતાં વસ્ત્રો પહેરી તેઓ મુખથી નામસ્મરણ કરતાં કરતાં ઘોતિયાની પાટલી વાળતા હતા. મને જેતાં તે બોલ્યા, ‘કેમ વચ્ચેથી જ કેવી રીતે ?’ મસ્ઝિદમાંથી આવ્યા લાગો છો ? મોઢા ઉપર આટલી અસ્વસ્થતા કેમ ? અને આજે આમ અચાનક એકલા કેમ ? આવો બેસો. હું હમણાં જ નાહીને બહાર આવ્યો છું અને આ ઘોતિયું પહેરી રહ્યો છું. હું જઈને ભગવાન ઉપર પાણીનો અભિષેક કરીને તરત જ પાછો ફરું છું એમ સમજો. આપ પાનનું બીંદું બનાવી ખાવ એટલામાં હું પૂજન વિધિ પતાવી દઉં. પછી આપણે શાંતિથી વાતો કરીએ. માધવરાવ ઘરમાં ગયા અને પછી ત્યાં બારી ઉપર નાથભાગવત પોથી પડી હતી, તે હાથમાં લીધી. ભાગવત ઉપર ૧૧મા સ્કંધ પર એકનાથ મહારાજે મરાઈમાં કરેલી આલોચના વાળો ગ્રંથ દૈવયોગથી ખોલતાં જ કલ્પના ન કરી શકાય તેવી રીતે જ્યાંથી સવારના વાંચવાનો આરંભ કરેલો અને અધ્યવચ્ચે જ એને મેં વાંચવાનો છોડી દીધેલો તે જ ભાગ ફરી વાંચવામાં આવ્યો. આ જોઈને ખૂબ નવાઈ લાગી. સવારે જે વાંચન આગસના કારણે અધ્યવચ્ચે છોડી દીધેલું તે બાબાએ પૂર્ણ કરાવ્યું અને મારી ઉપર શિષ્ટ લાદી દીધી. નિયમન એટલે દરાવેલો સમય ન ચૂકતાં નિયમથી કરેલું વાંચન. નિશ્ચિતપણે અને સંપૂર્ણપણે જીણાવથી કરેલ વાંચન પૂર્ણ થાય નહિ ત્યાં સુધી, તે નિયમિત ઉપાસના અધૂરી છોડીને પોતાની જગ્યાએથી ખસવું નહીં. (ઓ. પ૮-૭૮)

હવે આ નાથભાગવત સંબંધી થોડી અમસ્તી નાની વાત યાદ આવી, તે પણ કહ્યા વગર રહેવાય એમ નથી, માટે શ્રોતાઓએ તે આદરથી સાંભળવી. ગુરુભક્તિના રસથી પરિપૂર્ણ ભરેલું આ નાથભાગવત, સાઈભાબાની કૃપા પામેલા કાકાસાહેબ હરિ સીતારામ દીક્ષિત દરરોજ વાંચ્યતા હતા. આખા જગતના ઉદ્ધાર માટે શ્રી વિષણુ ભગવાને બ્રહ્મદેવઙ્ઘી ભૂમિમાં જે રોખું, જેમાંથી બ્રહ્મદેવે નારદઙ્ઘી જેતરમાં ધાન્યના પાકેલાં દુંડા ઉગાડ્યાં, તે જેતરના પાકેલા ધાન્યનાં દુંડામાં વ્યાસ મુનિએ દશ લક્ષણો જેવાં કે સૃષ્ટિની ઉત્પત્તિ દેવ, વીર વગેરે પુરાણો માટે જરૂરી દશ લક્ષણોથી યુક્ત

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શ્રીમહબાગવતમહાપુરાણ રચ્યું. જેની વ્યાસ પુત્ર શુક્રદેવે પરીક્ષિત રાજ રૂપી ખળીમાં સાફ કરીને કણસલા ઝાટકીને બળદોના પગ નીચે ગુંડીને ધાન્ય છૂટુ કર્યું. શ્રીધર સ્વામીએ આલોચના કરી. અને ત્યારબાદ તેને જનાર્દન સ્વામીએ કે જે ઈ.સ. ૧૫૦૪ થી ૧૫૬૮માં દોલતાબાદના હતના આશીર્વાદ પામેલા સંત કવિ હતો અને તે એકનાથ મહારાજના ગુરુ શ્રી જનાર્દન સ્વામીએ તેમણે મોજણી કરીને કિંમત આંકી. જેનાથી પૈઠણના એકનાથ મહારાજે સ્વાદિષ્ટ અને રસથી ભરપૂર એવા પુષ્કળ પાકા અનું સરસ જમણ તૈયાર કર્યું તે ભાગવતમહાપુરાણનો અગિયારમો સ્કંધ છે. કાકાસાહેબ તે દરરોજ વાંચતા હતા. આ અગિયાર સ્કંધો નથી તે જાણ. એકનીસ ખંડોનું વૃદ્ધાવન. અહીંથા નિત્ય બેસે જ્યાં શ્રીકૃષ્ણ. | સ્વાનદેપૂર્ણ પોતાની સત્તાથી ||૪૬ ડ|| માટે વાંચકોએ અહીંથા બત્રીસ ખંડોને બદલે એકત્રીસ ખંડોવાળું છે એવું વાંચવું. આ નાથ ભાગવતનું કાકાસાહેબ દીક્ષિત દિવસ દરમ્યાન પારાયણ કરતા હતા, અને રાત્રે એકનાથ મહારાજે રચેલ ભાવાર્થ રામાયણને વાંચતા હતા. જે ગ્રંથને ગુરુની આજા સમજીને દીક્ષિતે યથાર્થ જ્ઞાનનું સાધન સમજીને પ્રમાણભૂત કર્યો હતો. નાથભાગવત એટલે ભક્તિસુખદૃપી અમૃતનો સાર જ છે. અને જાણો કે જ્ઞાનેશ્વરીનો બીજો અવતાર છે. જ્ઞાનેશ્વર મહારાજે ગીતા પર મરાઈ ભાષામાં કરેલી આલોચના જ્ઞાનેશ્વરી પછી સુમારે ૨૮૦ વર્ષ બાદ લખાયેલો એ ટેટલો જ મહત્વનો ગ્રંથ છે. ખરેખર આ એકનાથ મહારાષ્ટ્ર ઉપર મોટો ઉપકાર છે. મળસ્કે સ્નાન કરી નિત્ય કર્મ, સાઇપૂજન વગેરે અને દેવપૂજન આરતી અને નૈવેદ્ય વગેરે પતાવીને દૂધનો પ્રસાદ અને થોડું ફ્રાળ ખાઈને શ્રોતુઓની જેઠે દરરોજના નિયમથી દીક્ષિત આ પોથી સવિસ્તાર આદરપૂર્વક વાંચતા હતા. જેના માધુર્યને લઈને ભાગવત પારાયણ તુકારામ મહારાજે ‘ભંડાર’ નામના દુંગર ઉપર એકાંતમાં એક હજાર પારાયણ કર્યા હતાં. તેનું વર્ણન કેવી રીતે કરી શકાય ? આ ગ્રંથ મહાપ્રસાદીકૃપ અને દિવ્ય છે. અને દીક્ષિત એક નિષ્ઠાવાન શિષ્ય હતા માટે સમર્પણ સાઠિએ લોકોના ઉદ્ઘાર માટે તે વાંચવાની તેમને આજા કરી હતી. ભાગવતના અગિયારમાં સ્કંધને ઉદ્ઘગીતા કહેવામાં આવ્યો છે. ઉદ્ઘવ શ્રીકૃષ્ણનો ચાહવ કુળમાંનો સેવક હતો. જેને શ્રીકૃષ્ણ નિજધામ સિધાવતાં પહેલાં કરેલો ઉપદેશ આ સ્કંધમાં છે. આ ઉદ્ઘવ ગીતામાં પ્રગટ થાય છે. માટે તેનું જે ભક્ત પારાયણ કરે છે, તેમને તપશ્વર્યા કરવા માટે જંગલોમાં ન જતાં ભગવંતની પ્રાપ્તિ થાય છે. મહાભારતમાં શ્રી કૃપણ અને અર્જુનનો સંવાદ છે. એના કરતાં પણ શ્રીમહબાગવતમાં શ્રીકૃષ્ણ અને ઉદ્ઘવ વચ્ચેનો સંવાદ વધારે રસાળ છે. તે ઉપદેશ આ નાથભાગવતમાં એકનાથ મહારાજના પ્રેમાળ શબ્દોમાં જેવો છે તેવો જ વણવેલો છે. એવો આ પ્રસાદીકૃપી ગ્રંથ જ્ઞાનહેવની જ્ઞાનેશ્વરી ભાવાર્થ દીપિકા સાથે સમર્પણ કૃપાળું સાઈનાથ શિર્ડીમાં દરરોજ વંચાવતા હતા. (ઓ. ૮૦-૮૪)

સખારામ હરિ ઉર્ફ બાપુસાહેબ જેગ જે બાબાના એક પરમ ભક્ત હતા. મેધાના મૃત્યુ બાદ એટલે કે તા. ૧૮-૧-૧૮૧૨ પછી બાબાની બપોરની આરતી મસ્જિદમાં છેલ્લે સુધી તેમણે જ કરી હતી. તેમને નાથભાગવત રાવબહદુર સાહેના વાડામાં વાંચવાની બાબાની આજા હતી. અને ભક્તોને તેનો ખૂબ ફાયદો થતો હતો. દરરોજ બાબા કેટલાએ ભક્તો પાસે તેમનું કલ્યાણ કરવાની ભાવનાથી આ ગ્રંથનું દીલથી શ્રવણ કરતા. બાબાની કૃપા કરવાની રીત અગાધ હતી ભક્ત દૂર હોય કે પાસે બાબા તેમના હૃદયમાં અને સાનિધ્યમાં રહીને અનેક પ્રકારે તેનો ઉપદેશ કરતા હતા. પોતે ભલે મસ્જિદમાં બેસી રહેતા હતા છતાં અમુકને કોઈ ચોક્કસ પ્રકારનાં કાર્ય સોંપીને તથા તેને પોતાની શક્તિ આપીને તે પૂર્ણ કરાવતા હતા. બાપુસાહેબ જેગને રા. બ. સાહેના વાડામાં પોથી વાંચવાનું કહેતા અને જેગ દરરોજ નિયમથી વાંચતા તથા શ્રોતાઓ તેને સાંભળવા બેસતા. બપોરે જમ્યા પછી જેગ હંમેશા બાબા પાસે જઈને બાબાનાં ચરણોમાં વંદન કરી, ઉદ્દી લઈને પોથી વાંચવાનું શરૂ કરવાની આજા માગતા. તેઓ કદી જ્ઞાનેશ્વરી તો કદી નાથભાગવત ખૂબ આનંદથી પારાયણ શરૂ કરી અર્થપૂર્ણ આખ્યાન કહેતા. આ પ્રકારે જેગને પોથી વાંચવાની આજા આપ્યા પછી જે જે ભક્તો બાબાને મળવા આવતા તેમાના ઘણાને બાબા પોથી સાંભળવા માટે મોકલતા. કોઈ કોઈ વખત બાબા જતે જ

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

નાની મોટી વાત કહેતા અને શ્રોતાઓ એના ઉપર ધ્યાન હે એ પહેલાં બાબા લોકોને કહેતા, ‘જ ઉઠ. વાડામાં પોથી સાંભળવા જ.’ એવા ભાવાથી શ્રોતાઓ પોથી સાંભળવા જતા ત્યારે પોથીમાંથી એવી જે કથા નીકળતી, જેના અનુસંધાનમાં બાબાએ પહેલાં કહેલી વાત વધારે દફ થઈ જતી અને એનો ખરો અર્થ પૂર્ણપણે સમજતો. જ્ઞાનેશ્વરની જ્ઞાનેશ્વરી અને એકનાથની વાણી બાબાની જ વાતોનો પુનરુચ્ચાર કરતાં હોય એવું જ લાગતું. ત્યારે શ્રોતાઓને આશ્રય થતું. કોઈ પણ એક નક્કી કરેલ પોથીનો ભાગ વાંચવો એવી બાબાની ચોક્કસ આજ્ઞા ન હોવા છતાં બાબાએ પહેલેથી જ કહેલી વાતોના સંબંધમાં સુયોગથી પોથીમાંનો ભાગ જેગ દ્વારા વાંચવામાં આવતો. ભગવદ્ગીતા અને ભાગવત આ બે ગ્રંથ ભાગવત ધર્મના સારભૂત ગ્રંથો છે. જે જેગ દરરોજ વાંચતા હતા. ભગવતગીતા ઉપર મરાઠીમાં જે આલોચના થઈ છે તેને જ્ઞાનેશ્વરી કહેવાય છે. જેનું નામ ભાવાર્થીપિકા છે. ભાગવતનો અગિયારમો સ્કંધ તે એકનાથ મહારાજનો નાથભાગવતમાંનો પરમાર્થ નિરૂપણનો આધાર છે. (ઓ. ૮૫-૧૦૮)

આ ભાગવત ધર્મની ડૃઢ પ્રમાણે નિત્ય ક્રમ સમજુને હું પણ તે દરરોજ વાંચતો હતો. પરંતુ તે દિવસે એમાં ખાડો પડ્યો અને દિવસ ખાલી ગયો. તેમાં એક કથા અધીપદ્ધી વાંચી અને સૌ મસ્તિદમાં જવા માટે નીકળ્યા. મેં પણ પોથી વાંચતાં વાંચતાં બાજુ મૂકી દીવી અને મસ્તિદ તરફ જવા માટે જલદીથી પગ ઉપાડ્યા. મનમાં ઈચ્છા હતી કે બાબાની વાતો સાંભળવી, પરંતુ બાબાના મનમાં બીજી જ કોઈ વાત હતી. ભાગવત વાંચવાનું છોડીને બીજાં કોઈ કષ્ટ કરવાથી બાબાને સંતોષ થતો ન હતો. માટે દરરોજના વાંચન પૈકી બાકી રહેલો ભાગવતનો ભાગ બાબાએ મારી પાસેથી જબરદસ્તીથી વંચાવ્યો હોય એવું મને લાગે છે. બાબાની વાતો યાદ આવતાં હવ્યમાં પ્રેમના પૂર જ ઊભરાવા માંડે છે. (ઓ. ૧૦૯-૧૧૨)

અહીંયા નાથભાગવતની કથા પતી અને તે અંગે નાની અમસ્તી વાર્તા પણ કહી સંભળાવી. માધવરાવની પૂજા પતી અને સવારી બહાર આવી.. ‘અરે ભાઈ ! બાબાના સંદેશો છે એ જ લઈને હું અહીં આવ્યો છું. શ્યામા પાસેથી પંદર ડ્રિપિયા દક્ષિણા લઈ આવ.’ હું બાબાની સેવા કરતો હતો. એટલામાં બાબાને તમારી યાદ આવી અને એમણે મને કહ્યું, ‘ઉઠ શ્યામા પાસે જે અને દક્ષિણા લઈને તરત પાછો આવ. થોડીવાર એમને ત્યાં બેસ અને વાતચીત કર અને પછી પાછો આવ.’ આ સાંભળીને માધવરાવ આશ્રયચક્કિત થઈ ગયા અને બોલ્યા, ‘ડ્રિપિયાના બહદરામાં મારા નમસ્કાર લઈ જવ. એ જ મારી દક્ષિણા.’ એ સાંભળી હું બોલ્યા, ‘હશે, આ એક કામ પત્યું, પંદર નમસ્કાર જેઠે લીધા અને છેઠે બાંધ્યા. પરંતુ વાતો કરવા માટે બેસોને ! જે વાત કહેવી હોય તે કહો, અને મારી સાંભળવાની ઈચ્છા પૂર્ણ કરો ! બાબાની પવિત્ર યશગાથા ડ્રીપી ગંગામાં દૂબકી મારીને પાપોને દૂર કરીએ.’ ત્યારે માધવરાવ બોલ્યા, તમે બેસો આ અમારા દેવનો ખેલ કંઈ આવો જ છે. માધવરાવ બાબાને દેવ કહીને સંભોધતા અને તેમનામાં બાબાને ઓરે, તુરે કહેવાની હિંમત પણ હતી. તમે પણ બધું જાણો છો. ક્ષણભર તો આરામ કરો. આ લો પાન અને આ કાથો, ડબ્બામાં ચૂનો અને સોપારી પણ છે. હું એક મિનિટમાં જ માથે ટોપી પહેરીને તૈયાર થઈને આવું છું. સાઠિબાબાની લીલાઓ તો અમર્યાદિત હતી. હું તમને કેટલી કહું અને કેવી રીતે કહું ? શિરડી આવ્યા પછી કંઈ ઓછી લીલાઓ જોઈ છે ? હું તો કેવળ ગામડાનો અનાડી માણસ છું, તમે તો બધા શહેરમાં રહેનારા સુશિક્ષિત માણસ છો. તમારા જેવા સામે ન સમજય એવી લીલાઓનું હું શું વર્ણન કરું ? આવું કહીને માધવરાવ ધરમાં ગયા, ભગવાનને કૂલો ચઢાવ્યાં અને તરત જ ટોપી પહેરીને બહાર આવ્યા અને મારી સાથે વાતો કરવા માટે બેઠા. ‘આ અમારા દેવની લીલાઓની કલ્પના કરતાં પણ આવડે એવું નથી. એમનું ચાતુર્ય ભલા કોણ સમજુ શકે ? એમના એલનો કોઈ જ પાર નથી. ખેલ એલીને પણ તે એનાથી અલિપ્ત જ રહે છે. તમે તો કેટલા મોટા, વિદ્યા સંપાદન કરેલા એકથી એક ચદ્રિયાતા વિદ્ધાન છો ! અમારા જેવા ગામડિયા અને મૂખાઓને બાબાનું આ ન સમજય તેવું ચચ્ચિત્ર કેમ કરીને સમજશો ? તેઓ જતે જ આ બાબતનો ફોડ ન પાડતાં અમારી પાસે તમારા જેવા માણસને શા માટે ઘકેલતા હશે ? એમની કરણીની એમને જ ખબર. એમનું વર્તન માણસ જેવું

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નથી પણ ઈશ્વરીય છે. વાતવાતમાં એક સરસ ઘટનાની યાદ આવી છે, તો એના વિષે થોડી વાત કરીને સમય પસાર કરીએ. અમારી સામે જ બનેલા બનાવનું હું કથન કરું છું. જેના મનમાં જેવો નિશ્ચય રહેતો ભાબા તેને તેવો જ પ્રગટ કરતા હતા. પણ કોઈ કોઈ વાર તે માણસને છેખત સુધી ચકાસતા. ભક્તની ભક્તિની અને પ્રેમની પરીક્ષા લીધા પછી જ ઉપદેશ કરતા હતા. ‘ઉપદેશ’ આ શબ્દ કાને પડતાં જ, વીજળીનો જબકારો થયો અને મને સાહેની બાબતમાં ગુરુચરિત્રની વાત યાદ આવી. ‘શ્યામા પાસે મને મોકલવાની આ યોજના મસ્તિષ્ઠમાંની મારા મનની ચંચળ સ્થિતિના કારણે તો નહિ હોય ને ? બાબાની કરણી વિચિત્ર હતી. આવી જે વૃત્તિ મનમાં પેદા થઈ એને મનમાં દબાવી દીધી. કથા સાંભળવાની ઈચ્છા બમણી વધી અને એને પૂરી કરવાનો મેં નિશ્ચય કર્યો. પછી બાબાની થોડી થોડી વાતો શરૂ થઈ અને એની ભક્ત વત્સલતા જેઠિને મને આનંદ થવા લાગ્યો. (ઓ. ૧૧૨-૧૩૪)

પછી શ્યામરાવે બીજી એક વાત કહી. તેઓ બોલ્યા, ‘એક દેશમુખ બાંધ હતાં. તેમના મનમાં આવ્યું કે સંતની મુલાકાત લેવી. સાઈબાબાની કીર્તિ સાંભળિને સંગમનેરના માણસોની સાથે એ બાંધ બાબાના દર્શને આવી. ખાશાબા દેશમુખની તેઓ મા હતાં. રાધાબાંધ તેમનું નામ હતું. સાઈબાબાના ચરણોમાં નિષા રાખીને તેણે બાબાનાં દર્શન કર્યા. દર્શન મનમાં ધર્યા પ્રમાણે થયાં. મુસાફરીનો થાક ઉત્તરી ગયો. અને શ્રીના ચરણકમળમાં પ્રેમથી જોડાયા. તેને પોતાના મનની મુરાદ યાદ આવી. તેના મનમાં તીવ્ર ઈચ્છા હતી કે સાઈસમર્થને ગુરુ બનાવવા માટે તેઓ યોગ્ય ઉપદેશ કરશે અને પોતાનો પરમાર્થ સધારી જશે. બાંધ ઉંમરમાં ઘરડાં હતાં અને બાબા ઉપર તેમને અપાર શ્રદ્ધા હતી. બાબા પાસેથી કોઈ પણ ચોક્કસ પ્રકારનો ઉપદેશ મેળવવો જ એવો મનમાં પાક્કો નિર્ધાર કરેલો. જ્યાં સુધી બાબા મારી ઉપર કૃપા કરીને એક પણ મંત્ર સ્વતંત્ર રીતે મને આપે નહિ, ત્યાં સુધી શિરડી છોડીને બીજે જવું જ નહિ. એવું એણે નક્કી કરી લીધેલું. શ્રી સાઈબાબાના મોઢેથી મંત્ર પ્રાપ્ત કરવો. બીજેથી મંત્ર મેળવવામાં પવિત્રતા નથી રહેતી. શ્રી સાઈ પુણ્યકારી મહાન સંત છે. તેઓ મારી ઉપર કૃપા કરશે જ. આવો મનમાં દદ સંકલ્પ કરીને તે બાંધ અંત: કરણથી ખાવાપીવાનું છોડી દઈને ઉપવાસ પર ઉત્તરી જુદે ચઢી. એક તો પહેલેથી જ ઉંમર વધારે અને પેટમાં અન્નનો દાણો નહીંકે થોડું પાણી પણ નહીં. ઉપદેશ ઉપર શ્રદ્ધા ભારે હતી. ડોશી ત્રણ દિવસ સતત ઉપવાસ પર રહ્યાં, જ્યાં સુધી બાબા કોઈ પણ પ્રકારનો મંત્ર આપે નહીં ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો. ગુરુમંત્રનો ઉપદેશ લીધા વીના શિરડી જઈ આવ્યાનો સો અર્થ ? જ્યાં ઉત્તર્યા હતાં ત્યાં જ ધરણાં લીધ્યાં અને મુશીબત ઉભી કરી. અન્ન જળ છોડી ત્રણ દિવસ તપ કર્યું અને પેલી દેશમુખબાંધ થાકીને ઉદાસ થઈ. માધવરાવને વિચાર આવ્યો કે આની કાંઈ ખબર પડતી નથી. આવા નસીબને શું કહેવું ? ડોશીને તો મરવાની બીક પણ નથી. પછી તેઓ મસ્તિષ્ઠમાં જઈ બાબાની પાસે બેસી ગયા અને બાબા પણ તેને તેમના નિયમ પ્રમાણે કુશળમંગળ પૂછવા લાગ્યા, ‘શ્યામા ! આજે શું વિચાર છે ? બધી ખબર તો સારી છે ને ? પેલો નારાયણ તેલી (આ શબ્દ એકાની અંત:સ્થ દુષ્ટ વૃત્તિને અનુલક્ષીને બાબા ધણીવાર બોલતા હતા.) ખૂબ વધારે બહેકેલો છે અને મને અતિશય છેતરે છે.’ ડોશીના મનના વિચિત્ર નિર્ધારથી શ્યામા પહેલેથી જ દુઃખી હતા. તેમણે તરત જ બાબાને પૂછ્યું, હવે ખરેખર શું કરવું જેઠિએ ? ‘આ શું દેવા ! ગોડ બંગલા ? ગોડ અને બંગલા આ બે દેશ જદ્વિવિદ્યા અને નજરબંધી કરવા માટે પ્રસિદ્ધ છે. માટે તેમણે બાબાને પૂછ્યું કે આ કેવો ચ્યાત્કાર છે ? તમારા ખેલ બીજાઓને સમજતા નથી. તું દરેક માણસને ગામમાં લઈ આવે છે અને તેમની ખબર અમને પૂછે છે ? પેલી મોટી ઉંમરની દેશમુખ બાંધએ ખાદ્ય પીધા વીના ત્રણ દિવસથી તારે માટે નિષા રાખીને બેઠી છે. પેલાં ડોશીમાં ખૂબ જદ્વી છે. તારાં ચરણોમાં એની શ્રદ્ધા એકદમ દ્રદ છે. તું એની સામે ભૂલે ચૂકે પણ જેવા પ્રયત્નો કરતો નથી. એને વગર કામનું કષ શા માટે આપે છે ? પહેલેથી જ સૂક્કલકડી જેવી એ બાંધ છે. લોકો કહેશે કે, ‘ડોશીમા ઉપદેશ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઇચ્છા ધરીને આવ્યા હતાં પણ સાઈબાબાને દ્વારા ન આવી અને તેને ભરણને શરણે ધરી દીધી.' જાબા ! આવા દોષારોપણ થવા હેતાં નહીં. અને તેના હિતની વાત તેને કહી દો, એની ઉપર કૃપા કરો અને અપયશ માથા પર લેતા નહીં. ડોશીમાના શસ્તીરમાં પ્રાણ રહ્યા નથી. એના પ્રાણ હવે આકુળ વ્યાકુળ થવા લાગ્યા છે અને એ મરી જશે. તમારે માથે દુષ્ટ કૃત્યનો આરોપ આવશે. ડોશીનું વ્રત પૂરું થવું ખૂબ અધરું છે. અમને મોટી ચિંતા થાય છે. કમનસીબે જે ડોશી મરી ગયાં તો ખરાબ પ્રસંગ બનશે. ડોશી ત્રાગુ કરીને બેઠાં છે. એની ઉપર તું કૃપા કર નહિ તો મને કાંઈ એની પરિસ્થિતિમાં આશા દેખાતી નથી. તારા મુખ વડે એને કંઈ કહે.' (ઓ. ૧૩૫-૧૬૦)

હવે અધ્યાયની મર્યાદા પૂર્ણ થઈ. શ્રોતાઓની આગળની કથા સાંભળવાની ઇચ્છા હવે પછીના અધ્યાયમાં, ભક્તિરસની સાથે સાચેસાચ પૂરી થશે. આગળ બાબાએ પ્રેમથી એ ડોશીને જે ઉપદેશ આપ્યો તે દ્વારાન્પૂર્વક સાંભળશો તો અજાનના ઘરમાં હડી જશે. હેમાડપંત સાઈના શરણે આવેલા છે. શ્રોતાઓને દંડવત્ પ્રણામ કરીને વિનંતી કરી રહ્યા છે કે, થોડા જ પ્રયાસોથી સંસાર પાર ઉત્તરવા માટે શ્રવણ તત્પર થાઓ. (ઓ. ૧૬૧-૧૬૩)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત
શ્રી સાઈસર્વધર્મના સત્ય ચરિત્રના 'મદ અનુગ્રહ - ૧' નામનો અઢારમો અધ્યાય અહીંથા સમાજ્ઞ થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



॥ અદ્યાય ૧૯ ॥

મહુ અનુગ્રહ - ૨

(મારી ઉપર એટલે કે હમાડપંત પર થયેલા બાબાના કૃપા પ્રસાદનું વર્ણન ભાગ-૨)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

શ્રીસાઈ સૂક્ષ્મમાં આતિ સૂક્ષ્મ અને મહાનમાં આતિ મહાન છે. પ્રલોહેવથી માંડીને નાનામાં નાના જાંખરા સુધી બધી જ
જતની વસ્તુઓમાં એ જ છે. આવા પરબ્રહ્મને રંગ, ડ્રષ્ટ અને આકાર આપીને આંખોથી જોવાની અંત:કરણમાં ઠચ્છા
ઉત્પન્ન થઈ છે. સૂર્યઉપાસક દીવાની વાટ ચેતાવીને સૂર્યની ભક્તિભાવથી આરતી કરે છે અને ગણપતિના ભક્તો ગોળના
ગણપતિ બનાવીને તેમને ગોળનું નૈવેદ્ય ધરાવે છે. ઘણા લોકો મહાસાગરમાંથી અંજલી અર્પવા માટે પાણી લાવીને તેનાથી
તેને અર્ધથ આપે છે. આ બધું ઉપર ઉપરથી જોતાં યોગ્ય નથી. પરંતુ સૂર્ય ને સાગર એ અત્યંત ઉદાર મનના હોવાથી તે
ભક્તોનો કેવળ ભાવ જુવે છે. એનું ઉચિત અથવા અનુચિત તરફ કયાંથી ધ્યાન હોય ? ભક્તોનું ગૌરવ વધારવું તે જ
તેમનો ધ્યયે હોય છે. (ઓ. ૧-૫)

‘સામાન્ય-શીલે-વ્યનસેષુ સખ્યમ्’ સરખા સ્વભાવ અને વ્યસન વાળાઓમાં ભિત્તા હોય છે. આ જે સર્વ સામાન્ય
નિયમ હોય તો પણ દેહ અને આત્મા આ બંનેનું સાથે રહેવું આ તેને માટે મોટો ન ટાળી શકાય એવો અનિવાર્ય અપવાદ
છે. સ્વભાવથી ભલે એકબીજાથી એ બિલકુલ જુદા છે છતાં તેમની દોસ્તી આશ્રયકારક છે. એકને બીજા વગર ચેન પડતું
નથી. એક પણ ક્ષણ તેઓ જુદા રહી શકતા નથી. આ શરીર નાશવંત છે, છતાં આત્મા કોઈ પણ સ્થિતિમાં બદલાયા
વીનાનો નિર્બિકારી અને કયારેય નાશ ન પામનારો અવિનાશી છે. બંનેને એક બીજા પ્રત્યે પ્રેમ અમર્યાદિત છે. અને તેને
કારણે જ સંસાર ચક્કમાં વારંવાર ફરવાનું માણસના ભાગ્યમાં આવે છે. આત્મા એ મોટી શક્તિ છે. તે સૂક્ષ્મ હોય છે, અને
આકાશ, પ્રકૃતિ જેવો અવ્યક્ત હોય છે. તેને ‘માયા’ એમ પણ કહેવામાં આવે છે. આ બધા કરતાં પણ પરમાત્મા સૂક્ષ્મ
છે. જ્યાં બધી ઇન્દ્રિયોને વિશ્રાંતિ મળે છે. બધાની અંતિમ ગતિ અને શુદ્ધ બ્રહ્મ તે આ જ. (ઓ. ૬-૧૦)

એવો આત્મા જતે નિર્બિકારી સ્ફુરિક જેવો નિર્મળ રહીને પણ સંસારમાં માયા અને કર્મથી બંધાયેલો રહે છે. રંગ જેવો
લાલ, કાળો, પીળો હોય તેવો સ્ફુરિકનો રંગ દેખાતો હોય છે, પરંતુ અસલમાં એ બધા રંગોથી જુદો વિકાર વગરનો અને
નિર્મળ હોય છે. દૂર મેદાનમાં મૂગજળ હોય એવું લાગે છે, ધીપલાની જગ્યાએ ચમકદાર રૂપાનો ભાસ થાય છે. દોરડાને
કયારેક જોવાથી સાપનો ખોટો ભાસ થાય છે. દોરડા ઉપર સાપનો આરોપ વસ્તુ હોવા છતાં પણ જેમ આધાર વગર ખોટો
ભાસ જ થાય છે. તેવી જ રીતે ‘હું દેહ છું’ આ અભિમાન મૂળમાં મુક્ત રહેલા આત્માને ખોટા બંધનોમાં ઘસડી લાવે છે.
શરીર ઇન્દ્રિયો મન અને પ્રાણ એના કરતા આત્મા જુદા ગણધર્મોવાળો છે, તે પોતાના તેજથી પ્રકારણનારો શુદ્ધ ચૈતન્યમુક્ત
આકાર અને વિકાર વગરનો છે. જ્યાં સુધી દેહ, બુદ્ધિ, મન અને પ્રાણને તેનું અભિમાન છે ત્યાં સુધી કર્તૃત્વ અને
ભોગતૃત્વ હોય છે અને તેની અનુભૂતિ પણ ટાળી શકતી નથી. વડનું બીજ કેટલું નાનું સરળું પરંતુ તેના ગર્ભમાં આખા
વડના વૃક્ષની શક્તિ ભેગી થયેલી હોય છે અને એ વૃક્ષના પેટમાં અગણિત બીજ હોય છે તેમજ તેમાં કરોડો

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

વટવૃક્ષો સમાયેલા હોય છે. પહેલાં બી. એકલું અંકુરે છે । એક બી. ના. પેટે તરુ કોટિ કોટિ ॥ આ પ્રકારે વડના પ્રત્યેક બીજમાં વડનું એક એક વૃક્ષ હોય છે જેનો અનુભવ સૃષ્ટિ નાશ થતા સુધી થતો રહે છે. આ વિશ્વમાં પણ ખરેખર એવું જ ચાલે છે તે ધ્યાન દઈને જુઓ. (ઓ. ૧૧-૧૮)

સાચતા, નિર્ભયતા, મુક્તિ, સ્વતંત્રતા અને પરમાત્માની પ્રાપ્તિ તેમાં જ જીવનની સફળતા છે અને આયુષ્ણનું અંતિમ ધ્યેય છે. જ્ઞાન વીના મોક્ષ નથી અને વૈરાગ્ય વીના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્યાં સુધી મનને સંસાર ક્ષણાંભગું લાગતો નથી ત્યાં સુધી વિરક્તિની કે વૈરાગ્યની કલ્પના પણ સ્કૂરતિ નથી. પરંતુ આ સંસારને જરૂર વગરનો લાગવામાં જગતનું અસ્તિત્વ દર્શિમાં આવે છે અને આ સંસારનો વેટમાર્ગ પંથમાં વચ્ચે જ ચક્કિત થઈ જય છે. તેને કયાં જવું તેની ખર્બર પડતી નથી. એવો આ વિશ્વનો આભાસ છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને બદ્દલે માયાનો ખોટો વિલાસ છે. પ્રપંચમાં ઉદ્ભબેલો સ્વર્ણનો દેખાવ છે. તેને માટે વગર કામનો ત્રાસ શા માટે કરવો ? સ્વર્ણમાંથી જગૃત થયા બાદ સ્વર્ણ જ રહેતું નથી. માટે જે સ્વરૂપુંપી સ્થિત છે તેને સંસારની કીર્તિ, સત્તા અને સંપત્તિ વગેરે પ્રાપ્ત કરવાની યાદ સુદ્ધાં આવતી નથી. બધા આત્માઓ એક જ છે એવું અનુભેલું જ્ઞાન થયા વીના અને આત્માના ખરા સ્વાદને જાણ્યા વીના શોક અને મોહમાં બંધન તુટ્યા માટે બીજે કોઈ જાગૃતિનો માર્ગ રહેતો નથી. (ઓ. ૧૯-૨૪)

જ્ઞાન માર્ગ આ બધામાં શૈક્ષ માર્ગ છે. એવો ઉપરેશ બાબા ભલે રાત દિવસ કરતા હતા છિતાં તે સર્વ સાધારણ ભક્તિ માર્ગનું અવલંબન અથવા તો આધાર લેવાનું જ કહેતા હતા. જ્ઞાન-માર્ગનો મહિમા સંભળાવતા તે કહેતા, ‘જ્ઞાનમાર્ગ રામફળ જેવો છે. ભક્તિમાર્ગ એટલે સીતાફળના સ્વાદ લેવા જેવો છે.’ તે સહેલાઈથી મળે એવો અને સ્વાદમાં મધુર હોય છે. જ્ઞાન એટલે સરસ મજાનું પાકેલું રામફળ અને ભક્તિ એટલે સરસ મીઠું સીતાફળ. બંને એક બીજાં કરતાં વધારે રસથી ભરેલાં અને મધુર હોય છે. બંનેની સુગંધ સરખી જ છે. રામફળ વૃક્ષ ઉપરથી તોડીને જે નીચે પકવે છે તેવાને ખાવામાં તેનો અંદરનો ભાગ તીવ્ર લાગે છે, પણ જે રામફળ ખાવા માટે ધીરજ ધરીને ઝાડ ઉપર જ પાકવા દે છે તેને તે મધુર લાગે છે. રામફળમાં મીઠાસ તો ખરી જ પણ આડ ઉપર રહીને જે તે પાકે તો જ. જે તે જમીન પર નીચે પડી જવાનો ડર હોય છે, તેવી જ રીતે જ્ઞાનમાર્ગનો આધાર લેનારને નિર્ભયતા નથી રહેતી. અને અણિમા મહિમા વગેરે એષ સિદ્ધિઓ પર વિજય મેળવવો પડે છે. તેમાં થોડી પણ બેદ્રકારી ચાલતી નથી. માટે દ્યાના સાગર શ્રી સાઈ પોતાના શિષ્યોને ખાસ કરીને ભક્તિ અને નામસ્મરણનું ઉપરાણું લેતા હતા. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જ્ઞાન કરતા ધ્યાન શૈક્ષ છે જ્ઞાનાત્માદ ધ્યાનં વિશિષ્યતે ॥ અ. ૧૨ શ્લોક ૧૨ ॥ એવું કહ્યું છે. શ્રીસાઈબાબા પણ ભક્તોને સંસાર બંધનો તોડવા માટે જ આ સાધન કહેતા હતા. (ઓ. ૨૫-૩૩)

આ વિષય ઉપરની કથાનું પાછલા અધ્યાયમાં વર્ણિન થતાં થતાં રહી ગયું. જે હવે હું અહીંચા કહું છું. મહેરબાની કરી શ્રોતાઓએ ધ્યાનપૂર્વક સાંભળ્યું. એક ઉંમરવાળાં વૃદ્ધ અને અશક્ત થયેલાં ડેશીએ સંકટ ઊભું કર્યું હતું. તેણે સાઈબાબા પાસે ગુરુ મંત્ર મેળવવા માટે અન્ન જળનો ત્યાગ કરીને વ્રતનો આરંભ કર્યો હતો. તેની આવી સ્થિતિ જેઠિને માધવરાવને બીક લાગી અને તે બાબા પાસે તટસ્થ રીતે તેની વાતનું સમાધાન કરવા ગયા. આવી આ પહેલાની કથાની અનુસંગતી છે. સાઈના મનના વિચાર દર્શાવનારી આ સાઈ સચ્ચારિત્ર રૂપી જ્યોત જળહળી ઉડી છે. તેના પ્રકાશમાં માર્ગદર્શક થઈને સાદા અને બોળા જનોને યોગ્ય માર્ગ મળો. બાબાની આજ્ઞા પરથી માધવરાવે મારી સાથે જે સુંદર કથાની રદ્દાત કરી તેને જ આપણે આગળ ચલીવાએ. માધવરાવ બોલ્યા, ‘ધરડી બાઈનો’ નિશ્ચય અને હઠ જેઠિને બાબા તેની ઉપર પ્રસન્ન થયા.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેના મનની કળ ફેરવી અને કથામાં પરિવર્તન આવી ગયું. બાબાએ તેને પ્રેમથી બોલાવીને કહ્યું, ‘માઈ ! તેં આવું વ્રત શા માટે લીધું છે ? શું તને તારું મોત યાદ આવ્યું છે ? કોઈ ઉમરલાયક બાઈ હોય તેને બાબા ‘માઈ’ અથવા ‘આઈ’ કહીને બોલાવતા અને પુરુષને ‘કાકા’, ‘બાપુ’ અથવા તો ‘ભાઈ’ કહીને બોલાવતા. આ બોલાવાની રીત કેવી મધુર ? જેવું બાબાનું પ્રેમાળ હૃદય તેવું જ તેમનું બોલવાનું પણ કર્ણપ્રિય હતું. શ્રીસાઈ દીનબંધુઓ માટે દ્વારા અને અભિમાનીઓ માટે તેમના કાન પકડનારા હતા. બાબાએ તેને ખૂબ મારી અને બોલાવી પોતાની સાથે બેસવાનું કહ્યું અને પછી પ્રેમપૂર્વક પોતાના ગુરુત્વની ગુપ્ત ચાવી તેના હાથમાં મૂકી એટલે તેમને આઠલું મોટું પદ કેવી રીતે પ્રાપ્ત થયું તેની ગુપ્ત યુક્તિ તેને કહી સંભળાવી.’ (ઓ. ૩૪-૪૩)

સંસારનાં દુઃખોની તીવ્રતા ઓછી કરવા માટે અને સંતાપ શમન માટે ભક્ત ચકોરની તરસ છીપાવવા માટે જ્ઞાનમય મેધઙ્ગપી બાબાએ સ્વચાનંદપી જગનો વર્ષાવ કર્યો તે હવે સાંભળો. તેઓ બોલ્યા, ‘માઈ ! જીવને બેહાલ શા માટે કરે છે ? હું તો માત્ર ભાખરીના ટુકડા માંગનારો ફરીર છું. મારી સામે તું પ્રેમથી જો. હું ખરેખરમાં એક બાળક છું અને તું મા છે. હવે મારી તરફ ધ્યાન રાખ. તને હું નવાઈની એક વાત કહું છું. જે તને ખૂબ જ સુખ આપશે. જો ! મારા ગુરુ એક મોટા ઓલિયા અને ઝૂપાનો સાગર હતા. તેની સેવા કરીકરીને હું થાકી ગયો. હતો છતાં તેમણે મારા કાનમાં મંત્ર કુંકયો નહિ. મારા મનની પણ એવી પ્રબળ ઈચ્છા હતી કે તેમનો સાથ ન છોડતાં ખૂબ પ્રયત્નો કરીને તેમના મૂખેથી ગુરુ મંત્ર લેવો. શક્ષાત્તમાં તેમણે મને તહ્યાબ્યો. પછી મારી પાસે તેમણે બે પૈસા માંગ્યા. મે તરત જ આપી દીઘા અને મંત્ર શબ્દ માટે ખૂબ વિનંતી કરી. મારા ગુરુ તો પૂર્ણકામ હતા. તેમને બે પૈસાની શી જરૂર ? જે શિષ્ય પાસે પૈસા માગે તેમને નિષ્કામ કેવી રીતે કહેવા? પણ આવી શંકા તમે મનમાં લાવતાં નહીં. તેમને વ્યવહારિક પૈસાની ઈચ્છા સ્વભન્માં પણ ન હતી. સોનું અને પૈસાનું તેમને શું કામ ? નિષ્ઠા અને સબુરી એ જ પેલા બે પૈસા હતા. બીજા નહિ. મેં તે તરત જ આપી દીઘા અને તેને લીધે ગુરુ માવલી મારા ઉપર પ્રસંગ થઈ. ધૈર્ય એટલે સબુરી અને કયારેય દૂર કરતા નહિ. પ્રસંગ કેવો અને ગમે ત્યારે આવી પડે તેમ છતાં આ બે વસ્તુ જ તને પાર ઉતારશે. પુરુષોનું પૌરુષત્વ એટલે સબુરી. તે સંતાપ અને દીનતા ઓછી કરે છે. યુક્તિ, પ્રયુક્તિથી સંકટોનું નિવારણ કરે છે, અને સર્વ પ્રકારના ડરને બાજુએ કરી દે છે. સબુરીના રસ્તામાં યશ હોય છે. અને વિપત્તિ અથવા તો સંકટો દૂર થઈ જય છે. અહીંયા અવિચારઙ્ગપી ત્રાસદ્યાયક બાબતોની કોઈને પણ ખર હોતી નથી. સબુરી એ સદગુણોની ખાણા છે અને સદગ્વિચાર રૂપી રાનની તે રાણી છે. મનસ્મૂતિમાં પણ દરશ સદગુણોમાં ધૂતિ એટલે ધૈર્ય, ધૈર્ય એટલે સબુરીને પ્રથમ સ્થાન આપ્યું છે. અ. ૬ ઓ. ૬૨ નિષ્ઠા અને સબુરી તે બંને સંગી બહેનો હોવા છતાં એક બીજા માટે જીવ કે પ્રાણ જેવા છે. સબુરી વગર મનુષ્યપ્રાણીની સ્થિતિ દ્વારાનક જ થઈ જય છે. પંડિત હોય કે મોટો ગુણવંત હોય તેના વીના એનું જીવન વ્યર્થ બને છે. (ઓ. ૪૪-૫૭)

‘હું બાર વર્ષ સુધી ગુરુના ચરણોમાં રહ્યો અને ગુરુએ જ મને નાનાથી મોટો કર્યો. ગુરુના હૃદયમાં મારે માટે બહુ જ પ્રેમ હૃતો, અને મને પણ અન્ન વસ્ત્રોનો તોટો ન હતો. તે મારા ગુરુ ભક્તિ વાળા પ્રેમની સાક્ષાત્ મૂર્તિ હતા. તેમણે પોતાના શિષ્યો સાથે ખરો લાગણીભર્યો સંબંધ સ્થાપ્યો હતો. મારા ગુરુ જેવો તો અન્ય ગુરુ ભાગ્યે જ મળો. તેમના સહવાસના સુખનું વર્ણિન કરતાં મને આવડતું નથી. તેમના પ્રેમનું કેવી રીતે વર્ણિન કરવું ? તેમનું મુખ જોતા મારી આંખો તો ધ્યાનસ્થ

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

થઈ જતી અને અમે બંને ખૂબ આનંદમાં આવી જતા. તેથી મને બીજે કશેય જોવાની જરૂર જ પડતી નહીં. હું રાતદિવસ પ્રેમથી ગુરુમુખનું અવલોકન કરતો હતો. મને ન હતી ખૂબ કે તરસ. તેમજ ગુરુ સિવાય મારું મન અસ્વસ્થ થઈ જતું. તેમના સિવાય મારું બીજે કયાંય ધ્યાન જ ન હતું. એમના સિવાય મારું બીજું કોઈ લક્ષ ન હતું. ગુરુ એ જ મારું અનુસંધાન હતું. ખરા ગુરુનું કૌશલ્ય અજબ જ હોય છે.' (ઓ. ૬૧-૬૫)

'મારા ગુરુ પણ મારું લક્ષ્ય સતત એમની ઉપર રહે એવી અપેક્ષા રાખતા હતા. આ સિવાય તેમને અન્ય કોઈ અપેક્ષા પણ ન હતી. એમણે મારી કદી પણ ઉપેક્ષા કરી નથી અને મારી ઉપર આવી પડેલા સંકટોથી સદ્ગય મારું રક્ષણ કર્યું છે. કયાએક હું ગુરુના પગ પાસે રહેતો તો કયાએક સમુદ્રને પેસે પાર પણ એમના સહયોગ સુખમાં અંતર પડતું નહીં. એ મને ફૂપાયુક્ત દિશિથી જ સાંભળતા હતા. કાચબી જેવી રીતે પોતાનાં બચ્યાંને પોતાની દિશિ વહે ભોજન આપે છે, તેવી જ મારા ગુરુની રીત હતી. ફક્ત દિશિથી જ તેઓ અમારા જેવા બાળ શિષ્યોને સંભળતા હતા.' 'આઈ ! મસ્નિદ્ધમાં બેસીને જે પણ કહું છું તે સાચું માન, જે મારા ગુરુએ મારા કાનમાં કોઈ પણ મંત્ર ફૂક્યો નથી તો હું તારા કાનમાં કયાંથી ફૂકું ? કાચબીની પ્રેમ દિશિથી જ એનાં બચ્યાંને સુખ સંતોષ મળે છે. 'માઈ' ! વગર કામની શા માટે દુઃખી થાય છે ? મને ઉપેશની વાતો બહુ ફાવતી નથી અને અખર પણ નથી. કાચબી નહીના એક કિનારે અને તેનાં બચ્યાં નહીની પેસે પાર હોવા છતાં નજર નજરથી જ તેનું પાલન પોષણ કરતી હોય છે. માટે જ કહું છું કે આ મંત્રની વ્યર્� ખટપટ શા માટે જેઠાંચે ? તો હવે તું જ અને અજ્ઞ જળ ગ્રહણ કર. જીવને ખોટો ઘોખામાં નાખીશ નહીં. મારી તરફ તારું લક્ષ્ય આપ એટલે પરમાર્થ તારા હાથમાં હશે. તું મારી સામે એક નિષ્ઠાથી જે અને હું પણ તારી સામે એ રીતથી જ જેઠાંશ. આ સિવાય અન્ય મારા ગુરુએ મને કંઈ જ શિખવાડયું નથી. સાધનસંપત્તાની કોઈ જરૂર નથી. છિશાંકોમાં નિપુણ થવાની પણ કોઈ જરૂર નથી. ફક્ત એક પુરાવો વિશ્વાસનો હોવો જેઠાંચે કે ગુરુ જ કર્તા હત્તી છે. માટે જ ગુરુનું મહત્ત્વ ખૂબ જ મોટું છે. ગુરુ સાક્ષાત ખ્રિસ્ત, વિષણુ અને મહેશ છે. આથી જે કોઈ ગુરુની સ્થિતિને ઓળખે છે, તે ત્રણે લોકમાં ઘન્ય થઈ જય છે. (ઓ. ૬૬-૭૫)

આ પ્રકારે બાબા તે ઉંમરતાયક બાઈને ઉપદેશ આપતા. તે વાત તેના મનમાં હસી ગઈ અને તેણે બાબાના ચરણે માથું મૂકીને પોતાના વ્રતનો અંત આણ્યો. આ કથા સાંભળીને મૂળથી જ એનો સંપર્ક જાણીને અને તેની સાર્થકતા જેઠાંને મારા મનમાં આનંદ અને આશ્રય થયું. બાબાની લીલા જેઠાંને મારો જીવ ભરાઈ આવ્યો. મારો અવાજ ઝંઘાઈને આ ઉત્તમ ઉપદેશ મનમાં બેસી ગયો. મારો કંઠ ગદગદ થતો જેઠાંને માધ્યવરાવ મને બોલ્યા, 'કેમ અણુણાસાહેબ ! કેમ અસ્વસ્થ છો ? અને આમ શાંત થઈને કેમ બેઠા છો ? બાબાની કથાઓ તો અગણિત છે. બોલો તમને કેટલી કહું ?' માધ્યવરાવ આમ બોલતા હતા એટલામાં મસ્નિદ્ધમાં વાગતો ઘંટ સંભળાયો. રોજ બપોરે જમતા પહેલાં ભક્તો મસ્નિદ્ધમાં જઈને બેસતા હતા. અને ગંધ અક્ષત અર્દ્ય વગેરે વિધિ સહ બાબાની પૂજા કરતા. ત્યાર બાદ બાપુસાહેબ જેગ પંચઆરતી લઈને ભક્તિભાવથી બાબાની આરતી ઉતારતા હતા. ભક્તગણો તે આરતી ગાતા હતા. તે આરતીનો સંકેત કરતી હોય તેવો ઉત્તમ ઘંટારવ થવા લાગ્યો અને અમારા મનની ઈચ્છા તૃપ્ત થઈને મસ્નિદ્ધની વાટ પડી. બપોરની આ આરતી પુરુષ અને સ્ત્રી ભેગાં મળીને કરતાં હતાં. સ્ત્રીઓ ઉપર મસ્નિદ્ધમાં અને પુરુષો નીચે ચોકમાં ઊભા રહીને કરતા હતા. મંગળ વાધોના અવાજમાં અને ઢોલ ત્રાંસાના ઝણકારમાં અત્યંત હર્ષભેર અને ઊંચા અવાજે એ બધી જ આરતીઓ ગવાતી. (ઓ. ૭૬-૮૫)

અમે મંડપના દરવાજે પહોંચ્યા ત્યારે આરતી જેરનેરથી ચાલતી હતી. મસ્નિદ્ધના પગથિયાં પુરુષ વર્ગથી ખીચોખીચ ભરેલાં હતાં. અને ઉપર ચઢવા માટે જરાપણ જગ્યા ન હતી. મારા મનમાં હતું કે આરતી થતાં સુધી નીચે જ ઊભા રહેવું ને આરતી થઈ ગયા પછી બધા સમુહ સાથે ઉપર બાબા પાસે જવું. મારા મનમાં આવો વિચાર આવે એની સાથે જ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

માધવરાવ જાતે જ પગથિયું ચઢ્યા અને હાથ બેંચીને મને બાબા પાસે લઈ ગયા. બાબા પોતાની જગ્યા ઉપર બેસીને સ્વસ્થતાથી ચલમ પીતા હતા. અને સામે જેગ ડાબા હથે ઘંટ વગાડીને પંચઆરતી ઉત્તરતા હતા. આવા એ આરતીના રંગમાં એવા પ્રસંગે માધવરાવ બાબા સામે જમણા હથે દક્ષિણ તરફથી બેસી ગયા. અને મને પણ બેસાડી દીધો. પછી શાંતમૂર્તિ સંતોના શિરોમણી એવા બાબા મંજુલ શબ્દોમાં બોલ્યા, ‘શ્યામરાવે શી દક્ષિણા આપી તે મને આપ.’ હું બોલ્યો, ‘બાબા ! આ શ્યામરાવ અહીંયા જ છે. એમણે દક્ષિણાને બદલે નમસ્કાર મોકલ્યા છે અને મને કહ્યું કે આ જ મારા પંદર ઝાપિયા બાબાને આપ.’ ત્યારે બાબા બોલ્યા, ‘સાંદું તે રહેવા હે.’ બીજી વાત કંઈ કરી કે નહિ ? બે જણ તમે કંઈ બોલ્યા નહીં ? શું શું વાતો કરી એ બધી મને કહો, નમસ્કારની વાત જવા દે. તેની બાબતમાં માધવરાવ સાથે શી શી વાત કરી એ મને કહે. વાત કહેવાની મને ઉત્કંઠા તો હતી જ અને મનમાં આનંદ સમાતો ન હતો. આટલા મોટા આરતીના અવાજમાં પણ એ પરમાનંદ હોઠો પરથી બહાર આવ્યો. તક્કિયાને અઢેલીને બેઠેલા બાબા પણ વાત સાંભળવા માટે થોડા આગળ આવ્યા અને મેં પણ થોડું મોહું આગળ કરીને વાત કહેવાની શરૂઆત કરી. ‘બાબા ! ત્યાં જે જે વાતો થઈ એ બધી મનને ગમી પણ એમાંની પેલી ઘરડી બાઈની વાત સાંભળીને ખૂબ નવાઈ લાગી. બાબા શ્યામરાવે એ કથા મને કહ્યા બાદ, મારા મનની અકળામણ મને સમજલવા માંડી. આ કથા ઝેપે તમે મારી ઉપર જે ફૂપા કરી તેની નિશ્ચિત ખાત્રી થઈ.’ એ સાંભળતાં જ બાબાએ ખૂબ જ ઉત્સુકતાથી મને કહ્યું, ‘કહે જે એ બધી વાતો મને, જેઓ તો ખરો ? કંઈ તે નવાઈ અને કંઈ ફૂપા ?’ વાત મેં તાજ જ સાંભળી હતી. ઉપરાંત તે મનમાં ખૂબ દસેલી હતી. એ મેં બાબાને અરખલિત કહી સાંભળાવી, અને તે સાંભળીને બાબાના મુખ પર પ્રસત્તા હેખાઈ. (ઓ. ૮૬-૧૦૦)

આ પ્રકારે બધી હકીકત મેં કહી સાંભળાવી, અને બાબાએ તે બરાબર ધ્યાન દઈને સાંભળી. તરત મને કહ્યું, ‘આ ખૂબ જ કિંમતી છે, માટે સમજુને મનમાં રાખજે.’ પછી ખૂબ ઉત્સાહથી ફરી પ્રશ્ન કર્યો, ‘એ સાંભળોલી વાત કેટલી મધુર હતી ? તારા મનમાં છસી કે નહીં ? સાર્થકતા થઈ કે નહીં ? હું બોલ્યો, બાબા ! એ કથા સાંભયા બાદ મને શાંતિ મળી. મારા મનની પીડા દૂર થઈ અને ચોક્કસ માર્ગ મળ્યો.’ જે સાંભળી બાબા બોલ્યા, ‘અમારી યુક્તિ જ ન્યારી છે આ એક જ વાત મનમાં રાખવી ખૂબ ઉપકારી થશે. આત્માનું અનુભવ જન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેને માટે તેનું ધ્યાન કરવું. એજ આત્માનું અનુષ્ઠાન છે. તેથી જ વૃત્તિનું સમાધાન થાય છે. સર્વ ઈચ્છાઓથી મુક્ત થઈને સર્વ પ્રાણી માત્રમાં વાસ કરનાર પરમેશ્વરને મનમાં લાવવો એટલે વ્યવસ્થિત ધ્યાન થરો. અને જે પ્રાપ્ત કરવું હશે તે મળરો. કેવળ મૂર્તિમંત જે જ્ઞાન, ચૈતન્ય અથવા અત્યંત આનંદ એ જ મારું સ્વરૂપ છે તે જાણ અને તેનું જ દરરોજ ધ્યાન કરતો રહે. જે મારા નિર્ગુણ નિરાકાર ઝપથી ધ્યાન સધાય નહીં તો મારા સગુણ સાકાર ઝપને ધ્યાનમાં રાખીને નખથી માથાના વાળ સુધી રાત હિવસ મનમાં લાવ. મારું આ રીતે ધ્યાન કરતાં કરતાં વૃત્તિ એકાગ્ર થશે અને ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એનું ભાન નષ્ટ થઈ જશે. આ પ્રકારે આ ત્રણેનો સમુદ્દ્રાય નહીં જેવો થયો કે ધ્યાન કરવાવાળાને ચેતના પ્રાપ્ત થાય છે. આ જ ધ્યાન કરનારાનું અંતિમ કર્તવ્ય છે. એનાથી જ પરમેશ્વરની સાથે સમરસતા પ્રાપ્ત થરો. કાચબી નદીની આ પાર હોય છે અને એનાં બચ્ચાં સામે કિનારે હોય છે. તેમને માની હુંક કે દૂધ મળતાં નથી. પરંતુ માની દાષ્ટ એ બચ્ચાને પોખણ આપે છે. બચ્ચાંએ કાચમને માટે માનું ધ્યાન કરવાનું હોય છે. બીજું કંઈ નહીં. તેમને દૂધ અન્ન કે ચારાની જડર નથી. મા તરફની નજર જ તેમને માટે પોખણ આપે છે. કાચબીનું બચ્ચાં તરફ ફરીને જેલું એટલે પ્રત્યક્ષ અમૃતની વૃષ્ટિ જ છે. તેનાથી બચ્ચાને સ્વામાનંદપી જેવો પોખણનો લાભ મળે છે, તેવી જ રીતે ગુરુ અને શિષ્યને એકરૂપ થવામાં લાભ મળે છે.’ (ઓ. ૧૦૧-૧૧૩)

આ પ્રમાણે સાઈબાબાના મુખમાંથી શબ્દો નીકળ્યા અને બીજી બાજુ આરતીનો જયધવનિ પણ થોખ્યો. બધાએ ‘શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ શ્રી સાઈનાથ મહારાજ કી જગ્ય’ એવો પોકાર કર્યો. આરતીની વિધિ પણ પૂર્ણ થઈ પછી બાપુસાહેબ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જેગ સાકર વહેંચવા લાગ્યા. એટલે બાબાએ પોતાના હાથનો પંને આગળ ધર્યો. એમાં જેગે દરરોજ પ્રમાણે મૂઢી ભરીને ખડીસાકર ખૂબ પ્રેમથી નમસ્કારપૂર્વક મૂકી. અને બાબાએ એ બધી જ સાકર મારા હાથમાં આપી દીધી અને બોલ્યા, ‘મેં કહ્યા પ્રમાણે જે વાત ધ્યાનમાં રાખ્યો તો આ સાકર જેવી તમારી હતત થશે.’ એના પર જ મેં બાબાને અભિવંદન કરી આ કૃપાનું દાન માર્ગ્યું, ‘આ જ આશીર્વાદના શબ્દો મારે માટે પુરતા છે. મને સંભળી લો.’ એ સાંભળી બાબા બોલ્યા, ‘આ કથા સાંભળવી એનું મનન કરવું, એનું ફરી ફરીને ચિંતન કરવાથી એ બરાબર ધ્યાનમાં રહેશે. એક સરખી યાદ આવશે અને ખૂબ આનંદ પ્રાપ્ત થશે. આ પ્રકારે જે કાંઈ તોં કાનથી સાંભળ્યું છે, તે મનમાં સંધરીશ તો તારા માટે કલ્યાણની ખાણ ખુલશે. અને તારા બધાં પાપો ધોવાઈ જશે. પવનના સૂસવાટા શરૂ થાય એટલે સમુદ્ર ઉપર મોંન ઉછળવા માંડે છે અને અસંઘ્ય પરપોટાની સાથે ફીઝનો કચરો કિનારા ઉપર આવીને અટકી જાય છે. મોંન પરપોટા, ફીઝ અને વમળ એ બધા એક જ પાણીના વિવિધ પ્રકારો છે. બધા જ દિનના ભ્રમ હોય છે. પવન શાંત થાય કે બધા થોભી જાય છે. આ કયો પ્રકાર થયો એ કહેવું કે બધું નારા પામ્યું એમ કહેવું ? તો આ બધો માયાનો જ ખેલ છે એમ સમજુને આવ્યું કે ગયું એ સરખું જ છે એવું જ સમજવું. સૃષ્ટિની આવી જ તોડકોડ હોય છે. વિવેકસંપત્ત માણસોને એનું અચરજ નથી થતું. એ નાશવંત વસ્તુ તરફ દીડતા નથી. અને સાશ્વત વસ્તુ મેળવી લેતા હોય છે. (ઓ. ૧૧૪-૧૨૫)

જ્ઞાન કરતાં પણ ધ્યાનનું મહત્ત્વ વધારે છે. પરંતુ તેને માટે જે વસ્તુનું ધ્યાન કરવાનું છે, તે બાબતનું યથાર્થ જ્ઞાન હોવું જરૂર છે. ભ્રહ્માની સર્વોપરી સત્તાનો સર્વને એવો ઘ્યાલ છે કે, બોધ થવા સિવાય એનું વ્યવસ્થિત રીતે ધ્યાન સધાતું નથી. આત્માનું સારું અનુભવેલું જ્ઞાન તે જ ધ્યાનનું મૂળ કારણ છે. તેને જ અંતર્યામી આત્માનું અનુષ્ઠાન કહેવમાં આવે છે. પરંતુ જે વિશેષ મુદ્દા સિવાયની વાતો છે તેને ધ્યાનમાં કરવામાં કેવી રીતે ફાવશે ? એ તો ફસાવી જાય છે. તો પછી અંતર્યામી આત્મા તે જ ઈશ્વર છે અને તે જ ગુરુ છે. ત્રણેયમાં કોઈ લેદ નથી. માટે સગુણ ઈશ્વરનું અથવા ગુરુનું ધ્યાન કરો તો ચાલે. વારંવારથી ચિંતન સારું અને પાકું થયું તેમજ ધ્યાતા અને ધ્યાન એકબીજમાં એકડ્રૂપ થઈ ગયાં એટલે દીવો પવન નથી હોતો. ત્યારે જરા પણ હાલ્યા વીનાનો સ્થિર થઈ જાય છે, તે જ પ્રમાણે ચિત્તને પણ શાંતિ મળે છે. તેને જ ‘સમાધિ’ કહેવમાં આવે છે. બધી ઈચ્છા આકંક્ષાથી બિલકુલ મુક્ત થઈને એ સર્વ પ્રાણીઓમાં અંતર્યામી છે, એવું જાણીને, અને પોતાના સિવાય આ જગતમાં બીજું કોઈ નથી એ સમજુને અને કોઈ પણ પ્રકારની બીક નથી એવી સ્થિતિ પ્રાપ્ત થઈ એટલે એ આત્મા ધ્યાનસ્થ સ્થિતિમાં આવી જાય છે. પછી અજ્ઞાનને હિસાબે ઉત્પત્ત થયેલાં કર્મોનાં બંધનો અને સંબંધો તડાતડ તૂટે છે. અમુક કરવું અને અમુક ન કરવું આ સંબંધના નિયમો આમ નિર્બધ છૂટતા હોય છે. અને મુક્તિનો આનંદ લૂંટવાનો મળે છે. (ઓ. ૧૨૬-૧૩૧)

પહેલાં આત્મા છે કે નહિ અને જે હોય તો તે બધી જ ડેકાણે એક જ અદ્દૈત છે, કે જુદે જુદે ડેકાણે જુદો જુદો છે અને એ કર્મ કરનારો કર્તા છે કે અકર્તા છે એ જેવા માટે છો છ એ શાસ્ત્રો શોધી રહ્યાં હોય. પ્રાણીમાત્રમાં આત્મા છે તે એક જ છે. તેનો અનુભવ કરવો તે જ જ્ઞાનની પરકાણ છે. મોક્ષની અને પરમાનંદની પ્રાપ્તિ ખરી ત્યાંથી જ થાય છે. આંધળા માણસને હાથીનું વર્ણન કરીને સમજવવા માટે બૃહસ્પતિ જેવા વક્તા લઈ આવીએ તો પણ એના વકૃતૃવથી હાથીનું ઇપ ધ્યાનમાં આવતું નથી. વાણીને અગમ્ય વસ્તુઓનાં વર્ણન કરતાં આવડતું નથી. શું વક્તાનું મુખ અને શ્રોતાઓના કાન આંધળાની ગયેલી આંખો પાઈ લાવી શકશો ? હાથીનું ખું સ્વરૂપ જેવા માટે માત્ર આંખો જ ઉપયોગી થઈ પડે છે. આંખો વગરના અંધજનો માટે અનુભવવા હાથી કેવી રીતે સમજશે ? માટે ગુરુ જ્યારે દિવ્યયક્ષુ આપે છે ત્યારે જ જ્ઞાનનો બંદાર હાથ લાગે છે. સાઈબાબા પોતે સંપૂર્ણ અનુભવ અને જ્ઞાનના બંદાર છે. તેમના સ્વરૂપનું યથારાક્તિ જ્ઞાન મેળવવું તે જ તેમના ધ્યાનનું અનુષ્ઠાન અને દર્શન છે. અજ્ઞાન, કામ અને કર્મ આનાં બંધનોથી સંપૂર્ણપણે અતિગ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

થવા માટે બીજું કોઈ સાધન નથી તે ધ્યાનમાં રાખો. (ઓ. ૧૩૨-૧૩૮)

સાઈ નથી અમારો કે તમારો. એ ખરેખર તો પ્રાણી માત્રમાં વાસ કરનારો છે. સૂર્ય જેમ આપ્યા વિશ્વ માટે છે. તેમ તે બધાને માટે જ છે. હવે એના સર્વ સાધારણ અને મૂલ્યવાન બોલ સાંભળો. વારે ઘડીએ આ બોલવામાં આવેતા શબ્દો ધ્યાનમાં રાખશો તો તમારું સહાને માટે હિત થરો. ‘પૂર્વ જન્મના ઋણાનુંબંધ સિવાય કોઈ પણ કયાંયે જતો નથી માટે માણસોને તો શું, પણ પણું પક્ષીઓને પણ તુચ્છતાથી હડ્ધૂત કરશો નહિ. આવનાર જનારનો આદર કરવો. તરસ્યાને પાણી અને ભૂખ્યાઓને રોટલો તથા ઉધાડા શરીરવાળા માટે વખત આપવા. જેનું ઢામ ડેકાણું નથી તેવાઓને બેસવા માટે ઓસરી આપવામાં આવશે તો શ્રીહરિને સંતોષ થરો. તારા મનમાં કોઈને પણ એક પૈસો આપવા માટે શંકા થતી હોય તો તે તું ના આપીશ પણ એવા લાચાર ઉપર ફૂતરાની માફક ભૂમાબૂમ કરતો નહિ. કોઈ તને મનમાં લાગી જય એવા બોલ બોલે તેમ છતાં તું તેને કોઈ કટુ ઉત્તર આપતો નહિ, સદાય જે સહિષ્ણુતા ધરાણ કરે છે અને શાંતિથી સહન કરે છે તે પુષ્ટ સુખ પામે છે. દુનિયા બલે અહીંની ત્યાં થઈ જય તો પણ પોતે કોઈ દિવસ વિચિત્રિત થતો નથી. પોતાની જગ્યા પર સ્વસ્થ રહીને દુનિયાના જેલ જેવા. અમારી અને તમારી વચ્ચેની દિવાલ તોડી નાખો ત્યારે આપવા જવા માટેનો મુખ્ય માર્ગ એકદમ ઘોખ્યો થઈ જરો. હું અને તું પણાની બેદ વૃત્તિ એ જ પેલી ગુરુ શિષ્ય વચ્ચેની ભીત છે. તેને નિશ્ચિતપણે પાડી નાખો નહિતર તેમાં એકત્વ સ્થિતિ પ્રાપ્ત થવી અધુરી છે. ‘અત્તા માલિક માલિક’ પરમેશ્વર એજ મારો સ્વામી છે.’ તેના સિવાય કોઈ વાલી નથી. એની કરણી અતૌકિક છે, અગાધ છે, અને ન સમજય તેવી જ છે. એ જે ધારે છે તે જ થાય છે. તેનો માર્ગ પણ તે જ બતાવે છે. એક ક્ષણ પણ ન વડેફતાં સમય આવતાં આપણા મનની મુરાફ પૂર્ણ થાય જ છે. આ બધી ઋણાનુંબંધની વાતો છે. માટે તમારી અમારી મુલાકાત દૈવ વસાત નસિબના કારણે થઈ છે. મનમાં એકબીજી ઉપર પ્રેમ રાખો અને સુખ અને સંતોષના અનુભવ લ્યો. અહીંયાં કોણ અમર છે? ફૂતાર્થ એને સમજલાંબો કે જેણે પરમાર્થ સાધ્યો છે. નહિ તો જ્યાં સુધી આ શાસોશ્વાસ ચાલે છે, ત્યાં સુધી જીવમાત્ર જીવતો રહે છે. માટે માણસોએ પોતાના આયુષ્યમાં પરમાર્થ વહુલો સાધી લેવો જેઠાએ. (ઓ. ૧૩૯-૧૫૧)

આ ફૂપાવચનો કાને પદ્યાં અને મારું આતુર મન સુખ પાખ્યું. મારા તરસ્યા મનને જણે પાણી મખ્યું અને હું આનંદિત થઈ ગયો, પાસે અપ્રતિમ બુદ્ધિ હોય અને કયારેય ન ડગનારી ખરી શ્રદ્ધા હોય તો સાઈબાબા જેવું ગુરુબળ મેળવવા માટે પ્રબળ ભાગ્યની આવશ્યકતા હોવી જેઠાએ. આનો સાર જેતાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં જે કહ્યું છે, તે જ સાચું છે. ગીતાનો અ. ૪ શ્લોક ૧૧માં તે કહે છે ‘યે યથા માં પ્રપદન્તે તાંસ્તથૈવ ભજમ્યાહમ्’ જે મને જેવી રીતે ભજે છે, તેવું જ ફળ હું તેમને આપું છું. માટે બધો ભાર કર્મ ઉપર જ છે. જેવું કાર્ય કર્યું હશે. તેવું જ જ્ઞાન મળેવું હશે. એ જેવો અભ્યાસ કર્યો હશે એ જ રીતે હિત સધાય છે. એ જ આ અધ્યાયનો સાર અને અમૃતબોધ છે. ગીતા અ. ૮ શ્લોક ૨૨માં કહ્યું છે ‘અનન્યાશ્વિતયંતો માભ્’ જે અનન્ય ભાવે મારું ચિંતન કરે છે. એવા નિત્ય યોગયુક્ત પુરુષોનો નિર્વહિ તથા વ્યવહાર ગોવિંદ જ ચલાવે છે. એ જ ભગવદ્ગીતાનો મર્મ અહીંયા લાગુ પડે છે. આ મધુર ઉપદેશ સાંભળીને મારી આંખો સામે સ્મૃતિનું ‘દેવાન્ભાવયનાને’ એટે યજણી તમે દેવોની સંભાવના કરો તેઓ તમારે માટે મૂઢુ થરો. ગીતા અ. ૩ શ્લોક ૧૧. આ વચન રહ્યું. પણ તમે પ્રયત્ન કરવા માંડો ફળની વિશેષ કાળજી તદ્દન છોડી હો. તમારી પાછળ હું દૂધની વાડકી લઈને ઊભો જ છું. પણ કહેશો કે જેર હું કરું અને દૂધનો ખ્યાલો તમે ઈચ્છા અનુસાર પીવો તો મને મંજુર નથી. મનુષ્યે કર્મ કરવા માટે તત્પર રહેવું, બાબાના આ સોગંદપૂર્વક કહેલા શબ્દોને માન આપીને જે કોઈ પોતાનું વર્તન તે પ્રમાણે રાખશે તેને અહીંયાં પૃથ્વી ઉપરના અને સ્વર્ગના સુખોની આણ હાથ લાગશે, એવું સમજ લેજો. (ઓ. ૧૫૨-૧૬૦)

હવે શ્રોતાઓ હું બીજું એક વિનંતી કરું છું કે, એક ક્ષણ માટે સ્થિર ચિત્ત કરી મારા અનુભવની, નિશ્ચય અને પોષણ

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

આપનારી સાઈબાબાના સ્વભાવ વિષેની એક વાત સાંભળો. એકાદું કોઈ સારું કામ કરવા માટે નિયમ રાખતાં સાઈમહારાજ તેને માટે કેવું ઉતેજન આપે છે અને મુખથી માગ્યા સિવાય ડેવી કૃપા કરે છે તે સાંભળો. ભક્તોએ બાબાને અનન્યપણે શરણે જવું તો જ તેને ભક્તિનું ફળ જેવા મળે છે, અને બાબાની લીલાઓનું નિત્ય નવું આશ્રૂ અનુભવવાનું મળે છે. ‘પ્રાતઃકાળે ઉધમાંથી જગૃત થતાં જે સારા વિચારોનાં મોંન ઉઠ તો તેને નિશ્ચયથી વધવા દેવાં. આગળ એ જ વિચારોની જે વધારે ઉપાસના થાય તો અત્યંત સંતોષ પ્રાપ્ત થશે, બુદ્ધિનો વિકાસ થશે અને મનને પ્રસન્નતા થશે.’ આવું એક સંતનું વચન છે. મને લાગ્યું કે આ વચનોનો અનુભવ કરવો. તે પ્રમાણે મેં જ્યારે અનુભવ મેળવ્યો ત્યારે મારા મનને શાંતિ થઈ અને અંતઃકરણને આશ્રૂ થયું. (ઓ. ૧૬૧-૧૬૬)

શિરડી જેવું પવિત્ર સ્થાન અને ગુરુવાર જેવો શુભ દિવસ હતો. મનમાં થયું કે રામનામનો અખંડ જપ કરવો જેઠાચે. બુધવારે રાત્રે બિધાના ઉપર શરીર નિદ્રાવશ થાય ત્યાં લગી મારા મનને શ્રીરામ પ્રભુના ચિંતનમાં કહી દીધું અને હદ્યમાં એવું જ ચિંતન ચાલવા દીધું. વહેલી સવારે આંખ ઉધારતા મનને રામનામની જ યાદ આવી. એવી સારી વૃત્તિ થયેલી જેઠાને જીવનની સાર્થકતા લાગી. પછી નિશ્ચય પ્રમાણે મન સ્થિર કર્યું. અને હાથ, પગ, મોંન ઘોંઠને મળે તે ફૂલો ભેગાં કરીને સાઈબાબાના સવારના દર્શને નીકલ્યો. દીક્ષિતનો વાડો છોડ્યો અને બુદ્ધીના વાડાની બહાર નીકળતાં જ બાબાના પરમ ભક્ત ઔરંગાબાદકર તેમને મધુર પદો ગાતાં સાંભદ્યા. તે ગીતના પ્રસંગની અનુરૂપતા ઓવી રૂપે કહીશ તો કહાય એમાં રહેલી સ્વાભાવિક મીઠાશ જતી રહેશે, અને શ્રોતાઓ નિરશા થશે. માટે એ આખું ગીત જ શબ્દ હું ગાઈને બતાવું છું, જેથી શ્રોતાઓને આનંદ થશે. તેમજ મૂળ ગીતના નિર્મળ ઉપદેશ સમજલવશે.

૫૬

‘ગુરુકૃપાંજન પાયો મેરે ભાઈ । રામવિના કુછ જનત નાહીં ॥૩૩॥
અંદર રામા બહાર રામા । જહાં દેખ વહાં પૂરનકામા ॥૧॥
જગત રામ સોવત રામા । સપ્તમે દેખત સીતારામા ॥૨॥
એકા જનાર્દની અનુભવ નીકા । જહાં દેખે વહાં રામ સરીખા ॥૩॥ ॥ગુરુ॥’

(હે ભથ્યા ! ગુરુકૃપાનું અંજન એટલે આંખોમાં આંજવાનું કાજળ, જેને લીધે દશ્ટ સાફ થાય છે. તે, જ મને મખ્યું છે. હું રામ સિવાય બીજુ કઈ વસ્તુને માનતો જ નથી. અંતઃકરણમાં રામ, બહાર રામ. જ્યાં જુઓ ત્યાં આ પૂર્ણ રામ. એટલે સર્વ ઈચ્છા પૂર્ણ થયેલા રામ જ દેખાય છે. જગતો હોઉં તો રામ, અને સૂતો હોઉં તો રામ અને સ્વખનમાં પણ મને સીતારામ જ દેખાયા કરે છે. સ્વામી જનાર્દનના શિષ્ય એકનાથને એક ઉત્તમ અને સરસ અનુભવ થયો છે. એને જ્યાં જુઓ ત્યાં એક જ સરખો રામ દેખાય છે.)

પહેલેથી જ મનમાં નિશ્ચય કર્યો હતો કે ચિત્તને રામનામનો જ રંગ લગાડવો. એ નિશ્ચયની શરૂઆત થઈ નથી ત્યાં જ, આ ગીતે જાણો કે તેની દફતા વધારી દીધી. તેને લીધે મનને જાણકારી થઈ કે, મારા નિશ્ચયરૂપી અંકુરને દ્વારાસાગર સાઈસમર્થ આ ગીત રૂપે પાણીનો છંટકાવ કરી રહ્યા છે, હાથમાં નાનો તંબુરો લઈને સાઈબાબાની સામે આંગણામાં ઉચ્ચ સ્વરે ઔરંગાબાદકર ગાયેલી આ પંક્તિ મેં સાંભળી. ઔરંગાબાદકર બાબાના પરમ ભક્ત અને મારા જેવા જ બાબા પ્રત્યે નિષ્ઠાવાન હતા. અનેક ગીતો તેમને મોઢે હોવાં છીતાં આ જ ગીત તે જ સમયે ગાવાની ઈચ્છા કેમ થઈ ? મારા વિચાર મનમાં હતા તેની તો કોઈને પણ જણ ન હતી. પછી એ જ ગીત કેમ ગાવાનું થયું ? ખરેખર બાબા જ જેવું સૂત્ર હલાવે છે ત્યારે મનમાં એવી જ ઈચ્છા થાય છે. આપણે બધાં જ માત્ર ચાવીવાળાં પૂતળાં જ છીએ અને આપણી આ સાઈમાંવડી એના સુત્રધાર છે. તેમણે જને બોલતાં સરસ મજાની ઉપાસના મારા હાથમાં આપી. મારા મનની ઈચ્છા જાણો કે બાબાના

શ્રી સાઈનું સત્ય ચાટિંગ

અંતઃકરણમાં પ્રતિબિંબિત થઈ. અને ઉપર વર્ણવ્યા પ્રમાણે તેમને તેની પ્રતીતિ મને આ રીતે કરાવી. (ઓ. ૧૬૭-૧૮૦)

નામનું કેટલું મહત્વ સંતો અને આચાર્યોએ વર્ણવ્યું છે ! હું પામર એનાં વધારે શું લખાણ કરું ? (સ્વામી સમર્થ રામદાસ કહે છે કે, રાધવનું નામ ખૂબ જ સરસ છે । લેવામાં ખૂબ જ સહેલું અને સસ્તું છે । ભાવથી લેતાં કરી નાખે મૂળ નિર્મણ । માનવ જીવો । તે જ કેવળ સાચું છે ॥૮૮॥ સંત તુકોબા કહે છે કે, ‘તુકો કહે રામનામમાં । ફૂતાર્થ થાય અમે ।’ અનોખો મોલ નામ લેવામાં । ના મંત્ર અધરો નથી । બે જ અક્ષરોનું છે કામ । ઉચ્ચારવું રામ રામ ॥ સંત તુલસીહાસ કહે છે, ‘રામનામ કર અમિત પ્રભા । સંત પુરાજા ઉપનિષદ ગાવા । સતત જપે છે શંભુ અવિનાશી । શિવ ભગવાન શાનઅનુરાગી॥’ રામરક્ષાસ્તોત્રમાં પણ શંકર ભગવાને પાર્વતી રામનામનું મહત્વ કહેતાં એવી તુલના શ્રી વિષણુ સહસ્ર નામ સાથે કરી છે. ‘રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે । સહસ્રનામ તુલ્યનું રામનામ છે આ ॥’ આનાશી આત્મસાક્ષાત્કાર થાય છે. ‘રામ’ આ બે અક્ષરોને વાતીયો ઉલટા બોલતો હતો. રસ્તે જતા આવતાને લૂંટનારાનો ઉદ્ઘાર થયો. વાતિયા નામનો કોળી હોવા છતાં પણ વાલ્મિકિ નામના ઋષી થયા. અને બોલેલા શબ્દો ખરા હોવાનું સિદ્ધ થયું. ‘મરા મરા’ આવું બોલતાં બોલતાં, જુબ પર રામ શબ્દ ઉઠ્યો અને રામ જન્મ્યા તેની પહેલાં જ એનું ચરિત્ર લખાતું ગયું. રામના નામથી પતિતપાવન થવાય છે. રામનામથી મોટો થાય છે. રામના નામથી કેટલાયે ભજનોની રચના થઈ છે. રામનામથી માણસને પ્રત્યે પણ થાય છે. રામનામના જ રટણથી જન્મ અને મરણના બંધ ઊભા થાય છે. મુક્તિ મળે છે. એક ફક્ત રામ નામના સ્મરણથી અગણિત લાભો થાય છે. જ્યાં રામનામનો ધોષ થાય છે ત્યાં વિષણુ ભગવાનનું સુદર્શન ચક ફરતું જ રહે છે અને હજરો લાખો વિદ્ધનોનો નાશ થાય છે. હીન દુઃખીઓનું રક્ષણ કરનાર આ રામનામ જ છે. (ઓ. ૧૮૧-૧૮૬)

સાઈબાબાનો ઉપદેશ કરવા માટે યોગ્ય જગ્યાની કે સમયની જરૂર ન હતી. તેઓ ઉઠતાં બેસતાં અને ચાલતાં સહેલાઈથી સર્વ ઉપદેશ કરતા હતા. આ વિષય ઉપરની એક મધુર રસપ્રદ વાત શ્રોતાઓએ આદરપૂર્વક સાંભળવી, જેથી કરીને સાઈબાબાના દ્યાળુપણાની અને સર્વવ્યાપકતાનો અનુભવ થશે. એક વખતે એક ભક્ત કોઈ એકની વાત કરતા હતા. એવામાં પોતાના ખરાબ મનના વિચારો તરફ ઝેંચાઈ ગયા. તે કોઈની છદેચોક નિંદા કરવામાં મશગુલ થયા હતા. મૂળ સારા ગુણો તો બાજુ પર રહી ગયા અને નિંદાના જબરદસ્ત પ્રવાહને પ્રાધાન્ય મળ્યું. અસલ વાત ભુલાઈ ગઈ અને નિંદા જોરશોરથી શરૂ થઈ. કોઈ કારણોસર કોઈનું આચરણ નિંદાવાલાયક કે ઠપકો આપવા જેવું હોય તો તેના ઉપર દ્યા ખાઈ એની સામે જ બે સારા બોધનો શબ્દો બોલીને તેને શિખામણ આપવી જોઈએ. નિંદા કદ્દી પણ કરવી નહીં. આ વાત સાધારણ રીતે બધા જ જાણે છે. પણ નિંદા કરવાની જે વૃત્તિ છે તે દાખતાં પણ દબાતી નથી, અને પેટમાં સમાતી નથી. ત્યાંથી તે કંઈમાં આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે હોઢો પર આવે છે. તે પછી સુખ સમાધાનથી બહાર વહેવા માંડે છે. નિંદા કરનારા જેવો ખરેખર, આખા ત્રિભુવનમાં કોઈ ઉપકાર કરવાવાળો નથી. જેની એ નિંદા કરે છે, એનું અનેક પ્રકારે કલ્યાણ પણ કરતો જય છે. કોઈ અરીધાથી મેલ દૂર કરે છે. કોઈ સાખુ જેવા સાધનો વાપરીને અને કોઈ સ્વચ્છ પાણીથી મેલ દૂર કરે છે, જ્યારે નિંદા કરવાવાળો, જુબથી મેલ કાઢે છે. બીજાને હલકો પાડવા માટે પોતાના માનસની અધોગતિ સહન કરે છે. તેમની આ ઉપકાર કરવાની ફૂતિ મહાન છે. નિંદા કરનારો ખરેખરમાં વંદ્નીય છે. જેમની તેઓ નિંદા કરે છે તેમને તેઓ પગલે પગલે સાવધાન કરે છે. નિંદાને નિભિસે તેમના દોષોની તેમને જાણ કરાવે છે અને ભવિષ્યના અનેક અનર્થ ટાળે છે. એમના ઉપકારોની હું કેટલી સ્તુતિ કરું ? એમની આ મહાનતાનું સાધુ સંતોષે અનેક રીતે વર્ણન કર્યું છે. એવા નિંદા કરનારાઓને મારા સાણંગ નમરસ્કાર. (ઓ. ૧૮૭-૧૮૮)

પેલા ભક્તના મુખમાં નિંદા કરવાનો ઉમળકો આવેલો જોઈને તે સાંભળનારાઓને ફિટકાર ધૂટયો અને એ બધી મંડળી બાબાના દર્શન માટે મસ્જિદ તરફ વળી અને પેલો નિંદા કરવાવાળો ભક્ત નાળા તરફ શૌચ માટે ગયો. સાઈબાબા

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પૂર્ણ અંતાજીની હતા. તે ભક્તોને યોગ્ય સમયે જ શિખામણ આપતા હતા. બાબાએ આનો કેવો રસ્તો કાઢ્યો તે સાંભળો. સમુહની જેડે બાબા લેંડીબાગ તરફ નીકલ્યા, એ વખતે બાબાએ નિંદા કરનાર પેલા ભક્તની બાબતમાં પૂછપરછ કરી. એ બાબતમાં ભક્ત મંડળીએ કહ્યું કે, તેઓ નાણા પર શૌચ કરવા ગયા છે. ત્યાર પછી પોતાનો કાર્યક્રમ પતાવીને બાબાની સવારી લેંડીબાગથી પાછી ફરી. નાણા પરથી પેલો નિંદક ભક્ત પણ ઘરે આવવા પાછો ફર્યો. રસ્તામાં એની અને બાબાની મુલાકાત થઈ અને પછી જે હકીકત બની તે કાળજીપૂર્વક સાંભળો. જે માટે હું શ્રોતાઓને બે હાથ જેડીને વિનંતી કરું છું. ત્યાં જ એક કંપાઉન્ડની બાજુમાં ગામમાંનું એક કુક્કર લોકોના મળોત્સર્ગને મિષ્ઠાત્ર સમજને ચાટીચાટીને આરોગતું હતું. એ તરફ હાથ લાંબો કરી, બતાવીને, બાબા પેલા ભક્તને બોલ્યા, ‘જુઓ! પેલા કુક્કરની લુભને કેવો ચસકો લાગ્યો છે! લોકોનું મળોત્સર્ગ કેવું મસ્તીથી ખાય છે, અને પોતાના આપ્તજનો ઉપર ગુર્સો ઢાલવીને પોતાના મનની હોંશ કેવી રીતે પૂરું કરી રહ્યું છે? ખૂબ પૂર્ણ્યો કમાયા પછી પ્રાપ્ત થયેલો આ માનવજન્મ જે આવી રીતે નકામો બગાડે છે. તે પોતાનું જ નુકશાન કરે છે. તેમને આ શિરડી ગામ કયું સુખ આપી શકે?’ બાબા આવું બોલતા ગયા અને એ વચ્ચનો પેલા નિંદા કરનારના અંત: કરણમાં સોંસરા ઉતરી ગયાં. એને સવારે બનેલી આખી વાત યાદ આવી તેથી બાબાએ બોલેલા માર્મિક શાખ્યો મનમાં ખૂબજ દુઃખી કરી ગયા. (ઓ. ૧૯૯-૨૦૬)

બાબા તો વખત જોઈને ભક્તોને અનેક રીતે ઉપદેશ કરતા હતા. એનો સાર પણ હવ્યમાં સંધરી રાખ્ય તો પરમાર્થ કદી દૂર રહી શકે ખરો? ‘જે હુશે મારો હરિ તો, તો આપશે ખાટલે બેઠા’ આ કહેવત જરાપણ ખોટી નથી. પણ આ વાત અત્ર વસ્તુ પુરતી મર્યાદિત છે અને એના પુરતી જ લાગુ પડે છે. એને પરમાર્થ માટે વાપરવાથી તેનો પરમાર્થ બધી જ બાજુએથી લૂંટાઈ જશે. ‘નેવું જે કરશે એવું જ એ બોગવશે’. (ઓ. ૨૦૭-૨૧૦)

બાબાના બીજા પણ બોલ સાંભળશો તો આત્માનાં ડોલવા લાગશે. અને ભાવભક્તિની જે અનુકૂળ પરિસ્થિતિ હશે તો એની જરૂર ખૂબ ઊંડી ઉતરી જશે. ‘હું પણામાં, જમીન પર કે લાકડા પર કે કોઈ પણ જગ્યા પર કે લોકવસ્તીમાં કે વેરાન જંગલોમાં આપણા દેશમાં તેમજ તે જ પૂર્ણ આકાશમાં પણ ફેલાયેલ છું. હું એક જ જગ્યા પર રહેતો નથી હોતો. સાડાત્રણ હાથની મર્યાદિત જગ્યામાં મારું અસ્તિત્વ છે, એવું જે માને છે તે એમની ભૂલભરેલી સમજણ દૂર કરવા માટે મેં દેહ ધારણ કર્યો છે. જે ભક્તો મનમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રાખતા એકનિષ્પત્તણે મારા એકલાનું રાતાદ્વિષસ ધ્યાન કરે છે. તેમને હું, તું પણાના ભાવ વીનાનો પ્રત્યક્ષ મારી સાથે એકરૂપ જ કરી નાખું છું. ગોળ ગળપણ વગર જુદ્દો રહી શકશે, સમુદ્ર મોનં વગરનો રહી શકશે અથવા તો આંખો તેજ વગર રહી શકશે, પણ મારો ભોગો ભક્ત મારાથી જુદ્દો થઈને રહી શકવાનો નથી. જેના મનમાં જન્મ ભરણના ફેરાથી નિશ્ચિંતપણે છૂટવું છે, તેને પ્રયત્નપૂર્વક શાસ્ત્રોના કહ્યા પ્રમાણે સહાયારી રહીને કોઈ પણ કારણસર મનોવિકાર વધવા ન હેતાં સહાસર્વદા શાંત અને સ્વસ્થ ચિત્તે રહેવું. તેમજ કોઈના પણ મનને ખુંચે, દુઃખ થાય, એવા શાખ્યાંપ્રયોગ કરવા નહીં. કોઈની પણ નાજુક ભાવનાઓને ઠેસ પહોંચાડવી નહીં, અથવા તો ઉધાડો પાડી એની ખોડ ખાંપણને છઠી કરવી નહીં. સદ્ગુરી મારામાં અને પાપરહિત કર્મોમાં નિરંતર મથ્ર રહેવું અને પોતાનાં કર્તવ્ય અને કર્મો તરફ ધ્યાન આપવું. મારામાં મન અને બુદ્ધિ લગાવીને સમર્થ એવા મારું સતત સ્મરણ કરવું. મારા આ પ્રકારના ભક્તને શરીરની પરવા નથી રહેતી અને કોઈ પણ જતની બીક રહેતી નથી. જે મારી તરફ અનન્યપણે જુએ છે, જે પાપથી મુક્ત કરનારી મારી કથાનું શ્રદ્ધાથી વર્ણન કરે છે કે સાંભળે છે, જે મારા સિવાય બીજા કોઈની ઉપર ભક્તિબાવ રાખતો નથી, તેનું ચિત્ત પરમાત્મા સ્વરૂપ જ થશે. (ઓ. ૨૧૧-૨૧૬)

‘મારું નામ લો મારા શરણે આવો,’ આવું બાબા બધાને કહેતા ગયા. પણ એની સાથે સાથે પોતે કોણ તો જણવા માટે તેમણે પોતાની કથાનું મનન અને શ્રવણ કરવાનો ઉપદેશ કર્યો. આ પ્રકારે કોઈ એકને ભગવાનનું નામ સ્મરણ, તો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બીજને ભગવાનની લીલાઓનું શ્રવણ તો ત્રીજને ભગવાનના પૂજા અર્થન માટે શ્રી બાબા કહેતા હતા. જુદા જુદા નિયમો, જુદી જુદી અધિકાર ધરાવનારી વ્યક્તિને કહેતા હતા. કોઈ એકને ‘અધ્યાત્મ રામાયણ’ તો કોઈને ‘જ્ઞાનેશ્વરીનું પુરુષરણ’ તો કોઈને ‘હરિષરદનું’ પારાયણ કરાવતા. તો કોઈને ‘ગુરુચરિત્રનું’ વાંચન કરવાનું કહેતા હતા. બાબા કોઈને પોતાના પગ પાસે બેસાડતા, કોઈને ખંડોબાના મંહિરમાં છાનામાના ચુપચાપ બેસવાનું કહેતા જેમ કે કાશીનાથ ઉપાસની તો કોઈને બળજબરીથી ‘વિષણુ સહસ્રાનામ’ બોલવાની ફરજ પાડતા. તો કોઈને ‘રામવિજય’ વાંચવાનો ઉપહેશ કરતા. તો કોઈને ધ્યાન ધરવાનું અને નામસ્મરણનું મહત્વ કહેતા. કોઈને વળી ‘ઇંદ્રોઽય ઉપનિષદ્ધ’ અને કોકને ‘ગીતા રહસ્ય’ વાંચવાનું કહેતા. તે સ્વ. લોકમાન્ય ટિણકે લખેલી ગીતા ઉપરની આલોચના છે. અને તે જ્ઞાનેશ્વરીની માફક મરાઠી ભાષામાં અત્યંત મહત્વની પ્રસિદ્ધ આલોચના છે. આમાં લોકમાન્યએ કર્મયોગ પર વધારે ભાર આપ્યો છે. શ્રીબાબાને સુદ્ધાં આ ગ્રંથ મહત્વનો લાગતો હતો. માટે એમણે આ ગ્રંથ ઉપર એક રૂપિયો મૂકીને સ્વ. બાપુસાહેબ જેગની ઝોળીમાં નાખીને તેને વ્યવસ્થિત વાંચવા માટે કહ્યું હતું. આ ગ્રંથોની સ્વાભાવિક મધુરતા શ્રદ્ધાપૂર્વક અનુભવવા માટે કહેતા હતા. આ પ્રકારે કોઈને કંઈ તો વળી કોઈને કંઈ દીક્ષા આપવાના પ્રકારોની સીમા જ ન હતી. કોઈને પ્રત્યક્ષ તો કોઈને સ્વખનમાં સૂચક ઉપહેશ આપવાની એમની એક પદ્ધતિ અનેડ હતી. દેરેક જાતના ભક્તો દોડી દોડીને બાબાનાં દર્શને આવતા હતા. એકાદ કોઈ દાઢિયાને દાડ પ્રત્યેની આદત છોડાવવા માટે સ્વખનમાં બાબા તેની છાતી ઉપર બેસતા અને તેના હથ પગ દબાવી દઈને દાડને કયારેય સ્પર્શ ન કરવા માટે કાન પકડીને તેની પાસે સોગંદ લેવડાવતા. ત્યારબાદ જ તેને છોડતા હતા. લગ્નના ધરમાં જ્યોતિષો ભીત ઉપર હરિ અને હર ચિત્રો કાઢે છે તેવી જ રીતે બાબા ‘ગુરુ અલ્લા ગુરુ વિષણુ’નો એક સરખો મંત્ર કોઈ એકાદ ભક્તના સ્વખનમાં જઈને લખી આવતા હતા. કોઈ ચોરી છુપીથી યોગાસનો કરીને હઠયોગના સાધનોનો પ્રયોગ કરવા લાગે કે બાબાને અંતરશાનથી તેની જાણ થતી અને તેવું કરનારાને અચૂક ટોણો મારતા હતા. આવા માણસોને કોઈ અન્નાણા માણસ માફકરે સંદેશો પાછવતા હતા, ‘કે ભાઈને સ્વસ્થ બેસતાં આવડતું નથી ? સબુરીને ઘરીને રહેવું ! કોઈકને પ્રત્યક્ષ મળીને ધમકાવીને કહેતા, અમારી એક કડવી અને કઠોર જત છે. એક બે વાર સમજલી જેઠાએ છીએ, પછી છેવેના ઠિલાજે ખૂબ જ કદક ઉપાય કરતા હોઈએ છીએ. અમારા શબ્દોની જે પરવા કરતા નથી, એવા સગા છોકરાઓને પણ બે ટુકડામાં ચીરીને ફેંકી દઈએ છીએ. (ઓ. ૨૨૦-૨૩૨)

શ્રી બાબા વિદ્યા, બુદ્ધિ, પરાક્રમ વગેરે ગુણોમાં મહાનુભાવ અને ઉદ્ધાર અંતઃકરણાબાળ મહાત્મા હતા. તેમના અદ્ભુત ફૃત્યોનું અને ચયમત્કારોનું હું ક્ષુદ્ર કેવી રીતે વર્ણન કરી શકુ ? તેઓ કોઈને જ્ઞાન અને વિરક્તિની પ્રાપ્તિ કરાવતા તો કોઈને સદ્ગ્રાવનાની મનોવૃત્તિ અને ભક્તિ આપતા. વળી કોઈને સંસારના વહેવારના નિર્દેશ અને પ્રસસ્ત વર્તનની શિસ્ત આપતા હતા. આ અંગેના ઉદ્ઘારણાદ્ધે નાનો સરખો ચટાકેદાર કિસ્સો હું શ્રોતાઓને કહી સંભળાવું છું. એક દિવસે ભરબપોરે બાબાના મનમાં શું આવ્યું કોને ખબર ! તેમની સવારી રાધાકૃષ્ણના ધરની બાજુમાં આવીને અચાનક થોબી ગઈ. સાથે થોડા લોકો પણ હતા. બાબા બોલ્યા, ‘લાલો લાલો રે એક નિસરણી !’ તરત જ એક જણે તાત્કાલિક જઈને નિસરણી લાવી આપી. બાબાએ તેને જેઠેના મકાનીન ભીત ઉપર લગાવી. અને જતે જ છાપરા ઉપર ચઢી ગયા. તેમના મનમાં શું યોજના હતી. તેની કોઈને ખબર જ ન પડી. તે વખતે એ નિસરણી વામન ગોદકરના ધરને લગાડી હતી. તે નિસરણી દ્વારા શ્રી સાઈ ઝટપટ છાપરા ઉપર ચઢી ગયા અને પડોશમાં આવેલા રાધાકૃષ્ણ માઈના છાપરા ઉપર ચઢી બાબા ઝડપથી તે ઓળંગી ગયા. આ ચયમત્કાર કોઈને સમજલ્યો જ નહિ. તે વખતે રાધાકૃષ્ણમાઈને ખૂબ જ ટાઢિયો તાવ ચઢ્યો હતો અને તેઓ ખૂબ જ બેચેન અને અસ્વસ્થ હતાં. કદાચિત રાધાકૃષ્ણમાઈનો તાવ ઉતારવા માટે તો બાબાએ આ હંમેશા પ્રમાણેનો વિચિત્ર ઉપાય તો નહોતો કર્યોને ? માઈ કદી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પણ બાબા પાસે મસ્ટિજિદમાં આવતાં ન હતાં. અને બાબા પણ તેમને ધારે કદી જતા ન હતા. આ સમયે બાબા પોતે પણ ખૂબ જ અશક્ત હતા. બે બાજુએથી જે બે જણા પકડી રાખે તો જ તેઓ ચાલી શકતા હતા. તો પછી નિસરણી ઉપરથી છાપરા ઉપર સડસડાઈ ચઢી જવાની શક્તિ તેમનામાં કયાંથી આવી. તરત જ બાજુના છાપરા પરનો ઢોળાવ ઓળંગીને તેઓ છાપરાની ધારે ધારે આવ્યા, ત્યાં પણ પેલી નિસરણી લગાવી અને બાબા નીચે ઉતરી ને આવ્યા. જમીન પર પગ મૂકતાં જ પેલા નિસરણી મૂકવાવાળાને જરા પણ વાર કર્યા વીના તરત જ બે ડ્રિપિયા ગજવામાંથી કાઢીને આપી દીધા. આમ બે ઠેકાણે ફક્ત નિસરણી મૂકવા જેટલી જ મહેનતના કામની ભરપાઈ બાબાએ બે ડ્રિપિયા આપીને પતાવી. પણ આથી ત્યાં ઊમેલા લોકોમાં સહેજે જુણાસા ઉત્પત્ત થઈ કે, બાબાએ નિસરણીવાળાને આટલે પૈસા શાના માટે આવ્યા? એમાંથી કોઈએ ધીરજ ધરી બાબાને પૂછતાં બાબાએ જવાબ આપેલો કે, ‘કોઈની પાસે મફત શ્રમ કરવાનો નહીં. કોઈની મહેનતનો થોડો ભાગ પણ મફત લેવો નહિં. કોઈની પાસે કામ કરવાનું પણ તેની સાથે એના શ્રમનો વિચાર પણ અવશ્ય મનમાં રાખવો. પોતાના જીવનમાં એવો નિયમ રાખો કે કોઈનો પણ પરિશ્રમ મફતમાં લેવો નહિં.’ બાબા આવું કેમ કરતા હતા, એનો ખરો ભર્મ કોને સમજશે? તેમની તેમને ખબર! સંતના અંતર મનની વાતો અતિ ગૂઢ હોય છે. બાબાના મુખમાંથી નિકળેલા શબ્દો એ જ અમારે માટે સર્વસ્વ આધાર છે. એ પ્રમાણે જે વર્તન કરવામાં આવે તો સંસારનો વહેવાર આસાનીથી ચાલશે. (ઓ. ૨૩૩-૨૪૯)

આગલા અધ્યાયનું માધ્યર્થ આ અધ્યાય કરતાં પણ વધારે સાચું હશે. એક ભોળીભાળી કામવાળી બાઈની છોકરી વેદાંતના ગૂઢ પ્રશ્નોના ઉક્લ લાલી આપશે. દાસગણું સ્વ. ગણેશ દત્તાત્રેય સહન્ત્રબુદ્ધેએ આ પ્રસાદ્દ્વપી ઈશ્વરીય કૃપા પામેલા કીર્તનકારે સામાન્યજીવનો પર ઉપકાર કરવા માટે સંસ્કૃત ભાષાના ‘ઈશાવાસ્ય’ નામના ઉપનિષદનું મરાઈ પ્રાકૃત ભાષામાં ભાષાંતર કરવાનો નિશ્ચય કર્યો. સાઈ કૃપાથી ગ્રંથ લખ્યો, પણ અમુક ગૂઢ અર્થ બાકી રહેતાં મનમાં સંશય પેદા થયો. પરંતુ બાબાએ તેનો ઉપાય કેવી રીતે બતાવ્યો? શિરડીમાં બેસીને એમણે દાસગણુને કહ્યું કે, તું પાર્લિમાં જય ત્યારે કાકાસાહેલ દીક્ષિતની કામવાળી બાઈ તારી શંકાનું સમાધાન કરશે. એ અધ્યાયમાં ઈશાવાસ્ય ઉપનિષદ્દ્વપી કમળ સામે વાળીની દેવી સરસ્વતીઝી ભરમી ગણગણતી આંટા મારશે. તેની સુવાસનું સેવન કરવાની રીતનો અને કલા કૌશલ્ય અને ચતુરાઈનો શ્રોતાઓએ ઉપયોગ કરવો. આગળના અધ્યાયમાં આ વિષય ઉપર જ કહેવામાં આવશે. કર્તા હત્તા દ્વારા સાગર શ્રીસાઈ જ છે. શ્રોતાઓએ એનું શ્રવણ કરતાં તેમનું કલ્યાણ થશે. હેમાંડંત શ્રી બાબાને શરણે ગયા છે. તેમજ સર્વ પ્રાઇઓમાં વાસ કરી રહેલ પરમેશ્વરમાં લીન થયા છે. શ્રોતાઓએ મને સરસ ધ્યાન લાગે તે માટે દાન આપવું. આ સાઈકથાનું નિર્દ્દ્રષ્ટ મધુર છે. (ઓ. ૨૫૦-૨૫૧)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજીવનની પ્રેરણા પામેલા ભક્ત હેમાંડંત રચિત.

શ્રીસાઈસમર્થના ચરિત્રના ‘મદ+અનુગ્રહ-૨’ નામનો ઓગણીસમો અધ્યાય અહીંથી સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



અધ્યાય ઓગણીસનું અર્થ વિવરણ

આ અધ્યાય બધામાં મોટો કે જે ૨૫૬ ઓવિઓનો છે. તેવી જ રીતે બધામાં ખૂબ જ મહત્વનો પણ છે. આમાંની લગભગ અર્ધી ઉપરની ૧૧૩ ઓવિઓ લગભગ ખુદ શ્રીભાબાના મુખેથી ઉચ્ચારેતા ઉપરેશ ઉપરથી લખવામાં આવી છે. તે સિવાય હેમાડપંતે ઠેકેઠકાળે સ્પષ્ટીકરણ અને બોધ વિવેચન પણ આપ્યું છે.

શરૂઆતમાં હેમાડપંતે અંતરાત્મા વાસ્તવિક રીતે કેવો હોય છે એ સમજલવીને સંસારી માણસો મૂર્ખ જેવા શરીરને જ આત્મા સમજને સુખ દુઃખ ભોગવતાં અને કર્તૃત્વના વર્મળમાં સપદાઈને કેવાં દુઃખી થાય છે તે સમજલવ્યું છે. આગળ શ્રી સાઈભાબાએ શાનમાર્ગ અને ભક્તિમાર્ગનું વિશેષ રૂપ રામક્રણ અને સીતાક્રણની ઉપમા આપીને સુંદર રીતે સમજલવ્યું છે.

રામક્રણને જાડ પરથી તોડવાથી અથવા નીચે જમીન ઉપર પડી ગયા બાદ એનો સ્વાદ કરવો થઈ જય છે. માટે એને જાડ ઉપર જ પાકવા દેવું પડે છે. પણ સીતાક્રણનું એવું નથી. તેને કયાંથી પણ પકવી શકાય છે. તેવું જ શાનમાર્ગ અને ભક્તિમાર્ગનું છે. શાનમાર્ગમાં વિધિ, વિધાનો અને બીજા નિયમોનું કષ્ટ હોય છે. એમાં ભૂત થાય તે ચાલતું નથી. જ્યારે ભક્તિમાર્ગમાં આવી કટકટ નથી. ‘અદ્યગુણો બહુમોલ’ માટે સાઈ હંમેશા પોતાના ભક્તોને ભક્તિ અને નામસમરણની જ પ્રેરણ આપતા હતા.

ત્યારબાદ દેશમુખ બાઈને બાબાએ આપેલ સુંદર ઉપરેશ આવે છે. એમાં બાબાએ ગુરુ પાસેથી કોઈ ગુપ્ત મંત્ર માંગવા માટેનો પોતાનો અનુભવ કહ્યો છે. અને ગુરુએ માગેતી બે પૈસાની દક્ષિણાદ્રી શ્રદ્ધા અને સભુરી જોડીને તેનું મહત્વ સમજલવીને કહ્યું છે. પછી બાબાએ પોતાના ગુરુનું રાત અને દિવસ કેવી રીતે ધ્યાન કરેલું અને ગુરુએ તેમને કેવી રીતે સાંભળેલા તે કહ્યું છે. પછી રાધાબાઈ દેશમુખને કાનમંત્રનો નાદ છોડાવી પોતાનું ધ્યાન કરવાનો સીધો અને સરળ માર્ગ શ્રી બાબાએ સમજલવ્યો.

શાન કરતાં પણ ધ્યાનનું મહત્વ સમજલવીને કહ્યું છે તેમ છતાં ધ્યાન કરવા માટે આત્માનું શાન હોવું જરૂરી છે. આત્મજ્ઞાન એ જ શાનની પરાકાશા છે. મોક્ષની અને પરમાનંદની ખરી શરૂઆત ત્યાંથી જ થાય છે. એ માટે આત્મા મૂળમાં છે કે નહીં, એ અદ્વૈત બધે જ ઠેકાળે એક જ છે કે જુદો જુદો છે અને એજ બધું કર્મ કરતો હોય છે કે ફક્ત સાક્ષી રૂપે જ ઊભો છે. આ બધું જાણવું પડે છે. છ શાસ્ત્રો બેગા કરવાથી પણ એનું શાન થતું નથી. પણ ગુરુએ હિંદ્ય દસ્તિ આપતાં તે તરત જ પ્રાપ્ત થાય છે.

પરંતુ પરમાર્થ માટે ભક્ત પ્રયત્ન કરતો હોય અને એના મનમાં એકાદી સદ્ગુરૂત્તિ ઉઠ તો સાઈમહારાજ ઉત્તેજન કેવી રીતે આપતા અને હોઠ હુલાવ્યા વગર ફૂપાદાન કેવી રીતે કરતા હતા. તે ખુદ હેમાડપંતને ‘ગુરુવાર જેવા મંગલ દિવસે, શિરડી જેવા પવિત્ર સ્થાને’ રામનામનું અખંડ કીર્તન કરવા અનુભવ પરથી આપણને સમજય છે. સંસારમાં વર્તવાની કેટલી બધી ચુક્તિઓનું શિક્ષણ આ અધ્યાયમાં બાબાએ આપ્યું છે.

(૧) કોઈ પણ, ગમે ત્યારે, આપણી પાસે કશાને માટે આવે તો તેની સાથે કેવી રીતે વર્તવું ? અને તે કંઈ માંગવા માટે આવે તો ધ્યાનમાં રાખો. ધારો કે કદાચિત એની અપાત્રતાના હિસાબે અથવા તો બીજાં અન્ય કારણોને લીધે તેને મદદ કરવાની તમારી દર્શા નથી તો બાબાનું કહેવું એ છે.

(૨) શબ્દો શબ્દો પરથી વાદવિવાદ વધે છે, જઘડો થાય છે. કોઈ એકે શાંત બેસવું એટલે બીજે આપોઆપ જ ઠંડો પડે છે. માટે બાબાની શિખામણ છે.

(૩) કોઈનીય નિંદા કરવી નહીં. એકાદ કોઈનું વર્તન નિંદા કરવા જેવું અથવા તો ઠપકો આપવા જેવું હોય તો તેની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નબળાઈ જાણીને તેને સામે બેસાડીને જ શિખામણના બે શબ્દો કહેવા. તેની પાછળ, તેની વર્તણુંક અંગેની ટીકા, મશકરી કે ચર્ચા કયારેથ કરવાં નહીં અને આવી ચર્ચામાં ભાગ સુદ્ધાં લેવો નહીં. આ માટે એક નિંદા કરનારને ભેગા થયેલા અન્ય ભક્તોની સામે વિષાના મિષાન ઉપર જીભના લબ્દકારા મારતા દુક્કર તરફ આંગળી ચીધી કેવો ઉતારી પાડ્યો હતો અને તેને જ નહિ પણ ત્યાં એકત્ર થયેલા સર્વ ભક્તોને કેવો સરસ બોધપાઠ આપ્યો.

(૪) એક ઘરને નિસરણી લગાવવાના બે ઢિપિયા આપીને મહેનતનો બદલો અને કોઈનો ઉપકાર બને ત્યાં સુધી પોતે નહીં સ્વીકારવાનું કેવું સુંદર રીતે બાબાએ ઠસાવ્યું. આમાં પરમાર્થની શિખામણ છે. પોતે સ્વીકારેલા ઉપકાર એટલે ઉધારી. તે ગમે તેટલી નાની હોય છતાં માણસે આ જન્મે નહિ તો બીજા જન્મે પણ તેને ચૂકવવી પડે છે. માટે મોક્ષ એટલે જન્મ મરણની મુક્તિ મેળવવા ઈચ્છતા માણસોએ બને ત્યાં સુધી કોઈની પાસે કંઈ પણ માંગવું જ નહિ. કોઈને ખોટો શ્રમ આપવો નહીં અને બેટ સોગાદ પણ લેવી નહિ. માત્ર એક જ અપવાદ છે. જે આવા પ્રકારની આપેતી સેવા અથવા બેટ વગેરેનો અસ્વીકાર તે આપનારના મનને જે દુઃખ પહોંચાડે તો એનો સ્વીકાર કરવામાં વાંદ્યો નથી.

(૫) બાબા શિસ્તના હિમાયતી હતા. ભક્તોના કલ્યાણ માટે દાડુંદિયા વગેરે વ્યસની ભક્તોના સ્વભનમાં જઈ છાતી ઉપર ચઢી જઈ મારવાનું ય છોડતા નહીં. વિરોધ કરવા છતાં ચોરી ધૂપીથી હઠયોગનાં આસનોની સાધના કરનારાઓને ન કહેવાના શબ્દો સંભળાવતા. તે કોઈ અન્નાયા માણસો મારફતે સર્દેશો મોકલતા અને તેમ છતાં સાંભળે નહિ તો તેને ઠપકો પણ આપતા. પોતાના શિષ્યના અથવા તો બાળકોના કલ્યાણ માટે તેમજ તેમને શિસ્ત સમજલવવા આવું કહ્ય થવું પડતું. એક આ જ અદ્યાયસાગરમાં બાબાનાં ઉપદેશકૃપી વચ્ચનોની લહેરો એક પદ્ધી એક ઊંઠ છે.

એમાંની દૂરેક વાત મનમાં ઠસાવીને એ પ્રમાણે આપણું જે વર્તન રાખીએ તો મને ખાત્રી છે, કે હેમાડપંતની માફક બાબા આપણા પણ હાથમાં મૂઠિભર સાકર મૂકીને કહેશે -

આ સાકર ગળી છે કેવી । તવ મનોઈચછા પૂર્ણ તેવી થશે ।
તવ સર્વ કલ્યાણ નક્કી થશે । અંતર - આર્તતા પૂર્ણ થશે ॥૧૧૮॥



॥ અદ્યાય ૨૦ ॥

ઇશાવાસ્ય ભાવાર્થ પોધનમું

(ઇશાવાસ્ય ઉપનિષદનો ગર્ભિત અર્થ અને તેનું તાત્પર્ય સ્પષ્ટ કહેવું)

ઇશાવાસ્ય ઉપનિષદ તે ઈશ, કેન, કઠ વગેરે ૧૧ પ્રસિદ્ધ ઉપનિષદો પૈકી ૧૮ મંત્રોનું નાનું પણ અત્યંત મહત્વનું ઉપનિષદ છે. આમ જ્ઞાવાં જતાં એકદરે ઉપનિષદો બધા મળીને ૧૦૮ છે. તે વેદોમાં છેવટના ભાગમાં આવતાં હોવાને કારણે તેમને 'વેદાંત' પણ કહેવામાં આવે છે. આ બધામાં પરમેશ્વરના નિર્ગુણ અને સગુણ તત્ત્વોના અનેક પ્રકારો કહ્યા છે.

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

ॐ ! આ કૃપાયુક્ત વચનોનાં મોતી ઉત્પત્ત કરનારા માનસરોવર ઝીપી સદગુરો ! તેમને મારા પ્રણામ હો. તમારા ચરણોમાં અનન્ય ભક્તોના સમુહ ઝીપી હંસપક્ષીઓનું તે આશ્રયસ્થાન છે. મહાન ઉદાર એવા તમે આશ્રેય આવેલા નિષ્ઠાવંતોને કૃપા ઝીપી મોતીઓનો ચારો આપીને તથા આત્મસ્વરૂપ જેવો વિશ્વાંતિનો આધાર આપીને તેમને જન્મ ભરણના ફેરણમાંથી ઉગારે છો. (ઓ. ૧-૨)

એ વાતે સાઈ ! સર્વ સિદ્ધિ પ્રાપ્ત થયેલા અને મોક્ષ પામેલા સિદ્ધ પુરુષોનું જાણે કે તે નિવાસ સ્થાન જ છે ! તેમનાં દર્શન માત્રથી સંસારનો થાક દૂર થાય છે અને તેના સતત સહવાસથી અને આસપાસ ફરવાથી સંસારનો ભ્રમ દૂર થાય છે. સાઈ મૂળમાં નિરાકાર છે. ભક્તોના કલ્યાણ માટે જ તે સાકાર થાય છે. તેમજ માયા અને મોહરઝીપી પાત્રનો સ્વીકાર કરીને એકાદ નાટકના પાત્ર પ્રમાણે આ સંસારના ખેલ આબેહૂબ રચ્યા છે. (ઓ. ૩-૪)

એવા શ્રી સાઈનું ધ્યાન કરીએ. ક્ષાણકાર ભાટે શિરડી જઈએ અને બપોરની આરતી પછી શું બને છે, તે ધ્યાન દઈને જેઠિએ. બપોરની આરતી પછી સાઈમહારાજ મસ્તિષ્ઠદના ઓટલા ઉપર કહેડા પાસે આવી અતિશય કૃપાળું નજરે ભક્તોને ઉદ્દી વહેંચતા હતા. પ્રેમાળ ભક્તો પણ નજીક જઈને બાબાના જેઠેલાં બંને ચરણોને નતમસ્તકે પ્રણામ કરીને તથા ઊભા રહીને બાબાનું મુખ જેતા હતા. તેઓ બાબા પાસેથી ઉદ્દીનો પ્રસાદ સ્વીકારતા હતા. બાબા પણ મૂર્ખીઓ ભરીને ભક્તોની હથેળીઓમાં ઉદ્દી મૂક્તતા હતા અને અંગુઠાથી કપાળ ઉપર લગાવતા હતા. બાબાના મનમાં ભક્તો ભાટે ન રોકી શકાય એવો અસીમ પ્રેમ હતો. દેરેક ભક્તોને કહેતા, 'ભાઈ જ જ મવા જ, અન્ના તું જ. ઘરે જઈને સરસ મજલું જમીને આવ. બધા પોતપોતાના ઘરે જવ.' આ બધું ભલે હવે જેવા મળતું નથી, છતાં બધા શિરડીના પ્રસંગો, અનેક વેળાએ ચોક્કસ પ્રમાણે ધ્યાનમાં આવતા આંખોની સામે દેખાય છે. આ પ્રકારે ધ્યાન ઘરીને બાબા સામે પગના અંગુઠાથી માંડીને ચહેરા સુધી જેઠિને તથા તેમનાં ચરણો પ્રેમથી દુર્વત્ત પ્રણામ કરીને કથાનું અનુસંધાન આગળ વધારીએ. (ઓ. ૫-૧૧)

પાછળના અધ્યાયના અંતે શ્રોતાઓને મેં કહ્યું હતું કે, બાબાએ ઉપનિષદનો અર્થ એક કામવાળી બાઈ પાસેથી ઉક્તિયો હતો. પ્રસિદ્ધ કીર્તનકાર દાસગણુંએ 'ઇશાવાસ્ય ભાવાર્થબોધિની' નામનો ગ્રંથ લખવાની શરૂઆત કરી હતી. મનમાં કોઈ શંકા ઉત્પત્ત થઈ. તે શિરડીમાં આવી સદગુરુ સાઈના ચરણમાં મુક્તાં. તેને માટે, 'આ શંકાનું નિવારણ તું જ્યારે

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

અહીંથી પાછો જઈશ ત્યારે કાકાના ઘરની નોકરાણી કરશે.' એવું બાબા જે બોલ્યા તે જ વાતથી હવે આ કથાના અનુસંધાનમાં આપણે આગળ વધીએ. શ્રોતાઓએ ખૂબ ધ્યાન આપવું એટલે નિર્દોષ શ્રવણ થશે. સંસ્કૃત ભાષાને ન જણવાવાળાઓ માટે ઈશાવાસ્ય ઉપનિષદ્ધના દરે શબ્દનો અર્થ ઓવીડ્ઝે લેગો કરીને સ્પષ્ટ કરવો એવી મનમાં આસ્થા રાખીને 'ઇશાવાસ્ય - ભાવાર્થબોધિનિ' ગ્રંથ સમજવા માટે સહેલો બનાવવા પ્રાકૃત મરાઈ ભાષામાં લખવા માટે દાસગણું મહારાજે આરંભ કર્યો. આ ઉપનિષદ્ધનો અર્થ ખૂબ ગહન છે. એના દેરેક શબ્દોનું ભાષાંતર તો થયું પરંતુ એનો ગર્ભિત અર્થ સમજ્યા સિવાય દાસગણું મનને સંતોષ થતો ન હતો. ચારે વેઢોનો જે સાર એ જ ઉપનિષદ્ધનો ખજનો છે. ઈશ્વરી કૃપા સિવાય તે મેળવવો જરાયે શક્ય નથી. કોઈ કહેરો કે હું મટો વિદ્ધાન દ્વારા પોતાની મેળે જ પ્રયત્ન કરીને તેનો અર્થ સમજ્યું લઈશ અને તેનો ખરો અર્થ કાઢી શકીશ તો સૂચિના પ્રલય સુધી તે ક્યારેય શક્ય નથી. ગુરુની કૃપા વગર અડચણો ઊભી થઈ. એનો ગૂઢ અર્થ જરાપણ હાથ લાગતો નથી. ઉલ્ટાના વાતેવાતે ગોટાળા સંજીવિ. પરંતુ જે ગુરુનાં શરણો જય છે. તેને જરા પણ તકલીફ ન પડતાં એનો ગૂઢ સાર નજર સામે આપોઆપ જ ખુલ્લો થઈ જય છે. આ ઉપનિષદ્ધો આત્મજ્ઞાન માટેનાં અથવા તો બ્રહ્મજ્ઞાન અંગેનાં શાક્ષો છે. તે જન્મ મરણનો નાશ કરનારાં શાક્ષો છે. જે લોકોએ અહંકાર છોડ્યો હોય અને જેઓ સંસારનાં બંધનોથી મુક્ત થયેલા હોય તેવા જ આ શાક્ષોનું વિવેચન કરવાને પાત્ર છે. તેમનો સહસ્રો લીધો એટલે ક્ષાળભરમાં અર્થ સમજ્ય છે. બૃદ્ધિની ગાંઠો અને પ્રતિબંધો ઉક્લિ જય છે. અને ગૂઢાર્થ ચોપખો સમજવા માંડે છે. ઈશાવાસ્ય ઉપનિષદ્ધ સામાન્ય માણસને સમજ્ય માટે મરાઈ ભાષામાં રચના કરતાં દાસગણું આવી જ સ્થિતિ થઈ હતી. પણ સાઈનાથની કૃપા થવાથી તેમની ગર્ભિત અર્થ સમજવાની મુશ્કેલી દૂર થઈ હતી. દાસગણું સંસ્કૃત ભાષાનું જ્ઞાન પૂર્તું ન હતું. પણ ઉપનિષદ્ધોના સાર કાઢીને રચેલા 'પંચદશી' નામના વેદાંત ઉપરના સંસ્કૃત ભાષાના સુપ્રસિદ્ધ અને સર્વમાન્ય ગ્રંથના કર્તા આચાર્ય વિદ્યારણ્ય અને શ્રી સાઈબાબાનાં ચરણોને વંદીને તેમને આ ઓવીબદ્ધ લખાણ લખવાની શક્યતા કરી. પહેલેથી જ દાસગણું વાણી એટલે દૂધની ઘારા અને તેમાં પછી સાઈની કૃપાઙ્કૃપી મીહાશ મળી. ત્યારે જઈને તે સતત વહેતી મધુરતાનું સર્જન થયું જેનો શ્રોતાઓએ ક્ષાળના વિલંબ વીના સ્વીકાર કરવો. (ઓ. ૧૨-૨૭)

આ તો 'ઇશાવાસ્ય - ભાવાર્થબોધિનિ'ની થોડી જલક આપવાનું કાર્ય થયું પણ તેનો મર્મ જણવા માટે શ્રોતાઓએ મૂળગ્રંથનું અવલોકન કરવું. આ કથાનું વર્ણન કરીને કહેવાનો મારો ઉદ્દેશ તદ્દન જુદ્દો જ છે તે હવે સાંભળો. પોતાના ભક્તો એકાદો ગ્રંથ નેણે વાંચવા માટે લેતા અને તેમાં તેમને કાંઈ ન સમજ્ય શકાય તેવું આવતાં સાઈમહારાજ તે ભક્તોની શંકાનું સમાધાન એક પણ શબ્દ બોલ્યા વીના કેવી રીતે કરતા હતા તે જુઓ. આ આખી કથાનો મુખ્ય હેતુ આ જ છે. તે અર્થ સારાંશઙ્ક્રે શ્રોતાઓને કહેવા તે જ મારી ઈચ્છા છે. કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો. ઓવીબદ્ધ સ્પર્શીકરણ અથવા તો વિવરણ છે, જે વિદ્ધાન લોકોએ તેને માન્ય ડેરવ્યું અને દાસગણુના મનની ઈચ્છા પૂર્ણ થઈ. પરંતુ તેમના મનમાં એક શંકા રહી. પંડિતોની સામે તે વિવરણ મુક્તું. તેની ઉપર પુષ્કળ ચર્ચા થઈ પરંતુ કોઈથી તે શંકાનું નિવારણ સમાધાનપૂર્વક થઈ શક્યું નહીં. એવામાં કોઈ કારણસર દાસગણું શિરડી જવાનું થયું. તે સાઈનાં દર્શન કરવા માટે દાસગણું માસ્નિકાર ગયા. સાણાંગ નમસ્કાર કરીને ભાબાનાં ચરણો પર પોતાનું માથું નમાયું અને સુખ સંપન્ત થયા. સંતની કૃપા દશ્િથી જેવું, તેમના મધુર અને પ્રેમાણ શબ્દો, સંતનું એ હસતું મુખ આ બધું ભક્તગણો માટે મંગળ પ્રાપ્ત કરાવે છે. તેમના દર્શન માત્રથી બધાં જ પાપો ધોવાઈ જય છે. તો પછી જે લોકોને તેમના નિત્ય સહવાસનો મોકો મખ્યો હશે, તેમનાં પુણ્યોનું કેવી રીતે વર્ણન કરવું ? (ઓ. ૨૮-૩૬)

દાસગણુંએ નમસ્કાર કરતાં ભાબા બધી અભર પૂછવા લાગ્યા, 'કેમ ગણું ! કયાંથી એકાએક આવવાનું થયું ? બધું ઠીકઠાક અને સુખ સમાધાનપૂર્વક તો છે ને ? ચિત્ત પ્રસન્ન છે ને ?' એ સાંભળી દાસગણું મહારાજે જવાબ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આપ્યો, ‘તમારી કૃપાનું છત હોય પછી મનમાં ભિન્નતા શા માટે આવે ? હું આનંદમાં છું. તમે આ બધું જણો જ છો, પછી સમાજના વિવેક ખાતર મને પ્રશ્ન પૂછી રહ્યા છો ? મારું કુશળ શા માટે પૂછી રહ્યા છો તે મને ખબર છે. તમે જાતે જ મારા તરફથી કોઈ એક વાતની શરૂઆત કરાવો છો, અને તેને રંગરૂપ ચઢવા લાગ્યા નથી કે વચ્ચમાં જ એવી મેખ મારો છો કે જેનો ઉક્લ કોઈને મળતો નથી.’ બંને વરચ્ચે આવો પરસ્પર સંવાદ ચાલ્યો અને દાસગણું બાબાના પગ દબાવવાની શરૂઆત કરી. પછી ઈશાવાસ્ય-બોધિનિ સંબંધે પ્રશ્ન પૂછ્યો, ‘બાબા ! ઈશાવાસ્ય બાવાર્થબોધિનિ લખતાં કલમ વચ્ચમાંથી અટકે છે અને મનમાં શંકા કુશંકા થયા કરે છે. તમે મને એ સારી રીતે સમજવો.’ આવું કહી દાસગણું જે જે બન્યુ હતું, તે તે અતિથી ઈતિ સુધી બાબાના ચરણોમાં રન્દૂ કર્યું અને સમજવા માટે ન ઉક્લાય એવી આશંકાઓ તેમની સામે માંડીને કહી. દાસગણું સાઈનાથને આજ્ઞા કરીને બોલ્યા, ‘બાબા ! મારો આ ગ્રંથ લખવાનો પરિશ્રમ ફોગટ જઈ રહ્યો છે. ઈશાવાસ્ય ઉપનિષદ અંગેની મારી હકીકત તો તમે જણો છો. મારી આ શંકા દૂર થયા સિવાય એ ગ્રંથનો ઊંડો અર્થ મને સમજવવાનો નથી. તે સાંભળી મહારાજ આશીર્વાદપૂર્વક આશ્વાસન આપીને બોલ્યા, ‘તું પ્રસન્ન મનથી રહે. આમા અધરું શું છે ? જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જઈશ ત્યારે પેલી કાકાની કામવાળી તારી આ શંકાનું નિવારણ કરી આપરો.’ (ઓ. ૩૭-૪૬)

કાકા એટલે ભાઉસાહેબ દીક્ષિત. તેઓ બાબાના એક પ્રેમાળ ભક્ત હતા અને જેઓ સદાને માટે કાયા, વાચા અને મનથી સતત ગુરુસેવામાં ભન્ન રહેતા. પ્રાચ્યાત મુંબદી શહેરથી થોડા અંતરે આવેલા પાર્ટે નામના ગામમાં આ હરિભાઉ રહેતા હતા. ધરનું માબાપે રાખેલું નામ હરિ હતું. લોકો તેમને ભાઉસાહેબ કહીને બોલાવતા. પણ બાબાએ એમનું ત્રીજું જ નામ પાડ્યુ હતું. કાકા મહારાજનીને બાબા, ‘બડે કાકા’ કહીને બોલાવતા. નાનાસાહેબ નિમોણકરને તેઓ, ‘મહાતરે કાકા’ એટલે બૂછાકા કહેતા, જ્યારે ભાઉસાહેબને ‘લંગડે કાકા’ કહેતા. તેનું કારણ એકે તેઓ લંડનમાં પગ લપસી જવાથી પડી ગયા હતા અને એક પગે લંગડાતા ચાલતા હતા. તેમને ‘બંધ્યા કાકા’ બંબા કાકા પણ કહી બોલાવતા હતા. કારણ કે તે શરીરે સ્થુળ હતા. માબાપ બાળકને એક નામ આપે છે. અને જન્મ રાશિ ઉપરથી પાડેલું બીજું નામ હોય છે. અમુક લોકોને વહાલથી અને હુલામણા નામથી પણ બોલાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભાઉ, બાપુ, તાત્યા, આણણા વગેરે. આવા પ્રકારનાં નામોથી અનેક રીતે ગૃહસ્થોને સંબોધવામાં આવે છે. સાઈમહારાજ ફેરે વ્યક્તિ માટે સમયે જે નવાં નવાં નામ મૂકતા તે જ પ્રચાલિત રહેતાં. જણો કે તે બધાને મળોલ એક પદવી જ ના હોય ! શ્રેષ્ઠતા દર્શાવવા માટે કોઈ બિઝુદ મખ્યુ હોય એવી ભાવનાઓથી બાબાના ભક્તો આવાં પ્રેથી પેલાં નામોને પોતે ઘારણ કરી લેતા હતા. ભાઉસાહેબ દીક્ષિતને કોઈક વાર ‘ભીષ્મ’ તો કહી ‘કાકા’ એવા નામોની છાપ બાબાએ પાડી અને એ જ નામોથી દીક્ષિત તથા બીજ ભક્તો લોકોમાં પ્રસિદ્ધ થયા. દીક્ષિતની આર્થિક પરિસ્થિતિ ઉત્તમ હતી, અને સમાજમાં પણ તેમનું પ્રતિષ્ઠિત સ્થાન હતું. છતાંય નમ્રતાની નિરહંકાર શિખામણ આપવા માટે બાબા તેમને કોઈક કોઈકવાર ગામમાં ઝોળી લઈને બિક્ષા માંગવા મોકલતા હતા અને લોકોની સામે જણો જોઈને કાકાને ‘ભીષ્મ’ કહીને બોલાવતા હતા. (ઓ. ૪૭-૫૩)

દાસગણુને અને બીજ બધાને મનમાં પુષ્કળ આશ્રય થયું કે, કાકાની નોકરાણી તે વળી કેવી રીતે ઈશાવાસ્યના પ્રશ્નોના ઉક્લ લાવી શકે ? નોકરાણી એટલે નોકરાણી એનું વળી શિક્ષણ કેટલું હશે ? દાહી અથવા તો શાસ્ત્રોની જણકાર હોય તોય વળી શાની મોટી ? બધું જ તેમને વિચિત્ર લાગ્યું. કયાં વેદોના અર્થ સમજવાની નિપુણતા અને કયાં આ નોકરાણીની સર્વ સામાન્ય બુદ્ધિ ? સાઈમહારાજ તો આ મશકરી જ કરી રહ્યા છે એવું લોકો બોલવા લાગ્યા. ખરેખર તો બધાને એવું લાગ્યું કે મહારાજ ફક્ત મન્જક કરી રહ્યા છે. પણ દાસગણુ મહારાજ જ એકલા એવા હતા કે જેમને આ વાત સાચી લાગી. સાઈબાબાના બોલ તેઓ સહેજ રીતે ગમ્ભતમાં બોલ્યા હોય એવું ભલે લોકોને લાગતું હોય પણ દાસગણુને

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

તો એ નક્કર સત્ય જ લાગ્યું. લોકો પણ આ ગમતથી બોલેલા શબ્દો હોવાં છતાં તે કહેવા પાછળ મજલ અને લીલા જેવા માટે આતુર થયા. બાબાના શબ્દો કદાચ મજલ મશકરી માટે હોય અથવા તો ના પણ હોય પણ એ કદી વ્યર્થ કે વિનાકારણ નહોતા. બાબાના એક એક અક્ષરોમાં ગૂઢ અર્થનો ભંડાર સમાયેલો રહેતો. તેમના મુખેથી જે જે શબ્દો નીકળતા તે કંઈ ફૂકત શબ્દો ન હતા, તેતો બ્રહ્મદેવે પ્રાણી માત્રના કપાળ ઉપર લખેલા વિધિના લેખ હતા. તેમાંનો એક પણ અક્ષર નકારો ન હતો. તેમજ તે શબ્દો પ્રમાણે જે બરોબર સમયે બધું બનતું. દાસગણુના મનમાં આ વાતની પાકી ખાની હતી. બીજ કંઈ પણ સમજતા હોય પરંતુ જેની જેવી શ્રદ્ધા તેવાં જ તેને ફળ મળતાં હતાં. જેવી ભાવના તેવાં ફળ અને જેવો વિશ્વાસ એવું બણ. જેટલું પ્રમાણ અંતઃકરણ તેટલો નિર્મણ બોધ પ્રાપ્ત થતો હતો. બાબા જ્ઞાનોમાં શિરોમણી હતા. તેમની વાત મિથ્યા કેવી રીતે હોઈ શકે? પોતાના ભક્તોની માંગણી પુરી કરવી તે વ્રત જાણે તેમણે લીધું હતું. ગુરુનાં વચન કદી ખોટાં ઠરતાં નથી. આ કથામન દઈને સાંભળો એટલે શારીરિક અને માનસિક વ્યથાઓ દૂર થશે અને તમારો પરમાર્થ સાધવાનો માર્ગ ખુલ્લો થશે. (ઓ. ૪૪-૬૫)

દાસગણું પાર્લિમાં કાકાસાહેબ દીક્ષિતના મુકામે પાછા કર્યા. કાકાની કામ કરવાવાળી બાછ ઉપનિષદ્ધનો અર્થ સમજવા માટે પોતાને કેવી રીતે ઉપરોગી થઈ પડરો તે જાણવાની તેમને ઉત્કંધા હતી. બીજે દિવસે વહેલી સવારે દાસગણું બિધાનમાં સવારની મધુર ઊંઘ માણી રહ્યા હતા. એવામાં એક આશ્રયકારક વાત બની. કોઈ એક કણબીની છોકરી મંજુલ સ્વરમાં ગાઈ રહી હતી. તે ગીતનું સુંદર માધુર્ય દાસગણુના હૃદયમાં અસર કરી ગયું. લાંબી તાન દઈને લલકારેલા અને મધુર પદ રચનાવાળા ગીતને સાંભળીને તેમનું મન તલ્લિન થયું અને તેઓ ધ્યાન દઈને સાંભળવા લાગ્યા. તેઓ બિલકુલ જગૃત થઈ ગયા અને ગીતનો અર્થ સમજવા માટે તે તરફ તેમનું ધ્યાન દોર્યું. શાંત ચિસે તેઓ સાંભળવા લાગ્યા અને ખૂબ જ આનંદિત થયા. તેઓ મનમાં બોધ્યા, ‘કોની છોકરી છે? કેવી ગંભીરતાથી તે આટાં મધુર ગાય છે? દશાવાસ્યનો કોયિદો તેણે ઉકેલ્યો કે શું? બાબાએ કહ્યા પ્રમાણેની નોકરાણી તે આ જ હોવી જેઠાં. જેઓ તો ખરો તે કોણ છે કે જેની ગામડી વાણીમાંથી ઉપનિષદ્ધોની શુતિના અર્થોની જાણકારી મને મળવાની છે?’ દાસગણું બહાર જઈને જેચું તો ખરેખર તે કણબીની છોકરી કાકાસાહેબની ચોકડીમાં બેસીને વાસણો ધસતી હતી. તપાસ કરાવતાં જાણવા મધ્યું કે દીક્ષિત સાહેબને ધરે નામહેવ નામનો એક નોકર હતો. તેની આ બહેન હતી. આ જ તે ‘કાકાની નોકરાણી. તેના જ પેલા ગીતથી ઉપનિષદ્ધોમાંની શંકાનું નિવારણ થશે. પહેલાં જ્ઞાનેશ્વર મહારાજે પાડાના મુખે વેદનો પાઠ સંભળાવેલો તેવો જ આ ચમત્કાર થયો. સંતોષે કયા ચમત્કાર નથી કર્યા? આ પ્રકારે આ છોકરીના ગાયનથી દાસગણુને સમાધાન થયું અને બાબાની મશકરીનો અર્થ બધાને સમજાઈ ગયો. કોઈક લોકોનું એવું પણ કહેવું છે કે, દાસગણું કાકાના દેવધરમાં પૂજન માટે બેઠા હતા તે સમયે આ ગીત તેમણે સાંભળ્યું. તે જે હશે તે. તેનું તાત્પર્ય એક જ કે સાઈમહારાજ પોતાના ભક્તોને અનેક નિમિત્તો બનાવીને કેવું શિક્ષાણ આપતા હતા તે જુઓ. ‘પોતાની જગ્યામાં બેસીને જ મને પૂછો, વગર કામના જંગલોમાં અને નિર્જન જગ્યાઓ પર અહીંથાં અને ત્યાં શા માટે ભટકતાં શોધતા ફરો છો? મારા સિવાય આ વિશ્વમાં ખાલી જગ્યા કયાંયે નથી. ભક્તોનો જ્યાં ભાવ હોય તો ગમે તે રીતે ગમે ત્યાં હું પ્રગટ થાઉં છું.’ (ઓ. ૬૬-૮૦)

પેલી આઠ વર્ષની છોકરીએ કમ્બર ઉપર એક ફટેલા ચણિયાનો કછોટો મારેલો હતો. તેમ છતાં તે પોતાના ગીતમાં એક જરી ભરેલી નારંગી રંગની સાડીના વખાણ સુમધુર અવાજમાં ગાતી હતી. ‘શું સરસ તે ભરેલ જરીની સાડી। કેટલી સુંદર તે સાડીની કિનાર। અને કેટલો સુંદર તેનો પાલવ॥’ પેલી છોકરી આ ગીત ગાવામાં મશગુલ હતી. તેને પેટ ભરીને ખાવાનું પણ નહેંતું મળતું અને સમ ખાવા જેટલું ચિથું પણ શરીર પર વીટાળવા માટે ન હતું. પણ કોઈની નારંગી રંગની સાડી ઉપર તે બેહદ ખુશ થયેલી જાણાતી હતી. આમ ગરીબ પરિસ્થિતિમાં પણ આનંદી સ્વભાવ જેઠ દાસગણું મહારાજને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

દ્વાયા આવી અને તેમણે મોરેશ્વર પ્રધાનને તેમણે કહ્યું ‘અરે જુઓ આનું શરીર ઉધારું છે. તેને એકાઢું લુગડું અપાવો તમારી આ સેવા દેવને પસંદ પડશે અને તમે પુણ્ય કર્માશો.’ મોરેશ્વર સ્વભાવે દ્વાયાણું હતા. તેની ઉપર દાસગણુની વિનંતી થઈ. તેમણે તરત જ એક સુંદર સાડી વેચાતી લાવીને પેલી છોકરીને આપી. જેમ કોઈ વાસી અને સ્વાદ વગરનું અન્ન દરરોજ ખાનારને પાંચ પ્રકારનાં પકવાનોથી ભરેલું સરસ મજાનું જમણ મળવાથી પુષ્કળ આનંદ થાય છે તેવો આનંદ પેલી છોકરીને આપેલ સાડી જેઠિને થયો. બીજે દિવસે તેણે તે સાડી પહેરી અને આનંદમાં બીજી છોકરીઓ જેઠે કુદરતી રમવા લાગી. તેને પેલી સાડી ખૂબ જ ગમી હતી. અને બીજી છોકરીઓ કરતાં તેનો ઠાઠમાઠ સરસ દેખાતો હતો. પછી બીજા દિવસે તે સાડી સંભાળીને ગોળ વીટાળીને ઘેર મૂકીને પેલો જ જૂનો ફાટેલો ચણિયો પહેરીને આવી છતાં તે જરા પણ બિજ્ઞ કે ઉદાસીન દેખાતી ન હતી. તેણે એ સાડી ન પહેરતાં સંભાળીને મૂકી દીધી. છતાં ભાવનાની બિજ્ઞતાને તીવી દાસગણુને તેની પહેલાંની ગરીબી છિન્ન બિજ્ઞ થયેતી ભાસી. કોઈને પણ નવાં કપડાં પેટીમાં મૂકીને જૂનાં કપડાંને પહેરવાનો વારો આવે તો મનમાં દુઃખ તો થવાનું. પણ આ છોકરીની વૃત્તિ અને ભાવનાઓ જુદા જ પ્રકારની હોવાને કારણે તેને એવું કંઈ જ લાગ્યું નહિ અને પહેલાં જેવી તે આનંદમાં જ રહેતી હતી. નવી સાડી ઘરે મૂકી અને જૂની પહેરીને આવી છતાં તે આનંદિત હતી. તેને પેલી નવી સાડીની કોઈ ઉણાપ દેખાતી ન હતી. મણતાં ન હોય એટલે ફાટેલાં વસ્ત્ર પહેરવાં અને સગવડ હોય તો પણ એવું જ ફરવું આને જ કહે છે ગરીબીમાં શ્રીમંતાઈ. હોય કે ન હોય છતાં તે પ્રમાણે સુખ સંપત્ત હોઈએ એ રીતે જીવિં કે તે રીતે જ ફરવું. આમ સુખ અથવા તો દુઃખ આપણા માનવા ઉપર હોય છે. દાસગણુનો આ જ તો પેલો ગૂઢ કોયડો હતો. આ પ્રકારે જ્યારે તેમને એનો ઉકલ મબ્બો ત્યારે તેમણે ઈશાવાસ્યના વિષય ઉપરનો ફોડ પડ્યો અને તેનો અર્થબોધ સમજન્યો. ઈશ્વરથી જ જ્યારે આ સમસ્ત પ્રત્યાપેલ છે ત્યાં તેના સિવાય કઈ જગ્યા ખાલી હોઈ શકે ? આનો વિચાર કોણ કરે ? માટે પૂર્ણ પ્રત્યામંથી આ પૂર્ણ જગતનો આભાસ કાઢી લેતા પૂર્ણ પ્રત્યામં જ બાકી રહે છે. તે છોકરીની ગરીબ અવસ્થાએ પણ ઈશ્વરનો જ અંશ છે. તથા ફાટેલાં કપડાં અને નવી સાડી પણ ઈશ્વરનો જ અંશ છે. દાન આપનારો અને દાનમાં આવેલી વસ્તુઓ, દાન આપવાની કિયા આ બધામાં પણ સંપૂર્ણપણે ઈશ્વર જ સમાયેલો છે. માટે જ ‘હું અને મારું’ મનમંથી કાઢી નાખવું, સહાયે કોઈ પણ વાતનું અભિમાન રાખ્યા વીના વર્તવું. ઈશ્વર પાસેથી જે એશ્વર્ય મળે છે, તે ત્યાગપૂર્વક ઉપભોગવવું, અને કોઈ પણ ચીજનો અતિ લોબ અથવા તો ઈચ્છાઓ રાખવી નહીં. (ઓ. ૮૧-૮૭)

આવી આ બાબાની ચમત્કારી વાળી હતી. અનેક ભક્તોએ તેનો અનુભવ કર્યો હતો. બાબાએ છેવટ સુધી શિરડી છોડ્યું ન હતું. છતાં તેઓ કોઈ પણ સ્થળે લોકવસ્તીમાં કે જંગલોમાં ભક્તોની સામે અચાનક પ્રગટ થતા હતા. કોઈને ખાતર મચિછિંદ્રગઢ ઉપર કોઈને માટે કોઈપણ જગ્યાએ દા.ત. કોલહાપૂર, સોલાપૂર, રામેશ્વર વગેરે તેમને મનમાં આવે ત્યાં પ્રગટ થઈને દર્શન આપતા હતા. કોઈને પોતાના અસલ પોષાકમાં તો જગતાં અથવા સ્વખભમાં રાત્રે અથવા દિવસે પણ દર્શન આપતા હતા અને ભક્તોની અતૃપ્ત ઈચ્છાઓ પુરી કરતા હતા. આવા કેટલા અનુભવોનું વર્ણન કરવું ? બાબાનું રહેવાનું શિરડીમાં હતું છતાં ન સમજન્ય તેવી રીતે કયાંચ પણ પ્રસ્થાન કરતા. જુઓને, આ છોકરી કોની શું સગી થાય ? એક બિચારી સાધારણ ગરીબ કામવાળી છોકરીનું કાકાને ત્યાં હોવું અને પછી દાસગણું મહારાજના ઈશાવાસ્યના કોયડાનો ઉકલ, આ બધો જાણી જેઠિને રચવામાં આવેલી માચાવી રચના તો નહીં હોય ? ત્યાં પહેલેથી તે કામવાળી હતી, તેની બાબાને ડેવી રીતે ખબર પડી ? વળી તેના મુખે આવું ગીત ગવડાવવું અને એમાંથી ઉપનિષદ્ધનો અર્થ સમજનવો એ બધું કેવું આશ્વર્ય ? એ કાંઈ પણ હોય પણ બન્યું નક્કી. આવું જે બન્યું એથી દાસગણું ખૂબ જ આશ્વર્ય થયું. તેમના મનની મુંજવણ દૂર થઈ ગઈ અને તેમને ઈશાવાસ્ય ઉપનિષદ્ધનો ગૂઢ અર્થ વ્યવસ્થિત રીતે સમજન્યો.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શ્રોતાઓના મનમાં શંકા આવશે કે, આ બધી ખટપટ બાબાએ શા માટે કરી ? પોતાના જ મોઢે શિરડીમાં જ આનો જવાબ આપીને શંકાનું નિવારણ કેમ ન કર્યું ? ત્યાંને ત્યાં જ આ કામ કરવાનું ફાયદું ન હોત ? પણ પછી પેલું ઈશાવાસ્યનું ભહન તત્વ લોકોને ડેવી રીતે સમજાવી શકત ? ઈશ્વર પેલી કામવાળી છોકરીમાં પણ સ્વયં વ્યાપેલા છે તે બધાને બાબાએ સિદ્ધ કરી આપ્યું. (ઓ. ૮૮-૧૦૭)

આત્માના સ્વરૂપનું બીલકુલ ખરેખરું વર્ણન તે જ સર્વ ઉપનિષદોનું અંતિમ ધ્યેય છે. આ જ મોક્ષ પ્રાપ્તિ માટે પાળવાના નિયમોનો અથવા આચરણોનો સાર છે અને એજ ભગવદ્ ગીતાના અર્થનું નિરૂપણ છે. પ્રાણી જુદાં જુદાં હોય છે પણ તેમનો આત્મા એક જ હોય છે. તે કંઈ કરતો નથી અને ભોગવતો પણ નથી, તે કયારેય અપવિત્ર નથી હોતો. તેને પાપ પુણ્ય વગેરે નેવું કંઈ નથી હોતું અને તેને કોઈ પણ જ્ઞાતિના કર્તવ્ય કર્મનું આચારણ પણ નથી હોતું. હું જ્ઞાતનો ઉચ્ચ બ્રાહ્મણ છું અને બીજ બધા મારા કરતાં નીચ જ્ઞાતિના છે આવી જ્યાં સુધી ભેદભાવની વૃત્તિ હોય છે ત્યાં સુધી કર્તવ્ય કર્મનાં આચારણ આવશ્યક હોય છે. હું દેહ વગરનો, સર્વ ઠેકાણો એક જ છું. મારા સિવાય બીજું કંઈ નથી, હું જ બધામાં વ્યાપેલો છું, આવું જે જ્ઞાન એ જ આત્મસ્વરૂપનું ખરું જ્ઞાન છે. પૂર્ણબ્રહ્મના એકાત્મ્યથી ઘૂરા પડેલ આ જ્ઞાતનાનું ધ્યેય કયારેક તો સ્વરૂપને નિશ્ચિતપણે પ્રાપ્ત થવું એ જ ધ્યેય હોય છે. શ્રુતિ, સ્મૃતિ અને વેદાંત આ બધાનો આ જ નિર્ણય તથા સિદ્ધાંત છે. મૂળ સ્થાનથી બટકેલાઓ સ્થિર પદની નિશ્ચયપૂર્વક પ્રાપ્તિ સાધવી તે જ અંતિમ ઉદ્દેશ્ય હોય છે. (ઓ. ૧૦૮-૧૧૩)

‘સર્વેષુ ભૂતેષુ તિર્ષંતં પરમેશ્વરમ्’ એટલે કે ગીતા અ. ૧૩ શ્લોક ૨૭માં પરમેશ્વર બધાં પ્રાણીઓના અંત:કરણમાં સમસ્વરૂપે રહેલ છે. આવી જ્યાં સુધી મનની સ્થિતિ થતી નથી ત્યાં સુધી સર્વપ્રાણીઓનો અંતરાત્મા જે ભગવાન શ્રીકૃષ્ણ છે. એવું જ્ઞાન પ્રકાશિત કરવામાં સમર્થ નથી હોતો. શાસ્ત્રોએ માન્ય કરેલ કર્મો કરવાથી ચિત્ત શુદ્ધ થયું કે સર્વ વિશ્વ અને પરમાત્માની એકરૂપતાનો અનુભવ થશે અને સંસારના શોક મોહ આદિની વિશુદ્ધનું પૂર્ણતાએ પહોંચેલું જ્ઞાન પ્રગટ થશે. જે સર્વનો સ્વામી છે, એવો પરમેશ્વર ત્રણો લોકમાં ચર અને અચર પ્રાણીઓમાં સમાયેલો છે, જે નિર્ઝિય, અખંડ અને અવિભાગિત છે અને પરાત્પર એટલે શ્રેષ્ઠ ઈશ્વર છે, તે શરીર વીનાનો ત્રિકાળના બંધન વગરનો અસ્તિત્વરૂપી સત્ય એટલે સત્ત સ્વભાવવાળો છે. જે આ ઈશ નામ અને ઇપવાળો છે અને જેમાં આ વિશ્વ અંદરથી અને બહારથી વ્યાપ્ત છે, તે હું જાતે જ છું વિશિષ્ટ ગુણ ઇપ સિવાય સંપૂર્ણપણે બધે જ ઠેકાણો સમાયેલો છું. જે મૂળમાં કોઈ પણ આકાર વગરનો છે અને તે માયાના ગુણોને કારણે આકાર સાથેનો ભાસે છે. અનેક વાસનાઓથી ભરેલું આ જગત વિચાર કરવા જેવું ન હોવાં છતાં પરમેશ્વર તે એક જ સર્વશ્રેષ્ઠ છે, એવો નિ:શંકપણે નિશ્ચય કરવો. (ઓ. ૧૧૪-૧૧૯)

જગત વિષેનો આ સારાસારનો વિચાર મનમાં ઠસ્તો નથી છતાં આ સંપત્તિ અને સોનું વગેરેનો લોભ કરવો જ નહીં. આટલું કરવું પણ મનને ફાવતું ન હોય તો, ફક્ત પોતાની કર્મ કરવાની પાત્રતા છે, તેમ સમજુને મરતાં સુધી કરતા રહેવું તે પણ દેરેક બ્રાહ્મણ, ક્ષત્રીય, વैશ્ય, શ્રૂદ્ધ વર્ણએ ધર્મને અનુસરીને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણેના વિધિવિધાન સાથે અન્ધિહીતી જેવા ઉચિત નિત્ય કર્મને ચિત્ત શુદ્ધ થાય ત્યાં સુધી કરવાં. આ એક ચિત્ત શુદ્ધિનો માર્ગ છે. બીજાં સર્વ સંસારિક બંધનો તોડીને જગતના વહેવારોથી પૂર્ણપણે મુક્ત થવું, અથવા તો, પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો એવો થાય. અને બીજે જ્ઞાનમાર્ગ આ બંને પૈકી એક પણ માર્ગનો આધાર ન લેવામાં આવે તો ઈશ્વરના નિયમ પ્રમાણે આવનારાં સુખ દુઃખો ભોગવાનાનું બાકી રહી જાય છે. એમના પતનનું ઈશાવાસ્યમાં આગળ આપેલા બીજાં મંત્રમાં અત્યંત કડક શબ્દોમાં વર્ણન કરેલું છે. અસૂર્યા નામ તે લોકા અન્ધેન તમસાડવૃત્તા: । તાંત્રે પ્રેત્યાડમિગચ્છન્તિ યે કે ચાત્મહણો જનાઃ ॥ આ પ્રકારે પોતાનો નાશ કરનારા લોક અસુરોના અનેક પ્રકારના જે નર સ્વરૂપ યોની દુઃખ કલેશ અને અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપેલ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઇ તેમાં મૃત્યુ પછી ફરી જન્મ છે. (ઓ. ૧૨૦-૧૨૩)

કોની કેટલી પાત્રતા છે તે ઓળખનારા સદ્ગુરુ પણ આ બ્રહ્મવિદ્યા કે ઉપનિષદોનો બોધ સાધારણ રીતે સૌને આપતા નથી. જ્યાં સુધી જગત અને પરમેશ્વર એક જ છે એવું માનવાની મનની વૃત્તિ થતી નથી ત્યાં સુધી ઉપનિષદોનો ઉપદેશ એ ફક્ત શબ્દોની જ મારામારી છે. એવો શાબ્દિક બોધ પણ હોવો જરૂરી છે કારણ કે જિજ્ઞાસુ પહેલાં તે જ માગે છે. માટે જ બાબાએ કામવાળી બાધ તને કહેશે એવું કહીને દાસગણુને શિરડીથી પાર્લા મોકલ્યા હતા. બાબાએ જ જે સમજવીને કહી દીધું હોત તો આગળનું કાર્ય થઈ શકત નહીં. ‘હું એકલો જ છું અને મારા સિવાય આ જગતમાં બીજું કોઈ નથી.’ આ બાબાનું જ્ઞાન સમજયું જ ન હોત. એ કામવાળી બીજી કોઈ નહિ પણ ‘હું’ જતે જ છું એની પ્રતીતિ બાબાએ કરાવી અને ઈશાવાસ્ય ઉપનિષદનો ભેદ અનુભવપૂર્વક સમજલ્યો. પરમેશ્વર અને ગુરુની વિશેષ ફૂપા જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સિદ્ધ પુરુષોના ઉપદેશની આવશ્યકતા રહે છે. આત્મજ્ઞાન કહેનારાં જે શાસ્ત્રો છે તેનું શ્રવણ કરવું. હું સર્વ ડેકાણો છું અને મારા સિવાય બીજું કોઈ નથી. આ જ બાબાતનું ચિંતન કરવું. આ પ્રકારે આત્માના સાચા સ્વર્ગપનું ચિંતન થયા બાદ તે આત્મા બીજે કોઈ નહિ પણ ‘હું’ જ છું એવું એકાત્મનું ધ્યાન થાય છે અને તેમની ઉપર જ આત્મા પ્રસંગ થતો હોય છે. આવી જ્યારે આત્મવિષયી ચર્ચા કરાય અને એકાગ્રતાથી એના તરફ ધ્યાન આપવામાં આવે તથા આવી જ એની સાથેની સ્થિર એકાત્મતા રાખવામાં આવે, તો જ પરમાત્મા પ્રાપ્ત થાય છે. અને ખાત્રીપૂર્વક મળે છે. (ઓ. ૧૨૪-૧૩૧)

આગળના અદ્યાયનો દ્યેય વિનાયક હરિશ્ચંદ્ર ઠાકુર, અનંતરાવ પાટણકર વગેરેની કથા કહેવાનો છે. શ્રોતાઓએ તેને આદ્વરપૂર્વક સાંભળતાં તેમનું મન પરમાર્થ તરફ લક્ષ વળશે. આ કથાઓ પણ એટલી જ મધુર છે. તે સાંભળીને શ્રોતાઓનો કોડ પૂરા થશે તથા મહાપુરુષોના દર્શનની હોંશ પૂર્ણ થશે અને ભક્તોના લાડકોડ ને નાહ પણ પૂર્ણ થશે. સૂર્યોદય થતાં જેમ અંધકાર દૂર થાય છે તેવી જ રીતે આ કથાકૃપી અમૃત પીવાથી સંસારની માયા મમતાનાં જળાં દૂર ફેંકાઈ જશે. સાઈભાબાની કલ્પના પણ ન કરી શકાય એવા કૌશલ્યનું વર્ણન તેમના સિવાય બીજું કોણ કરી શકશે? મને તો તેમણે ફક્ત નિમિત્ત બનાવીને, તેમણે જતે જ આ કથા મારી પાસે બોલાવી અને લખાવી છે. (ઓ. ૧૩૨-૧૩૫)

સર્વનું કલ્યાણ થાયો. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા હેમાડપંત રચિત શ્રીસાઈસમર્થના.

સત્ય ચરિત્રના ‘ઈશાવાસ્ય-ભાવર્થ-બોધનમ્’ નામનો વીસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



અધ્યાય ૨૦નું અર્� વિવરણ

અમુક વાચક ભિત્રોને પ્રક્રષ્ટ થશે કારણ કે એ પ્રક્રષ્ટ મારા મનમાં પણ ઉદ્દ્દેશ્યો હતો કે દાસગણુ મહારાજના ઈશાવાસ્યના એવા તે કયા મંત્ર માટે કે એમાંના કોઈ વિશિષ્ટ ભાગનો અર્થ સમજલ્યો ન હતો, કે જેને માટે તેઓ બાબા પાસે ગયા હતા? ખૂબ જ વિચાર કર્યા બાદ મારા ધ્યાનમાં એક વાત આવી કે પહેલા જ મંત્રના ઉત્તરાર્થમાં ‘તેન ત્યક્તેન લુગ્જુથા’ આ અર્થ માટે જ એ કોયડો હોવો જેઠાએ. ટીકાકારોએ પણ એના ખૂબ જુદાજુદા અર્થ કર્યા છે. કોઈ કહે છે. ‘ઇશ્વર જે સર્વ જગ્યાએ વ્યાપેલો છે, તે જ આપણી પાસે પણ છે. એની યાદ રાખીને મમતા અને આસક્તિનો ત્યાગ કરીને કર્તવ્યપાલન માટે વિષયોનો ઉપભોગ કરવો.’ ત્યારે બીજા કોઈ કહે છે, ‘આપણને ઇશ્વર કૃપાથી વિષયોનો જે ભોગ મળે છે તે ઇશ્વરને અર્પણ કરતાં જે બાકી રહે એનો ઉપભોગ કરવો.’ આને માટે પેલો ગીતાનો અધ્યાય-૩, ‘લોક ૧૨ નો આધાર લેવામાં આવે છે. ઈષ્ટાન્ ભોગાન્ હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિનાઃ । તેર્દ્તાનપ્રદાયૈભ્યો યો લુડક્તે સ્તેન એવ સઃ ॥૧૨॥ યજ્ઞથી તૃપ્ત થયેલા દેવ તમને ઈચ્છીત ફળ આપે છે. તેમનો આપેલો ભોગ તેમને ન અર્પણ કરતાં, જે જીતે જ તેનો ઉપભોગ કરે છે તેને ચોર જ કહેવાય. અહીયાં, ‘ઇશ્વરને અર્પણ કરવું’ એનો અર્થ ‘આ કામ માટે જેણે સહાય કરી છે તેને તેનો ભાગ આપવો’ એવો અર્થ લેવાનો છે. ત્યારે વળી ત્રીજી કોઈ કહે છે, ‘પોતાની જરૂર પુરતું જ ધન પોતાને માટે રાખીને વધેલું બીજાઓના ઉપયોગમાં વાપરવું. કોઈ પણ પ્રકારનો અતિલોભ કરવો નહિ. આ ધન કોણું છે ? કેવળ આપણું તો નથી જ.’

પરંતુ સાઈબાબાએ એનો અર્થ સ્વમુખે ન કહેતાં, તે કાકાની કામવાળી બાઈ મારફતે કહેવડાયો. એ બાઈની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી. ખાવા માટે પુરતું અન્ન અને પહેરવા માટે પુરતાં કપડાં પણ ન હતાં, છિતાં તે ખૂબ જ આનંદિત હતી. ન કરશો ફીકર યત્કિચિત । રહેવું સદા આનંદ ભરિત । ન કરવી ચિંતા આમરણાંત । ઉપદેશ નિત્ય એ બાબાનો ॥૧૧૩॥ અધ્યાય - ૧૭, ઓ. ૧૧૩ બીજાની વૈભવી સાડીઓ જેઠાને તેને ગર્વ થયો નહિ કે પોતાની ગરીબીની એને શરમ આવી નહીં. ઉલ્લુ તે સાડી ઉપર મધુર ગીત ગાઈને એનાં વખાણ કરતી હતી. બીજ દિવસે તેને પોતાને માટે એક નવી સુંદર સાડી મળી. એકાદ કોઈ નિર્વિકાર સંન્યાસીની માફક તેનો તિરસ્કાર પણ ન કર્યો. તેણે તે આનંદથી સ્વીકારી અને હોંશો હંશો પહેરી અને બીજી નાની છોકરીઓ જેઠે મસ્ત થઠને ગોળ ગોળ ફેર કુંદાં પણ ફરી. પણ બીજે દિવસે તે સાડીને સંભાળીને ગડી કરી પેટીમાં મૂકી આવી. તે તેનામાં આસકત થઈ નહીં. આ ફક્ત મારે માટે છે એવો સ્વાર્થ પણ રાખ્યો નહીં. બીજ કોઈક ને પણ એ પહેરવા માટે કામમાં આવે, અથવા તો એ પોતે પણ ફરી કોઈકવાર પહેરી શકે એવો એનો ઉદાર હેતુ હતો. પોતાની ગરીબી એ ભૂલી નહીં અને ફરીથી તે એટલા જ આનંદમાં રહેવા લાગી. સંસારમાં કેવી રીતે વર્તવું તેનું કેટલું મોટું ઉદાહરણ પેલી છોકરી મારફત સમજલ્યું અને ‘તેન ત્યક્તેન લુગ્જુથા’ નો અર્થ ઉક્લી ને સમજલ્યો. તેની જેઠે જેઠે એ કામવાળી બીજ કોઈ નહિ પણ પોતે જીતે જ છે. એવા આ ઉપનિષદ્ધના મહાન શલોકના અર્થ ‘ઇશાવાસ્યં ઈંદ્ર સર્વ યત્કિચિત્ જગતાં જગત’ નો અનુભવ પણ સૌને કરાયો. કેટલું સુંદર બાબાનું કૌશલ્ય ?

હવે ઉપરના અધ્યાયમાં ઓ. ૧૦૮-૧૨૩ વચ્ચે હેમાડપંતે ઈશાવાસ્ય ઉપનિષદ્ધના પહેલા ત્રણ મંત્રોનું વિવેચન કર્યું છે તે થોડું વધારે સ્પષ્ટ રીતે સમજવા પ્રયત્ન કરીએ. આ ત્રણ મંત્રો એટલે ભારતીય વેદાંત તત્ત્વજ્ઞાનનો સાર એમ માનવમાં આવે છે. માટે તે ત્રણને સારી રીતે સમજ લેવા માટે અને પુનરાવર્તન અને વિસ્તારનો દોષ સ્વીકારવા માટે વાંધો નથી.

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

અભિલ બ્રહ્માંડમાં જે કોઈ જગત અને ચેતન સ્વરૂપ જગત છે તે બધું ઈશ્વરથી જ વ્યાપેલું છે, તે ધ્યાનમાં રાખીને ઈશ્વરનું સદાય સમરણ કરીને આ જગતના વિષયોનો યથાવિધિ ઉપભોગ કરો. કોઈ પણ પ્રકારની ભમતા કે આસક્તિ રાખવી નહિ. આ ભોગ્ય વસ્તુઓ કોની છે ? અર્થાત્ કોઈની નથી. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં પણ આ જ કહ્યું છે. અ. ૨ શલોક ૬૪ ॥ ‘રાગદ્રેષ્વિમુક્તેસ્તુ વિષયાનિનિર્દ્રેષ્યાસ્તન् । આત્મવશ્યૈર્વિદ્યાત્મ પ્રસાદમભિગચ્છતિ ॥’ રાગ એટલે પ્રેમ અથવા તો દ્રેષ્વ રહિત અને આપણને સ્વાધીન રહેલી એવી ઈન્દ્રિયોના વિષયોના ભોગ ભોગવીને જ પુરુષ પ્રસાદ હોય છે.

શાસ્ત્રોમાં કહ્યું છે તે પ્રમાણે કર્તવ્ય કર્મ કરીને એ જ ઈશ્વરની પૂજન સમજુને ૧૦૦ વર્ષ સુધી લુંગવાની ઈચ્છા કરવી. આવાં કર્મો માણસને બંધનકર્તાં નથી હોતાં. આ સિવાય મોક્ષ પ્રાપ્ત કરવાનો બીજે કોઈ માર્ગ નથી. યજ્ઞાર્થાત્કર્મિઓનયત્ર લોકોડયં કર્મબન્ધનમ્ । તદર્થ કર્મ કૌન્તેય મુક્તસંગઃ સમાચાર ॥૮॥ યજ્ઞ કરવા માટે એટલે કે પરમેશ્વરને ખુશ કરવા માટે કરેલાં કર્મ સિવાયના બીજાં કર્મ લોકોને બંધનકારક થાય છે. માટે હું કુંતીપુત્ર ! સંગ અને આસક્તિ છોડીને પરમેશ્વરનો પ્રેમ મેળવા ખાતર તું કર્મ કર્યે જા. જેનાથી સર્વ ભૂતોની એટલે સર્વ સૂષ્ટિના સળવ અને નિર્જવ પદ્ધાર્થની ઉત્પત્તિ થઈ છે, અને જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, તેની પૂજન આપણાં કર્મો વડે કરવાથી મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ એ કર્મોમાં આસક્તત ન થતાં અને તેનાં ફળોની આશા ન કરતાં તે કર્મો કરવાં જેઠાં એ. બ્રહ્માર્પણ કરીને આસક્તિ વીના જે કર્મ કરે છે, તે કર્મજ્ઞાન પાનની માફક પાણીમાં ભીજાતો નથી તેમજ પાપથી દૂષિત થતો નથી. કર્મજ્ઞ બુદ્ધિયુક્તા હિ ફલં ત્વક્તવા મનીષિણાઃ । જન્મબન્ધવિનિર્મુક્તાઃ પદં ચચન્ત્યનામયમ् ॥ અ. ૨/૫૧ ॥ સમત્વ બુદ્ધિયુક્ત એવા વિદ્વાન જ્ઞાની પુરુષો કર્મ ફળોની આશા છોડીને જન્મબન્ધનોથી મુક્ત થાય છે, અને દુઃખ રહિત એવા પરમ પદને પ્રાપ્ત થાય છે.

પરંતુ આવું ન કરતાં પોતાનો આત્મધાત કરનારા લોકો અસુરોના એટલે કે દુષ્ટ સ્વભાવવાળા લોકો અનેક પ્રકારની નક્ક યોની, જેમાં દુઃખ કલેશ અને અજ્ઞાનદ્વારી અંધકાર વ્યાપેલો છે, એમાં મૃત્યુ પછી જન્મ લેતા હોય છે. મનુષ્ય શરીર બધી જ યોનીઓમાં શ્રેષ્ઠ અને દુર્લભ છે, જે સુદૈવથી મળવા છતાં જે મનુષ્યો જન્મ મૃત્યુદ્વારી સંસાર સાગર પાર કરવાનો પ્રયત્ન કરતાં નથી, તેઓ સહંતર મૂર્ખ છે. પહેલાં મંત્રમાં કહેલો જ્ઞાનમાર્ગ અથવા તો બીજી મંત્રમાં કહેલો કર્મમાર્ગ આ પૈકી કોઈ પણ માર્ગ કોઈ પણ જાતનો આધાર ન રાખતાં, સદાને માટે કામનો ઉપભોગ અને દુષ્ટ કર્મોમાં મન્ત્ર રહેતા જે આત્મધાતક લોકોને વારંવાર પશુ પક્ષી અથવા તો કીડાં, પતંગિયાં વગેરે જેવી નીચ અને દુઃખ યોનીમાં અથવા તો ભયંકર નક્કમાં પડવું પડે છે. અનેક ઈચ્છાઓથી ચિત્ત ભમતું હોય, મોહનણમાં ફસાયેલું હોય તેવા કામ ભોગમાં આસક્ત થયેતા લોકો ગંધાતા નક્કમાં પડે છે. એવા દુષ્ટ, ફરને હું હંમેશા આસુરી યોનીમાં જ નાખું છું. માટે જ મનુષ્ય યોનીમાં આવ્યા બાદ પોતાનો ઉદ્ઘાર કરવો.

આપણી જલ્દી જલ્દી જ આપણો ઉદ્ઘાર કરવો. પોતે પોતાનો વિનાશ કરવો નહીં. કારણ કે પ્રત્યેક જણ પોતે જ પોતાનો મિત્ર છે અને શત્રુ છે.



॥ અદ્યાય ૨૧ ॥

અનુગ્રહ કરણમ्

(વિનાયક ઠકુર, અનંતરાવ પાટણકર અને પંદરપુરના વક્ષિલ ઉપર કૃપા કરવી)

શ્રી ગણોશળુને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રલુને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

પાછલા અધ્યાયના અંતમાં જાણાયા પ્રમાણે વિનાયક હરીશાંદ્ર ઠકુરને મહાપુરુષ શ્રી સાઈનાથ મહારાજનાં દર્શન કેવી રીતે થયાં તે હવે શાંત ચિત્તે સાંભળો. વક્તાના બોલ કાન પર પડતાં, શ્રોતા જે આનંદમાં ડોલવા ન લાગે અને શરીર પર ઢ્વાંટા ફર્કે નહીં તો એવા બોલ નકામા ગયા એમ સમજવું. જે સાંભળીને શ્રોતા એના રંગમાં રંગાઈ જય નહીં, એના ગળામાં ઉત્કંઠાથી દૂમો ભરાય નહીં અને આંખોમાંથી હર્ષનાં આંસુ સરી પડે નહીં તો એવી કથા કહેવાનો અર્થ શો? એ કહેવું વ્યર્થ ગયું સમજવું. બાબાની વાણી મનને આનંદ આપનારી હતી. ઉપરેશ કરવાની તેમની રીત અતૌકિક હતી. દરેક વખતે તેમની લીલા નવી અને આશ્રમ્ય પમાડે એવી રહેતી. તેમના ચરણમાં મારા નમસ્કાર. (ઓ. ૧-૪)

આપણું નસીબ ખુલ્યા સિવાય સાધુ સંતોની સાથે મેળ બેસતો નથી. તેમના સાંનિધ્યમાં રહેવા છીતાં અત્યંત પાપી માણસોને તે દેખાતા નથી. આ સિદ્ધાંતની સચ્ચાઈ પુરવાર કરવા માટે દૂર અથવા આપણા જ દેશમાં પણ જવાની કોઈ જરૂર નથી. હું મારો જ પોતાનો અનુભવ શ્રોતાઓને કહું છું. વાન્દ્રા શહેરમાં તેમાં પીર મૌતાના નામના એક પ્રસિદ્ધ મુસલમાન સિદ્ધપુરુષ રહેતા હતા. હિન્દુ, પારસી અને બીજી જીતીના વિદ્વાન માણસો પણ તેમનાં પવિત્ર દર્શને જતા હતા. હું તે શહેરમાં ન્યાયાધીશ હતો. તેમનો એક ઠિનૂસ નામનો સેવક મુજલબર હતો. મૌતાના સાહેબના દર્શન માટે એ મને ઘણીવાર કહેતો હતો અને તેમના દર્શને મારે જવું જેઠાં તે માટે ખૂબ જ આગ્રહ કરતો હતો. ‘હજરો લોકો ત્યાં જય છે. આપણે શા માટે ત્યાં જવું? વગર કામના કોઈના ચાણે ચઢીને પોતાનું નામ શા માટે બગાડવું?’ આવા અનેક વિચાર મનમાં આવવાથી હું કયારેય એમના દર્શન માટે ગયો નહીં. જાણે કે હું પોતે જ પોતાના પદધાયાથી ગભરાયો હોઉં અથવા તો મારું દુંહેવ આડે આવ્યું હશે. આમ કેટલાંય વર્ષોનીકળી ગયા. મારી ત્યાંથી બદલી થઈ. જ્યારે સંત સમાગમનો સમય પાકયો ત્યારે શિરડી જેઠે કાયમનો સંબંધ જોડાઈ ગયો. કહેવાનો ભાવાર્થ એ જ કે, કમનસીબોનો અહીં પગપેસારો શક્ય નથી થતો. ઈશ્વરીય કૃપા હોય તો જ આ સંતોનો સહવાસ સહજ રીતે પ્રાપ્ત થાય છે. નહીં તો આવો યોગ તો ખૂબ જ મુશ્કેલ છે અને મહા મુસીબતે જ મળે છે. (ઓ. ૫-૧૨)

આ વિષય ઉપરની એક રસપ્રદ વાર્તા હવે શ્રોતાઓ કાળજીપૂર્વક સાંભળો. અનાદિ કાળથી આ સંતોનાં સંગઠનો અને ગુપ્ત વ્યવસ્થાઓ કેવી હોય છે તે હવે જુઓ. જેવા પ્રસંગો આવે અને જે સમય આવે તે પ્રમાણે તથા જે તે કેકાણે પોતાનું કાર્ય પૂર્ણ કરવા માટે આ સંત પુરુષો અવતાર લે છે પરંતુ તેઓ એકબીજાથી જુદા નથી. તેમનું રહેઠાણ સમય, કાર્યો બિન્ન હોવાં છીતાં મનથી સંતો એકબીજા સાથે સંપૂર્ણ રીતે જોડાયેતા અને એક બીજાથી માહિતગાર હોય છે. મનથી તેઓ એકબીજ સાથે જોડાયેતા જ હોય છે. સાર્વભૌમ રાજાઓની જેમ અનેક ઠેકાણે તેમનાં થાણાં હોય છે. જેમ અધિકારીઓની નિમણૂક કરી ત્યાંની આભાદી વૈલબ વધારવામાં આવે છે તેવી જ રીતે સ્વચાનંદની સમાચાર જુદી જુદી જગ્યા ઉપર પ્રગટ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

થઈને પોતાના આ સામ્રાજ્યનું ગાડું ચલાવે છે. તેઓ કારભાર ગુપ્તપણે હોય છે. (ઓ. ૧૩-૧૭)

એક વખતે એક અંગ્રેજ માધ્યમમાં શિક્ષણ પામેલા, બી.એ.ની પદ્ધતિ મેળવેલા ગૃહસ્થ વિનાયકરાવ ઠાકુર ક્રમે ક્રમે વધતાં મોટા નામાંકિત અધિકારી બની તાલુકા મામલતદાર નિમાયા અને સુદૈવથી સાઈબાબાના સમાગમમાં પણ આવ્યા. આ પદ્ધતિ મોટી અને ઠાઠમાઠવાળી હતી. પણ જેવી રીતે દુંગર દૂરથી રળિયામણા હોય છે, તેવી જ પરિસ્થિતિ તેમની થાય છે. પહેલાંના તે સારા દિવસો વિતી ગયા. જ્યારે અધિકારનો ડ્રાબ હતો અને પ્રજન પણ તે અધિકારીને માન આપતી હતી. એકબીજ માટે પ્રેમ અને આદર રહેતો હતો. હવેના તો હાલ પૂછશો નહીં. સુખની નોકરીનો તો સમય નીકળી ગયો. હવે તો જવાબદારી ખૂબ જ વધી છે. પગાર પણ ખાસો વધારે મળો છે. પણ ત્રાસ અને અથડામણ વધી ગઈ છે. હવે નોકરી ખૂબ મહેનત અને પ્રયત્નથી કરવામાં આવે તેમ છતાં હાલના તબક્કે પહેલા જેવું મામલતદારીનું માનપાન રહ્યું નથી. અને પ્રાંત અધિકારીઓનો વૈભવ પણ રહ્યો નથી. એ અધિકારીપદ પુષ્કળ પૈસા ખર્ચ્યા સિવાય તેમજ સતત અભ્યાસ અને મહેનત કર્યા સિવાય મળતું નથી. પહેલાં તેને બી.એ. પાસ થવું પડતું હતું, પછી તેને મુલકી ખાતામાં રોળુંદો રોકડનો હિસાબ રાખનારો કારકુન બનવું પડતું. તે સમયે મહિનાના ૩૦ ડ્રાપિયા પગારથી તેની શરૂઆત થતી. પછી યોગ્ય સમય થતાં સ્થળ ઉપર જવું પડતું અને જમીનના ક્ષેત્રની માપણી માટેનું કામ શીખવું પડતું, મોજણી કરવાળાઓની વચ્ચે રહેવાનું થતું તેમજ ખાતાની પરીક્ષા પાસ કરવી પડતી. ત્યાર પછી આગળ ઉપર કોઈ આસામી વૈકુંઠધામ પામે અને એની જગ્યા ખાતી થાય ત્યારે એવી જગાઓ તેમને ભાગે આવતી હતી. હવે આ લાંબી લચક નીરસ વાતોનો અંત લાવીએ. ફક્ત મોઢેથી બડબડ શા માટે કરવી ? એક ગૃહસ્થ વિનાયકરાવ ઠાકુરને સાઈબાબાની જેઠે મુલાકાત કેવી રીતે થઈ તે સાંભળો. (ઓ. ૨૮-૨૮)

બેળગાંધ પાસે વડગાંધ નામનું એક ગામદું છે. ત્યાં મોજણી કરવાલાઓની એક શીખાઉ ટુકડી આવી. તેઓએ ત્યાં મુકામ કર્યો. એ ગામમાં એક સંતુષ્ટ પુરુષ હતા. તે હતા પ્રસિદ્ધ કન્ના સંત અપ્પા મહારાજ. જેમનાં દર્શન માટે વિનાયકરાવ ઠાકુર ગયા. તેમનાં ચરણો ઉપર ભાથું મૂકી આશરીવાઈ અને પ્રસાદ મેળવ્યો. તે સંતપુરુષના હાથમાં તે સમયે નિશ્ચલદાસ કૃત ‘વિચાર સાગર’ નામનો ગ્રંથ હતો. જે તેઓ વાંચી રહ્યા હતા. આ ગ્રંથ આચાર્ય વિદ્યારણ્યના મૂળ સંસ્કૃત ભાષામાં ‘ંચદશી’ ગ્રંથના આધારે ઉત્તર ભારતના મહાત્મા નિશ્ચયલદાસે સામાન્ય માણસને સમજણું પડે માટે હિન્દી ભાષામાં સને ૧૮૪૮માં આ ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથનો વિષય અદ્રેતવાદ અને ઉદ્દેશ પ્રત્ય સાક્ષાત્કાર હોવાને કારણો આ ગ્રંથ ઉત્તમ મનાયો છે. આ ગ્રંથનું ભાષાંતર ભરાડી, ગુજરાતી, બંગાળી અને અંગ્રેજમાં થયેલું છે. આ ઉપરથી જ તેની લોકપ્રિયતા અને લોકઉપયોગીતા સિદ્ધ થાય છે. પછી થોડો સમય ગયા બાદ ચાલો હવે નીકળું છું, એવું કહેતા, તે સાધુએ પ્રસત્ર થઈને આનંદથી પેલા ગૃહસ્થ વિનાયકરાવ ઠાકુરને શું કહ્યું તે સાંભળો. ‘ભલે, હવે આવતા રહેલે. આ ગ્રંથનું અવલોકન કરનો. એટલે તમારા મનોરથો પૂર્ણ થશે એ ધ્યાનમાં રાખનો. તમારે પોતાની નોકરી નિમિત્તે ઉત્તર હિસા તરફ જવાનું થાય ત્યારે રસ્તામાં મોટા દૈવપોગથી એક મહાપુરુષનાં દર્શન થશે અને એ તમને આગળનો માર્ગ દેખાડશો. એ જ તમને ઉપદેશ કરીને પોતાની શિખામણ તમારા મનમાં ઠસાવશે અને તમારા મનને શાંતિ આપશે.’ (ઓ. ૨૮-૩૫)

વિનાયકરાવ ઠાકુરનું ત્યાંનું કામ પત્યું અને તેમની પૂના જિલ્લામાં જુન્નર મુકામે બદલી થઈ, અને નાણેધાટ ચઢીને જવાનું સંકટ ઉભું થયું. આ ઘાટ પરનો માર્ગ ખૂબ જ અધરો હતો. પાડા ઉપર સવારી કરીને તે પાર કરવો પડતો હતો. માટે પાસેના જ એક પાડાને વાહન તરીકે ઉપયોગમાં લેવા માટે તેના માલિકને બોલાવ્યો. આગળ ઉપર મોટા અધિકારી થવાશે, ત્યારે ઘોડાગાડી મોટર વગેરે મળશે. પણ હાલમાં તો પાડાની જ હાજરીમાં સમય કાઢવાનો વખત આવ્યો. પગે ચઢવા માટે ઘાટ અશક્ય હતો અને પાડાની સવારી સિવાય બીજ કોઈ સગવડ ન હતી. આવો આ નાણેધાટનો વાહન

શ્રી સાઈનું સત્ય ચાટિત્ર

વ્યવહાર હતો. માટે તેમણે વિચાર કર્યો, અને જુન ચઢાવીને પાડો તૈયાર કરાવ્યો. ખૂબ પ્રયત્નથી તે તેની ઉપર સવાર થયા. સવાર તો થઈ ગયા. પરંતુ પાડાની સવારી અને વિચિત્ર વાહન એટલે આંચકા, ઝટકા, અને ઝોકા ખાઈને તેમની પીઠમાં ચસક ભરાઈ. આ પ્રવાસ પૂરો થયો અને જુન્નરની તેમની કામગીરી સારી રીતે પતી ગઈ. ત્યાંથી મુકામ આગળ ચાલ્યો. થાણા જિલ્લામાં કલ્યાણ મુકામે તેમની બદલી થઈ. ત્યાં નાનાસાહેબ ચાંદોરકર જેઠે તેમની ઓળખાણ થઈ અને સાઈનાથ મહારાજની કીર્તિ સાંભળીને તેમનાં દર્શન કરવાની બુદ્ધિ સુઝી. બીજી જ દિવસે ચોઘડિયું બરાબર ગોઠવાયું અને ચાંદોરકર તૈયાર થયા તથા બોલ્યા, ‘ચાલો મારી સાથે. આપણે શિરડીની ફેરી કરી આવીએ. આપણે બંને બાબાનાં દર્શન પણ કરીએ, તેમનાં ચરણમાં મસ્તક ટેકવી ઉદ્દી આરીવાંદ લઈએ એક ખટલાની સૂનાવળી નક્કી થયેલી હતી. માટે તેમને સંગાથ છોડવો પડ્યો. નાનાસાહેબે ખૂબ આગ્રહ કર્યો. ‘ચાલો હવે ! બાબા સમર્થ છે, તે તમારા દર્શનની ઇચ્છા પૂર્ણ કરશે. પેલા મુકુદમાનું એટલું બધું શું મહત્વ છે ?’ પણ તે તેમને કેવી રીતે સમજલવું ? મુકુદમાની તારીખ ચૂકવાનો તેમને ડર લાગ્યો. નસીબે કપાળ ઉપર લખેલા ધક્કા કેવી રીતે ધૂટે ? મનમાં દર્શની અભિલાષા ધરતાં વિદનો આપોઆપ સરકી જય છે એવા પોતાના અગાઉ થયેલા અનુભવો નાનાસાહેબે તેમને કહ્યા. પણ ઠાકુરના મનને ખાત્રી થઈ નહીં જયારે પોતાનો સ્વભાવ જ આવો હોય તો તેઓ પણ શું કરી શકે ? તેમણે નક્કી કરી નાંખ્યું કે, પહેલાં દાવાનો નિકાલ લાવવો અને મનની અસ્વસ્થતા પહેલાં દૂર કરી નાંખવી.’ (ઓ. ઉ૬-૫૦)

ત્યારબાદ વિનાયકરણ ઠાકુર થાણા દાવાની કામગીરી માટે ગયા, અને ચાંદોરકર તો શિરડી જવા માટે નીકલ્યા અને દર્શન કરીને પાછા પણ આવ્યા. હવે ત્યાં થાણામાં કેવી મજેદાર ઘટના બની તે જુઓ. ઠાકુર તો સમયસર કોઈમાં હાજર રહ્યા. પણ દાવાને લગતું કામ આગળ ધકેલાઈ ગયું તથા તારીખો પડી અને બીજી બાજું ચાંદોરકરનો સંગાથ પણ ચાલ્યો ગયો. ઠાકુર ખૂબ જ નાસીપાસ થયા અને કહેવા લાગ્યા, ‘ચાંદોરકરના કહેવા ઉપર વિશ્વાસ રાખ્યો હોત તો સારું થયું હોત. તેઓ મને સાથે શિરડી લઈ ગયા હોત. તેમની સાથે શિરડી જવાનું પણ થાત અને દર્શનનું કાર્ય પણ સ્વસ્થ ચિત્તે પતી ગયું હોત. દાવો દાવાની જગ્યાએ રહ્યો અને હું સંત સમાગમ ચૂક્યો.’ પછી ઠાકુરે તરત જ શિરડી જવાનો કાર્યક્રમ ધડયો. મનમાં હતું કે, ‘વખતસર શિરડી જે હું પહોંચી જાઉં તો કદાચ નાનાસાહેબની મુલાકાત થઈ જય. અને તેઓ મને સાઈબાબાનાં ચરણ સુધી લઈ જઈ શકે. તેથી મનને આનંદ થશે. શિરડીમાં મારે તો કોઈ ઓળખાણ નથી. અને ત્યાંથી બધી જ રીતે હું અપરિચિત છું. જે નાનાસાહેબ મળી જય તો ખૂબ જ સારું થશે. પણ એવો યોગ ખૂબ જ અધરો છે.’ આવો વિચાર મનમાં કરીને આ ઠાકુર આગગાડીમાં બેઠા અને બીજે દિવસે તેઓ શિરડી પહોંચ્યા. પણ નાનાસાહેબ તો ત્યાં હતા નહીં. ઠાકુર જે દિવસે શિરડી જવા માટે નીકલ્યા, તે જ દિવસે નાનાસાહેબ ત્યાંથી પાછા આવવા શિરડીથી નીકળી ગયા હતા. ઠાકુર ખૂબ જ નિરાશ થયા. એટલામાં તેમના બીજી એક ભલા મિત્ર તેમને શિરડીમાં મળી ગયા અને તેમને સાઈબાબાનાં દર્શન કરાવીને તેમના મનની હોંશ પૂર્ણ કરી. બાબાનાં દર્શન કરતાં જ ઠાકુરનું મન બાબાનાં ચરણોમાં સ્થિર થયું અને તેમણે બાબાને સાણ્ણાં નમસ્કાર કર્યા. તેમનાં શરીરનું રોમરોગ પુલકિત થઈ ગયું અને આંખોમાંથી પ્રેમનાં અશ્રુ વહેવા લાગ્યાં. ક્ષણબર તેઓ આ દશામાં ઊભા હતા એટલામાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવું બધું જાણનારા નિકાળજ્ઞાની બાબા મુખ પર આછું હાસ્ય લાવીને તેમને શું બોલ્યા તે ધ્યાન દઈને સાંભળો, ‘કન્દડી અખ્પાના (કણાટકમાંના) કહેવા પ્રમાણે અથવા તો પાડા ઉપર બેસીને ઘાટ ચઢવા જેટલું અહીંથા આવવું સહેલું નથી અહિના માર્ગમાં શરીરને સહન કરવા સિવાય બીજે કોઈ ઉપાય નથી.’ આવા માર્મિક શબ્દો કાને પડતાં ઠાકુરનું અંત:કરણ ભરાઈ આવ્યું અને જે સંત પુરુષે પહેલાં આપેલાં વચન સાચા પડ્યાનો તેમને અનુભવ થયો. તેમણે બંને હાથ જોડીને સાઈબાબાનાં ચરણોમાં મસ્તક મૂક્યું અને બોલ્યા, ‘સાઈનાથ ! કૃપા કરો અને મારા જેવા અનાથને તમારું છત્ર આપો. તમે જ મારા મહાપુરુષ છો,

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નિશ્વલદાસ કૃત ગ્રંથનો ઉપદેશ મને સંપૂર્ણપણે સમજલયો છે. તેમજ જેનાથી વિશેષ કંઈ જ નથી એવો સુખનો અનુભવ મને થયો છે.' કચ્ચાં વડગાંધ અને કચ્ચાં શિરડી ! કેવી અજેડ આ સત્યપુરુષોની વાત ! થોડાં જ શાબ્દોની કેટલી સ્પષ્ટ અને ખુલ્લી ભાષા અને ઉપદેશનું કેટલું ચાતુર્ય ! એક કહે છે ગ્રંથ વાંચ્યો અને આગળ ઉપર કોઈ મહાપુરુષનો સમાગમ થશે. પછી તેચ્યો આગળ ઉપરના કર્તવ્યનો સાચો ઉપદેશ કરશે. દૈવ યોગથી તે પણ મળ્યા અને આવી માર્મિક અને સાંકેતિક વાણીથી તેની જાણ પણ કરાવી. એકના કહેવા પ્રમાણે ગ્રંથ વાંચ્યો, અને બીજાના કહેવા પ્રમાણે આચરણ કરવું જોઈએ. સાઈનાથે તેમને કહ્યું, 'આપાએ જે તમને કહ્યું છે, તે ખરેખર જ યથાર્થ છે. પણ અને જ્યારે આચરણમાં મૂકવામાં આવશે ત્યારે જ તમારા મનોરથો પૂર્ણ થશે.' 'નિશ્વલદાસ કૃત 'વિચાર સાગરના' વિષયનું ભક્તોના કલ્યાણ માટે અહીંથાં ઉચ્ચારણ થયું. થોડા દિવસો બાદ ગ્રંથનું પારાયણ કરીને શિરડીમાં તેનું આચરણ સમજલીને કહ્યું. પહેલાં ગ્રંથ સાંભળવો કે વાંચવો અને પછી તેનું મનન કરવું. ગ્રંથનું પારાયણ અથથી ઈતિ સુધીનું વાંચન અથવા તો પુનરાવર્તન કરવાથી તેનું એક સરખું ચિંતન થતું રહે છે. અમસ્તું વાંચવાથી કંઈ જ વળતું નથી. તેને આચરણમાં ઉતારવું જોઈએ. નહીં તો ઉંઘા મૂકેલા ઘડા ઉપર પાણી રેડવા જેવું થશે.' (ઓ. ૫૧-૭૨)

જ્યાં સુધી અનુભવપૂર્વકનું જ્ઞાન હાથ લાગતું નથી, ત્યાં સુધી ગ્રંથોનું વાંચન વ્યર્થ છે. જેને પોતાને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા ગુરુની ફૂપા સિવાય પુસ્તકીયું જ્ઞાન નકારું છે. આ વિષય ઉપરની એક નાની સરખી વાર્તા જે ભક્તિની ખરી યોગ્યતા અને પુરુષાર્થની આવશ્યકતા બતાવશે જે શ્રોતાઓએ પોતાના હિત ખાતર જરૂર સાંભળવી. એક વખતે પૂના શહેરમાં રહેનારા અનંતરાવ પાઠણકર નામના એક ગૃહસ્થને સાઈબાબાનાં દર્શાની ઉત્સુકતા જણી અને તેઓ જલ્દીથી શિરડી પહોંચી ગયા. તેમણે બધુંજ વેદાંત સાંભળ્યું હતું. મૂળ સંસ્કૃત ભાષામાં ઉપનિષદ્ધોની દીકા પણ વાંચી હતી. છતાં તેમનું મન સદાએ ચંચળ રહેતું અને તેમને ચેન પડતું નહીં. સાઈસમર્થનાં દર્શાન કરતાં જ પાઠણકરની દર્શિને સમાધાન પ્રાપ્ત થયું. તેમણે બાબાનાં ચરણશોમાં નમસ્કાર કરી યથાવિધિ પૂજન કરી. પછી હાથ જોડીને બાબાની પાસે સામે બેસીને અનંતરાવે ભક્તિપૂર્વક અત્યંત કરુણાથી બેહાલ દ્શામાં પ્રશ્ન કર્યો, 'અનેક ગ્રંથો જેથાં વેદ વેદાંગ અને ઉપનિષદ્ધોનો અભ્યાસ તથા અધ્યયન કર્યું. સારામાં સારાં શાસ્ત્રો અને પુરાણો સાંભળ્યા તેમ છતાં મન જિન્ન કેમ રહે છે ? વાંચેલું બધું વ્યર્થ ગયું એવું લાગે છે. મારા કરતાં તો અભાષ અને ગમાર પણ ભાવનાશીલ ભોળા ભક્તો સારા એમ મને લાગે છે. જ્યાં સુધી મન અસ્વસ્થ રહેતું હોય ત્યાં સુધીનું ગ્રંથનું વાંચન વ્યર્થ ગણાય. શાસ્ત્રોનો લિંડો અભ્યાસ પણ વ્યર્થ અને દેરક જતાનું પુસ્તકીયું જ્ઞાન પણ અર્થ વગરનું. જ્યાં સુધી ચિંતને શાંતિ મળતી નથી ત્યાં સુધી શાસ્ત્રોમાં વગર કામની ફુશણતાનો શો અર્થ ? વેદાંતનાં મહા વાક્યોના જરૂરનો શો અર્થ ? તેથી બ્રહ્મજ્ઞાન કર્યાંથી મળે ? એવું સાંભળવામાં આવ્યું છે કે સાઈબાબા ફક્ત દર્શનમાત્રથી જ મનની ચિંતા દૂર કરે છે અને છઠા મશકરીથી વાત કરીને સહેલાઈથી સન્માર્ગે વાળે છે. માટે હે મહાન તપસ્વી મહારાજ ! હું તમારે શરણે આવ્યો છું. મારા મનને સ્વસ્થતા અને શાંતિ મળે તેવા આશીર્વાદ આપો.' આ સાંભળીને સાઈમહારાજે વિનોદપૂર્વક આખ્યાન કહ્યું, જે સાંભળીને અનંતરાવને સંતોષ થયો અને તેમને પોતાના ગ્રંથ વાંચનથી મેળવેલું જ્ઞાન સક્ષણ થયાનો અનુભવ થયો. થોડા શાબ્દોમાં પરમ સાર વાળી કથા હું હવે કહી રહ્યો છું. શ્રોતાઓ સાંભળવા માટે તૈયાર થઈ જાવ. આ કથા રમુજ હોવા ઈતાં તેમાંનો બોધ લેવા જેવો છે. માટે તેનો અનાદર કોઈએ પણ કરવો નહીં. શ્રી સાઈબાબા અનંતરાવને બોલ્યા, 'એક વખતે એક સોદાગર જેવો વ્યાપારી આવ્યો. તેની સામે એક ઘોડાએ નવ લેંડાની લાદ નાખી. તે જમીન ઉપર પડતાં જ પોતાનું કામ કરવા માટે તત્પર રહેનારા સોદાગરે પોતાના ઉપવસ્તુનો છેડો પસરાવીને તે બધા બેગા કરીને સખત રીતે બાધી લીધા અને તેના મનને એકાગ્રતા મળી.' 'સાઈનાથ શું બોલ્યા ? એનો શું અર્થ હોઈ શકે ? સોદાગરે એ લાદ કેમ બેગી કરી લીધી એ કંઈ સમજાયું નહીં..' આ વિચાર કરતાં કરતાં અનંતરાવ મસ્ઝિલદમાંથી પાછા વબ્બા. તેમને આ બધું સંભાષણ રા. બ. સાઠેના વયોવૃદ્ધ અને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કર્મનિષ્ઠ સસરા અને બાબાના નિષાવાન ભક્તોમાંના એક દાદા કેળકરને સવિસ્તારથી કહી સંભળાવ્યું અને કહ્યું, ‘એ સોદાગર કોણ ? લીડીનું પ્રયોજન શું ? નવનું જ મહત્વ શું ? મને આ સમજલવો. આ આવો કેવો ગૂઢ કોયડો છે, દાદા ? મને કંઈ સમજલતું નથી. બાબાના મનની વાત ચોખ્ખી સમજલય એવું મને રોકું સમજલવો.’ દાદા બોલ્યા, ‘મને પણ કંઈ સમજલતું નથી. બાબાનું બોલવું હંમેશા આવું ન સમજલય એવું અને ગહન હોય છે. પણ તેમની જ પ્રેરણાથી અને શક્તિથી મને જે સમજલઈ રહ્યું છે તે તું કહી રહ્યો છું. ઈશ્વરની કૃપાથી જ પેલો ધોડો અને પેલા નવ લેંડાની લાદ એટલે નવ પ્રકારની નવધા ભક્તિ છે. ભક્તિ વગર એકલા જ્ઞાનથી પરમેશ્વર પ્રાપ્ત થતો નથી. શ્રવણ અથવા કીર્તન, વિષણુનું એટલે ઈશ્વરનું નામસ્મરણ, ચરણસેવન, અર્થન એટલે ઉપયાર અને વિધિપૂર્વક પૂજન, વંદન એટલે નમસ્કાર કરવા દાસ્ય એટલે સેવક પ્રમાણે સેવા ચાકરી કરવી, સાખ્ય એટલે દેવની સાથે મૈત્રીભાવથી વર્તવું અને આત્મનિવેદન એટલે કે ઈશ્વરને સર્વસ્વ અર્પણ કરીને તેને શરણે જવું. એવી આ નવ પ્રકારની નવધા ભક્તિ છે. શ્રીમહાબાળપુરાણ સર્કંધ ૭ અધ્યાય ૫ શ્લોક ૨૩માં આ પ્રમાણે તે સમજલવી છે. શ્રવણ કીર્તન વિષણો:સ્મરણં પાદસેવનં । અર્થનં વંદનં દાસ્યં સાખ્યમાત્મનિવેદનમ् ॥ આવી ભક્તિ અનુકૂળે પરીક્ષિત, શુક, પ્રલહાદ, લક્ષ્મી, પૂથુરાજન, અઙ્ગર, હનુમંત, અર્જુન અને બતીરાજનએ કરી હૃતી તે તું જણી લે. અંતઃકરણાથી પૂર્ણ વિશ્વાસ અને ભાવ ધરીને તેમાંથી એક પણ કરવામાં આવે તો, ભાવનો ભૂખ્યો શ્રીહરિ ભક્તોની સામે પ્રગટ થાય છે. જ્ય, ત્ય, વ્રત યોગસાધના વેદો અને ઉપનિષદ્દોનો અભ્યાસ તથા આત્મજ્ઞાન અને અભિમાનથી કરેલો પ્રચાર આ બધો ભક્તિ સિવાયનો નકામો શ્રમ છે. વેદશાસ્ત્રોમાં પારંગતની જરૂર નથી, જ્ઞાનીમાં ખપાવીને જગતભરની કીર્તિની પણ જરૂર નથી કે લુખ્યી ભક્તિ તરફની પ્રીતિની પણ જરૂર નથી. કેવળ પ્રેમળ ભક્તિ જ થવી જોઈએ. આપણે પોતાને સોદાગર જ સમજો. વ્યવહારમાં દેખાય તે વાત તરત કરવી પછી ભલેને તે નવ ધોડાની લાદ જેવી ગંદી હોય તેમ છીતાં ખોટું અભિમાન છોડીને હાથ ધરવી જોઈએ. એ જ ગર્ભિત અર્થ છે. સમજુ લોકે શ્રવણ વગેરે નવ પ્રકારની ભક્તિની ઘણા ફર્સી કે જ્ઞાનના રાજીને પરમેશ્વરને આનંદ થવા માંડે છે. ધોડાને નવ લેંડા નાખ્યા અને સોદાગર, આતુરતાથી ભેગા કરવા માટે ધસ્યો, ટેટલી જ આતુરતાથી દોડીને પરમેશ્વર તરફ નવધા ભક્તિભાવ રાખો તો મનને જરૂર શાંતિ મળશે. તેનાથી મનની સ્થિરતા વધશે. બધાને માટે સહ્યભાવ ઉપજશે અને ગંભીરતામાં વધારો થશે. એવું ન થાય તો મનની ચંચળતા ચાલુ જ રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જ ગુરુમહારાજનું કહેવું છે.’ બીજે દિવસે અનંતરાવે બાબાના ચરણ સ્પર્શ કરી નમસ્કાર કરતી વખતે બાબાએ તેમને પૂછ્યું, ‘લેંડા પાલવમાં બાંધ્યા કે ?’ એ સાંભળી અનંતરાવ પ્રાર્થનાપૂર્વક બોલ્યા, ‘આ ગરીબ ઉપર તમારી કૃપા કાયમ રહેવા હો, એટલે એ સહેલાઈથી બંધાઈ જશે. એનું એટલું મહત્વ !’ પછી બાબાએ તેમને આરીવાઈ આપ્યા અને ‘કલ્યાણ થશે’ એવું આશ્વાસનપૂર્વક કહ્યું. અનંતરાવને મનમાં આનંદ થયો અને તેમને ખરેખર જ સુખ શાંતિ મળી. (ઓ. ૭૩-૧૦૪)

હવે એક નાની સરખી કથા શ્રોતાઓ દ્યાન દઈને સાંભલો એટલે તમને સાઈભાબાના અંતર્જ્ઞાનની અને સન્માર્ગ પ્રવર્તકતાની કલ્પના આવશે. એક વખત પંદ્રપુરના એક વકીલ શિરડીમાં આવ્યા અને આવતાંની સાથે જ મસ્નિજદમાં જઈને બાબાનાં દર્શન કર્યા. પછી લાવેલ દક્ષિણા આપી અને બાજુ પર સરકી ને બેસી ગયા. એટલામાં તે ક્ષણે ત્યાં ચાલેલા સાઈભાબાનાં સંભાષણ સાંભળવાની ઉત્સુકતા જગી. તે વખતે તેમની તરફ મોંફેરીને તેમને ઉદ્દેશીને સાઈભાબા કંઈક બોલ્યા. તે વકીલના મનમાં ખૂબ જ સોંસરુ ઉત્તરી ગયું અને સાથે પદ્ધતાપ પણ થયો. ‘લોકો પણ કેટલા લભાડ હોય છે ! પરે પડે છે, દક્ષિણા પણ આપે છે અને મનમાં ગાળો પણ હે છે. તે કેવી આશ્ર્યની વાત છે !’ બાબાનું આ વાક્ય સાંભળીને વકીલ કંઈ બોલ્યા નહીં, પણ સ્વર્સ્થ બેસી રહ્યા. છીતાં તે મનમાં બરાબર સમજ ગયા, બાબાના બોલ સાચા છે એ તેમને સમજલયું, અને એ માટેનો બાબાનો ઉદ્દેશ શું છે તે સમજલઈ ગયું જ્યારે તેઓ વાડામાં ગયા ત્યારે એમણે દીક્ષિતને કહ્યું, ‘બાબા કોઈને માટે પણ આવું માર્ભિક મનમાં લાગી આવે એવું બધું યોગ્ય જ હતું. આવતાની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સાથે જે મારી ઉપર વિફર્ખા તે કેવળ મારે માટે કરેલ એક ઈશારો કે સુચના જ હતી કે કોઈ પણ નિંદા કે મજલકને અંત:કરણમાં ટેકો કે આધાર આપવો નહિ. અમારા મુન્સિફ પંદ્રપુરના સભ જ્ય તાત્યાસાહેબ નુલકર, આંખોના ભયંકર વિકારથી દષ્ટિ વિકૃત થવાથી તેને કારણે અસહ્ય વેહનાઓના ત્રાસથી તે ખૂબ ત્રાસી ગયા હતા અને પોતાની પ્રકૃતિ સુધારવા માટે રજી ઉપર ઉત્તરીને અહીંચા શિરડીમાં બાબા પાસે રોકાયા હતા. વકીલના ઓરડામાં આ વિષેની વાતો નીકળી અને કોઈનો કોઈની સાથે સંબંધ ન હોય તેવી વગર કામની ચર્ચા ચાલી અને ઉહાપોહ થયો. ‘દવાદારુ કર્યા વગર સાઈબાબાના ચાણે ચઢીને શરીર પરના રોગોનાં સંકટો કયારેય દૂર થયાં છે કે ? મુન્સિફનું આવું ઉચ્ચ પદ જેને મળ્યું હોય એવાને આવું વર્તવું શોભા આપે ?’ આ પ્રકારે પેલા મુન્સિફની નિંદા ચાલતી હતી અને સાથે સાથે મશકરી પણ શરૂ થઈ. હું પણ એમાં થોડે ઘણે અંશે ભાગીદાર હતો. આ વાતની અયોગ્યતાએ બાબાએ મને પરથ્યો બતાવી દીધો. બાબાનો આ કટાક્ષ ન હતો, પણ મારી ઉપર એક કૃપા જ હતી. કારણ કે વગર કામની કોઈની ચર્ચા કરવી નહિ અને કોઈની બાબતમાં દુષ્ટ વિચારો મનમાં લાવવા નહિ. બીજે એક પુરાવો મળ્યો કે સો કોંસનું અંતર હોય છતાં બાબાને બધાના મનની વાતની ખબર રહેતી. તેઓ ખરેખર અંતર્શર્ણાની હતા. વચ્ચે કોઈ પર્વત હોય કે પહાડ સાઈબાબાની દષ્ટિએ ચીજની આડસ કોઈ ન હતી. દરેક પ્રકારની ગુપ્ત વાતો તેમની પાસે ઉધાડી થઈ જતી. ત્યારથી જ વકીલ નિશ્ચય કર્યો કે હવે કોઈની પણ નિંદા કરવી નહીં. અને કોઈના વિષે ખરાબ બોલવું નહીં. સાઈના નજરથી કંઈ છૂંછું નથી એની તેમને ખાત્રી થઈ ગઈ અને કોઈ પણ પ્રકારનું ખરાબ કર્મ કરવાનું તેમના મનનું જોર ખલાસ થઈ ગયું, તથા સત્કર્મોની દક્ષતાનો ઉદ્ઘય થયો. શ્રીસાઈબાબા સર્વવ્યાપી હોવાને લીધે, તેમને કોઈ ફસાવી ન શકે એવો વિશ્વાસ તેમના મનમાં પાકો બેસી ગયો.’ (ઓ. ૧૦૫-૧૨૨)

આ કથાનો સંબંધ તે વકીલ સાથે ભલે હોય તો પણ તે બધી જ રીતે, બધી બાજુઅથી અને બધાને માટે આ ઉપદેશ એટલો જ કામનો અથવા બોધદાયક છે. અહિં દરેક વકીલ, વક્તા, શ્રોતાઓ અને સાઈના બીજાં ભક્તોનો પણ આવો જ નિશ્ચય હોવો જેઠાં એવી હું ખરા દિલથી પ્રાર્થના કરું છું. સાઈકૃપાઙ્ખી મેધનો વરસાદ થતાં આપણે બધાને તૃપ્તિ થસે. તેમાં કોઈ નવાઈ નથી. તરસના માર્યા વ્યાકુળ થયેલા બધાની તૃપ્તણા દૂર થશે. સાઈનાથનો મહિમા અગાધ છે, અમર્યાદિત છે. એમની કથા પણ શ્રેષ્ઠ છે. સાઈના ચરિત્રની સીમાઓ પણ અનંત છે. સાઈ પોતે જ પરબ્રહ્માના મૂર્તિમંત અવતાર સ્વરૂપ છે. હુવે પદ્ધીના આગળના અદ્યાયની કથા શ્રદ્ધાળુ શ્રોતાઓએ આદરપૂર્વક સાંભળવી. એ તમારા મનોરથો પૂર્ણ કરશે અને ચિત્તને અપૂર્વ શાંતિ આપશે. સાઈસમર્થને ભક્તોની ભવિષ્યમાં આવનારી સંકટમય પરિસ્થિતિઓની પહેલેથી જ ખબર હોય છે અને જેને તેઓ છઠા મશકરી રૂપે, વિનોદી વાતો સંભળાવીને અને હસતા દૂર કરે છે. ભક્ત હેમાંડંત સાઈને શરણે આવ્યા છે. આ ભાગની કથા અહીં પૂર્ણ કરું છું. આગળની કથાની સંગત એ ‘ભક્તોનું સંકટ નિવારણ’ છે. કૃપાના સાગર એવા શ્રી સાઈ, ભક્તોનાં આવનારા અને સહન કરવામાં કઠીન એવાં સંકટોને પહેલેથી જ જાણી લઈ, એ માટેનો તેમને સમયસર આણસાર આપીને એનું નિવારણ કેવી રીતે કરતા હતા તે સાંભળો. (ઓ. ૧૨૩-૧૩૦)

સર્વનું કલ્યાણ થાયો. આ પ્રમાણે સંત અને સભજનોની પ્રેરણા પાયેલા લક્ત હેમાંડંત રચિત.

શ્રીસાઈસમર્થના સત્ય ચરિત્રનો ‘અનુગ્રહ-કરણમ્’ નામનો એકવીસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણા.

